



બદલાતા હવામાનમાં કુશળ જેતી જળ-ઉર્જા-કૃષિ ઉત્પાદનનું સંકલન - “બમણી આવકના ઉપાયો”



ડૉ. કિરીટ એન. શેલત



કુશળ ખેતી



બદલાતા હવામાનમાં કુશળ ખેતી

જળ-ઉર્જા-કૃષિ ઉત્પાદનનું સંકલન - “બમણી આવકના ઉપાયો”

: સંપાદક :

ડૉ. કિરીટ અન. શેલત
ડૉ. મયુર વ્યાસ
ડૉ. આર. એચ. પટેલ
ડૉ. આઈ. આર. રાઠોડ
નિશા શાહ



સંપર્ક :

અન.સી.સી.ઓસ.ડી.

પટેલ બ્લોક, રાજ્યીપ ઇલેક્ટ્રોનિક્સ કમ્પાઉન્ડ,
સ્ટેડિયમ છ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૪

ફોન : ૦૭૯-૨૬૪૨૧૫૮૦

પ્રકાશક :

ડૉ. કિરીટ એન. શેલત, IAS (RTD)

એક્ઝિક્યુટિવ ચેરમેન

એન.સી.સી.એસ.ડી.

પટેલ બ્લોક, રાજ્યીપ ઈલેક્ટ્રોનિક્સ કમ્પાઉન્ડ,

સ્ટેડિયમ છ રસ્તા, નવરંગપુરા,

અમદાવાદ-૩૮૦ ૦૧૪

ફોન : ૦૭૯-૨૬૪૨૧૫૮૦

પ્રથમ આવૃત્તિ : “બદલાતા હવામાનમાં કુશળ ખેતી” ૨૦૧૪

દ્વિતીય આવૃત્તિ : “બદલાતા હવામાનમાં કુશળ ખેતી માટે ટકાઉ મૂલ્યવર્ધક અન્ન-કૃષિ ઉત્પાદન માટેની સાંકળ”
૨૦૧૫

તૃતીય ભાગ : “બદલાતા હવામાનમાં કુશળ ખેતી માટે ટકાઉ મૂલ્યવર્ધક અન્ન-કૃષિ ઉત્પાદન માટેની સાંકળ”
૨૦૧૬ (હિન્દી)

ચોથો આવૃત્તિ : “બદલાતા હવામાનમાં કુશળ ખેતી” ૨૦૧૬ (અંગ્રેજી)

પાંચમો આવૃત્તિ : બદલાતા હવામાનમાં કુશળ ખેતી જળ-ઊર્જા-કૃષિ ઉત્પાદનનું સંકલન “બમણી આવકના ઉપાયો”

પ્રાપ્તિસ્થાન :

નિશા શાહ

સીઈઓ,

એન.સી.સી.એસ.ડી.

પટેલ બ્લોક, રાજ્યીપ ઈલેક્ટ્રોનિક્સ કમ્પાઉન્ડ,

સ્ટેડિયમ છ રસ્તા, નવરંગપુરા,

અમદાવાદ-૩૮૦ ૦૧૪

ફોન : ૦૭૯-૨૬૪૨૧૫૮૦

© ડૉ. કિરીટ એન. શેલત

મુદ્રક :

સાહિત્ય મુદ્રણાલય પ્રા.લિ.,

સિટી મિલ કમ્પાઉન્ડ, કાંકરિયા,

અમદાવાદ-૩૮૦ ૦૨૨

ફોન : ૦૭૯-૨૫૪૬૮૯૦૧-૦૨

ऋणास्वीकार

એન.સી.સી.એસ.ડી. દ્વારા તા. ૩૦ જુલાઈ, ૨૦૧૬ના રોજ “બદલાતા હવામાનમાં કુશળ બેતી જળ-ઉર્જા-કૃષિ ઉત્પાદનનું સંકલન - બમણી આવકના ઉપાયો” - આ વિષય પર તજ્જ્ઞો અને ખેડૂતોને સાથે રાખી એક પરામર્શ બેઠક રાખવામાં આવી, જેમાંથી ખેડૂતોના પ્રશ્નો જાણી નિવારણરૂપે આ માહિતી તૈયાર કરવામાં આવેલ છે.

આ માહિતી તૈયાર કરવામાં ડૉ. એન. સી. પટેલ - વાઈસ ચાન્સેલર - આણંદ કૃષિ યુનિવર્સિટી અને ડૉ. એ. આર. પાઠક - વાઈસ ચાન્સેલર - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડૉ. સી. જે. ડાંગરીયા - વાઈસ ચાન્સેલર - નવસારી કૃષિ યુનિવર્સિટી અને ડૉ. અશોક પટેલ - વાઈસ ચાન્સેલર - સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો મહત્વનો ફાળો છે.

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને સંશોધકો ડૉ. બાબરીયા, ડૉ. સોલંકી, ડૉ. રંક, ડૉ. વ્યાસ, ડૉ. દેવરાજ, ડૉ. ઉસડીયા, ડૉ. કોરાંટ અને અન્ય દ્વારા આ તકનિકી માહિતીને ખેડૂતો માટે તૈયાર કરવામાં જે સહકાર મળેલ છે જે અમૂલ્ય છે.

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતોને પહોંચતી કરવામાં આવે અને પાકોનું ઉત્પાદન વધારવામાં આવે જે માટે અગ્ર કૃષિ સચિવ - ગુજરાત ડૉ. અરુણ સોલંકી અને ડૉ. સંજ્ય પ્રસાદ તરફથી જે યોગદાન મળેલ છે જે ઘણું મહત્વનું છે.

ડૉ. શેરસિયા - ડાયરેક્ટર - બાગાયત વિભાગ, ગાંધીનગર, ડૉ. સી. એમ. પટેલ - જોઈન્ટ ડાયરેક્ટર - સ્ટેટ હોર્ટિકલ્યર મિશન અને જિલ્લાના નાયબ બાગાયત અધિકારીઓ તરફથી જે સહકાર ગ્રાપ્ત થયો જે અતિ મહત્વનો છે.

આ પુસ્તકના સંપાદક મંડળના સભ્યો સર્વ શ્રી મયુર વ્યાસ, ડૉ. આર. એચ. પટેલ અને ડૉ. આઈ. આર. રાડોડનો તેઓના વિશેષ યોગદાન માટે ખાસ આભાર માનું છું. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સિટ્યુટના સર્વ શ્રી જે. એસ. ગોસલીયા, શ્રી માવજીભાઈ ભારૈયા અને શ્રી મલયભાઈ જોખીનો જેઓએ આ પ્રકાશન માટે મહત્વના વિચારો પૂરા પાડ્યા છે તે બધાનો હું ખાસ ઋણી છું. પૂજ્ય કાકા શ્રી કાન્તીસેન શ્રોદ્ધ દ્વારા વિકસાવાયેલ વિવિધ આવકના સાધનોનો ખ્યાલ ખૂબ જ આવકારપાત્ર અને અનુકરણીય છે.

આ પુસ્તકના પ્રકાશનમાં સાહિત્ય મુદ્રણાલય પ્રા.લિ.ના ડાયરેક્ટર શ્રી શ્રેયસ વિષ્ણુપ્રસાદ પંજ્યાના સહયોગ બદલ તેઓનો વિશેષ આભાર માનું છું.

મને વિશ્વાસ છે કે, આ માર્ગદર્શિકા માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ વ્યવસાય સાથે સંકળાયેલા તમામને અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ભાવિ પેઢીને સાચી દિશાનું માર્ગદર્શન પૂરું પાડશે.

- નિશા શાહ
સીઈઓ, એન.સી.સી.એસ.ડી., અમદાવાદ



ડૉ. કિરીટ એન. શેલત, IAS (RTD)
એક્ઝિક્યુટિવ ચેરમેન
એન.સી.સી.એસ.ડી., અમદાવાદ
તા. ૦૪-૧૦-૨૦૧૬

ડૉ. કિરીટ એન. શેલત

પ્રસ્તાવના

બદલાતા હવામાનમાં રાષ્ટ્ર અને વિશ્વ, કુદરતી વિપત્તિને કારણે ઘણી બધી મુશ્કેલી અનુભવે છે. તેમાં સૌથી વિશિષ્ટ વિપત્તિ કૃષિ-અનાજ અને પેદાશોની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં ઘટાડાની છે. તેની સૌથી વધુ વિપરીત અસર માત્ર લોકોની જરૂરિયાતો માટેની બધી સામગ્રીનો અભાવ ઉપરાંત, સ્થાનિક કક્ષાએ ગામડામાં ખેડૂતની આવક અને કૃષિ-પશુપાલન ઉત્પાદનમાં ઘટાડાની છે.

આ માટે એન.સી.સી.એસ.ડી.એ છેલ્લાં દ વર્ષમાં ખેતી અને પશુપાલનને બદલાતા હવામાનની પરિસ્થિતિમાંથી થતી અસર સમજવા અને તેના ઉકેલ તૈયાર કરી તે ખેડૂતોને ઉપલબ્ધ કરવા માટે વિશિષ્ટ પ્રયાસો કર્યા છે. બદલાતા હવામાનમાં ચતુર ખેડૂત (Climate Smart Farmer) તૈયાર કરવાનો અભિગમ હાથ પર લીધો છે. તેમાં ગુજરાત સરકારનું કૃષિ ખાતું, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ICAR અને તેની સંસ્થા CRIDAનો સહયોગ પ્રાપ્ત થયો છે.

વાસ્તવમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે ૨૦૦૪થી કૃષિ મહોત્સવનો આ અભિગમ શરૂ કરાવ્યો હતો. જેમાં સમગ્ર યોજનાઓના મધ્ય કેન્દ્રમાં ખેડૂતને લાવીને, દર વર્ષ જમીનની ફળદૂપતા અને હવામાનની સમજ આપવાની અને મે માસમાં પાકની વાવણી પહેલાં ખેડૂતોને તેમના ધરે - ગામમાં માર્ગદર્શન આપવાનો આ અભિગમ હતો. તેથી ગુજરાતના કૃષિ ઉત્પાદનનો દર જે ૧ થી ૨ ટકા હતો તે દ ટકાથી વધુ થયો - ખેડૂતોની આવક બમણી થઈ.

હવે વડાપ્રધાન બન્યા પછી તેઓશ્રી સમગ્ર રાષ્ટ્રના તમામ ખેડૂતોની આવક બમણી કરવા માટે વહીવટીતંત્ર અને કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને આહવાન કર્યું છે. તાજેતરમાં હું જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને શુભેચ્છા માટે મધ્યો ત્યારે તેમણે પણ ગુજરાતમાં આ માટે બધાએ સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ તેવી વાત કરી હતી.

ગુજરાતના ખેડૂતો આજે આગળ છે - અલબત્ત, છેલ્લાં બે વર્ષમાં કુદરતી આફિત - દુકાળ જેવી પરિસ્થિતિના કારણે પીછેહઠ થઈ છે. આવી પરિસ્થિત ઉપરિસ્થિત થાય તેમ ધતાં પણ ખેડૂતની આવક ઘટે નહીં અને વધે, ઉત્પાદકતા અને આવક બમણી થાય તે માટે વધુ સંકલિત અને ઘનિષ્ઠ પ્રયાસો જરૂરી છે. કૃષિ ઉપરિસ્થિત વારંવાર હવામાનના અણધાર્યા અને વિપરીત ફેરફારને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતાઓ વધવાને કારણે ખેડૂતો આ બ્યવસાય છોડવાનું વિચારે છે, જ્યારે કેટલાકે તો આ બ્યવસાય છોડી દીધો છે.

આ 'બદલાતા હવામાનમાં કુશળ ખેતી' પુસ્તકની પાંચમી આવૃત્તિ ખેતી કેવી રીતે ટકાવવી ? તેમાં કેમ ઉત્પાદન વધારવું ? ઉત્પાદન અને વેચાણમાં ખેત પેદાશોનો થતો વ્યય કેમ અટકાવવો ? કઈ આધુનિક કાર્યપદ્ધતિ અને ટેક્નોલોજી અપનાવવી તેનું આમાં વાસ્તવિક દાખલાઓ સાથે વિવરણ છે.

દેશમાં પડકારરૂપી બદલાતા હવામાનમાં જ્યારે વિપરીત અસરો થાય છે ત્યારે વધુ તકેદારી રાખી - જાગૃત રહીને પાકોના ઉત્પાદનનું સૌથી વધુ મૂલ્ય પ્રાપ્ત કરવાની તાકીદ જરૂર હોય છે. આ અભિગમને લક્ષમાં રાખી પુસ્તક “બદલાતા હવામાનમાં કુશળ ખેતી” ખેતી માટે હોઈ દ્વિતીય ભાગ “બદલાતા હવામાનમાં કુશળ ખેતી માટે ટકાઉ મૂલ્યવર્ધક અન્ન-કૂષિ ઉત્પાદન માટેની સાંકળ”, “બદલાતા હવામાનમાં કુશળ ખેતી માટે ટકાઉ મૂલ્યવર્ધક અન્ન-કૂષિ ઉત્પાદન માટેની સાંકળ” (હિન્દી) અને “બદલાતા હવામાનમાં કુશળ ખેતી” (અંગ્રેજી) અને હવે આ પાંચમી આવૃત્તિ “બદલાતા હવામાનમાં કુશળ ખેતી જળ-ઉર્જા-કૂષિ ઉત્પાદનનું સંકલન બમણી આવકના ઉપાયો”માં ખેતી-ખારાશના લીધે બાગાયતી પાકો અને ક્ષેત્રપાકો પર થયેલ અસરો અને નિવારવાના વૈજ્ઞાનિક ઉપાયોના અભિગમનનું વર્ણિન કરવામાં આવ્યું છે. આ અભિગમ ખેતીના પરિવર્તન-રૂપાંતરને ટેકારૂપ બની શકે છે. બદલાતા હવામાનના સંદર્ભમાં દેશની ખેતી વધુ સક્ષમ અને કુશળ બની શકે. આમ થતાં અન્ન સલામતી અને બદલાતા હવામાનના પડકારોને સફળતાથી જીવી શકાશે.

આ પુસ્તકમાં બદલાતા હવામાનમાં બાગાયતી પાકો, ક્ષેત્રપાકો અને તેને થયેલ અસરો અને નિવારવાના વૈજ્ઞાનિક ઉપાયોના અભિગમનનું વર્ણિન કરવામાં આવ્યું છે. આ અભિગમ ખેતીના પરિવર્તન-રૂપાંતરને ટેકારૂપ બની શકે છે. બદલાતા હવામાનના સંદર્ભમાં દેશની ખેતી વધુ સક્ષમ અને કુશળ બની શકે. આમ થતાં અન્ન સલામતી અને બદલાતા હવામાનના પડકારોને સફળતાથી જીવી શકાશે.

— ડૉ. કિરીટ એન. શેલત IAS (RTD)
એક્ઝિક્યુટિવ ચેરમેન
એન.સી.સી.એસ.ડી.

અનુક્રમણિકા

| ક્રમ | પ્રકરણનું નામ | પાન નં. |
|------|--|----------------------------------|
| ૧. | બદલાતાં હવામાનમાં કુશળ ખેતી કુશળ ખેતી એટલે શું ? શા માટે ? ટકાઉ વિકાસ | ૯ |
| ૨. | બદલાતા હવામાનમાં જળચક ઘટતાં જતાં ભૂગર્ભ જળઓટો ભારતમાં વાતાવરણ બદલાવની જળચક ઉપર થયેલ અસરો વાતાવરણ બદલાવ અને જળચક વાતાવરણના બદલાવથી જળચકમાં સંભવિત વિપરીત અસરો અને તેના ઉપાયો ટકાઉ ખેતીમાં સંકલિત પિયત વ્યવસ્થાપન | ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૭ ૧૮ |
| ૩. | બદલાતું હવામાન અને જમીન-ભૂમિ જમીનની ઉત્પાદકતા ઉપર થતી અસરો અને તેના ઉપાયો જમીન ઉપર વાતાવરણના બદલાવાની થતી અસરો જમીનનું પૃથક્કરણ જમીન ઉપર વાતાવરણ બદલાવની અસરોના ઉપાયો | ૧૯ ૨૦ ૨૦ ૨૧ ૨૨ |
| ૪. | ટકાઉ ખેતી માટે કાર્ય-પદ્ધતિ સંકલિત નીંદણ વ્યવસ્થા સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ મિશ્ર પાક પદ્ધતિ તથા પાક ફેરબદ્લીમાં બદલાવ આવરણયુક્ત પાકની ખેતી પદ્ધતિ સજીવ ખેતી (ઓર્ગેનિક ફર્મિંગ) | ૨૪ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૨૫ |
| ૫. | બદલાતા હવામાનમાં પશુપાલન વ્યવસ્થાપન હવામાનમાં બદલાવ અને તેની અસરો ત્રણુજણ્ય વાતાવરણ ફેરફારની પશુપાલન વ્યવસ્થા ઉપર થતી અસરો બદલાતા હવામાનની મરધાંપાલન વ્યવસાય પર થતી વિપરીત અસરો બદલાતા હવામાનમાં તળાવોમાં મત્સ્યપાલન માટે ધ્યાનમાં રાખવાના સૂચિત ઉપાયો | ૨૬ ૨૬ ૩૧ ૩૩ |
| ૬. | આકસ્મિક પાક-આયોજન આકસ્મિક પાક-આયોજન એટલે શું ? | ૩૪ |
| ૭. | કુદરતી હોનારતો વખતે વ્યવસ્થાપન વાતાવરણ બદલાવથી સર્જતી કુદરતી હોનારતોનાં નુકસાનો અને પુનઃસ્થાપન | ૩૫ ૩૫ |

| | |
|--|-----|
| ૮. ખારાશના વધતા જતા પ્રશ્નો તેમજ વાતાવરણ બદલાવની બાગાયતી પાકો અને ક્ષેત્રપાકો ઉપર માઠી અસર ૪૧ | |
| ધાન્ય, કઠોળ, રોકડિયા પાકો, બાગાયત અને વન્ય પાકો, ઘાસચારા અને શાકભાજના પાકો ઉપર થયેલી વિપરીત અસરો | ૪૩ |
| જમીનમાં ખારાશ ઉદ્ભવવાના મુખ્ય કારણો | ૪૪ |
| ખારી જમીન ઉપર સંશોધન દ્વારા થયેલી મોજણીનાં તારણો | ૪૫ |
| ખારી અને ભાસ્મિક જમીનોમાં પાક ઉત્પાદન માટે ભલામણ કરાયેલી વિવિધ ખેતી પદ્ધતિઓ | ૪૭ |
| ખારાશ અટકાવવાની મહત્વની કૃષિ ટેક્નોલોજી / તજ્જ્ઞતાઓ અને ખારી જમીનમાં ભલામણ કરાયેલી કૃષિની વિવિધ પદ્ધતિઓ | ૪૮ |
| ખારી જમીનમાં વાંસ, સરૂ, નિલગિરી તેમજ ચેરની પણી પદ્ધતિથી ખેતી (જમીનનું ધોવાણ તેમજ ખારાશ ઓછી કરવામાં મહત્વનો ફાળો) | ૪૯ |
| એગ્રોફોરેસ્ટ્રી અને સીલ્વી પાસ્ચર/ઘાસચારા પાકોના વ્યવસ્થાપન/મેનેજમેન્ટનો ખારી જમીનને જૈવિક રીતે સુધારવામાં મહત્વનો ફાળો | ૫૦ |
| ખારી અને ભાસ્મિક જમીનો ન બગડે તે માટે મહત્વના અગમચેતીના ખાસ ઉપાયો | ૫૦ |
| ખારી અને ભાસ્મિક જમીનોમાં પાક અને જાતોની પસંદગી | ૫૫ |
| ખારી જમીનમાં ભલામણ કરાયેલી કૃષિ તજ્જ્ઞતાઓ / ટેક્નોલોજી / ખેડૂત ઉપયોગી ભલામણો | ૬૮ |
| દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન અંગે ઉભરાટ અને દાંતી કેન્દ્ર ખાતે સંશોધન કેન્દ્ર પર થયેલા સંશોધન ઉપરની ભલામણો | ૭૦ |
| ખારી જમીનને નવસાધ કરવાની ભલામણ | ૭૨ |
| જૈવિક પદ્ધતિ દ્વારા ખારી જમીનની સુધારણા | ૭૩ |
| ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વિવિધ પાકોનું હાઈટક ફાર્મિંગ કરતાં પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણો | ૭૪ |
| બદલાતા હવામાનમાં બાગાયતી પાકોનું નુકસાન ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો | ૭૮ |
| બદલાતા હવામાનની બાગાયતી પાકો ઉપર થયેલી અસરો | ૭૯ |
| બાગાયતી પાકોનું વ્યવસ્થાપન | ૮૩ |
| આબોહવામાં બદલાવની દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક ઉપર થયેલી વિપરીત અસરો | ૮૪ |
| બાગાયતી પાકોમાં રૂટ સ્ટોકનું મહત્વ વધારે ઉત્પાદન માટે અગત્યનું અંગ/ફાયદા | ૮૮ |
| પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણો | ૯૯ |
| શાકભાજનાં પાકોનો વિસ્તાર અને ઉત્પાદન | ૯૪ |
| બદલાતા હવામાનમાં અને જમીનની ખારાશને અનુકૂળ ખેતી/મધ્યપાલન એકવા કલ્યારલ ફાર્મિંગ, | |
| વ્યવસાય દ્વારા સારી આવક મેળવતા ગુજરાતના ખેડૂતમિત્રો અને સંસ્થાઓ. | ૧૦૨ |

| | |
|--|-----|
| ૯. મૂલ્યવર્ધક અન્ન-કૃષિ ઉત્પાદનનો અભિગમ | ૧૧૦ |
| મૂલ્યવર્ધક સાંકળ | ૧૧૧ |
| અન્ન-કૃષિ ઉત્પાદન સાંકળનો અભિગમ | ૧૧૧ |
| કૃષિ પેદાશોનું ટકાઉ મૂલ્યવર્ધક સાંકળનું માળખું | ૧૧૩ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદનનું ટકાઉપણું | ૧૧૩ |
| મૂલ્યવર્ધક કૃષિ પદ્ધતિના પાયાના સિદ્ધાંત | ૧૧૩ |
| મૂલ્યવર્ધિત કૃષિ સાંકળને સમાંતર ટકાઉપણાં સુધારવા માટેની શક્ય પદ્ધતિ અને ઉકેલ | ૧૧૬ |
| એક સરળ મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનમાં દર્શાવાયેલા ખોરાકની નુકસાની અને બગાડના કારણો અને ચેઈનના સહભાગીઓ-સૂત્રધારો દ્વારા લઈ શક્ય અને શક્ય પગલાં | ૧૧૮ |
| ખોરાકનું નુકસાન અને બગાડ ઘટાડવા માટેના શક્ય પગલાં | ૧૨૦ |
| બજારમાં સરકાર દ્વારા ખરીદી | ૧૨૪ |
| ૧૦. મૂલ્યવર્ધન - સ્થાનિક પ્રોસેસિંગ | ૧૨૫ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન - ફળ, અનાજ - સ્થાનિક કક્ષાએ પ્રોસેસ કરીને બજારમાં સીધી રીતે મોકલવું | ૧૨૫ |
| પુરવઠાની સાંકળ - સપ્લાય સાંકળ હાલની પરીસ્થિતિ | ૧૨૫ |
| સૂચિત પુરવઠાની સાકળ - સૂચિત સપ્લાય ચેઈન | ૧૨૬ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાંકળ વેચાણ પદ્ધતિ | ૧૨૬ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાંકળના લાભો | ૧૨૭ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાંકળ માટે ખેડૂતે ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દાઓ | ૧૨૭ |
| મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાંકળમાં પ્રોસેસિંગ મશીનના ઉપયોગ દ્વારા મૂલ્યવર્ધન | ૧૨૮ |
| કૃષિ ઉત્પાદન આધારિત ઉદ્યોગો માટેના કેટલાક લઘુ મશીનોની માહિતી | ૧૨૮ |
| ૧૧. સફળતાનાં ઉદાહરણો | ૧૩૧ |
| (૧) રૂકમાવતી રીવર બેઝિન મેનેજમેન્ટ પ્રોજેક્ટ | ૧૩૧ |
| (૨) દાહોદનું પરિવર્તન | ૧૩૪ |
| (૩) કૃષિમાં સાહસિક નેતૃત્વ કરતા ગુજરાતના ખેડૂતો | ૧૩૭ |
| (૪) સ્થાનિક નેતૃત્વનો વિકાસ | ૧૩૮ |
| (૬) જમીન તંદુરસ્તી વિશ્લેષણનાં આધારે સંતુલિત ખાતરનો ઉપયોગ - જંબુસર, ભરૂચ, ગુજરાત | ૧૩૮ |
| (૭) બાયો-ટેક્નોલોજી | ૧૩૮ |
| ૧૨. ઉપસંહાર | ૧૪૦ |
| ૧૩. બદલાતા હવામાનમાં ટકાઉ ખેતી માટે ખેડૂતો દ્વારા ઉદ્ભબતા પ્રશ્નો અને જવાબો | ૧૪૪ |
| ૧૪. સંસ્થાઓનો પરિચય | ૧૪૬ |
| નેશનલ કાઉન્સિલ ફોર કલાઈમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ટેવલપમેન્ટ એન્ડ પબ્લિક લિડરશીપ | ૧૪૬ |
| સાહિત્ય મુદ્રણાલય પ્રા.લિ., અમદાવાદ | ૧૪૭ |
| ૧૫. ખેડૂતમિત્રોને ખાસ વિનંતી | ૧૪૮ |

બદલાતા હવામાનમાં કુશળ ખેતી

કુશળ ખેતી એટલે શું ? શા માટે ?

ખેતી અને પશુપાલન એ વર્ષોથી ચાલ્યો આવતો વ્યવસાય છે. ખેડૂતો-પશુપાલકો જ્યારે જ્યારે ઝતુઓ અને તેની પરિસ્થિતિમાં બદલાવ થાય છે ત્યારે પોતાના વંશપરંપરાગત ઉપયોગ અને અનુભવોનો ઉપયોગ કરે છે, પરંતુ હાલમાં થતા કુદરતના ફેરફારો અગાઉ કોઈ પણ વખત ન બન્યા હોય તેવા છે. ફેરફારોની સંખ્યા વધી છે. તેની તીવ્રતા વધી છે. તે વ્યાપક પ્રમાણમાં કમોસમી બન્યા છે. સાથે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વરસાદ મોડો શરૂ થાય છે. બે વરસાદ વચ્ચે સમયાંતર વધતું જાય છે. વરસાદના દિવસો ઓછા થાય છે અને એકાદ દિવસમાં વધુ વરસાદ પડવાના પ્રસંગો વધ્યા છે. આના કારણે કૃષિ ઉત્પાદકતા ઉપર અસર પડી છે. આ અસર ના પડે અને ઉત્પાદકતા વધતી જાય તે માટે બદલાતા વાતાવરણમાં ‘કુશળ ખેતી’ આવશ્યક છે. સાથે સાથે સમગ્ર વિસ્તારની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિસ્થિતિ સંકલિત રાખી ખેતીનો વૃદ્ધિદર વધારવાનો છે.

બદલાતા વાતાવરણમાં તેની પ્રતિકૂળ અસરોને પહોંચી વળે એવી ખેતી એટલે કુશળ ખેતી. તેનાં અંગ નીચે પ્રમાણે છે :

૧. કાર્યપદ્ધતિ : વાતાવરણને અનુરૂપ અને વાતાવરણમાં થતા ઓચિંતા ફેરફારો થાય ત્યારે ટકાઉ ખેતી કેવી રીતે કરવી તેની ખેડૂતને જાણ અને આવકમાં ઘટાડો ન થાય તે માટે અગમચેતી.
૨. કૃષિપાકોની વ્યવસ્થાઓ : પસંદગીમાં ભિશ્રપાકો, પાકો અને ફળાઉ ઝાડ, પાકો અને ઘાસચારો, જરૂરિયાત મુજબ ફેરબદલી, ટૂંકાગાળાના પાકો.
૩. ખેડૂત પાસે એક કરતાં વધુ આવકનાં સાધનો જેવાં કે, ખેતી-પશુપાલન, ખેતી-મરધા-બતકા પાલન, ડાંગર અને મત્સ્યઉદ્યોગ, કૃષિ અને વૃક્ષો સાથે ઉગાડવાં, કૃષિ સાથે ગૃહઉદ્યોગ. આવી પરિસ્થિતિમાં એકની નિષ્ફળતા સામે અન્ય વિકલ્પથી આવક મળી રહે છે.
૪. કૃષિ અને પશુ સંવર્ધનમાં જ્યાં ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે તેમાં ઘટાડો : જેવાં કે સેન્ટ્રિય ખાતર, ટપક અને હુવારા સિંચાઈ પદ્ધતિ - પશુપાલનથી ઉત્પન્ન થતા છાણ જેના દ્વારા સૌથી વધારે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, તેના ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા નિકાલ વગેરે.
૫. કૃષિ - ઝાડ - પાન દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું ફોટોસિન્થેસીસ પ્રક્રિયા દ્વારા શોખણ થાય છે. તેથી ખેતી નીચે વધુમાં વધુ ખરાબાની જમીનમાં લેવામાં આવે તો હવામાંથી CO_2 ઘટી શકે. ગ્રીનહાઉસ ગેસ ઓછા થાય. સાથે રોજગારી અને અન્ન ઉત્પાદનની સમસ્યા હલ થાય તેમ છે. આથી રાખ્યી નીતિમાં કૃષિને સૌથી વધુ મહત્વ આપવાનો અભિગમ.
૬. આ સમગ્ર અભિગમમાં ખેતીને કેન્દ્રમાં રાખી ટકાઉ વિકાસનો ઉદેશ હાંસલ કરવાનો છે.

ટકાઉ વિકાસ :

સર્વસામાન્ય વ્યાખ્યા :

માનવ જરૂરિયાતો પૂર્ણ કરવા કુદરતી સંસાધનોનો એવો ઉપયોગ કરવો કે જેથી આવી જરૂરિયાતો માત્ર વર્તમાન સમયમાં જ નહિ, પરંતુ શાશ્વત સમય સુધી પૂર્ણ થતી રહે.

- વિકાસશીલ દેશોના સંદર્ભમાં : વ્યાપક રીતે પ્રચલિત અસરોના અનુસંધાનમાં વિશિષ્ટ અર્થવટન.
- આ એક લાંબા ગાળાની પ્રવૃત્તિ છે, જે દેશની સામાજિક-આર્થિક પ્રવૃત્તિને સ્પર્શ છે. તેમાં કુદરતી સંપત્તિના કુશળ ઉપયોગ દ્વારા થતો આર્થિક વિકાસ એ સૌથી મહત્વની બાબત છે.

- કુટુંબના અસ્તિત્વને ટકાવવા માટેની જરૂરિયાતો પૂરી કરે છે.
- આવકમાં ઘટાડો થયા વિના તે દરેકને પ્રાભુ બને છે.
- વ્યક્તિની આવકમાં વૃદ્ધિ અને જીવનધોરણમાં ઉત્તરોત્તર સુધારો થતો રહે છે.
- જે તે વિસ્તારની સમૃદ્ધિના વિકાસ સાથે ગરીબ પરિવારો અને અંતરિયાળ વિસ્તારના વિકાસને તેન્દ્રમાં રાખી, સમાજ અને દેશનો વિકાસ સાધી શકાય છે.

કુદરતી પરિષ્ઠળો :

- પરસ્પર આધારિત એવાં પાંચ કુદરતી શક્તિઓનોમાં આકાશ (વાતાવરણ), સૂર્ય, પૃથ્વી, જળ અને વનસ્પતિનો સમાવેશ થાય છે.
- પ્રકૃતિનાં આ પાંચ શક્તિઓનો પ્રકૃતિનું સંતુલન અને સમતા જાળવે છે. તેમનો યોગ્ય ઉપયોગ જીવનનિર્વાહ માટે જરૂરી મૂળભૂત સંસાધનોનું સર્જન કરે છે, જેનાથી જીવસૃષ્ટિ ટકાવીને ટકાઉ વિકાસ જાળવી શકાય છે.
- આ શક્તિઓનો વર્ષની વિવિધ ઋતુઓ અને ઋતુચક માટે જવાબદાર છે, જે પર્યાવરણ તરીકે ઓળખાય છે.
- કોઈ પણ એક કુદરતી શક્તિઓનો વધુ પડતો અથવા તો અયોગ્ય ઉપયોગ અન્ય શક્તિઓત પર વિપરીત અસર કરે છે, જેની કુદરતી સંતુલન પર પ્રતિકુળ અસર થાય છે. જેમકે ભૂગર્ભ જળને વધુ પડતું બેંચવાથી જમીનમાં ખારાશ દાખલ થાય છે, વધે છે અને રણ વિસ્તાર વધારે છે. પ્રાકૃતિક બળતણના વધારે પડતા ઉપયોગથી હાનિકારક ગેસો વાતાવરણમાં પ્રસરે છે, જેનાથી ઉષ્ણતા શોષણાનું સંતુલન જોખમાય છે, પરિણામે વધારે ગરમી પેદા થાય છે.
- આ શક્તિઓનોનો અસમાન ઉપયોગ અનેક પ્રકારની સામાજિક અને રાજકીય અસ્થિરતાઓ સર્જ છે, પરિણામે સમાજમાં અસંતોષ પેદા થાય છે.

‘વૈશ્વિક ઉષ્ણતા’ની અસર :

- જ્યારે જ્યારે કુદરતી સંતુલન અને તેના શક્તિઓની સમતુલા જોખમાય છે ત્યારે તેની સૌ પ્રથમ માઠી અસર ઋતુચક પર પડે છે. આથી પર્યાવરણમાં પરિવર્તન આવે છે જે મોટે ભાગે કુદરતી આફિતોમાં પરિણામે છે. આધુનિક સમયમાં તેને ‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’થી સર્જતું ‘ગ્લોબલ વોર્મિંગ’ કહેવામાં આવે છે.
- સમગ્ર વિશ્વમાં હાલમાં અસંખ્ય કુદરતી આફિતો સર્જય છે, જે રોજેરોજના ‘બ્રેકિંગ ન્યૂઝ’ બની રહી છે. આ કુદરતી આફિતોની ધનિજતા અને અસરો ગઈ સદીના પ્રમાણમાં વર્તમાન સદીમાં ભયાનક પુરવાર થઈ છે. આની સીધી જ અસર ટકાઉ જીવનનિર્વાહ ઉપર થાય છે - ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કૃષિને અસર થતાં નાના ખેડૂતો ગરીબી રેખાની નીચે ધકેલાય છે. પાકોની ઉત્પાદકતા પર વિપરીત અસર થતાં ખાદ્યાનોના ભાવવધારામાં પરિણામે છે, જેની શહેરી અને ગ્રામ્ય એમ બધી જ વસ્તી પર વિપરીત અસર થાય છે.

વૈશ્વિક ઉષ્ણતાનાં કારણો :

વૈશ્વિક ઉષ્ણતાનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :

- હાનિકારક ગેસો હવામાં વધુ પ્રમાણમાં પ્રસરતાં વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડ (CO_2)નું એકત્રીકરણ થતાં ઉષ્ણતા વધે છે.
- વૈશ્વિક વસ્તીવધારાના કારણે વીજળી અને ગેસનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય છે.
- વિકાસશીલ દેશોના મધ્યમવર્ગના લોકોની આવકમાં વધારાના કારણે વીજળી તથા ગેસોનો ઉપયોગ થતો હોય તેવાં ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે.

- લોકોની આવક અને ઈન્ફાસ્ટ્રક્ચરની વધુ સારી સવલતોના લીધે વાહનવ્યવહારનો ઉપયોગ વધ્યો છે.
- ઔદ્યોગિકિકરણ, શહેરીકરણ તેમજ બાંધકામ અને ખાણઉદ્યોગમાં વધારો થયો છે. જેમાં જમીન જવાથી કૃષિ વિસ્તારમાં ઘટાડો થાય છે અને કુદરતી રીતે શોખાતા કાર્બન ડાયોક્સાઈડ ઓછો થાય છે એટલે વાસ્તવમાં CO_2 નું પ્રમાણ વધે છે.
- ‘ગ્રાન્લોબલ વોર્મિંગ’ માટે જવાબદાર પરિબળો વકરવાનું ચાલુ રહેતાં ભવિષ્યમાં તેની અસરો અનેકગણી વધવાની સંભાવના રહે છે.

કાર્બન ડાયોક્સાઈડ (CO_2)ને શોષવાની સફળ ટેકનોલોજી :

એતી (વનસ્પતિ) પ્રકાશ-સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડ (CO_2)ને શોષે છે તે કુદરતની કરામતથી સૌ કોઈ પરિચિત છે. જો કે લીલોતરીમાં થઈ રહેલ ઘટાડો કાર્બન ડાયોક્સાઈડના શોષણમાં પણ થઈ રહેલ ઘટાડો કે વનસ્પતિ દ્વારા વાતાવરણમાં છોડવામાં આવતા ઓક્સિજન વિષેની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ નીચેની બાબતોને લીધે એતી (વનસ્પતિ)ના વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

- શહેરીકરણમાં વૃદ્ધિ
- ઔદ્યોગિકિકરણ અને આંતરમાળખાડીય સેવાઓમાં વૃદ્ધિ
- વધુ અને નિશ્ચિત આવક મેળવવા ખેડૂતોનું શહેર તરફ પ્રયાણ, જેનાથી ઉદ્ભબેલ બિનઉપયોગી ખેત-જમીનની સમસ્યા
- અનિયમિત અને વધુ પડતા વરસાદને કારણે જમીનની ખારાશ અને ધોવાણમાં વધારો, જેનાથી ખેતપાકોને નુકસાન થાય છે.
- સટોડીયા દ્વારા જમીનની મોટા પાયે ખરીદી, જેનાથી જમીનની કિંમતમાં અસાધારણ વધારો થયો છે.

આ ઘટનાઓને કારણે વિશ્વમાં ખાદ્યાન્નમાં ખૂબ મોટો ઘટાડો થયો છે અને વિકાસની આવી આંધળી દોટને કારણે દુનિયાના ઘણા ભાગોમાં ગરીબો માટે અનાજની ઉપલબ્ધિ એક વિકટ સમસ્યા બની છે.

વર્તમાન સમયમાં ભારતમાં કુદરતી આફતો અને તેની અસરો :

અન્ય દેશોની જેમ ભારતમાં કુદરતી આફતો ઉદ્ભબી છે અને નવી સદીમાં તેની સંઝ્યામાં વધારો થયો છે.

ગુજરાતનો ભૂકુંપ : જાન્યુઆરી - ૨૦૦૧

ભારત ખાતેના ભૂકુંપોમાં ભૂજ કેન્દ્રનો આ ભૂકુંપ વિનાશક હતો.

| | | | |
|-------------------|----------|----------------|--------------|
| મૃત્યુ આંક | : ૧૮,૭૨૭ | ઈજાગ્રસ્ત | : ૧,૬૬,૦૦૦ |
| ધરવિહોણા | : ૬ લાખ | પડી ગયેલાં ધરો | : ૩,૪૮,૦૦૦ |
| ઢોરોનો મૃત્યુ આંક | : ૨૦,૦૦૦ | અંદાજિત નુકસાન | : ૧.૩ બિલિયન |

આ ધરતીકુંપ પછી પણ આ વિસ્તારની ધરતી પર નિયમિત રીતે ઘણા દિવસો સુધી ધરતીનો પ્રૂજારો રહ્યો હતો.

તાજેતરનાં વર્ષોમાં ભારતમાં કુદરતી આફતો અને તેની અસરો :

- ૨૦૦૪ ડિસેમ્બરમાં આવેલ સુનામી દરમિયાન આંદામાન-નિકોબાર, પોનીયેરી, કેરાલા, આંધ્ર પ્રદેશમાં ખેતીપાક, પશુધન, ધરો, માનવમૃત્યુ મોટી સંઝ્યામાં થયાં હતાં.

- ૨૦૦૫ જુલાઈમાં મુંબઈના પૂરમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અનેકવિધ નુકસાનો થયાં.
- ૨૦૦૬ના સુરતના પૂરમાં પાક, ઢોર અને માનવહાની, શહેરી સેવાઓને માઠી અસર, અંદજે રૂ. ૨૨,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.
- ૨૦૦૭માં રાજ્યસ્થાનમાં ભારે વરસાદને કારણે ઢોર તથા પાકને ભારે નુકસાન, રોગચાળાના ફેલાવાની અસર.
- ૨૦૦૮માં બિહારની કોશી નદીમાં પૂરને લીધે બિહાર, યુ.પી.માં વ્યાપક નુકસાન.
- ૨૦૦૯ના વિલંબિત ચોમાસાને લીધે દુષ્કાળની માઠી અસર ઘણાં રાજ્યોમાં થઈ.
- ૨૦૧૦ પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને કરા પડવાની ઘટનાઓ ઘણી બને છે, તેની ઉભા પાક અને ફળજીડ પર ઘણી માઠી અસરો થાય છે.
- ૨૦૧૧-૧૩ ઓરિસ્સામાં દરિયાઈ વાવાઝેઠું, ઉત્તરાંચલમાં ભારે પૂર અને આ કારણે ખેતી અને પશુપાલનને ભારે નુકસાન

વાતાવરણીય પરિવર્તન નીચે મુજબની કુદરતી આફ્ટોમાં પરિણામે છે :

- જાનદાનિ
- ખેત-પાક અને પશુધનનું નુકસાન
- જીવનનિવીહનાં સાધનો ગુમાવવાં
- રોગચાળો ફેલાવાનું જોખમ
- ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓને ભારે નુકસાન
- સામાજિક અને આર્થિક વિકાસની ગતિમાં પીછેછઠ
- ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ગરીબી તરફ ધકેલાય છે.
- જુદા જુદા પાકોની ઉત્પાદકતામાં ઘટાડો થતાં અન્નની અધતના પડકારનો સામનો કરવો પડે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનું તાજેતરમાં સંશોધન આ વાતની પુષ્ટિ કરે છે.

(અ) આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાપમાનની મગફળીનાં પાક પરની સંવેદનશીલતા સંબંધી સંશોધન નીચે દર્શાવેલ છે : (cv.JL-24)

| તાપમાનનો સરેરાશ ફેરફાર (0 C) | અનાજ ઊપજ પર અસર (kg/ha-1) | % પાયાની સરેરાશ ઊપજ (2200 kg/ha-1) માં ઘટાડો |
|---------------------------------|------------------------------|---|
| ૧ | ૨,૧૫૨ | ૨.૧ |
| ૨ | ૧,૮૮૮ | ૧૪.૨ |
| ૩ | ૧,૫૧૪ | ૩૧.૨ |

ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર ૧૮ લાખ હેક્ટર છે. એટલા માટે જો ૩૦ C ના તાપમાનમાં વધારો થાય તો મગફળીની ઊપજમાં ૩૧.૨ ટકા ઘટાડો થાય. એટલે કે વાર્ષિક ૧૩.૨ લાખ ટનનું ઉત્પાદન ઘટે.

Source : Dr. A. M. Shekh, V.C. Anand Agricultural University, Gujarat

(બ) આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાપમાનની ઘઉંની પેદાશ પરની અસરોનું સંશોધન (cv.GW-496)

| તાપમાનનો સરેરાશ ફેરફાર (0 C) | અનાજ ઉપજ પર અસર (kg/ha-1) | % પાયાની સરેરાશ ઉપજ (2200 kg/ha-1) માં ઘટાડો |
|---------------------------------|------------------------------|---|
| ૧ | ૪,૦૭૮ | - ૩૦ |
| ૨ | ૩,૬૭૫ | - ૩૭ |
| ૩ | ૩,૨૬૬ | - ૪૪ |

ગુજરાતમાં ઘઉંના વાવેતરનો કુલ વિસ્તાર ૪.૮૮ લાખ હેક્ટર છે. એટલા માટે જો ૩૦ C ના તાપમાનમાં વધારો થાય તો ઘઉંની ઉપજમાં ૪૪ ટકા ઘટાડો થાય. એટલે કે વાર્ષિક ૧૨.૫ લાખ ટનનું ઉત્પાદન ઘટે.

Source : Dr. A. M. Shekh, V.C. Anand Agricultural University, Gujarat

વર્તમાનમાં દુગળીના ભાવમાં થયેલા અસાધારણ વધારાએ ઘણો વિવાદ પેદા કર્યો છે. જો આ જ ઘટના ઘઉં-ચોખા માટે ઉદ્ભબે તો મોટી સામાજિક અને રાજકીય અસ્થિરતા સર્જય. હવે વાતાવરણમાં થનાર સંભવિત ફેરફારો અને તેની અસરોની વાત કરીએ.

ભારતમાં ભવિષ્યની સ્થિતિ :

- ૨૧મી સદીના અંત સુધીમાં વરસાદની રચનામાં ફેરફાર થશે.
- ઉષ્ણતામાનમાં ૨° થી ૪° સે. વધશે.
- મોટા ભાગના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધશે.
- બે વરસાદ વચ્ચે ગાળો વધશે. કેટલાક દિવસોમાં વધુ વરસાદ તીવ્રતાથી આવશે.
- શિયાળામાં અને ચોમાસાના અંતમાં પ્રમાણમાં વધુ ગરમી રહેશે.
- ચોમાસાના અંતમાં વાવાઝોડાનું પ્રમાણ વધુ જોવા મળશે.
- કમોસમી વરસાદ, વાવાઝોડા અને કરા પડવાનું પ્રમાણ વધશે.

વૈશ્વિક ગરમીની ભારતમાં ખેતી ઉપર જોવા મળેલ અસરો :

- છેલ્લા દાયકામાં ગરમીનું પ્રમાણ ૧/૨° સે. વધેલી જોવા મળી છે.
- સને ૨૦૦૨ના દુષ્કાળથી ૧૦ ટકા પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ.
- ૨૦૧૨માં ચોમાસું મોંસું શરૂ થવાથી (જુલાઈના અંતમાં) ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળેલ.
- ઘઉંના મોડા વાવેતરથી ઉત્પાદનમાં ઘઉં પાકવાની અંતિમ અવસ્થાએ તાપમાનના ભારને કારણે ઉત્પાદન ઘટે છે.
- સને ૨૦૦૩ (ડિસેમ્બર) અને ૨૦૦૪ (જાન્યુઆરી)માં થીજવી દેનારી ઠંડીને કારણે રાઈ, ટામેટો, બટાકાં, રીંગણા, આંબા, જામફળ, પાપૈયા વગેરેના ઉત્પાદન ઉપર માટી અસર જોવા મળેલ.
- સને ૧૯૮૮ અને ૨૦૦૫માં (૧,૫૦૦ મિ.મી.થી વધુ) અતિવૃદ્ધિને કારણે ચોમાસું દુગળીના ઉત્પાદન ઉપર ભારે અસર થતાં તેના ભાવ વધી ગયા હતા.

- સને ૨૦૦૮માં પશ્ચિમ દરિયાઈ કિનારાના કાજુના વાવેતરના ઉત્પાદન તથા ગુણવત્તામાં ઘટાડો જોવા મળેલ.
- મે, ૧૯૯૮માં દરિયાની સપાટીનું ઉષ્ણતામાન વધતાં (2.0° - 2.4° સે.) દરિયાઈ કિનારે રહેતા ૮૫ ટકા પરવાળા જીવોમાં નિખાર જોવા મળેલ.

વાતાવરણના બદલાવની અસરો એકંદરે ત્રણ મોટા વર્ગમાં વહેંચી શકાય :

- છેલ્લાં દાયકામાં થયેલ બદલાવનું મૂલ્યાંકન કરી ખેતી માટે નવી વ્યૂહરચના ઘડવાની રહે.
- મોસમ દરમિયાન આવતા અણધાર્યા વાતાવરણના બદલાવોને પહેંચી વળવા ‘આકસ્મિક આયોજન’નો અમલ કરવો પડે.
- મુખ્ય આફ્ઝો જેવી કે, પૂર અથવા ચકવાતની સમગ્ર જીવનવ્યવહાર પરની ગંભીર અસરને યથાવત પરિસ્થિતિમાં લાવવા નિશ્ચિત વ્યૂહરચના અપનાવવાની રહે.

બદલાતા વાતાવરણની અસરોને ઓછી કરવા આપડો અગાઉથી તેને અટકાવવાનાં પગલાં ભરવા જોઈએ. સમયસર કાર્યવાહી અને આયોજન તથા સંયુક્ત પ્રયત્નો કરવાથી વાતાવરણના બદલાવની વિપરીત અસરો મંદ પાડી શકાય છે, ટકાઉ ખેતી જાળવી શકાય છે. વાસ્તવમાં વધુ આવક પણ પ્રાપ્ત કરી શકાય તેવી એક આ મોટી તક છે. જે બાબતનું વિશ્લેષણ હવે પછી કરવામાં આવ્યું છે.

● ● ●

બદલાતા હવામાનમાં જળયક

સિંચાઈ અને પશુપાલન માટે પાણીની સમસ્યા

ઘરતાં જતાં ભૂગર્ભ જળસોતો :

- ઉંચી ક્ષમતાવાળા પંપ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ ઉંથી પાણી બેંચવાના કારણે ભૂગર્ભજળનાં સ્તર નીચે જવા પામ્યાં છે.
- આના પરિણામે સમુદ્રનાં ખારા પાણી દરિયા નજીકની જમીનની નીચે તળોમાંથી ભૂતળમાં ધસી જાય છે. આથી જમીનની ખારાશ વધી છે. જમીનની ઉત્પાદકતા ઘરતી જાય છે.

એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં કમશા: જમીનમાં ખારાશ વધતી જાય છે. ટ્યૂબવેલમાં પાણીનાં તળ ૧૦૦ ફૂટથી વધુ નીચે ગયા છે. દરિયાનું પાણી દરિયાની નજીકમાં આવેલ જમીનની તિરાડો મારફતે ફળદૃપ જમીનો તરફ ધસી રહ્યું છે, જેની અસર અમદાવાદ અને તેની આજુભાજુના તાલુકાઓમાં પણ વર્તાય છે. ટ્યૂબવેલથી વધુને વધુ પાણીનો બેંચાવ આ પરિસ્થિતિ વધુ વિકટ બનાવી રહેલ છે.

વાસ્તવમાં, બેતીને માટે પાણીની ઉપલબ્ધિ એક મોટી સમસ્યા ધીરે ધીરે બની રહી છે. આનું વધારાનું કારણ એ છે કે, નવા નવા શહેરી વિસ્તારો ઝડપથી વધતા જાય છે, જેમાં શહેરીઓના બાથરૂમમાં પુષ્ટ પાણીનો વય થાય છે. વળી, આધુનિક મોટી શક્તિવાળા પર્મોનો આવી ટાઉનશીપોમાં ઉપયોગ કરવામાં આવે છે. જે ભૂતળનું પાણી ઝડપથી બેંચી લે છે.

ટકાઉ બેતી માટે બેદૂતને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને જાળવણી-સંગ્રહ એ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે.

ભારતમાં વાતાવરણ બદલાવની જળયક ઉપર થયેલ અસરો :

| વિસ્તાર/સ્થાન | અસરો | અનુસંધાન |
|------------------------------------|---|-----------------------------|
| સમગ્ર ભારત | <ul style="list-style-type: none"> ● મધ્ય ભારત વિસ્તારમાં ચોમાસાની ઝતુ જમીન ઉપર વરસાદના વહેતા પાણીમાં વધારો જોવા મળે છે. ● જ્યારે શિયાળામાં આ વધારાનો તફાવત નહીંવત્તુ પ્રમાણમાં હોય છે. ● ચોમાસાની ઝતુમાં બાણીભવનનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. | લાલ અને એન્કર ૧૧૮૩ |
| ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ | <ul style="list-style-type: none"> ● દરિયાની સપાટીમાં ૧ મીટર ઊંચાઈનો વધારો થયેલ છે. જેને લીધે વિસ્તારમાં ૧,૭૦૦ કિલોમીટર અગત્યની બેતીલાયક જમીનોમાં દુબાણમાં જતાં કૃષિ ઉત્પાદન ઉપર વિપરીત અસર જોવા મળેલ છે. | આઈપીસીસી, ૧૮૮૨ |
| ભારતીય દરિયાઈ કિનારો (ગુજરાત સહિત) | <ul style="list-style-type: none"> ● દરિયાની સપાટીમાં ૧ મીટર વધારો થતાં ભારતીય દરિયાઈ કિનારાની કુલ ૫,૭૬૩ કિ.મી. વિસ્તાર અને ૭.૧ લાખ વસ્તી જે લોકોના ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થયેલ છે. | જેનેન્યુ, ૧૮૮૩ |
| સમગ્ર ભારતમાં (ગુજરાત સહિત) | <ul style="list-style-type: none"> ● એકદરે સમગ્ર ભારતમાં બાણીભવનના પ્રમાણમાં વધારો થયેલ જોવા મળેલ છે. | ચાહોપાધ્યાય અને હુલ્મ, ૧૮૮૭ |
| સમગ્ર ભારત (ગુજરાત સહિત) | <ul style="list-style-type: none"> ● જમીનમાં ચોમાસાની ઝતુમાં ૧૫-૨૦ ટકા બેજનું પ્રમાણ જોવા મળેલ છે. | લાલ અને સીંગ ૨૦૦૧ |

| | | |
|-------------------------------------|---|-------------------|
| રાજ્યસ્થાન અને ગુજરાત | ● જમીનના ઉષ્ણતામાનમાં વધારો જોવા મળેલ છે. | ગોયલ, ૨૦૦૪ |
| ભારતની નદીઓનો વિસ્તાર (ગુજરાત સહિત) | ● સામાન્ય રીતે વરસાદના વહેતા પાણીનો ઘટાડો જોવા મળેલ છે. | ગોયલ અને રાઉ ૨૦૦૬ |

પ્રાપ્તિસ્થાન : ડૉ. એ. કે. સીંગ - તેચ્ચુટી ડાયરેક્ટર જનરલ, આઈ.સી.એ.આર., નવી દિલ્હી

વાતાવરણ બદલાવ અને જળચક (Water Cycle) :

| જળચક માટેનું પરિબળ | વાતાવરણમાં બદલાવની સંભવિત અસરો |
|--|---|
| વાર્ષિક વરસાદમાં થનાર અસર | વૈશ્વિક સ્તરે ૨૧મી સદીમાં નોંધપાત્ર વધારો-ઘટાડો તફાવત જોવા મળશે. |
| ચોમાસા દરમિયાન વરસાદ પડવામાં તફાવત | દરેક જગ્યાએ વરસાદની ઋતુ દરમિયાન વરસાદ પડવાની પેટનીમાં તફાવત - ક્રમિક બે વરસાદ વચ્ચે સમયાંતરમાં વધારાની અસર જોવા મળશે. |
| ચોમાસા દરમિયાન વરસાદ પડવામાં તફાવત જોવા મળશે. | <ul style="list-style-type: none"> ● દરેક જગ્યાએ વધારો-ઘટાડો જોવા મળશે. ● ચોમાસાની ઋતુ નોર્મલ કરતાં મોરી (Late) શરૂ થશે. ● ચોમાસા દરમિયાન વરસાદની અનિયમિતતાથી સુકારાની પરિસ્થિતિ અથવા/ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. |
| પૂરની અસર (Flood) | ચોમાસામાં ભારે તીવ્રતાથી વરસાદ પડવાની શક્યતા છે. પૂરની અસરને લીધે ઊભા પાકને ગંભીર નુકસાન થશે. પૂરથી જમીનનું ઉપરનું પડ ધોવાણ થવાથી જમીનની ફળદૃપતામાં ઘટાડો થશે. દા.ત., તાજેતરમાં અંબિકા અને પૂર્ણ નદીમાં આવેલ પૂરની અસરો. |
| સુકારાની સુકારાજનક પરિસ્થિતિની અસર | સુકારાને કારણે અને વરસાદની અનિયમિતતાને લીધે જુદા જુદા વિસ્તારમાં પાણીની આવકમાં તફાવત જોવા મળશે. વરસાદની અનિશ્ચિતતાને લીધે ઉષ્ણતામાનમાં વધારો જોવા મળે છે. જેને લીધે બાધીભવન વધુ થવાથી જમીનમાં ભેજની ખેંચ પેદા થાય છે. જેની પાક ઉત્પાદન ઉપર માઠી અસર જોવા મળે છે. |
| જમીનમાં પાણીના તળની સપાટી ઉપર થતી અસર | વરસાદ પડવાના જથ્થામાં અને વરસાદ પડવાના દિવસોની સંખ્યામાં ઘટ થવાથી નદીઓ અને જમીનમાં રીચાર્જનું પ્રમાણ ઘટશે. આ ઉપરાંત જમીનના ભૂતળમાંથી વધુ પાણી ખેંચાવાથી ભૂગર્ભજળની સપાટીમાં સતત ઘટાડો જોવા મળશે. |
| બાધીભવન અને બાધ્યોત્સર્જન | હવામાનમાં ઉષ્ણતામાનમાં વધારો થતા બાધ્યોત્સર્જન અને બાધીભવનમાં અતિ તીવ્ર વધારો જોવા મળશે. ખાસ કરીને દૂધાળાં હોરની પીવાના પાણીની જરૂરિયાત વધશે. |
| નદીઓના મુખ પ્રદેશ અને જમીનમાં ખારાશના પ્રમાણમાં થતી અસરો | દરિયાના પાણીનું સ્તર ઊંચું થવાથી ભરતી વખતે, દરિયાકિનારે અને જમીનમાં અંદરના ભાગમાં અને નદીઓના તટમાં ખારાશનું પ્રમાણ વધશે. ઉષ્ણતામાન વધવાથી જમીનના નીચેના ક્ષારો ઉપર આવશે જે જમીનને ખારી બનાવશે. આ તમામની અસર પાકોની ઉત્પાદકતા ઉપર પ્રતિકુળ રહેશે. |

પ્રાપ્તિસ્થાન : કલાયમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર - FAO - 2013માંથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ કરવામાં આવ્યું છે.

વातावरणના ભદ્રાવશી જળથીક (Water Cycle)માં સંભવિત વિપરીત અસરો અને તેના ઉપયોગ :

| વિવિધ ક્ષેત્ર પરિસ્થિતિ ધરાવતા વિસ્તારો | નિર્માણ થનાર સંભવિત પરિસ્થિતિ | વાતાવરણ ભદ્રાવની વિશેષ અસરો | જનજીવનને સ્થાની શામાજિક પ્રજ્ઞનો | સ્થૂળિત ઉપયોગો |
|--|---|---|---|--|
| કંઈ-સૌ. ૨૧૫૨ અને ઉત્તર ગુજરાત (સ્ક્રો- અંધુસ્ક્રો (Low Rainfall Zone) | <ul style="list-style-type: none"> વરસાદની અનિયમિતતા. સુકુરાત (સ્ક્રો-વિસ્તાર) પૂરની પરિસ્થિતિ શ્રીયું ઉજાતામાન | <ul style="list-style-type: none"> વરસાદની અનિશ્ચિતતા. અનિયમિતતા એને અનિયમિતતા બેંકૂતોને ચિંતા ત્રયાજવે. જમીનની ફળકૃપા અને ઉત્પાદકતા પર વિપરીત અસરો વધારે (ઉજાતામાનથી દૂધ્યાળાં હોયની દૂધ આપવાની શક્તિમાં ઘટાડે થાય છે. | <ul style="list-style-type: none"> વાતાવરણ ભદ્રાવની અનિયમિતતાને લીધે પ્રાકની ઉત્પાદકતા અને દૂધની આવકાના ઘટાડાના કરણે ગરીબીનું પ્રમાણ વધવાની શક્યતા સંકષિત દાખલ જગતના ઝોતાની કારણે કાર્યક્રમ ઉપયોગ કરવો. સુકૃતાની પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકો અને પણુંઓનું સંભાવિત સ્થળાંતર કંડમો-વોટરશેડ થોળનાં બંધપૂલા યોજના ઘાસથારના તેપે અને પીવાના પાણીની ખાસ વહેન વ્યવસ્થા એત-તલાવયી પાક વિમા યોજનાનો લાયાન લેવો. અપકલ્પિત પાક અધ્યોજનાંની અપાપેલી સ્થાનાંઓનો અભિનવ કરવા અને શક્ક્ય હોય ત્યાં મિશ્રપાક લેવા. જે વિસ્તારમાં વધુ વરસાદ પુરતી હોય ત્યાંથી ધારસારે ગ્રાન કરવો. દા.ત., દક્ષિણ ગુજરાતમાં આવેલ સહકારી સુગર મુંબી પાસે શેરવાના કુચાલ. | <ul style="list-style-type: none"> જગતસંચય અને જગત સંરક્ષણના વિવિધ ભાવામણ કરેલ ઉપયોગો. અપનાવવા. સેક્ટરી, અધ્યક્ષરકારી, પુલિલની ભાગવાની દ્વારા થતાં વિકાસનાં કંડમો-વોટરશેડ થોળનાં બંધપૂલા યોજના સેક્ટરી, પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકો અને પણુંઓનું સંભાવિત સ્થળાંતર કંડમો-વોટરશેડ થોળનાં બંધપૂલા યોજના એત-તલાવયી પાક વિમા યોજનાનો લાયાન લેવો. અપકલ્પિત પાક અધ્યોજનાંની અપાપેલી સ્થાનાંઓનો અભિનવ કરવા અને શક્ક્ય હોય ત્યાં મિશ્રપાક લેવા. જે વિસ્તારમાં વધુ વરસાદ પુરતી હોય ત્યાંથી ધારસારે ગ્રાન કરવો. દા.ત., દક્ષિણ ગુજરાતમાં આવેલ સહકારી સુગર મુંબી પાસે શેરવાના કુચાલ. |

| વિવિધ ક્ષેત્ર પરિસ્થિતિ ધરાકતા વિરસ્તારો | નિમ્નાંશ થનાર સંભવિત પરિસ્થિતિ | વાતાવરણ ભડકાવની વિશિષ્ટ અસરો | જનજીવનને સ્પર્શિતા આમાર્ગિક પ્રક્રિયા |
|--|---|---|---|
| દક્ષિણ ગુજરાત (High Rainfall Zone) | <ul style="list-style-type: none"> વાર્ષિક વરસાદમાં સંભવિત ઘટાડો વરસાદના દિવસોની અનિયમિતતા ખૂબાં પૂર્ણ પ્રક્રિયા દૂસરી પ્રક્રિયાનું હોય. ઉષ્ણતામાનમાં વધારો પૂર્ણ પરિસ્થિતિના પ્રક્રિયા ક્રોસમ્યુનિ વરસાદ અને માવઠા. | <ul style="list-style-type: none"> વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતા ખેડૂતોને વિનાનિ આવાયે જમીનની ફળજીવતા અને ઉત્પાદકતા પૂર્ણ અસર થવાની સંભવિતતા અસરો ફળજીવોમાં પરિપક્વ થવાની અવસ્થા વખતે વિપરીત અસરો ક્રોસમ્યુનિ વરસાદ અને માવઠા. વરસાદના અનિયમિતતામાં વધારો પ્રાણીની લભ્યતામાં ઘટવાયી પાડો અને ફળજીવની ઉત્પાદકતા ઉપર અસર | <ul style="list-style-type: none"> ગરીબ અને આદિવાસી ખેડૂતોની નવી બુબતો અપનાવવાની શક્તિ એણી હોવાયી તેમની આવક ઉપર વધુ અસર થવાની સંભવિતતા અસરો જમીનની ફળજીવતા અને ઉત્પાદકતા પૂર્ણ નિયતજીવ માટે પગલાં લેવાં. આક્રિસ્ટિક પ્રકાર આચેજનમાં આપેલી સ્ક્રેનનાઓનો અમલ કરવો અને શક્ત હોય તાં મિશ્રપ્રકાર લેવા. દેંકા સમયમાં તેચાર થાય તેવાં પ્રક્રિયા જોઈએ તેવા પાડો. દા. ટ., એંડ્રા પૂર્ક પ્રિયત આપવા માટે ફાર્મ ઉપર પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પ્રિયત માટે ટપ્પક પ્રકાર પોજનાનો લાભ લેવો. પ્રિયતના લાભ ઓતનો ઉપયોગ કરવો જોઈએ. આમસેવકી અને વિસ્તરણ અધિકતરીએ ગરીબ બેદૂતોના પ્રકાર માટે થ્યાન આપવું અને મદદગાર થર્ચું. |
| મધ્ય ગુજરાત (Medium Rainfall Zone) | | | |

ટકાઉ ખેતીમાં સંકલિત પિયત વ્યવસ્થાપન (Integrated Water Management) :

જોડુત્વમિત્રોએ પાણીના વ્યવસ્થાપન માટે સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે. તેના માટે નીચેનાં પગલાં લેવાં અનિવાર્ય છે :

૧. ખેતતલાવડી અને ટ્રેન્ચ પદ્ધતિનો ઉપયોગ, આથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે.
૨. ટપક અને કુવારા પદ્ધતિનો ઉપયોગ
૩. ખેતીમાં મલ્લિંગ, સેન્ટ્રિય ખાતરો, લીલો પડવાશનો ઉપયોગ
૪. મિશ્ર પાક પદ્ધતિ, ફળાઉ ઝાડ સાથે ખેતી
૫. સરકારશ્રીની વોટરશેડ અને સહભાગી ચેકડેમની યોજનાનો મહત્તમ લાભ
૬. હ્યાત તળાવો, ચેકડેમો અને નહેર-કેનાલની સરફાઈ અને જળવણી.

ઉપરોક્ત તમામ બાબતો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો, પરંતુ સૌથી મહત્ત્વની બાબત - સહિયારા પ્રયત્નો કરવા - કોઈ શરૂ કરશે એમ રાહ જોઈ બેસી ન રહેવું. પાણીની ઉપલબ્ધિ રહેશે, પણ અગાઉની જેમ નહીં. એટલે પાણીનો મહત્તમ સંગ્રહ એ આવશ્યક બાબત બને છે.

● ● ●

બદલાતું હવામાન અને જમીન-ભૂમિ

જમીનની ઉત્પાદકતા ઉપર થતી અસરો અને તેના ઉપાયો :

વાતાવરણના બદલાવની સીધી અસર જમીનની ફળદુપતા ઉપર થાય છે. વાસ્તવમાં પાકના વિકાસમાં જમીનનો મહત્વનો ફાળો છે :

- જમીન પાકને જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે, પરંતુ ઓછા વરસાદ અથવા ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થતાં અનુક્રમે જમીન દ્વારા મળતા ભેજ/પાણી તથા પોષકતત્વો પાકને પૂરતા મળી શકતા નથી.
- જમીનની ગરમી વધતાં સેન્ટ્રિય પદાર્થ જલદી નાશ પામે છે.
- પાકને ભૌતિક રીતે ટંડ્યાર ઊભા રહેવામાં ટેકો આપે છે.
- જમીન જૈવિક કિયાઓ, જૈવિક વિવિધતા તથા પાકની ઉત્પાદક જાળવી રાખે છે.
- જમીન બીજના સંવર્ધન માટે માધ્યમ પૂરું પાડે છે અને સતત વિકાસ માટે ખાતરી આપે છે.
- જમીનમાંથી ખોરાક, રેસા (કપડા), બળતણ અને ઔષધીય ઉત્પાદન વગેરે મેળવી શકાય છે કે જે જીવનની પ્રાથમિક જરૂરિયાત છે.
- જમીન, છોડ તથા અન્ય જીવ માટે જરૂરી ભેજ પકડી રાખે છે અને તેમને જરૂરી પાણી પૂરું પાડે છે.
- જમીન એ પાણી માટે ગળણી તરીકે તથા ઝેરી પદાર્થોની અસરોને નબળી બનાવવાનું કામ કરે છે.
- જમીન કાર્બન, ઓક્સિજન અને પાક માટે જરૂરી પોષકતત્વો જેવાં કે, નાઈટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્ખિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર પૂરા પાડે છે, જે પાક ઉત્પાદન અને વાતાવરણ ઉપર અસર કરે છે.
- જમીનજન્ય જીવાત અને જમીનીય રોગોનું નિયમન કરવામાં જૈવિક વિવિધતાના ફળાનો ઉપયોગ કરવો જોઈએ.
- જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ, સેન્ટ્રિય પદાર્થ, ખાતર, જીવાત અને રોગનિયંત્રકો વગેરે વિઘટન દ્વારા નાશ પામે છે. તેમની ઝેરી અસર ફેલાતા અટકાવે છે.
- જમીન રહેઠાણ માટે તથા માળખાકીય વિકાસ માટે જગ્યા આપે છે.
- જમીન પર્યાવરણ માટે વારસાકીય ખજાનો છે.
- જમીન આનંદ-પ્રમોદ માટે કુદરતી દશ્યો પૂરાં પાડે છે.

જમીન ઉપર વાતાવરણના બદલાવાની થતી અસરો :

- વાતાવરણમાં ગરમી વધતાં આ ગરમી જમીન દ્વારા શોષાય છે, જેથી જમીનની ગરમીમાં વધારો થાય છે.
- ઓછા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે છે.
- ભારે વરસાદ કે પૂરને કારણે જમીનના ઉપરના ફળદુપ પડનું ધોવાણ થાય છે.
આ બધાં કારણોને લઈ જમીનની ફળદુપતા ઘટે છે.

ઉપરોક્ત પ્રશ્નો હલ કરવા જમીનનું પૃથક્કરણ કરાવવું જરૂરી છે :

જમીનનું પૃથક્કરણ કરવાથી જમીનમાં રહેલાં પોષક તત્ત્વો, બેજ, ઉપયોગી જીવાણુઓ, સેન્ટ્રિય તત્ત્વ, જમીનની નબળાઈ વગેરે જાણી શકાય છે. આ પૃથક્કરણના રિપોર્ટના આધારે જમીનનું યોગ્ય બ્યવસ્થાપન કરવાથી જમીનની તંદુરસ્તી તથા ફળદુપતા જાળવી શકાય છે.

આમ, જમીનનું પૃથક્કરણ એ ટકાઉ પાક ઉત્પાદન મેળવવાની એક અગત્યની ચાવી છે.

- એક ઉલ્લેખ મુજબ જમીન વાતાવરણના બદલાવની અસરોના હુમલાને શોખી લે છે. તેથી બેડૂતોએ દર વર્ષે તેમનાં બેતરોની જમીનનું પૃથક્કરણ કરાવવું જોઈએ. આપણા રાજ્યમાં બેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ 'સોઈલ હેલ્પ કાર્ડ' એ સ્થિતિસ્થાપક પાક પદ્ધતિની ચાવી છે. જમીનની તંદુરસ્તી બતાવતી કુંડળી છે. જમીનના પૃથક્કરણના આધારે બેડૂત પોતાની જમીનનો પ્રકાર, જમીનમાં રહેલા લભ્ય પોષક તત્ત્વોનું પ્રમાણ, જમીનમાં ખારાશનું પ્રમાણ તેમજ જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ જાણી શકે છે. પૃથક્કરણ દરમિયાન, જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે જણાય તો ખારી જમીનને અનુરૂપ પાકો લેવો જોઈએ. જમીનની ખારાશ ઘટાડવા માટેની કાર્યપદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
- 'સોઈલ હેલ્પ કાર્ડ' પ્રોગ્રામમાં જમીનના પૃથક્કરણની માહિતી ઉપરાંત બેડૂતના ગામ કે તાલુકામાં થતા વરસાદ અને હવામાન આધારિત પ્રણાલીગત થતા પાકો ઉપરાંત તે વિસ્તારના વાતાવરણને અનુકૂળ બીજા આર્થિક રીતે ફાયદારૂપ કર્યા નવા પાકો લઈ શકાય તેની માહિતી પણ આપેલ છે, જેનો બેડૂતોએ ઉપયોગ કરી પાકમાં વિવિધતા લાવવી જોઈએ અને વાતાવરણના બદલાવ સામે રક્ષણ મેળવવું જોઈએ.
- દરેક પાકને પોષક તત્ત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે જે જમીનના પૃથક્કરણના આધારે આપવાના હોય છે, જેથી ખાતરનો વધુ પડતો બિનજરૂરી વપરાશ રોકી શકાય છે અને પાકની જરૂરિયાત મુજબ ખાતર આપવાથી પાકનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત જમીન ચકાસણીના રિપોર્ટને આધારે જમીનની ફળદુપતામાં સમયાંતરે થતા ફેરફારો જાણી શકાય છે. પાકને આપવાના થતા ખાતરમાં કેટલી વધ-વધ કરવી તે જાણી શકાય છે. જેથી ખાતરના વધુ પડતા વપરાશને રોકીને બિનજરૂરી અપાતા ખાતર પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે.
- દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનમાં ખારાશ વધવાની શક્યતા છે. આ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જે હવે પછીના સફળતાના ઉદાહરણોમાં આપેલ છે. આ જમીનમાં 'ફોસ્ફો જિલ્સમ'નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

પાકની ઉત્પાદકતા ટકાવવા માટે આ આવશ્યક છે.

જમીન ઉપર વાતાવરણ બદલાવની અસરોના ઉપાયો :

| પ્રચલિત પદ્ધતિ | ઉત્પાદકતા વધારવાની પદ્ધતિ | વાતાવરણના બદલાવની અસરો ઓછી કરવી |
|--|--|--|
| <p>૧. જમીનનો ખેડ : જમીનને ભરભરી કરે છે અને પાકના વાવેતર માટે ખેતર તૈયાર કરવામાં આવે છે. જમીનમાં હવાની અવર-જવર થવાથી સેન્દ્રિય પદાર્થનું કહોવાણ જલદી થાય છે. વારંવાર ભારે સાધન દ્વારા ખેડ કરવાથી જમીનમાં નીચે સખત પડ બંધાય છે, જે મૂળના વિકાસમાં તથા વધારાના વરસાદના પાણીના નિતાર માટે અડયણરૂપ બને છે.</p> | <p>સંરક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવવી, જેમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતોનો સમાવેશ થાય છે :</p> <p>૧. ખેડનું પ્રમાણ ઘટાડવું, શક્ય હોય તો યાંત્રિક સાધનની મદદથી બીજને જમીનના ફળદ્વારા પડમાં વાવવા અને નીદણ નિયંત્રણ માટે નીદણનાશક દવાનો ઉપયોગ કરવો.</p> <p>૨. જમીન ઉપર પ્લાસ્ટિક કે પરાળ પાથરવું, જેનાથી નીદણ વૃદ્ધિ ઓછી થાય છે. જમીનમાં ભેજ ઊરી જતો અટકાવે છે. જમીનનું તાપમાન જાળવે છે. જમીનનું પવનથી થતું ધોવાણ અટકાવે છે અને જમીનમાં કાર્બનનું પ્રમાણ પ્રસ્થાપિત કરે છે.</p> | <p>સુધારેલી ખેતીપદ્ધતિ અપનાવવાથી વાતાવરણના બદલાવની અસરો ઘટાડી શકાય છે. તેમ છતાં ખેતી દરમિયાન વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરે દવાઓ, નીદણનાશકો વાપરવાથી સાધારણ ગ્રીનહાઉસ ગોસની નકારાત્મક અસર થઈ શકે છે.</p> |
| <p>૨. જમીનનો ઉપરનો પોપડો સખત થવો : આ પ્રશ્ન કચ્છ, ખંભાત, તારાપુર તથા દાંડીમાં પવનથી થતા ધોવાણને કારણે વિકટ બન્યો છે તેમજ ઊંચા તાપમાનને કારણે સેન્દ્રિય પદાર્થ નાશ પામવાથી આ પ્રશ્ન વિકટ રહ્યો છે. આનાથી વરસાદનું પાણી જમીનમાં ઊતરતું નથી અને જમીન ધીમે ધીમે ઉજ્જવલ થતી જાય છે.</p> | <p>કચ્છમાં જળસ્થાવ યોજના : દરિયાઈ ખારાશનો જમીનમાં વિસ્તાર વધતો અટકાવવા ચેક તેમ બનાવવા, ગામતળાવો બનાવવા, ખેત તલાવડીઓ બનાવવી, નાળાબંધી કરવી વગેરેનો તથા વાતાવરણના બદલાવની અસરોને પહોંચી વળવા સફળતાપૂર્વક ઉપયોગ થયેલ છે.</p> | <p>કચ્છમાં થયેલ કામને બીજા વિસ્તારમાં પણ અપનાવી વાતાવરણની અસરો ઘટાડી શકાય છે. આ સફળ કિસ્સાઓ હવે પણી આપવામાં આવ્યા છે.</p> |
| <p>૩. ડાંગરના વાવેતર વિસ્તારમાં ખેતરની જમીનનું 'પડલિંગ' કરવું : 'પડલિંગ'થી જમીનમાં અવાહક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને ગ્રીનહાઉસ ગોસ ઉત્પન્ન થાય છે. આમ, પાણી ભરેલા ડાંગરનાં ખેતરો મિથેન ગોસ ઉત્પન્ન થવાના મુખ્ય ઝોત છે.</p> | <p>એસ.આર.ઈ. (SRI) ડાંગરની ખેતી પદ્ધતિથી ઉત્પાદન વધારવા ઉપરાંત ગ્રીનહાઉસ ગોસ ઉત્પન્ન થવાનો પ્રશ્ન હલ થઈ શકે છે.</p> | <p>SRI પદ્ધતિથી ડાંગરનું વધુ ઉત્પાદન મળે છે. પાણીની બચત થાય છે. ખાતરની કાર્યક્ષમતા વધારી શકાય છે તેમજ બીજની બચત થાય છે.</p> |

| પ્રયત્નિત પદ્ધતિ | ઉત્પાદકતા વધારવાની પદ્ધતિ | વાતાવરણના બદલાવની અસરો ઓછી કરવી |
|--|--|--|
| <p>૪. ખાતરનો ઉપયોગ : પાકની વૃદ્ધિ માટે જરૂરી ૧૬ તત્ત્વોમાંથી એક તત્ત્વની પણ જમીનમાં ઊણાપ હોય તો પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, જેથી પાકને સમતોલ પોષણ પૂરું પાડવું જરૂરી છે. ઘણી વખત ખેડૂતો પાકનો જરૂરિયાત કરતાં વધારે ખાતર આપે છે, જેથી પાકની જરૂરિયાત કરતાં વધારાનું ખાતર જમીનમાં પાણી સાથે ભણે છે જે જમીન અને પાણીને પ્રદૂષિત બનાવે છે. ખાતરનો અમુક જથ્થો ગેસના રૂપમાં ફેરવાય છે અને હવામાં ભણે છે જે ગ્રીનહાઉસની અસર ઊભી કરે છે. વધારે ખાતર આપવાથી પાકનો ઉત્પાદનખર્ચ પણ વધે છે જેથી નફાનું ધોરણ ઘટે છે.</p> | સંકલિત પોષણ વ્યવસ્થા કે જેમાં રાસાયણિક ખાતર (જમીનના પૃથકુરણ મુજબ) સાથે સેન્દ્રિય ખાતર આપવામાં આવે છે. આમાં પોષક તત્ત્વોના પ્રમાણનું સમતોલન જણવાય છે. પાકને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે. વધુમાં સેન્દ્રિય ખાતર જમીનની ફળકુપતા જાળવે છે તેમજ ખાતર વાપરવાથી જમીનમાં ભેજ પકડાઈ રહે છે. | વધારે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવાથી જમીનમાં ખાતરમાંથી છૂટો પડેલ નાઈટ્રોજન (NO ₃) જમીન તથા પાણીને પ્રદૂષિત કરે છે. ખાતરમાંથી નાઈટ્રોજન, નાઈટ્રસ ઓક્સાઈડના વાયુરૂપમાં વાયુ છૂટો પડી વાતાવરણમાં ભણે છે જે ગ્રીનહાઉસની માત્રા વધારે છે. આ અસરો નિવારવા : 1. એમોનિયમવાળા નાઈટ્રોજનયુક્ત ખાતરને બદલે યુરિયા ખાતર યોગ્ય પદ્ધતિથી આપવું અથવા 2. ખાતરમાંથી નાઈટ્રોજન ધીમે ધીમે છૂટો પડે તેવું ખાતર વાપરવું અથવા ખાતરને લીમડાના તેલ/સલ્ફરની માવજત આપી વાપરવું. 3. નાઈટ્રોજનયુક્ત ખાતર પાકના મૂળ વિસ્તાર નશ્ચક આપવું. |
| <p>૫. પાકની વિશિષ્ટતા અને વાર્ષિક પાક મૌલાત :</p> <ul style="list-style-type: none"> ● અમુક પાક પદ્ધતિથી જમીનના સેન્દ્રિય તત્ત્વમાં ઘટાડો થાય છે. ● પાકની જમીનથી ઉપરના સંઘળા ભાગની કાપણી કરવામાં આવે છે જેનો ઘાસચારા માટે કે બળતણા તરીકે અથવા ઉદ્યોગ માટે નહીં તો જીવાતનો નાશ કરવા ખેતરમાં બાળી દેવામાં આવે છે. | સેન્દ્રિય ખેતીમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓ વાપરવામાં આવતી નથી. પણ પાકની કઠોળ વર્ગના પાક સાથે પાક ફેરબદલી, મિશ્ર ખેતી પદ્ધતિ, કમ્પોસ્ટ, છાણિયું ખાતર, જૈવિક ખાતર, લીલો પડવાશ, સેન્દ્રિય મલ્ય વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ● જૈવિક વિવિધતા લાવવાથી પાકમાં આવતી જીવાતનું જીવનચક ખોરવાય છે. ● ખેતર ફરતે ક્ષુપ કે ઝાડ વાવવાથી જમીનની સ્થિતિસ્થાપકતા વધે છે અને વિવિધ ખેતીની પેદાશ (ખોરાક, બળતણા, રેસા, લાકડું) પણ મેળવી શકાય છે. ● યોગ્ય એગ્રો-ફોરેસ્ટ્રી પદ્ધતિ અપનાવવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજન તત્ત્વનું પ્રમાણ વધારી શકાય છે. જમીનની ઉત્પાદકતા વધારી શકાય છે. વિવિધ ખેતપેદાશ મેળવી શકાય છે. ખેતરનું હવામાન સુધારી શકાય છે. પવનની ગતિ ધીમી પાડી શકાય છે. આમ, સંઘળી રીતે વાતાવરણના બદલાવને સ્થાયી કરીને સ્થિતિસ્થાપકતા લાવી શકાય છે. | ક્ષુપ અને ઝાડ ખેતર ફરતે વાવવાથી પર્યાવરણ સુધારવામાં મદદરૂપ થાય છે. |

પ્રાપ્તિકાળ : Climate Smart Agriculture, Source Book, FAO - 2013 સ્થાનિક પરિસ્થિતિને સાનુકૂળ કરીને

ટકાઉ ખેતી માટે કાર્ય-પદ્ધતિ

સંકલિત નીંદણ વ્યવસ્થા (Integrated Weed Management) :

પાકની વચ્ચે ઊગતા નકામા બિનઉપજાઉ છોડને નીંદણ કહેવાય છે. જે સાથે હવા પોષકતાત્ત્વો અને પાણી વગેરે મેળવવામાં મુખ્ય પાક સાથે હરીફાઈ કરે છે અને મુખ્ય પાકનું ઉત્પાદન અંદાજિત ૩૦ થી ૩૫ ટકા ઘટાડે છે. જેથી ટકાઉ ખેતી માટે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ :

- કોહેવાયેલ છાણિયું ખાતર અથવા ગોબર ગેસની સ્લરી દ્વારા ઉત્પન્ન કરેલ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી નીંદણના બીજ નાશ પામે છે અને ખેતરમાં ફરી વખત ઊગી શકતા નથી.
- ઉનાળાના સમયમાં જ્યારે જમીન વાસેલ અવસ્થામાં (Fallow Land) હોય ત્યારે ઊડી બેડ કરી જમીનને તપાવવી જોઈએ. આમ કરવાથી જીવાણુઓ, જીવાતના દ્વારા અને કોશેટાનો નાશ થઈ જાય છે.
- વાવેતર માટે સુધારેલ સંકરણ તથા સુધારેલ સર્ટિફાઈડ બિયારણોનો ઉપયોગ કરવો જોઈએ.
- શરૂઆતના પાકની વાવણીથી ૧૫ થી ૪૫ દિવસ સુધી પાકને ૨ થી ૩ વખત હાથથી નીંદણ કરવું જોઈએ અને ૨ થી ૩ વખત આંતરબેડ કરવી જોઈએ.
- પહોળા પાટલે વવાતા પાકોમાં સેન્ટ્રિય અને અસેન્ટ્રિય આવરણ (માલ્ટિયા) પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જમીનમાં બેજ જળવાઈ રહે છે. માલ્ટિયાના ઉપયોગને લીધે જમીનમાં ઉઝાતામાન વધવાથી નીંદણ ઊગી નાશ થાય છે અને ફૂગ અને રોગના જીવાણુઓ પણ મૃતપાય થઈ જાય છે.
- હાલ રાસાયણિક નીંદણનાશક દવાઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરી શકાય.
- કેટલાક એવા પાકો પણ છે જે કુદરતી રીતે નિંદણને ઊગતા અટકાવી શકે છે. દા.ત., તલ, ઘઉં

સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ (Integrated Diseases and Pest Management) :

પાક ઉત્પાદનમાં જુદા જુદા પાકમાં વિવિધ જીવાતો અને રોગો, પાકોનું ઉત્પાદન ઘટાડે છે. આ માટેનાં પગલાં નીચે પ્રમાણે છે :

- જમીનજન્ય રોગો અને જીવાતોના દ્વારા અને કોશેટાને નિયંત્રણ કરવા માટે મહિનામાં ખાઉથી ઊડી બેડ કરવી જોઈએ.
- જો પિયતની સુવિધા હોય તો પાકની વાવણી પહેલાં એક મહિના અગાઉ જમીનમાં સોઈલ સોલેરાઇઝેશન (Soil Solarization) કરવું. આનો અર્થ એ છે કે જમીનને પિયત આપી તેને ખાસ્ટિકથી કવર કરવું. આમ થવાથી જમીનમાં ઉત્પન્ન થતી ગરમીના કારણે નીંદણ ઊગવાનો, ફૂગ અને રોગના જીવાણુઓનો નાશ થાય છે.
- બીજને વાવતાં પહેલાં બીજની માવજત (Seed Treatment) ભલામણ કરેલ દવાઓથી કરવી જોઈએ.
- રોગ અને જીવાત પ્રતિકારક જતોની વાવણી માટે પસંદગી કરવી જોઈએ.
- જમીનમાં એક જ પાક પદ્ધતિ (Sole Cropping Pattern) ન અપનાવતાં પાકની ફેરબદલી કરવી જોઈએ.
- જો ઊભા પાકમાં જીવાત નિયંત્રણ માટે ખેતરની ફરતે અથવા ખેતરમાં અમુક અંતરે પીજર પાકો (Trap Crop)ની લાઈનોની વાવણી કરવાની પદ્ધતિ અપનાવવાથી જુદી જુદી જીવાતોનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય છે. દા.ત.,
 - ટામેટાની ખેતીમાં હજરી ગલગોટાનું વાવેતર કરવાથી હેલીઓથીસ (લીલી ઈયળ) નામની જીવાતનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે.
 - મકાઈના પાકમાં કાતરાના નિયંત્રણ માટે ખેતરની ફરતે ઉ થી ૪ હાર શણના પાકની કરવાથી કાતરાનું નિયંત્રણ સરળતાથી કરી શકાય છે.

મિશ્ર પાક પદ્ધતિ તથા પાક ફેરબદ્દીમાં બદલાવ :

બદલાતા હવામાનમાં મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતોને ઘણી જ આશીર્વાદરૂપ નીવેઠે છે. મિશ્ર પાક પદ્ધતિ એટલે વિવિધ પ્રકારના પાકો અને ફળજાડ સાથે સંયુક્ત રીતે ઉગાડવાની પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ પ્રકૃતિ સાથે અનુકૂલન સાથે છે અને વિશિષ્ટ પ્રકારની જીવાતોનું પ્રભુત્વ વધવા દેતાં નથી. પરજીવી અને પરભક્તી જેવા પ્રાકૃતિક દુશ્મન જીવાતોના સહઅસ્તિત્વને કારણે જીવાતો પર ગતિથી અંકુશ જાળવવામાં સહાયરૂપ થાય છે.

ગુજરાત રાજ્યમાં મિશ્ર પાક પદ્ધતિનાં ઉદાહરણો – તલ સાથે કપાસ અને તુવેર, મકાઈ સાથે તુવેર, મકાઈ સાથે સોચાબિન, કપાસ સાથે મગફળી, કપાસ ફરતે તુવેર, મગફળી અને મકાઈ, પપૈયા અને શાકભાજી.

મિશ્ર પાક પદ્ધતિથી વાતાવરણના બદલાવને લીધે ઓછો વરસાદ, ભેજ, રોગ, જીવાતનો ઉપદ્રવ, વધુ ગરમી/ઠંડીને કારણે એક પાક નિષ્ફળ થાય તો બીજા પાકમાંથી ખેડૂતને ઉત્પાદન કે આવક મળી રહે છે.

આવરણયુક્ત પાકની ખેતી પદ્ધતિ (Mulching) :

મલ્ટિયુના એટલે જમીનના ઉપરના પડ પર આવરણ કરવું. સામાન્ય રીતે ઝડપાનથી આ થાય છે. પ્લાસ્ટિકનો પડા ઉપયોગ કરવામાં આવે છે. આનાથી નીચે મુજબ લાભ થાય છે :

- જમીનનો ભેજ ટકાવી રાખે છે.
- જમીનમાં ઉપયોગી તત્ત્વો જળવાઈ રહે છે.
- નકામું ધાસ ઊગી શકતું ન હોવાથી નીંદણની જરૂર પડતી નથી.
- જમીનમાં શીતળતા ટકાવી રાખે છે.

વૃક્ષની છાલ, નકામાં પાંડાં, નીંદણ કરેલા ધાસ સેન્ટ્રિય ખાતર બને છે. પરિણામે જમીનની તંદુરસ્તી વધે છે :

- ઓર્ગેનિક સ્વરૂપના મલ્ટિયુના મલ્ટિયુના છાલ, નકામાં પાંડાં, નીંદણ કરેલું ધાસ, કમ્પોસ્ટ ખાતર કે લીલો પડવાશ લાભદાયી પુરવાર થાય છે.

સજીવ ખેતી (Organic Farming) :

સજીવ ખેતી કરતા ખેડૂતો પાક ઉત્પાદન માટે ફક્ત સેન્ટ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે. જીવાતો, રોગ અને નીંદણનું નિયંત્રણ કરે છે. સજીવ ખેતી કરવાથી જમીનમાં રહેલાં સૂક્ષ્મ જીવો પોષકતત્ત્વો છોડે છે, પરિવર્તન કરે છે અને છોડને ઉપયોગી તત્ત્વો તબદીલ કરે છે. સજીવ ખેતીની ઉપયોગિતા નીચે પ્રમાણે છે :

- જમીનમાં સેન્ટ્રિય પદાર્થો જમીનના સારા બંધારણમાં અને જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. આનાથી લાંબાગાળે જમીનની ઉત્પાદકતા વધે છે.
- આમ કરવાથી રાસાયણિક ખાતરો ઉપર થતો ખર્ચ બચે છે એટલે કુલ ઉત્પાદન ખર્ચ ઘટે છે.
- સજીવ ખેતીથી છોડની તંદુરસ્તી વધે છે જે રોગ અને જીવાતોનો પ્રતિકાર કરી શકે છે.
- સજીવ ખેતીથી જમીનના બિન્ન બિન્ન સૂક્ષ્મ જીવોની વસ્તી અને લાભદાયક ક્રીટકો દ્વારા જૈવિક વિવિધતા વધે છે.

જમીન પર ફેલાતા પાકો

પહોળા પાટલે વવાતા પાકો જેમ કે, કપાસ, દિવેલા, તુવેર, તલ વગેરે પાકોની વચ્ચે મગફળી, મગ, મઠ, ચોળા જેવા પાકો લઈ શકાય. આમ કરવાથી સહપાક સાથે નકામા છોડ ઊગવાનું અને ફેલાવવાનું અંકુશિત થાય છે. આ ઉપરાંત વિવિધ પોષક તત્ત્વો જમીનને તંદુરસ્ત રાખે છે. વળી, બાણીભવનના પ્રમાણને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે. કઠોળ જેવા પાકને ઉગાડીને કોઈ એક જ પ્રકારની જીવાતના ઉદ્ભબવને પણ નિયંત્રણ કરી શકાય છે. હાલમાં ખેડૂતો ઉનાળામાં જમીન ઉપર ફેલાતા પાકો જેવા કે, કાકડી, તડબૂચ અને સક્કરટેટી પાકોની ખેતી કરવાથી પ્રતિ યુનિટ વિસ્તારમાંથી ઓછા ખર્ચ વધુ સારી આવક મેળવી શકે છે.

• • •

બદલાતા હવામાનમાં પશુપાલન વ્યવસ્થાપન

હવામાનમાં બદલાવ અને તેની અસરો :

હવામાનમાં બદલાવ એટલે સાઢી ભાષામાં કહીએ તો ઉષાતામાન, લેજ, વરસાદ, સૂર્યપ્રકાશ, બાધીભવન, પવન વગેરે પરિબળોમાં અચાનક થતા ફેરફારો, જેની ચાલુ જનજીવન અને સજીવો ઉપર ગંભીર અસર થાય છે, જેને આપણે હવામાનનો બદલાવ (Climate Change) તરીકે ઓળખીએ છીએ.

વાતાવરણનો બદલાવ સામાન્ય રીતે બે રીતે થાય છે :

૧. કુદરતી રીતે

૨. માણસો દ્વારા કરવામાં આવતાં વિવિધ કાર્યો/હરકતો દ્વારા :

કુદરતનો નિયમ છે કે પૃથ્વીના વાતાવરણને ઠંડું કરવા માટે અને સૃષ્ટિ ઉપરના તમામ જીવંત પદાર્થોને સાનુકૂળતા પેદા કરવા વાતાવરણ ઊભું કરવા માટે હવામાનનાં પરિબળોનું સ્વયંભૂ નિયંત્રણ કરે છે. ભૌગોલિક દિનાંએ જોઈએ તો ભારતમાં ઉનાળું, ચોમાસું અને શિયાળો એમ ત્રણ પ્રકારનું હવામાન જોવા મળે છે. હાલમાં વિશ્વકક્ષાએ જે હવામાનમાં ઋતુજીવનું ફેરફારો નાના ગાળાના હોય છે અને તેનાથી સહેલાઈથી બચી શકાય છે.

વાતાવરણના બદલાવમાં માનવસર્જિત નકારાત્મક કાર્યો મહત્વની ભૂમિકા ભજવે છે. પૃથ્વી ઉપર માનવવસ્તીનો વિસ્કોટક વધારો થવાની સાથે તેની જરૂરિયાતો પણ વધી રહી છે. જે જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૃથ્વી ઉપરનું વાનસ્પતિક આવરણ (Biosoil) દિવસે દિવસે જંગલો કપાવાને લીધે અને ઝડપથી ઔદ્યોગિકીકરણ થવાને લીધે અને વધુમાં ગામડાઓનું શહેરીકરણ થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વાતાવરણમાં અસર્ય ગરમીનો વધારો જોવા મળેલ છે, જેને કારણે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રદૂષણ વધવાથી વાતાવરણના ઉષાતામાનમાં દિવસે દિવસે અસર્ય વધારો થઈ રહેલ જોવા મળે છે. વાતાવરણનો બદલાવ એ માનવસર્જિત સમસ્યા અને મોટો પડકાર છે.

ઋતુજીવનું ફેરફારની પશુપાલન વ્યવસ્થા ઉપર થતી અસરો :

ઉનાળો :

ઉનાળાની ઋતુમાં જ્યારે ઉષાતામાનમાં અસર્ય વધારો જોવા મળે છે ત્યારે દુધાળાં ઢોરોમાં દૂધ ઉત્પાદનની ક્ષમતા, ઈંડાનું ઉત્પાદન અને મત્સ્ય ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળે છે. ઉનાળામાં ઢોરની બોડી ટેમ્પ્રેચર ઠંડું રાખવા માટે શક્તિનો વપરાશ વધુ થતો હોવાથી તેની ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે જેથી ઢોર હીટમાં આવેલ છે કે નહીં તેનાં લક્ષણો બરાબર જાણી શકતાં ન હોવાથી ઢોરોમાં કૂત્રિમ વીર્યદાન કરવામાં ઘણી જ મુશ્કેલી અનુભવાય છે જેને કારણે ભેંસના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળે છે અને ગાયના દૂધ ઉત્પાદનમાં નજીવો ફેરફાર જોવા મળે છે.

જો ઉનાળાની ઋતુ લંબાય અને ચોમાસુ ઋતુમાં વરસાદ મોડો થાય, તો તેના કારણે દુધાળાં ઢોરોની આરોગ્ય ઉપર ગંભીર અસર જોવા મળે છે. જેની દૂધ ઉત્પાદકતા ઉપર ઘણી જ વિપરીત અસર જોવા મળે છે.

વધારે ગરમી અને ઠંડીને કારણે દુધાળાં ઢોરમાં, મરધાં-બતકાંના ખોરાક લેવામાં પણ ઘટાડો જોવા મળેલ છે, જેને લીધે મરધાંના વિકાસ અને ઈંડાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે. પક્ષીઓમાં મરણનું પ્રમાણ વધવાથી અને રોગ પ્રતિકાર કરવાની શક્તિમાં ઘટાડો થતો જોવા મળે છે.

વધારે ગરમીને કારણે તળાવ અને દરિયાઈ માછલીઓની વૃદ્ધિ, પ્રજનન અને ઉત્પાદન ઉપર ખાસ વિપરીત અસર જોવા મળે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો જોવા મળે છે.

ચોમાસું :

ચોમાસાની ઋતુમાં ઢોરને લીલું ધાસ પૂરી માત્રામાં મળી રહે છે. બેડૂતો વધારે માત્રામાં ચોમાસામાં દુધાળાં ઢોરને લીલા ધાસનું નીરણ કરે છે. લીલા ધાસમાં ચરબી, શર્કરા અને પ્રોટીનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં ન હોવાથી દૂધમાં ચરબીનું પ્રમાણ ઘટે છે અને ઢોર વારંવાર બીમાર પડે છે. ચોમાસાની ઋતુમાં જો વરસાદ વધારે પડે તો પૂર આવે છે અને ઢોરોમાં રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડે થવાથી રોગચાળો ફાટી નીકળે છે.

શિયાળો :

શિયાળાની ઋતુ દુધાળાં પશુઓ માટે ઉત્તમ ગણાય છે. શિયાળામાં ભેંસોનું દૂધ ઉત્પાદન વધે છે. જ્યારે ગાયોનું ઉત્પાદન થોડી માત્રામાં ઘટતું જોવા મળે છે. શિયાળાની ઋતુ ઢોરોમાં ગાભણ થવા માટે ઉત્તમ ઋતુ ગણવામાં આવે છે. વાતાવરણમાં જ્યારે વધારે ઠંડીનું પ્રમાણ હોય ત્યારે દુધાળાં ઢોરોના રક્ષણ કરવા માટે દુધાળાં પશુઓને તેના શરીરની ગરમીને જાળવી રાખવા તેમને કંતાનથી ઢાંકવાં જોઈએ અને ઠંડા પવનથી બચાવ કરવો ખૂબ જ જરૂરી છે.

દુધાળાં ઢોરો, મરધાં અને મત્સ્યઉછેર પર વાતાવરણના બદલાવની થતી અસરો :

સમયની સાથે વસ્તીનો વધારે પડતો અસહ્ય વધારો થવાથી તેમની જરૂરિયાતને સંતોષવા ઔદ્યોગિકીકરણ થવાથી વાતાવરણમાં જેરી ગોસોનું પ્રમાણ વધવાથી, પર્યવરણમાં જોખમાતા પ્રાણીજીવન ઉપર તેની વિપરીત અસર થયેલ છે. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડું પડવાને બદલે વધવા લાગ્યું છે. જે દુધાળાં ઢોરોની દૂધ આપવાની ક્ષમતામાં ઘટાડે કરે છે. દુધાળાં ઢોરો ઉષ્ણતામાન અને ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધવાથી તેમની ઉત્પાદનશક્તિ ઘટવામાં સીધી અસર જોવા મળે છે. ગરમીનો ભાર (Heat Stress) ને ત્રણ ભાગવામાં વહેંચી શકાય :

વાતાવરણના બદલાવની દુધાળાં ઢોરો પર થતી વિપરીત અસરો :

૧. સાધારણ ગરમીની થતી અસરો/ભાર (Mild Stress) : આ વખતે ઢોરોમાં શાસોચ્છ્વાસના પ્રમાણમાં વધારો જોવા મળે છે અને ઢોરોના શરીર ઉપર પરસેવો જોવા મળે છે અને ઢોરોને વધારે પીવાના પાણીની જરૂરિયાત રહે છે તેને સાધારણ ગરમીની અસરો/ભાર (Mild Stress) કહેવામાં આવે છે.
૨. મધ્યમ કક્ષાની ગરમીની થતી અસરો/ભાર (Moderate Heat Stress) : આ સમય દરમિયાન ઢોરો ખૂબ જ પરસેવો પાડે છે અને ઝડપી શાસોચ્છ્વાસની કિયાને લીધે હાંફિનું જોવા મળે છે.
૩. ગંભીર ઉષ્ણાની અસરો/ભાર (Severe Heat Stress) : આ સમય દરમિયાન ઢોરો ખુલ્લા મોં રાખીને હોંફ છે અને ઢોર ગભરાયેલું જોવા મળે છે. ખોરાક લેવાનું સંપૂર્ણ બંધ કરી દે તે અવસ્થાને ‘ગંભીર ઉષ્ણાની અસર’ થઈ તેવું માનવામાં આવે છે. આ ગંભીર પ્રકારની ગરમીની અસરને લીધે જો તાત્કાલિક ઢોરને ઠંડું કરવામાં ન આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.

ગરમીના ભારની ઢોરના દૂધ ઉત્પાદન પર થતી અસર :

જ્યારે વાતાવરણમાં ઉષ્ણતામાન અને ભેજનું પ્રમાણ વધે ત્યારે દૂધ ઉત્પાદનમાં ૧૦ થી ૩૦ ટકા સુધી ઘટાડે જોવા મળે છે.

ગરમીના ભારની ઢોરોની પ્રજનનશક્તિ પર થતી અસરો :

વાતાવરણમાં ઉષ્ણતામાન વધવાથી પ્રજનનશક્તિ ઉપર સીધી અસર જોવા મળે છે જે ઢોરોની ગર્ભધારણ કરવાની શક્તિમાં ઘટાડે કરે છે, જેને લીધે ઢોરોને એક કરતાં વધારે વખત કૂત્રિમ વીર્યદાન કરવું પડતું હોવાથી ખર્ચ વધુ આવે છે અને વિયાળના સમયમાં સામાન્ય કરતાં મોકું થાય છે.

વातावरणमां વધારે પ્રમાણમાં ઉષ્ણતામાનની અસર રહે તો વાઇરડાં-વાઇરડીના મરણનું પ્રમાણ (Mortality) વધુ જોવા મળે છે જેને કારણે ઢોરના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે અને વાઇરડાની પુખ્ત અવસ્થા આવતાં વધુ સમય લાગે છે, વધુ ગરમીથી નર પશુમાં શુકાશુની સંઘામાં ઘટાડો જોવા મળે છે.

ઢોરોના સ્વાસ્થ્ય અને રોગ પર થતી અસરો :

વાતાવરણમાં વધારે ઉષ્ણતામાન અને બેજના પ્રમાણમાં વધારો થવાથી ઢોરની રોગ-પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે અને ચેપી રોગોનું પ્રસારણ વધે છે.

વાતાવરણના બદલાવ માટે સંરક્ષણના ઉપાયો :

વાતાવરણનો બદલાવ એ કોઈ હાથની વાત નથી જેને કારણે દૂધ ઉત્પાદન, દીડાનું ઉત્પાદન અને મત્સ્ય ઉત્પાદન ઉપર ઘટાડાની અસરો જોવા મળે છે. માટે તેના સંરક્ષણ માટે નીચે દર્શાવ્યા પ્રમાણે ઉપાયો બેદૂતમિત્રોએ કરવા જોઈએ :


૧. દુધાળાં ઢોરોની જાતોની પસંદગી : ગુજરાતમાં મુખ્યત્વે હવામાન બે પ્રકારનું જોવા મળે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ગરમ અને સૂકું હવામાન જોવા મળે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગરમ અને વધુ ભેજવાણું હવામાન જોવા મળે છે જેથી જે તે હવામાનના જે તે વિસ્તારને ધ્યાનમાં રાખી ઢોરોની ખરીદી કરવી જોઈએ. દા.ત., સાબરકાંઠા વિસ્તાર માટે ભેંસની ખરીદી કરવી હોય તો તે બેદૂતે મહેસાણા અને પાલનપુર વિસ્તારમાંથી ઢોરોની ખરીદી કરવી જોઈએ. વિસ્તારને અનુકૂળ ગાયોની સ્થાનિક જાતો જેવી કે, કંકરેજ, ગીર અને અન્ય વિસ્તારની ગાયોની પસંદગી કરવી જોઈએ કે જેથી ત્યાંના વાતાવરણમાં પણ સારી રીતે ટકી શકે.

૨. ઢોરોની રહેઠાણ વ્યવસ્થા : ઢોરોની રહેવાની વ્યવસ્થા અતિ મહત્વનું પાસું છે. જો ઢોરોને સારી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો અંદાજિત ૫૦ ટકા વાતાવરણના બદલાવની અસર સામે સંરક્ષણ મેળવી શકાય તેમ છે. ઢોરોના આદર્શ રહેઠાણમાં નીચે મુજબની વ્યવસ્થા હોવી જોઈએ.

(૧) ઢોરોનાં રહેઠાણાંક હંમેશાં

પૂર્વથી પણ્ણિમ દિશાને ધ્યાને લઈને બાંધવાં જોઈએ જેથી રહેઠાણાંકમાં સૂર્યપ્રકાશ ઢોરને પૂરતા પ્રમાણમાં મળી રહે અને પવનની દિશા પણ ઉત્તમ રહેવાથી રહેઠાણાંકમાં હવાની અવર-જવર સારી રીતે થવાથી ઢોરોને આ રહેઠાણાંક વધુ અનુકૂળ આવે છે.

(૨) રહેઠાણની ઉપરની છત ઉપર ૩" જગાઈનું સૂક્ક ઘાસનું આવરણ કરવું



જોઈએ જે સૂર્યની સીધી ગરમીને રોકવામાં મદદરૂપ થાય છે. ઉપરની છતમાં ઘાસનું આવરણ કરતાં પહેલાં છતને ચૂના અને સિમેન્ટથી કલર કરવો જોઈએ.

- (૩) રહેણાંકનું ભોંયતળિયું ગટર તરફ થોડા ઢાળવાણું હોવું જોઈએ અને આ ભોંયતળિયાની ઉપર લાકડાનો વેર પાથરવો જોઈએ, જેથી કરીને પશુઓને બેસવાની સગવડતા રહે અને છાણ તથા ગૌમૂત્ર ગટર મારફતે સહેલાઈથી બહાર નીકળી શકે.
- (૪) રહેઠાણમાં બારી-બારણાં દક્ષિણ-ઉત્તર દિશામાં હોવા જોઈએ એટલે જ્યારે બપોર પછી શિયાળામાં વધારે ઠંડા પવનો આવે ત્યારે તેને બંધ કરી ઠંડી સામે ઢોરોનું રક્ષણ સારી રીતે કરી શકાય છે.
- (૫) દુધાળા ઢોરોનાં રહેણાંકવાળી જગ્યામાં ઢોરો સારી રીતે હરીફરી શકે તેટલી જગ્યા રાખવી જોઈએ એટલે કે દરેક ઢોરને ૩ મીટર લંબાઈ \times ૧.૫ મીટર પહોળાઈની જગ્યા મળી રહે તેમ રાખવી જોઈએ અને દરેક રહેણાંકમાં છતની ઊંચાઈ ૩ મીટરથી ઓછી ન હોવી જોઈએ.
- (૬) દરેક રહેણાંકમાં ઠંડક માટે પૂરતા પ્રમાણમાં પંખાની પૂરેપૂરી સુવિધા, પાણીનો સ્પ્રે થઈ શકે તેવી સુવિધા અને પાણીના જથ્થા માટે મોટી પાણીની ટાંકી ઢોરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી સુવિધા હોવી જોઈએ.
- (૭) ઢોરોના રહેણાંકની આજુભાજુ લીલા ઘાસચારાના પાકો જેવાં કે લીમડો, અરડુઓ ઝડોથી ઘેરાયેલું હોવું જોઈએ જે ઉનાળાના સૂકા વાતાવરણમાં ઢોરોને અનુકૂળતાવાણું ઠંડુ વાતાવરણ પૂરું પાડી શકે અને તેનો પાનનો લીલાઘાસ ચાસ તરીકે વાપરી શકાય અને દુધાળાં પશુઓના રહેણાંકને ગરમીથી બચાવ થઈ શકે. વધુમાં, રહેણાંકની નજીકની જગ્યામાં ઢોરોને સ્વચ્છ પાણીથી નવડાવવાની વ્યવસ્થાનું આયોજન કરવું અને જરૂર પડે શેડમાં ડ્રોગર અને મિનિસ્ટ્રીકલરનું આયોજન કરવું જોઈએ.

૩. ઢોરોને નીરણ કરવાની સુવિધા (Feeding Practices) :

વાતાવરણના બદલાવ સામે રક્ષણ આપવા માટે દુધાળાં ઢોરોને ખાણ-દાણ તથા ઘાસચારાની પૂરેપૂરી વ્યવસ્થા કરવી એ અતિ મહત્વની બાબત છે. દરેક જણે ખાતરી કરવી જોઈએ કે ઘાસચારો અને દાણનો જથ્થો ૨૪ કલાક સુધી ચાલે તેટલી માત્રામાં છે. ઢોરને આપવામાં આવતા સૂકા ઘાસચારામાં યુરિયા દ્રાવણથી માવજત આપવી જોઈએ અને સૂડાથી સૂકું અને લીલું ઘાસ કાપીને નિરણ કરવું જોઈએ, જેમાં દાણ અને મિનરલની માત્રા પૂરેપૂરી છે. ઢોરને આપવામાં આવતો ઘાસ અને ખાણ-દાણ તાજો, સ્વાદિષ્ટ, ઉત્તમ ગુણવત્તાયુક્ત તથા જૈવિક રીતે ઊંચી કિંમત ધરાવતો હોવો જોઈએ. નીચે ગુણવત્તા ધરાવતી પરાળ જેવા ઘાસચારાનું પ્રમાણનું નીરણ એકદમ ઓછું કરવું જોઈએ.

૪. ઢોરોને આપવામાં આવતો સુમિશ્રિત ઘાસચારો અને ખાણ-દાણ :

દુધાળાં ઢોરોની પ્રકૃતિ પ્રમાણે ખાણ-દાણ અને ઘાસચારો બદલવો એ ફાયદાકારક બાબત છે. ૨૪ કલાક દરમિયાન ખાણ-દાણ અને ઘાસ ઢોરને મળી શકે તેના કરતાં દિવસ દરમિયાન ઘાસ-દાણ અને નિરવામાં આવતાં ઘાસમાં બદલાવ કરવામાં આવે તો ઢોરોને દિવસના ઠંડા સમય દરમિયાન વધારે ખોરાક લે છે. ખાણ-દાણ અને ઘાસચારો નીચે પ્રમાણે ભલામણ મુજબ ઢોરોને આપવો જોઈએ.

વધારે ગરમીના સમયમાં દુધાળાં ઢોરોની રાખવાની કાળજી :

- ખાણ-દાણમાં ચરબીનું પ્રમાણ પ થી હ ટકા કુલ સૂકા ઘાસચારાની માત્રા કરતાં વધવું જોઈએ નહીં.

- પ્રોટીનનું પ્રમાણ ૨૦-૨૫ ટકાથી વધારે ન હોવું જોઈએ અને રેસાઓનું પ્રમાણ ૫૫-૬૦ ટકાથી વધારે પ્રમાણ ન હોવું જોઈએ.
- ઢોરોને સહેલાઈથી પાચન થાય તેવા રેસાયુક્ત અને ચરબીયુક્ત ભલામણ કરેલ ઘાસચારો આપવો જોઈએ.
- બાયપાસ પ્રોટીન અને બાયપાસ ફેટનો વપરાશ કરવો જોઈએ.
- ઢોરોને આપવામાં આવતું પાણી ઠંડું, સ્વચ્છ અને તાજું હોવું જોઈએ.

વધારે ઠંડીના સમયમાં દુધાળાં ઢોરોની રાખવાની કાળજી :

- સૂકા હવામાનમાં ગાયો અને ભેંસોને વધારે ઘાસચારો અને ખાણ-દાણની જરૂરિયાત રહે છે.
- ગાયોને આરામ કરવા માટે સૂકું અને સુકારામુક્ત સ્થળ વધારે અનુકૂળ આવે છે.
- દુધાળાં ઢોરોને આરામ કરવા માટે સારા અને સૂકા ભોંયતળિયા ધરાવતી બેઠક વ્યવસ્થા વધારે અનુકૂળ આવે છે.
- દુધાળાં ઢોરોની રહેણાંક જગ્યા ઉપરથી બહાર ચરવા માટે લઈ જાઓ ત્યારથી તેનાં આંચળ સૂકા રહેવા જોઈએ તેમજ આ રહેણાંકની જગ્યાએ સફાઈ કરી ડાય સૂકવવી જોઈએ. આંચળને ૩૦ સેકન્ડમાં સૂકા પેપરથી સાફ કરવા જોઈએ અને આ રહેણાંકની જગ્યાની સફાઈ માટે ફિનાઈલ અને ટેટોલથી રહેણાંકને સાફ કરવું જોઈએ. જેથી મચ્છર અને માખીના ઉપદ્રવને નિયંત્રણ કરી શકાય.

સૂકા વાતાવરણમાં ઢોરોને રક્ષણ આપવા માટે લેવાની કાળજી :

- પૂરી માત્રામાં ઘાસચારાનું સૂકા વાતાવરણમાં રક્ષણ કરવું જોઈએ.
- ઢોરોને આપવામાં આવતાં જળ-ઝોતનું રક્ષણ કરવું જોઈએ.
- ઢોરોને નીરણ સહકારથી કાપેલ ઘાસ અવશ્ય નાખવું જોઈએ.
- ઝેરયુક્ત પદાર્થોથી છોડ અને દાણનું રક્ષણ કરવું જોઈએ.
- સાઈનાઈડ જેવાં ઝેરી તત્ત્વોથી બચવા માટે જુવાર જેવા ઘાસચારાના

દુધાળાં પશુઓને ચોમાસાની ઋતુમાં વધારે પડતો વરસાદ પડે અને પૂર આવે ત્યારે તેમના રક્ષણ માટે લેવાની કાળજી :

1. આ સમય દરમિયાન ઢોરોને મુક્ત રીતે ઊંચાઈવાળા વિસ્તારમાં હરીફરી શકે તેવી વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ.
2. વધારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જય ત્યારે ઘાસનો પૂરતો જથ્થો પૂરથી નુકસાન ન થાય તે રીતે સાચવવા માટે ઊંચી જગ્યાએ પ્લાસ્ટિક/તાડપત્રીથી સંપૂર્ણ ઢાંકી દેવું જોઈએ. ઘાસને સાચવવા માટેની જગ્યા સંપૂર્ણ કોરી અને અંદર પાણી જઈ શકે નહીં તેવી જગ્યાએ રાખવું જોઈએ.

૫. પર્યાપ્ત માત્રામાં પીવાના પાણીની લભ્યતા :

1. ઢોરોને તબેલામાં પીવાના પાણીની ટાંકીનું ઊંચાઈ પર આયોજન કરવું જોઈએ. આ ઢોરોને પીવાનું પાણી શુદ્ધ અને તાજું હોવું જોઈએ. દુધાળાં ઢોરોને ૨૪ કલાક પાણીની જરૂરિયાત રહે તેવું આયોજન તબેલામાં કરવું જોઈએ.
2. દૂધનું ઢોવાણ કર્યા પછી ગાયોને તાજું અને સ્વચ્છ પાણી પીવડાવવું જોઈએ. વાતાવરણમાં જ્યારે ઉષ્ણતામાનમાં વધારો જોવા મળે ત્યારે ઢોરોને ૨૦ થી ૫૦ ટકા પીવાના પાણીની વધારે જરૂરિયાત રહે છે.

૬. ઢોરોને સંવર્ધન સમયે રાખવાની થતી કાળજી :

સંવર્ધનના સમયે દુધાળાં ઢોરોની નીચે દર્શાવ્યા પ્રમાણે અવશ્ય કાળજી રાખવી જોઈએ :

૧. દુધાળાં ઢોરોના દરેક વેતર દરમિયાન કેટલું દૂધ ઉત્પાદન આપે છે તેની નિયમિત રજિસ્ટરમાં અવશ્ય નોંધ કરવી જોઈએ અને તેની ઉપરથી કૃત્રિમ વીર્યદાન માટેનો ડોઝ નક્કી કરવો જોઈએ.
૨. કૃત્રિમ વીર્યદાન કરતાં રહેલાં સાંધ કે પાડાની વીર્યદાન માટે પસંદ કરતી વખતે તેના મા-બાપ દ્વારા તૈયાર થયેલ પેઢીમાં કેટલું દૂધ ઉત્પાદન આપ્યું હતું તેની આંકડાકીય માહિતી અવશ્ય જાણી લઈ તેવા સાંધ કે પાડાનું દુધાળાં ઢોરોને સારી ઓલાદના ગુણો જળવાઈ રહે અને વધુ દૂધ ઉત્પાદન મળે તે હકીકત ધ્યાને લઈ પાડા કે સાંધની પશુ સંવર્ધન માટે પસંદગી કરવી જોઈએ. જે સાંધ દ્વારા વાછરડી/પાડીનો જન્મ થયો હોય તેનું દૂધ ઉત્પાદન સર્વિસ માટે વપરાયેલ ઢોર કરતાં વધારે દૂધ ઉત્પાદન મળવું જોઈએ, દુધાળાં ઢોરો જ્યારે ગરમીમાં આવે ત્યારે કૃત્રિમ વીર્યદાન વહેલી સવારે અથવા સાંજના ઠંડકના સમયમાં કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ રીતે કરવાથી ઉત્તમ પરિણામ મળે છે. કૃત્રિમ વીર્યદાન અનુભવી સ્ટાફ દ્વારા કરાવવું જોઈએ, જેથી કૃત્રિમ વીર્યદાન નિષ્ફળ જવાની તક ઓછી રહે છે. બને ત્યાં સુધી કુદરતી રીતે ઢોરોને સંભોગ કરવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી જોઈએ.

૭. વાછરડાં, વાછરડી અને પાડીનો ઉછેર :

વાછરડાં, વાછરડી અને પાડીનો ઉછેર આદર્શ પશુપાલન વ્યવસાય માટે મહત્વનું પાસું છે. જો વાછરડાં, વાછરડી અને પાડીને સંપૂર્ણ સમતોલ ખોરાક અને રસીકરણ કરવામાં આવે તો તે ૧૮થી ૨૪ મહિનામાં બંધાઈ સારું દૂધ ઉત્પાદન આપવા માટે સક્ષમ બને છે. વાછરડા, વાછરડી અને પાડીના ઉછેર માટે જે ખર્ચ કરવામાં આવે છે તે એક પ્રકારનું મૂરીરોકાણ છે, જે પશુપાલકને દૂધની સાથે સારો નફો કમાઈ આપે છે.

૮. રસીકરણ અને માંદગીનો અટકાવ :

દુધાળાં પશુઓને નિયમીત રીતે પશુના ડોક્ટર દ્વારા અપાયેલી સલાહ મુજબ સમયસર રસીઓ મુકાવવી જોઈએ અને છ મહિને કૃમિઓને નાશ કરવાની ગોળીઓ આપવી જોઈએ. દુધાળાં પશુઓ બીમાર ન પડે તે માટે તેને સ્વચ્છ રાખવું જોઈએ અને રહેઠાણ પણ સ્વચ્છ રાખવું જોઈએ. દિવસમાં એક વાર તેનું રહેઠાણ પાણીથી સાફ કરવું જોઈએ. માખીઓનો ઉપદ્રવ અટકાવવો જોઈએ.

બદલાતા હવામાનની મરધાંપાલન વ્યવસાય પર થતી વિપરીત અસરો :

વાતાવરણમાં ઊંચા ઉષ્ણતામાને મરધાંપાલન પર થતી વિપરીત અસરો :

(અ) વાતાવરણમાં ઉષ્ણતામાન ઉંઘાં ૩૪° સે. કરતાં વધારે જોવા મળે ત્યારે :

- પુખ્ત ઉંમરના મીટ માટેના મરધાં ૩૪° સે. વધુ ઉષ્ણતામાનને કારણે ૮.૪ ટકા મરણનું પ્રમાણ જોવા મળે છે.
- બોર્ડલર મરધાંમાં વધુ ઉષ્ણતામાને ૦.૮૮ ટકા મરણનું પ્રમાણ જોવા મળે છે.
- દેશી મરધાંમાં વધુ ઉષ્ણતામાને ૩૪° સે. હોય ત્યારે મરણનું પ્રમાણ ૦.૩૨ ટકા જોવા મળે છે.

(બ) વાતાવરણમાં ઊંચા ઉષ્ણતામાને મરધાંમાં ખોરાક લેવાના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે.

- ૩૧.૬° સે. ઉષ્ણતામાને ૧૦૮.૩ ગ્રામ/પક્ષી/દિવસે.
- ૩૭.૮° સે. ઉષ્ણતામાને ૬૮.૮ ગ્રામ/પક્ષી/દિવસે.

(ક) વાતાવરણમાં ઊંચા ઉષ્ણતામાને હૃડાના ઉત્પાદનમાં ઘટાડો :

- બોઈલરમાં ૭.૫ ટકા હૃડા ઉત્પાદન ઘટે છે.
- લેયરમાં ૬.૪ ટકા હૃડા ઉત્પાદન ઘટે છે.
- (૩) મરધાના રહેવાના ઘર/શેડમાં ઉષ્ણતામાનમાં ૨૮° થી ૪૨° સે. વધારો થાય તો મરધાના શરીરના ઉષ્ણતામાનમાં ૪૧° થી ૪૫° સે. વધારો જોવા મળે છે.
 - ૪૨° સે. કરતાં મરધાંઘરમાં વધારે ઉષ્ણતામાન હોય ત્યારે મરધાનું મરવાનું પ્રમાણ વધે છે.
 - જે મરધાની ડોક ખુલ્લી (પીંછાં વગરની) હોય તેવા મરધાં પીંછાવાળી ડોકવાળા મરધાં કરતાં નીચેના હેતુઓ માટે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
 - ગરમી સામે પ્રતિકારક
 - વૃદ્ધિ અને તંદુરસ્તી સાથે પ્રતિકારક
 - ખોરાક લેવાની કાર્યક્રમતા વધારે જોવા મળે છે.
 - રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવે છે.

અસત્ય વધારે ગરમીના સમયમાં મરધાંપાલન માટે નીચેના ઉપાયો કરવા જોઈએ :

- મરધાંમાં વધારે ગરમીના સમયમાં પ્રોટીનમાં ૨ ટકા અને ૧૦૦-૧૫૦ કેલરી/ક્રિ.ગ્રા. ખોરાક લેવાની શક્તિમાં ઘટાડો જોવા મળે છે.
- આવા સમયે મરધાંને વહેલી સવારે ખોરાક આપવો જોઈએ અથવા દિવસમાં પાણી સાથે ૩-૪ વખત ખોરાક આપવો જોઈએ.
- આવા સમયે મરધાં ઘર/શેડની દીવાલો ચુનાથી ધોળાવવી જોઈએ.
- આવા સમયમાં મરધાંઘરમાં ૧૧.૦૦ થી ૧૮.૦૦ સુધી પંચ.મી. વિસ્તારમાં ફરી શકે તેવા ફુવારાથી ઠંડકની સુવિધા કરવી જોઈએ.
- આવા સમયે મરધાંઘરમાં ઠંડક માટે પૂરતા સીલાંગ ફેનનો ઉપયોગ કરવો જોઈએ.
- આવા સમયમાં શક્તિદાયક અને વિટામિન્સ પૂરા પાડે તેવા પાણીયુક્ત ખાણા-દાણા મરધાંને પ્રતિકારક શક્તિ મળે તે માટે આપવા જોઈએ.
- આવા સમયે મરધાંનું પ્રમાણ ૧૦ ટકા ઘટાડવું જોઈએ.

વાતાવરણમાં અક્ષમ્ય ઠંડીનું પ્રમાણ વધે તો મરધાંપાલન માટે નીચેની કાળજી લેવી જોઈએ :

- આવા સમયમાં મરધાના ખોરાક/ખાણા-દાણમાં ફૂડ પ્રોટીન અને શક્તિનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક આપવા.
- મરધાંઘરમાં ઉષ્ણતામાનમાં વધારો કરવા ઈલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવો જોઈએ.
- મરધાંઘરમાં ૧૦ ટકા વધુ મરધાનું પ્રમાણ વધારવું જોઈએ.
- મરધાંઘરને બહારની હવાની ઠંડીની સીધી અસરને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.

વातावरणમાં પૂર અને વધુ વરસાદની પરિસ્થિતિ સર્જય ત્યારે મરધાંપાલન માટે રાખવાની કાળજી :

- પૂર અથવા વરસાદની અસર મરધાઘરને ન થાય તે માટે જમીનથી ઉ ફૂટ ઊંચાઈએ મરધાંઘરનું ગ્રાઉન્ડ લેવલથી ઊંચે રાખવું જોઈએ.
- આવા સમયમાં મરધાં માટેના ખાણ-દાણને પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ, જેથી ખાણ-દાણને ભેજ અને ફૂગની અસર થઈ શકે નહીં.
- આવા સમયમાં આર્થિક આરક્ષણ મેળવવા માટે મરધાંપાલન વ્યવસાય માટે મરધાંઘર/શેડ, યાંત્રિક સાધનો, પક્ષીઓનો અવશ્ય વીમો લેવો જોઈએ.

બદલાતા હવામાનમાં તળાવોમાં મત્સ્યપાલન માટે ધ્યાનમાં રાખવાના સૂચિત ઉપાયો :

1. વધારે સુકારાની પરિસ્થિતિ (Drought Condition) હોય ત્યારે :

- આવા સુકારાના સમયમાં તળાવોમાં ટેન્કરથી અથવા ફૂવામાંથી પાણી પરિસ્થિતિ કરી ભરવું જોઈએ અને તળાવમાં પૂરતા પાણીની આયાત મત્સ્યપાલન વ્યવસાય માટે જાળવવી જોઈએ.
- સમયાંતરે તૈયાર થયેલ પુખ્ત માછલીઓને તળાવથી હાર્વેસ્ટિંગ કરી સમયર માર્કેટિંગ કરવું જોઈએ. બીજા જળાશયો / તળાવમાં ટ્રાન્સફર કરવી જોઈએ.

2. પૂર અને અતિયક્વાતની પરિસ્થિતિમાં :

પૂર નદીઓના માછલાં પકવવામાં માછીમારોને મદદરૂપ બને છે, પરંતુ તળાવોના માછલાં અન્યત્ર જગ્યાએ ઓવર ફ્લોથી અન્યત્ર નીચાણવાળી જગ્યાએ તણાઈ જવાથી નુકસાન થાય છે તથા બીજી અન્ય પ્રકારની માછલીઓ તળાવમાં મિક્સ થાય છે. આવા સમયે બને પ્રકારની માછલીઓનું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. આવા સમયે તળાવને રીપેર કરવા જોઈએ અને સ્વચ્છ કરી તળાવમાં તાજું પાણી ભરવું જોઈએ.

3. અતિ ગરમી અને ઠંડી પડે ત્યારે :

વધારે ગરમી અને ઠંડીના સમયમાં માછલીઓ જળાશયોમાં તેની સંખ્યા-પ્રમાણ ઉપર ગંભીર વિપરીત અસર જોવા મળે છે. આવા સમયે માછલીઓ જળાશયોની ઊંડાણવાળી જગ્યાએ સલામત જગ્યાએ સ્થળાંતર કરે છે. જેથી તેમની વૃદ્ધિ ઉપર માઠી અસર થાય છે અને માછલીનું ઉત્પાદન ઘટે છે તેમજ ઠંડીના સમયમાં માછલીઓના સંવર્ધન ઉપર વિપરીત અસર થવાથી ઘટાડો જોવા મળે છે. ઠંડીના સમયમાં જળાશયોમાં ઓક્સિસજન જગ્યાવવા માટે ઉપયોગ કરવો જોઈએ. જેથી આ અંગે જળાશયોમાં આવા સમયે પર્યાપ્ત માત્રામાં આહાર આપવો જોઈએ.

• • •

આકસ્મિક પાક-આયોજન

આકસ્મિક પાક-આયોજન એટલે શું ?

પાક વાવ્યા પહેલાં કે પાક વાવ્યા પછી વાતાવરણમાં આકસ્મિક, અનિયન્ત્રિત, પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જય અને તેની પાક વૃદ્ધિ કે ઉત્પાદન ઉપર સીધી કે આડકતરી રીતે નુકસાનકારક અસરો સર્જય ત્યારે તેને નિવારવા કે તેનો પ્રભાવ ઓછો કરવા જે આયોજન/વ્યવસ્થા કરવામાં આવે તેને આકસ્મિક પાક-આયોજન કહે છે.

ઓચિંતા વાતાવરણના બદલાવથી કૃષિપાકો પર થતી અસરો :

- વરસાદની અનિયમિતાને કારણે જે તે વિસ્તારની પાકપદ્ધતિમાં (Cropping System) ફેરફાર અનિવાર્ય બનેલ છે.
- ઉષ્ણતામાન વધવાને કારણે પાકની પાણીની જરૂરિયાત વધી છે જેને લીધે ઉત્પાદનખર્ચ વધે છે.
- વધુ તાપમાનની પરિસ્થિતિમાં કુમળા પાનવાળા પાકમાં દાહક અસર થાય છે. પરાગરજ ફલિનીકરણ માટે અસક્ષમ થઈ જતાં દાઢા ઓછા બંધાય છે જેથી પાક-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.
- ઓછા વરસાદ/જમીનના ઓછા ભેજને કારણે બીજના ઉગાવા ઉપર વિપરીત અસરો જોવા મળે છે.
- ઓછા વરસાદને કારણે પાકને ખાતરરૂપે પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં આપી શકાતા નથી જેથી ઉત્પાદન ઓછું મળે છે.
- ચોમાસામાં સરેરાશ વરસાદ કરતાં વરસાદ ઓછો પડે અથવા સરેરાશ જેટલો જ વરસાદ થાય પણ સપ્રમાણ ન પડે તો પાક નિષ્ફળ જવાની કે ઉત્પાદન ઓછું મળવાની શક્યતા રહે છે.
- વધુ વરસાદને કારણે રોગ-જીવાત વધવાથી ખેતીખર્ચ વધે છે. ખેતરમાં પાણી ભરાઈ જવાના (Waterlogging/Flooding) ગ્રસ્નો થવાથી પાકની વૃદ્ધિ નભળી પડે છે. પાક નિષ્ફળ જાય છે.
- ઓછા વરસાદને કારણે જમીનમાં પૂરતો ભેજ ન થવાથી જમીનમાં રહેલાં પોષક તત્ત્વોનું પાક દ્વારા શોષણ ઓછું થાય છે.
- પાકની કાપણી સમયે આકસ્મિક વરસાદ/વાવડોડાને લીધે પાક-ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે અને બજાર ભાવ ઓછા મળે છે તેમજ છોડ ઢળી પડે છે, ફળ-કૂલ ખરી પડે છે.
- ચોમાસું મોહું થવાથી ડાંગરનું ધરુ મોટી ઉમરનું થઈ જવાથી ધરુની ફેરરોપણી બાદ ફૂટ (Tilling) ઓછી મળે છે જેથી ઉત્પાદન ઘટે છે.
- વરસાદની અનિયમિત પરિસ્થિતિને કારણે પશુપાલન, મરધાપાલન અને મત્સ્ય ઉદ્યોગના ઉત્પાદનમાં ફેરફાર જોવા મળે છે.

ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જવું (Flood) :

- ઊભા પાકના ખેતરમાંથી પાણીનો નિકાલ કરવો.
- મકાઈના ડેડા તૈયાર થઈ ગયેલ હોય તો ઊભા પાકમાંથી ડેડા લણી લેવા.
- બાજરી અને ડાંગર જેવા પાક કાપણી માટે તૈયાર થઈ ગયેલ હોય તો કાપણીનો સમય લંબાવવો.
- ડાંગરના પાકમાં પ ટકા મીઠાના દ્રાવણનો છંટકાવ કરવાથી વરસાદને કારણે બી ઊગી જતા અટકાવી શકાય છે તથા ઘાસ કાળું થતું અટકાવી શકાય છે.

બદલાતા હવામાનની કૃષિ અથવા કૃષિને લગતા અન્ય વ્યવસાયો ઉપર થતી અસરો :

સામાન્ય રીતે, વાતાવરણના બદલાવને કારણે ગરમીનું પ્રમાણ સરેરાશ તાપમાન કરતાં ઉનાળાની ઋતુમાં પ્રમાણમાં વધારે તેમજ શિયાળાની ઋતુમાં સરેરાશ તાપમાન કરતાં ઓછું તાપમાન જોવા મળેલ છે.

આ ઉપરાંત વરસાદની અનિયભિતાને કારણે ચાર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જે જેતી માટે નુકસાન/ફાયદાકારક છે.

- ચોમાસું વહેલું શરૂ થવું.
- ચોમાસું મોહું શરૂ થવું.
- ચોમાસું શરૂ થયા પછી લાંબા સમય સુધી ફરી વરસાદ થવાનો સમય ખેંચાવો (Dry spell).
- ચોમાસાના અંતમાં એટલે કે પાક પાકવાના સમયે વરસાદ જ ન થવો (ચોમાસું પૂરું થઈ જવું - Early withdrawal of monsoon) અથવા વરસાદ ઓક્ટોબર માસ સુધી લંબાવો. (Extended monsoon)

બિનયેતવ્યા વાતાવરણના ફેરફારોની અસર હેઠળ આકસ્મિક પાક-આયોજન :

જ્યારે બિનયેતવ્યા વાતાવરણના બદલાવની એકાએક અસરો હવામાનમાં જોવા મળે ત્યારે તેના પ્રત્યાધાતરૂપે સૂચિત ઉપાયો ખેડૂતોએ અપનાવવા જોઈએ :

- ગરમ પવનો ફુંકાવા (Heat Wave) :
 - ટૂંકા ગાળે પાકને પિયત આપવું જોઈએ.
 - પાક ફરતે ગરમી સામે ટકી શકે તેવા પાક કે વનસ્પતિની વાડ બનાવી જોઈએ. (દા.ત., કેળ કે પણૈયા ફરતે શેવરીની વાડ કે ઉનાળું મકાઈ ફરતી જુવારની પ થી હ લાઈનનો પણો ઉગાડવો જોઈએ.)
- ઠંડો પવન ફુંકાવો (Cold Wave) :
 - ટૂંકા ગાળે પાકને પિયત આપવું જોઈએ.
 - નકામું ધાસ બાળીને ખેતરમાં ધુમાળો કરવો જોઈએ.
- વરસાદ થયા પછી લાંબા સમય સુધી ફરીથી વરસાદ ન થવો (Dry Spell) :
 - ૮-૧૦ દિવસના વિરામની પાક ઉપર કોઈ ખાસ અસર થતી નથી.
 - જો વરસાદનો વિરામ ૧૫ દિવસનો વર્તાય તો પાકને તેની કટોકટી અવસ્થાએ પિયત આપવું જોઈએ.
 - પાકને યોગ્ય અંતરે આણો કરવો અને જ્યાં ખાલા હોય ત્યાં ખાલા પૂરી ઢેવા.
- જો વરસાદનો વિરામ ૨૫-૩૦ દિવસનો વર્તાય તો :
 1. ચાસમાં આંતરખેડ કરવી.
 2. નિદામણ દૂર કરવા.
 3. એકાંતરે ચાસે પાક બચાવવા પૂરક પિયત આપવું.
 4. દિવેલા-કપાસ-તુવેર જેવા પાકોમાં ર ટકા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો.
 5. પૂર્તિ ખાતર (યુરિયા)નો હપતો પાકને આપવાનો બાકી હોય તો ફરી વરસાદ આવે ત્યાં સુધી લંબાવવો.
 6. જો પિયતની સગવડ ન હોય અને પાક બચાવી શકાય તેમ ન હોય તો પાકની એકાંતર હાર ઉપાડી લેવી.

- ચોમાસું નિયમસરના સમય કરતાં વહેલું પૂરું થઈ જવું :
 - આવી પરિસ્થિતિ પાકને નુકસાનકારક છે.
 - દાણાના વિકાસ માટે પાકના પાકવાના સમયે જો ભેજની ખેંચ વર્તાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવા સંભવ છે જે નિવારવા પૂરક પિયત આપવાની વ્યવસ્થા કરવી.
- ચોમાસું નિયમસર કરતાં વધુ લંબાય :
 - આવી પરિસ્થિતિ લેટ ખરીફમાં થતાં પાક માટે ફાયદારુપ છે. કાળી કે મધ્યમ કાળી જમીનમાં બિનપિયત લેવાતાં ચણા, ઘઉં, સવા, રાઈ, જવ વગેરે પાકો વિલંબિત ચોમાસાના ભેજથી સારી રીતે લઈ શકાય છે.

ખેડૂતો દ્વારા કરી શકાય તેવા જળસંગ્રહણાં કામો :

- ખેતરને ખંડમાં વિભાજિત કરવું (**Compartmental Bunds**) :

જો ખેતર વધારે લાંબું હોય અને ખેતરનો ઢાળ ૧ ટકા જેટલો હોય તો ખેતરમાં ઢાળ વિરુદ્ધ પાળા નાખી વરસાદનું વહી જતું પાણી રોકી ખેતરમાં ભેજ સંગ્રહ કરી શકાય.
- પદ્ધી પદ્ધતિ વાવેતર (**Contour Farming**) :

જો ખેતરનો ઢાળ ૧ થી ૨ ટકા હોય તો ઢાળની વિરુદ્ધ ખેતરના એક છેદેથી બીજા છેડે લેવલ જળવાય તે રીતે પાકની ખેડ તથા વાવેતર કરવું.
- પદ્ધી પાક પદ્ધતિ (**Strip Cropping**) :

ખેતરમાં જમીનનું ધોવાણ અટકાવવા તથા જમીનની ભેજ સંગ્રહશક્તિ વધારવા મુખ્ય પાકની બે લાઈન વચ્ચે હ થી ૮ લાઈન જમીન ઉપર પથરાય તેવા પાક વાવવા જોઈએ. દા.ત., તુવેરની બે લાઈન વચ્ચે જમીન ઉપર પથરાતી વેલડી મગફળી હ થી ૮ લાઈન કરવાથી વરસાદનું પાણી ખેતરમાં સંગ્રહ થાય છે, જે તુવેરને લાંબા સમય સુધી મળે છે.

મિશ્ર કે આંતરપાક પદ્ધતિ (Mixed/Inter Cropping) :

જુદા જુદા બે અથવા બે થી વધારે પાકનાં બીજ ભેગા કરી વાવેતર કરવામાં આવે તેને મિશ્ર પાક પદ્ધતિ કહેવામાં આવે છે. તે જ રીતે બે જુદા પાકના બી અલગ અલગ હારમાં એક જ સાથે વાવવામાં આવે તેને આંતરપાક પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ પ્રકૃતિને અનુસરે છે જેમાં પાકને નુકસાન કરતી જીવાતના કુદરતી શત્રુઓનો વધારો થાય છે જેને પરભક્ષી અને પરોપજીવી ક્રીટકો/જીવાત કહે છે. એક પાકની ખેતીપદ્ધતિમાં પાકની વિવિધતા ન મળતી હોઈ જૂઝ પ્રમાણમાં પરોપજીવી કે પરભક્ષી ક્રીટકો જોવા મળે છે. કેટલીક મિશ્ર પાક પદ્ધતિ જેમ કે તલ + કપાસ, તુવેર + મકાઈ, ઓરાણ ડાંગર + મકાઈ, તુવેર + ઓરાણ ડાંગર, મકાઈ + સોયાબીન, તુવેર + મગફળી તેમજ જુવાર + મગ શુજરાતમાં સફળ રહી છે.

ચાસ અને પાળા (Ridge-Furrow Systems) :

આ પદ્ધતિથી પાકનું વાવેતર કરવાથી ચાસમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. વરસાદનું પાણી ખેતરની બહાર વહી જતું રોકી શકાય છે એટલું જ નહીં, પાળામાં ભેજ લાંબા સમય સુધી સંગ્રહિત રહે છે જે પાકને લાંબા સમય સુધી મળે રહે છે.

ઉનાળામાં ઊંડી ખેડ કરવી (Deep Tillage in Summer) :

દર ત્રણ વર્ષમાં એક વખત જમીનની ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ કરવાથી જમીનના નીચેના તળમાં જામેલ સખત પડ તૂટે છે જેથી વરસાદનું પાણી જમીનમાં નીચે ઉત્તરતા જમીનની ભેજ ધારણશક્તિ વધે છે. આ

ઉપરાંત જમીન છેક ઉડે સુધી સૂર્યના આકરા તાપથી તપાતાં રોગોના જીવાણું તથા પાકને નુકસાન કરતી જીવાત નાશ પામે છે અને તેમાંથી પોષક તત્ત્વો છૂટાં પડે છે. ધરો તથા ચીઢો જોવા હઠીલા નિંદામણોને કાબૂમાં રાખી શકાય છે.

ટેકરાળ વિસ્તારમાં ઉત્તરોત્તર કર્મે પાળા બનાવવા (Graded Bunds) :

ટેકરીવાળા વિસ્તારમાં કે જેનો ૧ થી ૬ ટકા ઢાળ છે (જ્યાં ખેતીપાક થઈ શકે તેમ નથી) ત્યાં ઢાળની વિરુદ્ધ પાળા બનાવવાથી વરસાદનું પાણી નીચે વહી ન જતાં જમીનમાં ઉત્તરે છે. પાળો બનાવવા પાળાના આગળના ભાગમાં લીધેલ માર્ટીને કારણે નીક બને છે. આ નીકમાં યોગ્ય અંતરે ઝાડ વાવી શકાય. વધુમાં, બે પાળા વચ્ચેની જમીનમાં કે જ્યાં સારો ભેજ રહેલ હોય છે ત્યાં સારા પ્રકારનું ધાસ (સેન્ક્સ કે ધામણ) રોપી શકાય.

જમીનનો વૈકલ્પિક ઉપયોગ (Alternative use of land) :

– એગ્રો-ફોરેસ્ટ્રી (Agro-forestry) :

ઓછા વરસાદવાળા વિસ્તારમાં સફળતાપૂર્વક પાક લેવામાં જોખમ રહે છે. જમીનની ફળદુપતા પણ ઓછી હોય છે. આવી પરિસ્થિતિમાં ટૂંકા ગાળાના પાક/લેજની ખેંચને પણ જમીન શકે તેવા પાક (મગ, ચોળા, મઠ, રાઈ, ચણા, જીવાર, બાજરી, દિવેલા વગેરે) સાથે ઝાડ (બાવળ, ખીંડો, સીસમ, સાગ વગેરે કે જોનો છાંયો ગાઢ ન હોય) રોપવામાં આવે છે. ચોમાસું નિષ્ફળ જાય તો પણ ઝાડ વૃક્ષ પામે છે અને લાંબા ગાળે સારી આવક ઝાડમાંથી મળે છે. આને આપણે ટકાઉ ખેતીપદ્ધતિ કહી શકીએ.

– જંગલમાં ઝાડ સાથે ધાસચારાની ખેતીપદ્ધતિ (Silvi Pasture Management) :

ચરિયાણ વિસ્તારમાં આ પદ્ધતિ સફળતાપૂર્વક અપનાવી શકાય. ચરિયાણ વિસ્તારમાં દુષ્કણ સમયે પણ ટકી શકે અને ફરીથી ફૂટ ઝડપી મળે તેવી ધાસની જાત પસંદ કરી તેનાં બી ચોમાસામાં ચરિયાણ વિસ્તારમાં નાખવા જોઈએ. ઝાડની પસંદગીમાં પણ જે ઝાડનાં પાન પશુઓ માટે ચારા તરીકે ઉપયોગી થાય તેવા ઝાડ પસંદ કરવા જોઈએ.

– ખેતીપાકો સાથે બાગાયતી પાકની ખેતીપદ્ધતિ (Agri-Horticulture) :

જે વિસ્તારની જમીન ફળદુપ હોય, વરસાદ પણ ૫૦૦ મી.મી.થી વધુ થતો હોય, ત્યાં આ ખેતીપદ્ધતિ આર્થિક રીતે ફાયદારૂપ થાય છે. આ પદ્ધતિમાં ખેતીપાકો સાથે બાગાયતી પાકો લેવામાં આવે છે.

સરકાર/પંચાયતને કરવા જોઈતાં કામો :

- જળસ્નાવ યોજના
- વોટર હોર્સિસ્ટન્સ માળખા બાંધવા.

ઉપરનાં કામો લોકભાગીદારીથી ખેતીના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકારે ગ્રામ એજન્સી દ્વારા બાંધકામની ગુણવત્તા જળવાય તે રીતે કરવા જોઈએ.

બદલાઈ રહેલા વાતાવરણની અસરો મર્યાદિત કરવા યોગ્ય ખેતીપદ્ધતિ (Good Agri-Cultural Practices) :

- બદલાતા હવામાન સામે ટકી રહે તેવી પાકની જાત પસંદ કરવી. ગરમી સહન કરી શકે, ઢળી ન પડે, તાપ સહન કરી શકે, ભેજની ખેંચ સહન કરી શકે, રોગ-જીવાત સામે પ્રતિકાર શકતી ધરાવતી પાકની જાત વગેરે.
- ભેજના સંગ્રહ માટે સેન્દ્રિય ખાતરો, લીલો પડવાશ (જે તે જમીન તથા વરસાદના પ્રમાણને ધ્યાને રાખી પાક પસંદ કરવો), વિવિધ કમ્પોસ્ટનો ઉપયોગ કરવો.

- પિયત પાણી તથા ખાતરના કાર્યક્રમ ઉપયોગ માટે સ્લિંપ્કલર કે મલ્વિંગ સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ.
- ભારે કાળી જમીન કે ઢાળવાળી જમીનમાં નિતાર નીકો બનાવવી જોઈએ.
- વાવેતરના સમયે વાતાવરણનું ઉષ્ણતામાન વધારે હોય તો વાવણી સમયમાં ફેરફાર કરી અનુકૂળ સમયે પાકનું વાવેતર કરવું.
- મજૂરોની અછત હોય ત્યાં યાંત્રિક ખેતી દ્વારા સમયસર ખેતીકાર્યો પૂર્ણ કરવાં જરૂરી છે. યુવાન ખેડૂતોએ આ બાબતે પહેલ કરવાની રહે.
- ખેત પ્રક્રિયા અને મૂલ્યવૃદ્ધિ દ્વારા ગુણવત્તાયુક્ત કૃષિ-ઉત્પાદનના ઘણા સારા ભાવ મેળવી શકાય.
- ખેડૂતો ઊંચી કિંમત ધરાવતા હાઈ વેલ્યુડ પાકોનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી ખેતી કરી શકે છે. સાથે સાથે કૃષિ વિમાનું કવચ પણ મેળવી શકાય.
- સુવિકસિત સહકારી વિકાસલક્ષી સંસ્થાઓ દ્વારા અધતન ઓનલાઈન માર્કેટિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાના ઉત્પાદનના સારા ભાવ મેળવી શકે છે.
- સંકલિત જીવાત-રોગ નિયંત્રણ, સંકલિત નિંદામણ, સંકલિત પિયત વ્યવસ્થા તથા સંકલિત પાક પોષણ વ્યવસ્થા અપનાવી ખેતીખર્ચ ઘટાડવો જોઈએ તથા વધારે પડતા પિયત પાણીનો, ખાતરનો તથા દવાઓના ઉપયોગથી જમીન અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ.

● ● ●

કુદરતી હોનારતો વખતે વ્યવસ્થાપન

વાતાવરણ બદલાવથી સર્જતી કુદરતી હોનારતોનાં નુકસાનો અને પુનઃસ્થાપન (Strategy for Restoration) :

વાતાવરણના બદલાવની અસરો હાલમાં છેલ્લા દાયકાથી જોવા મળેલ છે. કેટલીક મોટે પાયે સર્જતી આક્રિસ્મિક કુદરતી હોનારતોને લીધે સમગ્ર કૂષ્ઠ ક્ષેત્ર, પશુપાલન અને તમામ જનજીવન ઉપર તેની ઘણી જ વિપરીત ગંભીર અસરો જોવા મળે છે. આ પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ખાસ આક્રિસ્મિક પગલાં હાથ ધરવાથી લાંબે ગાળે લોકોનું જનજીવન પુનઃ સારી રીતે ચાલુ કરી શકાય.

ડા.ત.,

- ઉત્તરાખંડમાં ચાલુ વર્ષે ભારે વરસાદ દ્વારા થયેલ અતિવૃદ્ધિથી જનજીવનમાં થયેલ ભારે તબાહી
- ઓરિસ્સામાં થયેલ વિનાશકારી ચક્કાવાત/વાવાજોડું
- ફિલિપાઈન્સમાં થયેલ વિનાશકારી વાવાજોડું
- ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લાઓમાં થયેલ પૂરની વિનાશકારી આફ્ટો
- ઉપરોક્ત સર્જયેલ કુદરતી હોનારતોને કારણે થયેલ વિનાશકારી નુકશાનને હાલના પૂર નિયંત્રણ કે ભૂકુંપ માટેની નિયત કરેલ વ્યવસ્થાપન પદ્ધતિના સંપૂર્ણ પુનઃસ્થાપન માટે કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
- સદર કુદરતી મોટી હોનારતો/આફ્ટોને પુનઃસ્થાપન કરી જન-જીવન ચાલુ કરવા માટે ખાસ સેશિયલ નિયંત્રણનાં પગલાં (Strategy for Restoration) અપનાવવી અતિ મહત્વની બાબત છે, જેને માટે સરકારશ્રી દ્વારા ખાસ રાહતો આપવામાં આવે છે.

આવી કુદરતી હોનારતો/આફ્ટોમાં કાયમી ધોરણે જન-જીવન પુનઃસ્થાપન કરવા માટે નીચેના ઉપાયોગ હાથ ધરવા જરૂરી છે :

કુદરતી હોનારતો સામે તેને પુનઃસ્થાપન કરવા માટેના કાયમી ઉપાયો :

| | |
|--|---|
| <ul style="list-style-type: none">દરિયાની પાણીની સપાટીમાં થતો સખત વધારો અને જેને લીધે દરિયાકિનારાની ખેડાણાલાયક જમીનો હુબાણમાં જતી અટકાવવાના ઉપાયોખેતરોની ઉપરના પડનું વધુ વરસાદ કે પૂરને લીધે ધોવાણ થઈ જવું.ભારે વિનાશકારી વાવાજોડાથી જમીનના ઉપરના ભાગમાં અને જમીનની અંદરના ભાગમાં જમીન ક્ષારયુક્ત બનવી.ચેક ડેમોનું ધોવાણ થઈ જવું. | <ul style="list-style-type: none">ખેડૂતોને હુબાણમાં ગયેલ જમીનની જગ્યાએ અન્યત્ર બીજા સ્થળોએ ખેતીલાયક જમીનો આપવાની વ્યવસ્થા કરવા વિચાર કરવો.દરિયાકિનારાના નીચાણવાળી જગ્યાએ રક્ષણાત્મક દીવાલો બાંધી અને મેન્ચ્રૂવ, શરૂ, વાંસ-જાડોનું મોટા પાયે વાવેતર કરી સંરક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા.પૂરથી ધોવાયેલ ખેતરમાં નવી માટી લાવી ખેતી માટે તેની પુનઃસ્થાપન કરવાના પ્રયત્નો હાથ ધરવા.આવી જમીનોનું પૃથક્કરણ કરાવી તે પ્રમાણે પાકો વાવવા માટેનું વૈજ્ઞાનિક ધોરણ અપનાવવું. |
|--|---|

- ટ્રેકટર જેવી ફાર્મ મશીનરી અને અનાજ સંગ્રહવાનાં પીપ, સ્ટોરેજ બીન્સ અને કૂણિનાં ઓજારોને ભારે નુકસાન થવું.
- પશુ અને મરધાં-બતકાંનો ભારે પૂર હોનારતને કારણે વિનાશ થવો.

- નુકસાન થયેલ ખેતીના સાધનો જેવાં કે, ટ્રેકટર વગેરે માટેના પ્રયત્નો હાથ ધરવા.
- ભરી ગયેલ ઢોર અને મરધાં-બતકાંની જગ્યાએ નવા આપવા માટેની યોજનાનો લાભ લેવો જોઈએ.
- નુકસાન થયેલ કે નાશ પામેલ ટ્રેકટર, અન્ય ખેતીનાં સાધનો રીપેર અથવા નવા લાવવા માટેની રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ.

• • •

ખારાશના વધતા જતા પ્રક્રિયા તેમજ વાતાવરણ બદલાવની બાગાયતી પાકો અને ક્ષેત્રપાકો ઉપર માઠી અસર

બદલાતા હવામાનમાં બાગાયતી પાકો અન્ય ટૂંકા ગાળાના સિજનલ પાકોની સરખામણીમાં લાંબા ગાળા સુધી નિયમિત અને વધુ આવક આપે છે, પરંતુ હવામાનમાં વૈશ્વિક ગરમી (Global Warming) ને કારણે નીચે દર્શાવ્યા પ્રમાણેના ફેરફારો જોવા મળ્યા છે. આને લીધે વિવિધ બાગાયતી પાકો અને ક્ષેત્રિય પાકો તથા પશુપાલન અને જનજીવન ઉપર વિપરીત અસર જોવા મળી છે.



હિમાયાદિત પ્રદેશોમાં બરફ ઓગળવાને કારણે દરિયાઈ પાણીની સપાટીની ઊંચાઈમાં થયેલો ઉ-૪ ફૂટનો વધારો

Effect of Salinity Sodicity on Agriculture sector under the situation of climate change

૧. હિમાયાદિત પ્રદેશોમાં જ્વાલા વોર્મિંગને કારણે બરફ ઓગળવાથી દરિયાની સપાટીમાં સરેરાશ ઉ થી ૪ ફૂટ જેટલો વધારો છેલ્લાં ૧૫ વર્ષમાં થયો છે.
૨. હવામાન બદલવાને લીધે અમેરિકા, ભારત, જાપાન, ચીન, થાઇલેન્ડ વગેરે દેશોમાં સાઈકલોનની વિપરિત અસર સર્જવાને લીધે કૃષિ, જનજીવન તેમજ ઉદ્યોગધંધા ઉપર બહુ જ માઠી અસર જોવા મળે છે. દા.ત. ભારતમાં ઉત્તરાખંડમાં વધુ વરસાદથી થયેલા ભૂસ્ખલનથી પારાવાર નુકસાન.

૩. આના કારણે વિશ્વના તમામ દેશોમાં દરિયાકાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં, દરિયા દ્વારા, ગલી દ્વારા અને દરિયાને જોડતી નદીઓના મુખ્ય પ્રદેશમાં ભરતી અને વરસાદના કારણે બેતીલાયક જમીનોમાં અંદરના ભાગમાં ખારાં પાણી ફરી વળવાથી દિવસે દિવસે ખારાશ હેઠળનો વિસ્તાર વધતો જાય છે.
૪. બાગાયતી અને ક્ષેત્રિય પાકોના મૂળ વિસ્તારમાં કારને લીધે જમીનમાં રસાકર્ષણ (osmosis)નું દબાણ વધવાથી આ પાકોમાં પાણી, પોષક તત્ત્વો અને હવાની અવરજવરના જટિલ પ્રશ્નો ઉપસ્થિત થવાના લીધે બાગાયતી પાકો તેમજ ક્ષેત્રિય પાકોનો વિકાસ ઝુંધાય છે અને પાક ઉત્પાદન ઘણું જ ઓછું અથવા નહિવત્તુ પ્રમાણમાં મળે છે. દા.ત. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ખારાશ વધવાને લીધે ડાંગર અને ઘઉના પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ પડતી ખારાશને લીધે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
૫. કેરીના પાકમાં ફૂલ બેસવા / મોર આવવાની અવસ્થાએ હવામાનમાં ફેરફારને કારણે જ્યારે એકાએક કરા પડે છે અથવા હિમ પડે છે અથવા વધુ ગરમીને કારણે પરાગારજ બળી જવાથી મોર ખરી પડે છે ત્યારે કેરી બેસવાની શક્તિમાં ભારે ઘટાડો જોવા મળે છે. દા.ત. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ, કરા અને વધુ વરસાદને કારણે કેરીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો.
૬. ભારે કાળી અને કારવાળી અને વધુ વરસાદના વિસ્તારમાં આવેલી જમીનમાં પાણીનું સ્લર ઊંચે આવવાથી પાકના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. દા.ત. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પરિસ્થિતિને લીધે દરિયાઈ પદ્ધીમાં આવેલા આંબાવાડિયા અને ચીકુની વાડીનું પ્રમાણ દિવસે દિવસે ઘટવા પામ્યું છે. વધુમાં શેરડી, કેળા જેવા રોકડિયા પાકો અને ક્ષેત્ર પાકો હેઠળનો વિસ્તાર પણ ખારાશને લીધે ઘટયો છે અને ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. વધુ ગરમીને કારણે રોગ અને જીવાતના પ્રમાણમાં પણ વધારો થયો છે. દા.ત. કેળા અને શેરડીના પાકના ઉત્પાદનમાં થઈ રહેલો ઘટાડો મુખ્યત્વે વધુ પડતા રોગ અને જીવાતને કારણે છે.
૭. ઉત્તર ગુજરાતમાં સબમર્સિબલ પંપથી ૨,૦૦૦ ફૂટ અને તેથી વધુ ઊંડાઈએ જમીનમાં ભૂતળમાંથી સિંચાઈના પાણીનું લિફ્ટાઇંગ કરીને પિયત માટે ઉપયોગ કરવામાં આવે છે. નીચેના ભૂતળમાં આવેલાં કારવાળા પાણીનો ખેડૂત મિત્રો સિંચાઈ તરીકે ઉપયોગ કરતા હોવાથી મરી-મસાલાના પાકો જેવા કે જીરુ, ધાણા, ઈસબગુલ, વરિયાળી, મરચાં તથા કપાસ તેમજ લીંબુ વર્ગના પાક ઉપર તેની વિપરીત અસર જોવા મળી છે. આને કારણે હારિજ, રાધનપુર, ચાણસ્મા, સાતલપુર, વાવ, થરાદ વગેરે વિસ્તારોમાં કારની અતિ તીવ્ર અસર જોવા મળે છે અને જમીનની ઉપરની સપાટી ઉપર સફેદ રંગના પેચ / ધજ્બા નરી આંખે દેખી શકાય છે.
૮. મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ખારાશ વધવાને લીધે દ્રાક્ષ, દાડમ, કેળા જેવા બાગાયતી પાકો તેમજ અન્ય ક્ષેત્ર પાકોની બેતીમાં મોટે પાયે અસર થવા પામી છે અને ઉત્પાદનમાં અસહ્ય ઘટાડો નોંધાયો છે.
૯. પોરબંદર, વેરાવળ વિસ્તારમાં દરિયાનાં પાણી જમીનથી ઊંચા લેવલ સુધી આવવાથી નાગરવેલના પાન, નાળિયેરી, આંબા, મગફળી, તલ, દિવેલા અને કપાસ જેવા અન્ય કૂષ્ઠ પાકોમાં ઉત્પાદન ઉપર વિપરીત અસર જોવા મળી છે. બદલાતા હવામાનમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ જેવાં રાજ્યોમાં સૂકી દ્રાક્ષના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે વાઈન ઈન્ડસ્ટ્રી બંધ થાય તો નવાઈ નહીં, એવી વિપરીત અસરો જોવા મળી છે.



ખારાશ તેમજ બદલાતા હવામાનની દ્રાક્ષના પાક ઉપર થયેલી વિપરીત અસરો

મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં થતી દ્રાક્ષની ખેતી પર થતી વિપરીત અસરોથી વજન અને ગુણવત્તામાં થયેલો ઘટાડો.

૧૦. તામિલનાડુ અને કેરળ રાજ્યમાં દરિયાનાં પાણીથી જમીનમાં ખારાશ વધવાને લીધે તેજાના અને મરી-મસાલાના પાકો તેમજ ફૂષિ પાકો તેમજ બાગાયતી પાકો જેવા કે નાળિયેરી, સોપારી અને ખાસ કરીને ડાંગરના ઉત્પાદનમાં ઘણો જ ઘટાડો થવા પામ્યો છે.

ધાન્ય, કઠોળ, રોકડિયા પાકો, બાગાયત અને વન્ય પાકો, ઘાસચારા અને શાકભાજના પાકો ઉપર થયેલી વિપરીત અસરો :

૧૧. જે વિસ્તારોમાં બારેમાસ પિયતની સુવિધાઓ છે. દા.ત. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો અમુક વિસ્તાર, ખેડા જિલ્લાના માતર, લિંબાસી અને ભાલ વિસ્તારમાં ઘઉં, બાજરી, ડાંગર, ચણા, રાયડો, જુરુ, સૂંદ્રિયા જુવાર અને રચકો તેમજ ઘાસચારાના પાકોમાં ક્ષારની અસરને લીધે દિવસોદિવસ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દા.ત. ગુજરાતમાં તારાપુર, ઝંભાત, લિંબાસી, સોજિત્રા અને ભાલના વિસ્તારમાં હારીજ, ચાણસમા, રાધનપુર, થરાદ, વાવ, દિયોદરમાં અમુક જમીનો ખારાશને લીધે બિનઉત્પાદકતાને આરે આવી ગઈ છે.

૧૨. મધ્ય ગુજરાતમાં આવેલા ભાલ પ્રદેશમાં ૧૦૦ માઈલથી વધારે વિસ્તારમાં પથરાયેલા ત્રણથી ચાર જિલ્લાની જમીનના ઉપરના લેવલથી ૨.૫ થી ૪ ફૂટની ઊંડાઈએ હાર્ડપાન (સખત સર્ફેચ પડ / સબ સોઇલ) આવેલ હોવાથી ચોમાસાનું પાણી નવેમ્બર-ડિસેમ્બર સુધી આ જમીનમાં લાંબા ગાળા સુધી જમીન ઉપર (Submergence) ફેલાઈ-ભરાઈ રહે છે અને દિવાળી પછી આ જમીનમાં બેજ (Residual moisture) આધારિત બિન પિયત ઘઉં, ચણા અને અન્ય કસુંબી, સૂંદ્રિયા જુવાર, રાઈ, જુરુ, શાકભાજ જેવા શિયાળું પાક લેવામાં આવે છે. આ જમીનમાં સોઽિયમ તેમજ હાનિકારક ક્ષારોનું ગ્રમાણ ઉંચું હોવાથી સામાન્ય જમીનોની જેમ ઉત્પાદન લઈ

શકાતું નથી, જેથી ધર્તિ, જીરુ, વરિયાળી, કપાસ તેમજ ધાસચારાના પાકોમાં દિવસે દિવસે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.

૧૩. સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર અને વિરમગામના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારના કારણે તેમજ નબળી ગુણવત્તાવાળું સલાઈન વોટર-ભાંભરૂ પાણી સિંચાઈ માટે આપવાથી હાઇબ્રીડ કપાસ, જીરુ, વરિયાળી, દિવેલા, સૂંઢિયા જીવાર, ચણા, રાઈ વગેરે પાકો ઉપર ખારાશની વિપરીત અસરને લીધે ઉત્પાદનમાં ઘણો જ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
૧૪. કચ્છ વિસ્તારમાં દરિયાનું પાણી બેડાણ થયેલી જમીનો ઉપર ફરી વળવાથી, જમીનનાં પેટાળમાં ખારાશ વધવાથી અને વધારે પવનને લીધે ખારેક અને કેરીના પાકને આંધી અને તોફાનને કારણે તથા અન્ય કૃષિ પાકો જોવા કે મગફળી, કઠોળ, દિવેલા, બાજરી અને કપાસના પાક ઉપર જીણી રેતીના ઢગલા થઈ જવાથી પાકને થતી મિકેનિકલ ઈન્જિનીને કારણે વિપરીત અસર જોવા મળે છે.



ખારેકના પાકમાં બદલાયેલા હવામાનમાં ખારાશને લીધે થયેલી વિપરીત અસરો


૧૫. ગુજરાતમાં ૧,૬૦૦ કિ.મી. દરિયાકિનારો આવેલો હોઈ આ વિસ્તારમાં માછીમારી અને મીઠા બનાવવાનો ધંધો, દરિયાઈ માલની ડેરફેર તેમજ આયાત અને નિકાસના ધંધા ઉપર હવામાન બદલાવને લીધે વિપરીત અસર જોવા મળે છે. આને લીધે જનજીવન અને પશુપાલન જેવા વ્યવસાયો અને કૃષિ આધ્યારિત ઉદ્યોગો ઉપર વિપરીત અસર જોવા મળે છે. આમ, ખારી અને ભાસ્મિક જમીનોમાં બદલાતા હવામાનમાં ખેતી અંગેના અતિ વિકટ પ્રશ્નો ઊભા થાય છે. એનું નિવારણ કેવી રીતે કરવું અને આ જમીનોને બેડાણનીચે કેવી રીતે લાવવી એ બે બાબતો આજે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ વૈજ્ઞાનિકો માટે ચર્ચાનો મુખ્ય વિષય છે.

જમીનમાં ખારાશ ઉદ્ભવવાના મુખ્ય કારણો :

૧. જમીનમાં નીચેના સ્તરમાં આવેલા માતૃ ખડકોમાંથી કારો છૂટા પડી કેપીલરી/કેશાકર્ષણ પ્રક્રિયા દ્વારા જમીનની ઉપરની સપાટી પર જમા થવાથી જમીન ખારી બને છે.
૨. દરિયાનાં પાણી ભરતી દ્વારા (Intrusion of tidal water) દરિયા કિનારાની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં જમીન ઉપર ફરી વળવાથી જમીન ખારી બને છે.

૩. દરિયાનાં પાણી જમણ દ્વારા (Ingress of sea water) જમીનમાં નીચેના સ્તરમાં જવાથી આવી જમીનો ઝડપથી ખારી બને છે.
 ૪. વધુ પિયત દ્વારા કારો જમીનમાં મોટી માત્રામાં દા.ત. સળગતા દિવાની દિવેટમાં કેરોસીન ઉપર ચે છે તેમ આ કારો જમીનમાંથી ઉપરની સપાટી ઉપર એકત્રિત થાય છે.
 ૫. અપૂરતી નિતાર વ્યવસ્થા અને જમીનનું લેવલ ન હોવાથી ખારાશ ફેલાય છે.
 ૬. સબ સોઈલમાં સખત પડ હોવાથી દા.ત. ભાલપ્રદેશ, સૌરાષ્ટ્રની જમીનોમાં ચૂનાનું પડ આ કારોને લીધે જોવા મળે છે. હારીજ, ચાણસ્મા, થરાદ, ખારાઘોડા, વિરમગામ તેમજ સુરેન્નગર જિલ્લામાં આવી સબસોઈલનું નિર્માણ મોટા પાયે થયેલું જોવા મળે છે.
 ૭. સિંચાઈનાં પાણીનો અવૈજ્ઞાનિક પિયત પદ્ધતિથી ઉપયોગ કરવાથી, દા.ત. ડાંગર અને શેરડીના પાકમાં ઘણી જ મોટી માત્રામાં પાણીનો બગાડ થાય છે. આથી આ માટે ભલામણ કરેલ શ્રી પદ્ધતિ (SRI System) દ્વારા ડાંગરનું ટ્રાન્સપ્લાન્ટિંગ અને નીકપાળા પદ્ધતિથી શેરડીનું વાવેતર કરવું જોઈએ.
 ૮. જમીનમાં પાણીનું સ્તર કિટિકલ લેવલથી ઉપર રહેવાથી પાકના મૂળઝોન વિસ્તારમાં શેરડી, આંબા, ચીકુ વગેરે પાકો ઉપર વિપરીત અસર થતાં પાક ઉત્પાદનમાં ગંભીર ઘટાડો થવા પાખ્યો છે.
 ૯. વધારે પડતા રાસાયણિક ખાતરો જેવા કે ફ્લોરાઇડ અને સલ્ફેટ, નાઈટ્રોજનયુક્ત ખાતરો તથા ઔદ્યોગિક વસાહતોના દૂષિત (Effluent Industrial water) પાણીનો વધુ ઉપયોગ કરવાથી NO_2 / નાઈટ્રસ ઓક્સાઇડથી જમીન વધુ કારમય બને છે. આવી જમીનોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે થયેલા સંશોધન પ્રમાણે બોરોન, આર્યન્, સીસુ વગેરે હાનિકારક કારોનું પ્રમાણ વધારે હોવાથી પાક ઉપર તેની હાનિકારક અસરો જોવા મળે છે.
 ૧૦. કમાન્ડ વિસ્તારમાં કેનાલનાં પાણીનો જમણ દ્વારા કાયમી ભરાવો થવાથી વોટર લોગિંગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
 ૧૧. સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં વધારે પડતું બાધીભવન થવાથી જમીનમાં નીચેના સ્તરમાં આવેલા કારો જમીનની ઉપર, સપાટી ઉપર કેશાકર્ષણ દ્વારા જમા થાય છે. દા.ત. દાંતી, દાંડી, ઉભરાટ, ખંભાત, જામનગર, ગંધીધામ, ખારાઘોડા, હારીજ, ચાણસ્મા અને થરાદની ખારપાટ જમીનના ઉપરના ભાગમાં સફેદ પાઉડર રૂપે કારોના પેચીસ/ધંબા ઘણા વિસ્તારમાં જોવા મળે છે.
 ૧૨. પવનથી દરિયાના કારોનું દૂરના સ્થળો સુધી સ્થળાંતર થવું.
 ૧૩. જંગલોનો નાશ
 ૧૪. નહેરો દ્વારા વધુ પડતા પિયતનો ઉપયોગ
 ૧૫. પાકને જરૂરિયાત કરતાં વધારે પિયત આપવાથી. દા.ત. ડાંગર અને શેરડીના પાકને જરૂરિયાત કરતાં ૪૦થી ૫૦% વધુ પિયત આપવાથી પાણી જમીનમાં નીચે ઉત્તરી જવું, નીચાણવાળા ભાગમાં જમણ થવું વગેરે કારણોને લીધે વધારે પડતું પાણી લાંબેગાળે જમીનને બગાડે છે. રોગ અને જીવતનું પ્રમાણ વધે છે, ખેતી ખર્ચ વધે છે અને નબળું પાક ઉત્પાદન મળવાથી બજારભાવ પણ ઓછા મળે છે.
- ખારી જમીન ઉપર સંશોધન દ્વારા થયેલી મોજણીનાં તારણો :**
૧. એક મોજણી મુજબ જણાયું છે કે, ખેડાણલાયક જમીનો Saline Soils ૮૦ મિલિયન હેક્ટર ખેતી કરવા માટે ઉપયોગ કરવામાં આવતાં આ જમીનમાંથી ૮.૪ મિલિયન ટન પોષક તત્ત્વો અને ૬૦૦૦ મિલિયન ટન જમીનના ઉપરના પડમાં આવેલી ફળદ્વાર્પ જમીનનું ધોવાણ થાય છે.

૨. સમગ્ર દુનિયામાં ખારી અને ભાસ્મિક તથા પાણીના ભરાવાવાળી જમીનોમાં બેતી કેવી રીતે કરવી એનો અતિ ગંભીર અને વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એક રાજ્યીય મોજણી મુજબ (Abrol et al. 1988) ભારતમાં આવી ખારી અને ભાસ્મિક જમીનોનું પ્રમાણ, ૨૩.૨ લાખ મિલિયન હેક્ટર ખારી જમીનો અને ૦.૫ મિલિયન હેક્ટર ભાસ્મિક જમીનો જેટલું છે. આવી જમીનો મુખ્યત્વે સૂકા પ્રદેશો, અર્ધસૂકા પ્રદેશો અને અર્ધ ભેજવાળા પ્રદેશોમાં આવેલી છે.



ભારતમાં જુદા જુદા રાજ્યોમાં આવેલી ખારી અને ભાસ્મિક જમીન હેઠળનો વિસ્તાર

૩. ગુજરાતમાં ૧.૩૩૪ મિલિયન હેક્ટરના વિસ્તારમાં ખારી અને ભાસ્મિક જમીનો આવેલી છે, જે ભારતમાં બીજા કમનું સ્થાન ધરાવે છે, પરંતુ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લેતાં ગુજરાત આ બાબતે પ્રથમ સ્થાન ધરાવે છે. દરિયાકિનારાની ખારી ભાસ્મિક જમીનોનો ગ્રીજા ચુપમાં સમાવેશ થાય છે, જે સમગ્ર ભારતમાં ૩.૧ મિલિયન હેક્ટરમાં આવેલી છે. આમાં ગુજરાતનો દરિયાકિનારો ૧૬૦૦ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે, જે ૦.૮૧૪ મિલિયન હેક્ટર વિસ્તાર ધરાવે છે અને સમગ્ર ભારતમાં ગ્રીજાનું સ્થાન ધરાવે છે. આવી જમીન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, ભાલપ્રદેશમાં ખેડાણ કર્યા સિવાય વર્ષોથી ૩૪૪૩ / બંજર પરિસ્થિતિમાં પડી રહી છે. તેનો ઉપયોગ ભલામણ મુજબની કૃષિ ટેક્નોલોજી તેમજ સરકારી તંત્રનાં કાર્યક્રમ અમલીકરણ દ્વારા બેતી અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગ ધંધામાં વૈજ્ઞાનિક ફલે કરી શકાય તેમ છે. આ માટે અગ્રભાતાના ધોરણે "Action Plan" તૈયાર થાય એ રાજ્ય સરકાર માટે ગંભીર અને અતિ સંવેદનશીલ સમસ્યા છે કે જેથી કરીને દરિયાઈ પડીની આવી લાખો હેક્ટરમાં પથરાયેલી જમીનોમાં કૃષિની અધતન ટેક્નોલોજી દ્વારા ઉત્પાદકતામાં વધારો કરી શકાય.

ખારી અને ભાસ્મિક જમીનોમાં પાક ઉત્પાદન માટે ભલામણ કરાયેલી વિવિધ ખેતી પદ્ધતિઓ :
ખારી અને ભાસ્મિક જમીનો કોને કહેવાય તે જાણવું ખાસ જરૂરી છે.

ખારી જમીનો (Saline Soils) :

ખારી જમીનો (Saline Soils)ની સામાન્ય રીતે ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી $>4.00 \text{ dS/m}$ થી વધારે હોય છે અને વિસ્થાપિત Na નું પ્રમાણ ૧૫%થી ઓછું અને અમલતા આંક (pH) ની માત્રા ૮.૫ નીચે હોય છે. હાનિકારક ક્ષારોનું પ્રમાણ જેવા કે CO_3 , HCO_3 , CL, SO_4 , MgSO_4 , Boron અને Lead વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે આ જમીનમાં રસાકર્ષણ દાખ (Osmotic Pressure)નું પ્રમાણ વધારે પ્રમાણમાં રહેવાથી છોડને જમીનમાંથી પાણી તથા પોષક તત્ત્વો લેવામાં તથા હવાની અવરજનરમાં મુશ્કેલી પડે છે.

ભાસ્મિક જમીનો (Alkaline Soils) :

જે જમીનોમાં સામાન્ય રીતે ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી $\text{EC}4.00 \text{ dS/m}$ થી ઓછી, વિસ્થાપિત Naનું પ્રમાણ $>15\%$ અને અમલતા આંક $\text{pH} > 8.5$ થી વધારે હોય તેવી જમીનોને ભાસ્મિક જમીનો કહેવામાં આવે છે. દા.ત. ગુજરાતમાં દરિયાઈ પદ્મીમાં આવેલા દમણ, વલસાડ, સુરત, દાંતી, ઉભરાટ, ખંભાત, ભાવનગર, જામનગર, દ્વારકા, વેરાવળ અને કચ્છમાં આ ટાઈપની જમીનો લાખો હેક્ટરમાં બિન ઉત્પાદક હાલતમાં મોટે ભાગે બંજર હાલતમાં જોવા મળે છે.

આવી જમીનોનો અનુકૂળ ક્ષાર પ્રતિકારક જાતોની શોધ અને વાવણીની પદ્ધતિઓ, અનુકૂળ પિયત પદ્ધતિઓ તેમજ સેન્દ્રિય અને અસેન્દ્રિય ખાતર આપવાની ભલામણ મુજબની પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી માટે ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. એના દ્વારા એની ઉત્પાદકતામાં વધારો કરી, ગ્રામ્ય કક્ષાએ વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે.

Management Practices Advocated for Saline and Alkaline Soils in Gujarat state

ખારી જમીનમાં ખેતી સારી રીતે કરી શકાય એ માટે નીચેની ભલામણો મુજબની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવાથી વધુ અને સારું ઉત્પાદન મેળવી શકાય છે.

- (૧) જમીન વ્યવસ્થા
- (૨) પાકની જતની પસંદગી
- (૩) બીજનું પ્રમાણ
- (૪) બીજની માવજત
- (૫) વાવણીની પદ્ધતિ
- (૬) ખાતર
- (૭) પિયત વ્યવસ્થાપન વગેરે કૃષિ કાર્યો સામાન્ય જમીનમાં કરવામાં આવતી ખેતી પદ્ધતિ કરતાં તદ્દન જુદી રીતે કરવા પડે છે. બેદૂતમિત્રો વૈજ્ઞાનિકોએ કરેલી ભલામણો અપનાવે તો વધુ સારું પાક ઉત્પાદન, ખારી-ભાસ્મિક જમીનોમાં પણ મેળવી શકાય છે.
- (૮) ખાતર વ્યવસ્થાપન
- (૯) પોસ્ટ-હાર્વેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ
- (૧૦) અધતન સહકારી અથવા MOU કરેલી સંસ્થા દ્વારા માર્કેટિંગનો ઉપયોગ

ખારાશ અટકાવવાની મહત્ત્વની કૃષિ ટેક્નોલોજી / તજ્જશ્શતાઓ અને ખારી જમીનમાં ભલામણ કરાયેલી કૃષિની વિવિધ પદ્ધતિઓ :

ખારી જમીનમાં ભલામણ કરાયેલી ટેક્નોલોજી / કૃષિ પદ્ધતિઓ નીચે મુજબ છે, જે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે :

૧. ક્ષારને આવતો અટકાવવા / સરકારશ્રીની જળ અને જમીન સંરક્ષણ અને ક્ષાર લેન્ડ બોર્ડ, જંગલ વિભાગ, ડ્રેનેજ વિભાગ અને સિંચાઈ વિભાગની વિવિધ યોજનાઓનો કાર્યક્રમ અમલ.
૨. ક્ષાર પ્રતિકારક વિવિધ પાકોની પસંદગી તેમજ પિયત અને ખાતર વ્યવસ્થાપનની ભલામણ કરાયેલી વિવિધ કૃષિ પદ્ધતિઓ / ટેક્નોલોજીનો ઉપયોગ.

કૃષિ પાકો ઉપર થયેલી અસરો :

(ધાન્ય, કઠોળ, કેશ કોપ, બાગાયત અને વન્ય પાકો, ધાસચારો અને શાકભાજના પાકો)

૧. જે વિસ્તારોમાં બારેમાસ પિયતની સુવિધાઓ છે. દા.ત. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તારો, ખેડા જિલ્લાના માતર, લિંબાસી, ભાલ વિસ્તારમાં ઘઉં, બાજરી, ડાંગર, ચણા, કપાસ, રાયડો, જુદુ, સૂંધિયા જુવાર અને રજકો ધાસચારોના પાકોના વિસ્તારમાં ક્ષારની અસરને લીધે ઉત્પાદકતામાં તથા ઉત્પાદનમાં દિવસે દિવસે તીવ્ર ઘટાડો જોવા મળે છે.
૨. મધ્ય ગુજરાતમાં તારાપુર, લિંબાસી, સોજિત્રા અને ભાલના વિસ્તારમાં અમુક જમીનનો બિન ઉત્પાદકતાને આરે આવી ગઈ છે.
૩. ઉત્તર ગુજરાતમાં હારીજ, સમી, ચાણસ્મા, રાધનપુર, સાતલપુર, થરાદ, વાવ અને દિયોદર વિસ્તારની જમીનો ઈન્ન્યોસ સેલિનિટીને લીધે અસરગ્રસ્ત બની બિનઉત્પાદક થઈ ગઈ છે.
૪. સૌરાષ્ટ્રમાં સુરેન્ધ્રનગર અને વિરમગામ, જામનગર, ભાવનગર, વેરાવળ, પોરબંદર અને કચ્છની જમીનો પણ ક્ષારથી મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત બની છે.

ખારી જમીનમાં વધુ ઉત્પાદન અને આવક આપતી બોરની સુધારેલી જાતો



(૧) બોરની સુધારેલી જાત : ગોલા બોર



(૨) બોરની સુધારેલી જાત : મેહરુન બોર

ખાસિયતો :

1. પ્રુનિંગ કર્યા પછી નવા પીલાની ફૂટ આવવાથી રોગ અને જીવાતનું પ્રમાણ નહિવત્તુ જેવા મળે છે.
2. વધુમાં નવા પીલાની ફૂટ ઉપર તંદુરસ્ત, મોટી સાઈઝના, નાના સફરજન જેવા ફળ બેસે છે.
3. સૂકા અને અર્વસૂકા વિસ્તારમાં બોરની ભીઠાશની ગુણવત્તા ઉત્તમ કક્ષાની રહેવાથી ઊંચા બજાર ભાવ મળે છે.
આ બોર નિકસ માટે ઉત્તમ કવોલિટીના છે.

ખારી જમીનમાં વાંસ, સરૂ, નિલગિરી તેમજ ચેર્ની પઢી પદ્ધતિથી ખેતી (જમીનનું ધોવાણ તેમજ ખારાશ ઓછી કરવામાં મહત્વનો ફાળો)



ખારી જમીનમાં વાંસની ખેતી પદ્ધતિ

ખારી જમીનમાં નિલગિરી વચ્ચે ઘાસચારાની ખેતી પદ્ધતિ

- જમીનનું ધોવાણ થતું અટકાવવાનું કાર્ય કરે છે.
- બીજા પાકોની સરખામણીમાં વધારે વળતર આપતો પાક છે.
- વાંસનો પાક બહુવર્ષાયુ હોવાથી આવી જમીનોમાં સેન્દ્રિય તત્ત્વો વધુ પ્રમાણમાં ઉમેરાતાં જૈવિક રીતે જમીનને નવસાધ્ય કરે છે.

- બીજા પાકોની સરખામણીમાં વધારે વળતર આપતો પાક છે.
- વર્ષ દરમયાન ખેડૂતોને લીલું ખાસ આપતો પાક છે અને જૈવિક રીતે જમીન નવસાધ્ય બને છે.
- નિલગિરી લાંબે ગાળે ટીમ્બર વેલ્યુને લિધે સિઝનલ પાકો કરતાં વધુ આવક આપે છે.
- વધુ વરસાદમાં નિલગિરીનો પાક જમીનના બાંધાને સુધારે છે અને વચ્ચેના આંતર પાકમાં અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.



ખારી અને ભાસ્મિક જમીનમાં ખારેક અને નાળિયેરી જેવા ક્ષાર પ્રતિકારક પાકોની જેતી એગ્રોફોરેસ્ટ્રી અને સીલ્વી પાસ્ચર/ધાસચારા પાકોના વ્યવસ્થાપન/મેનેજમેન્ટનો ખારી જમીનને જૈવિક રીતે સુધારવામાં મહત્વનો ફાળો :

એગ્રોફોરેસ્ટ્રી તેમજ સીલ્વી પાસ્ચર પાકોનું વધુમાં વધુ વાવેતર/પ્લાન્ટેશન કરવાથી તેમજ કારચુક્ત જમીનોનો ભલામણ મુજબ કાર્યક્રમ ઉપયોગ કરવાથી જમીનમાં ક્ષારોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

1. એગ્રો ફોરેસ્ટ્રીમાં મુખ્યત્વે વિલાયતી બાવળ, સુબાબુલ, બરસીમ, રચકો, નિલગિરી, સરનું પ્લાન્ટેશન, વાંસ, એકેશિયા, ઈન્ડિકા, ચેરુ (Mangrove) સીસમ જેવા પાકોનું પ્લાન્ટેશન ક્ષાર અવરોધક પાકો જેવા કે ખારેક, નાળિયેરી, ડાંગર, ઘઉં, સૂંઢિયા જુવાર, સુબાબુલ, રાઈ અને વિલાયતી બાવળ તથા ક્ષાર સામે સારી રીતે ટકી શકે તેવા વૃક્ષોનું વાવેતર (પાળા ઉપર અથવા પાળાની ધાર ઉપર) કરવાથી સામાન્ય સિઝનલ પાકો કરતાં બહુવર્ષિયુ જાડોની જેતી વધુ ઉત્પાદક અને આર્થિક દાખિયે નફાકારક જણાઈ છે.
2. વધુમાં એગ્રો ફોરેસ્ટ્રીમાં ઊગાડાયેલા જાડોની વચ્ચેના ભાગમાં ખારી જમીનમાં સારી રીતે ટકી શકે તેવા ધાસચારાના પાકો જેવા કે ગતનપેનીક, મલટીકર જુવાર, સૂંઢિયા જુવાર, બ્યુપેનીક, હાઈબ્રીડ નેપીયર ધાસ, રોડ ધાસ, રજકાધાસ, બરસીમ અને સુબાબુલનું આંતરપાક તરીકે સાંકડે ગાળે વાવેતર કરવાથી આવી જમીનમાં રૂટ બાયોમાસ તથા ધાસનાં મૂળ જમીનમાં સંપૂર્ણ કહોવાઈ જવાથી ઓર્ગેનિક એસિડ/કાર્બોનિક એસિડનું પ્રમાણ વધુ થવાથી સોલ્ટ અફેક્ટેડ જમીનો જૈવિક રીતે (Biological rejuvenation) નવસાથ કરવાની પ્રક્રિયામાં સીધી અસર થાય છે અને ઉત્પાદકતા વધારવાનું અગત્યનું કાર્ય કરે છે.

ખારી અને ભાસ્મિક જમીનો ન બગડે તે માટે મહત્વના અગમચેતીના ખાસ ઉપાયો : (Preventive measures for soil Salinity and Alkalinity)

દરિયાઈ પડીના કિનારાવાળા વિસ્તારોમાં Mangrove / ચેરુના / સિલ્કોનીયા વૃક્ષનું મોટા પાયે પ્લાન્ટેશન કરવાથી દરિયાનાં પાણીને કિનારાના વિસ્તારમાં જતું અટકાવી શકાય છે. સરુ, નિલગિરી, સુબાબુલ, વિલાયતી બાવળ વગેરે જાડોનું દરિયા કિનારે મોટા પ્રમાણમાં વાવેતર કરવાથી દરિયાનું પાણી નીચાણવાળા ભાગમાં જતું અટકાવી શકાય છે.



દરિયા કિનારે મેન્ચુવ / ચેરના વૃક્ષોનું પ્લાન્ટેશન મોટા પાયે કરી દરિયાકાંડા વિસ્તારની જમીનોનું થતું ધોવાણ તેમજ ખારશને અટકાવી શકાય છે.

(A) કારને આવતા અટકાવવાના પ્રાથમિક ઉપાયો (Prventive measures)

- (૧) દરિયાકિનારાના નીચાણવાળા ભાગમાં આવેલા નદી નાળા, કીક, ડાયેકનું ખર્જિંગ કરી તથા પથ્થરની પાકી આડી લાંબી દિવાલો બાંધીને નીચાણવાળા ભાગમોમાં ભરતી, વરસાદને લીધે કિનારાના અંદરના ભાગમાં પ્રસરતા/આગળ વધતા દરિયાનાં ખારા પાણીને અટકાવવું જોઈએ. દા.ત. ખંભાત, વલસાડ, દાંડી, દાંતી, ઉભરાટ, જામનગર અને ભાવનગર, પોરબંદર, વેરાવળ અને કચ્છ વિસ્તારમાં સરકારશીની જમીન સંરક્ષણ અને જંગલ ખાતાની વિવિધ યોજનાઓ મારફત દરિયાઈ ભરતીનું પાણી અંદરના બેડાણલાયક વિસ્તારોમાં જતું અટકાવવું જોઈએ.
- (૨) તમામ દરિયાઈ પદ્ધીના કિનારે ખારી જમીનમાં ખારાશ સહન કરી શકે તેવા મેન્ચુવ, ચેરુ, સરુ, નિલગિરી, નાળિયેરી જેવા વૃક્ષોનું મોટા પાયે સરકારશીની યોજનાઓ દ્વારા પ્લાન્ટેશન કરવું જોઈએ.
- (૩) મોટા જળસ્ત્રાવ વિસ્તાર જેવા કે નર્મદા, મહી, ઉકાઈ, કાકરાપારના કમાંડ વિસ્તારમાં આવેલા મોટા જળસ્ત્રાવો, કેનાલો અને ફીલ્ડ કેનાલોની દીવાલો સિમેન્ટથી પાકી કરવી જોઈએ કે જેથી નીચેના અને આજુબાજુના જળસ્ત્રાવ વિસ્તારમાં ઝમણાનું પાણી અટકાવી શકાય.
- (૪) બેતરમાં પાણી લઈ જવાના ઓપન/ખુલ્લા ઢાળિયાઓને બદલે સિમેન્ટની પાઈપો, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનનો ઉપયોગ કરવો.
- (૫) સૂકા, અર્ધસૂકા વિસ્તારમાં જમીનની ઉપર પથરાઈ જાય / Spreading type crops એટલે કે જમીન ઉપર ફેલાતા મગફળી, મગ, મઠ, ચણા, સક્કરટેટી, તડબુચ, દૂધી જેવા પાકોનું એકલું અથવા આંતર પાકો તરીકે મોટા પાયે વાવેતર કરવાથી જમીનના નીચેના સ્તરમાં કારો કેષાકર્ષણથી આવતા અટકાવી શકાય છે.
- (૬) આવી જમીનોમાં પદ્ધીપાકો જેવા કે નિલગિરી, સરુ, ચેરુ, બોરડી, વાંસ, સાગર, નાળિયેરી, સોપારી, કારઅવરોધક ઘાસચારાના પાકો જેવા કે સુબાબુલ, સૂંધિયા જુવાર, ગતન પેનિક, પેરા ઘાસ, હાઈશ્રીડ નેપીયર, રોડ ઘાસ, ડાંગર વગેરેનું પદ્ધી પદ્ધતિથી વાવેતર કરવાથી જમીનોમાં ઉપર આવતા કારોનું પ્રમાણ ઘટાડી શકાય છે.



દરિયા કિનારે આવેલી ક્ષારયુક્ત જમીનોમાં ગતન પેનીક, પેરા ગ્રાસ, સુભાબુલ, વિલાયતી બાવળ, રચકો, સૂંઢિયા જુવાર, ઘાસનું ખાન્ટેશન જૈવિક રીતે જમીનને સુધારવાનું તેમજ દરિયાકાંડા વિસ્તારમાં લીલો ઘાસચારો દૂધાળા પશુઓને પૂરો પાડવાનું મહત્વાનું કાર્ય કરે છે.

(૭) ઉપરોક્ત સમગ્ર વિસ્તારમાં માટીનું ધોવાણ અટકાવવા અને વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે માટીના તેમ (Earthen Dam) ઉપરાંત જમીન સંરક્ષણ વિભાગ, જળ સંરક્ષણ વિભાગ, બાગાયત, જંગલ ખાતું, નહેર વિભાગ, ડ્રેનેજ વિભાગ, ઈરીગેશન વિભાગ, ખારલેન્ડ બોર્ડ મારફત આડ બંધ અને પાળા બાંધવાનું કામ મોટે પાયે હાથ ધરવું જોઈએ.

(B) ખારી જમીનોમાં ભલામણ મુજબની અધ્યતન પાક પદ્ધતિનો ઉપયોગ (Curetive / Control Measures) :

- (૧) આવા વિસ્તારમાં દરિયા કિનારે સોલ્ટ લવિંગ પાકો, જેવા કે ઘાસચારાના પાકો, બાગાયતી પાકો જેવા કે નાળિયેરી, સોપારી, ખોરાક, એચ્રોઝોરેસ્ટ્રીના પાકો જેવા કે ચેરુ, વાંસ, સીસમ, નિલગિરી, બોરડી તેમજ ડાંગર-ફીસ, ડાંગર, સૂંઢિયા જુવાર, ગતન પેનીક ઘાસ, જીંગા/માછલી ઉછેર, કરચલા ઉછેર જેવા એકવા ફાર્મિંગ તેમજ અન્ય પાકોની જેતી પદ્ધતિ અપનાવવાથી વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.
- (૨) દરિયા કિનારે ખારાશમાં ટકી શકે તેવા મેન્ચ્યુવ, યુકેલીપ્ટસ, નાળિયેરી, બોરડી અને ટેટ પામ / ખારેક, પામ, ઓઈલ, પીલુડી, કયડા, ઈકળ વગેરેનું પણી પદ્ધતિથી મોટા પાયે ખાન્ટેશન કરવું જોઈએ કે જેથી દરિયા કિનારાનું ધોવાણ અટકાવી શકાય. આ પાકો દરિયાઈ પણીમાં કુદરતી રીતે જૈવિક પદ્ધતિથી (Biological Method) ખારી જમીનને નવસાધ કરવાનું મહત્વાનું કાર્ય પણ કરે છે.



ખારી અને ભાસ્મિક જમીનમાં વાંસની પદ્ધી પદ્ધતિથી અધતન ખેતી અપનાવતાં સિજનલ પાકો કરતાં
વધુ ફાર્મ ફોરેસ્ટ્રી પાકોમાં આવક મેળવી શકાય છે.

- (3) કારની સામે ટકી શકે તેવા ગતન પેનીક, હાઈબ્રિડ નેપીયર, ધરો, વાંસ, રોડગ્રાસ, સુબાબુલ, વાંસ, વિલાયતી
બાવળ, જેવા ધાસોનું વાવેતર કરવાથી ખારી જમીનોને જૈવિક રીતે નવસાધ્ય કરી ખેતીલાયક બનાવી શકાય
છે. વધુમાં દરિયાઈ પદ્ધીમાં રહેતા ખેડૂત મિત્રોના પશુઓને બારેમાસ લીલો ધાસચારો આપી શકાય છે અને
સારું ઉત્પાદન મેળવી શકાય છે. આવા પાક ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.



- (4) એગ્રોફોરેસ્ટ્રીના કારયુક્ત જમીનોમાં થતા ફાયદાઓ – ખારી અને ભાસ્મિક જમીનમાં સીલ્વી પાશ્ચયર મેનેજમેન્ટ :
નિલગિરી તેમજ એગ્રોફોરેસ્ટ્રીના પાકો જેવા કે વાંસ, ચેરુ, સરુ, નાળિયેરી, સોપારી, ખારેક, સિલ્કોનીયા,
ચીમટ જેવા મુખ્ય પાકોની વચ્ચે ધાસચારાના પાકનું વાવેતર કરવાથી સોલ્ટનું પ્રમાણ ઘટાડી જમીનને જૈવિક
રીતે સુધારી શકાય છે.

- (૨) વધુમાં આવી આ જમીનમાં ઘાસચારાના પાકોથી ઓર્ગેનિક મેટરનું પ્રમાણ જમીનમાં વધવાથી જૈવિક રીતે (Biological method) જમીનને ઓછા ખર્ચ કાયમી ધોરણે નવસાધ્ય કરી શકાય છે.

ઈનલેન્ડ સેલિનિટી / સોડિસીટી અટકાવવાના ઉપાયો : (Preventive measures to control inland salinity and sodicity)

ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ભાલ પ્રદેશમાં તથા હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં દરિયાથી અંદરના ભાગમાં આવેલા વિસ્તારોમાં નીચેના કારણોને લીધે સેલિનિટી અને આલ્કલિનિટીના વધુ વિકટ પ્રશ્નો ઊભા થાય છે.

જમીનમાં ખારાશ પેદા થવાના મુખ્ય કારણો : (Causes for development of salinity and sodicity)

- (૧) જમીનના નીચેના ભાગમાં આવેલા માતૃ ખડકોમાંથી ક્ષાર વિધાટિત થઈ કેખાકર્ષણ દ્વારા જમીનની ઉપરની સપાટી ઉપર જમા થવાથી આવી ઈનલેન્ડ જમીનો કે જે દરિયાથી અંદરના ભાગમાં દૂર સુધી આવેલી હોય તે પણ ખારી બને છે.
- (૨) ઉત્તર ગુજરાતમાં પિયત માટે ખેડૂત ભિત્રો દ્વારા જમીનમાં ૨૦૦૦ ફૂટથી પણ વધારે ઊંડાઈએથી પાણી લિફ્ટ કરીને ફૂલ્ઝ પાકોને પિયત કરવામાં આવે છે. પાણીમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું (TDS) પ્રમાણ વધારે હોય છે જેનો પિયત તરીકે વધારે વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સમી, હારીજ, ચાણસમા, રાધનપુર, થરાદ, વાવ, હિયોદર, સુરેન્દ્રનગર, વિરમગામ, ખારાધોડા અને ભાલ વિસ્તારની ૧૦૦ માઈલ વિસ્તારમાં પથરાયેલી ખારી જમીનો અને કષ્ટ વગેરે વિસ્તારની જમીનો આ રીતે ખારી બની છે અને દિવસે દિવસે આવી જમીનોની બિન ઉત્પાદકતામાં વધારો થતો જોવા મળે છે.
- (૩) અવૈજ્ઞાનિક પાક પદ્ધતિ અને જમીનની ફળદૂપતા / ફર્ટિલિટી જાળવવામાં કાળજ ન રાખવાથી જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધે છે.

ખારી અને ભાસ્મિક જમીનમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સૂચવાયેલા વૈજ્ઞાનિક ઉપાયો :

ખારી અને ભાસ્મિક જમીનમાં પાકની પસંદગી માટે સૌ પ્રથમ,

- (૧) જમીનની જાત
- (૨) અનુકૂળ પાક પદ્ધતિ
- (૩) વાવેતરની પદ્ધતિ
- (૪) જમીન વ્યવસ્થા
- (૫) પિયત વ્યવસ્થાપન
- (૬) ખાતર વ્યવસ્થાપન
- (૭) પોર્ટ હાર્ટ ટેક્નોલોજી
- (૮) અધતન માર્કેટિંગ સિસ્ટમનો ઉપયોગ (સહકારી, કોર્પોરેટ હાઉસ, સ્ટેન્ડર્ડ એજન્સી સાથેના વેચાણના કરાર) વગેરે માટે સંશોધન કરેલી ભલામણ કાર્ય પદ્ધતિ અપનાવવાથી ખારી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ખારી અને ભાસ્મિક જમીનોમાં પાક અને જાતોની પસંદગી :

કોઠો નં. ૧ : વિવિધ પ્રકારના પાકોનું એની કાર સહનશીલતા મુજબ વર્ગીકરણ

| વધુ કાર સહનશીલ | મધ્યમ કાર સહનશીલ | કાર સંવેદનશીલ |
|---|--|----------------------------------|
| ખેતી પાકો | | |
| ચોમાસું : ઈક્કડ, કપાસ, જુવાર | બાજરી, ડાંગર, તમાકુ, મકાઈ, સૂર્યમુખી, એરંડા, તલ, સોયાબિન | મગફળી, અડદ, ચોળા, મગ, ચણા |
| શિયાળું : જવ, ઘઉં, સરસવ | શેરડી, રાયડો, વાલ, જું | |
| શાકભાજના પાકો | | |
| સુગરબીટ અને પાલક, મૂળા, લસણ અને રિંગાણ | ટામેટા, ગાજર, કોબી, ફલાવર, બટેટા, રીંગણા, લસણ, તુંગણી, મૂળા વગેરે | વાલોળ, દૂધી, તુરિયા, ચિભડા, ભીડા |
| ધાસચારાના પાકો | | |
| ખારીયું, સુદાન ધાસ, પેરાધાસ, ઘઉં (પોપટીયા), જુવાર, ગુંદરી, બરસીમ, સુબાબુલ, ધરો | મુંજ, બડું, બાજરી (જાએચબી-૨૨૭) જુવાર (એસઆરએફ-૨૦૬), ગુંદરી, નેપીયર, ગજરાજ, ગાજર, મૂળા | રજકો, ફલાવર |
| ફળાડ | | |
| ખારેક, સોપારી, અંજર, નાળિયેરી, ગુંદા, કયડા, બોર આંબલી | દાડમ, જામફળ, નાળિયેરી, બોર, આમળા અને દ્રાક્ષ | આંબા, લીંબું, બદામ, કેળા, |
| વન્ય પાકો | | |
| પીલુડી, ગાંડો બાવળ, ખેર, ચેરુ, સીસમ, સુબાબુલ, એકેસીયા ઈન્ડિકા, વાંસ, નિલગિરી, સરુ | નિલગિરી, લીમડો, ખીજડો, આંબલી | સાગ, સાદડ, સેવન, સીસું |

કોઠો નં. ૨ : જુદા જુદા ખેતી પાકોની કાર સહનશીલ જાતો (ઉત્તરતા કર્મે)

| પાકનું નામ | ઉત્તરતા કર્મમાં કાર સહનશીલ જાતો |
|------------|---|
| કસુંબી | આઈ.સી. ૧૧૮૮૮, તારા, ભીમા |
| કપાસ | જાએયુડીએચ-૭, ધુંમડ, જીકોટ-૨૧, કલ્યાણ |
| જુવાર | ગુંદળી, સીએસએચ-૫, સી-૧૦-૨ |
| બાજરી | જાએચબી-૨૩૫, એમએચ-૧૬૮/૧૭૮, બીકે-૫૬૦, જાએચબી-૧૦૫ |
| ડાંગર | દેશી ભાત રાતા, ટીએન-૧, જ્યા |
| મગફળી | જેએલ-૨૪, જે-૧૧, રોબર્ટ, ટીજી-૩૨, ટીજી-૨૬ |
| ઘઉં | જે-૨૪, ખારસીયા, પોપટીયા, અરણેજ-૨૦૭, કલ્યાણસોના, એચડી-૨૦૦૮ |

| પાકનું નામ | ઉત્તરતા કમમાં કાર સહનશીલ જાતો |
|------------|--|
| શેરડી | જે-૨૪, ખારસીયા, પોપટીયા, અરણેજ-૨૦૭, કલ્યાણ સોના, એચડી-૨૦૦૮ |
| દિવેલા | જીએયુસીએચ-૧, એસકેઆઈ-૭૩, વીપી-૧ |
| સૂર્યમુખી | ઈસી-૬૮૪૯૧૪, ઈસી-૬૮૪૯૧૫ |
| તુવેર | ગુજરાત-૧૦૦, ટીસીપીએચ-૮, બીડીએન-૨ |
| ચણા | આઈસીસી-૪, આઈસીપી-૨૮ |
| તલ | પૂર્વ-૧ |
| રાયડો | વરુણા, એએસ-૧૦ |
| રીંગાણા | પીઆરએલ-૧, ગ્રીન રાઉન્ડ, મંજરીગોટા, ગુજરાત-૧ |
| મરચા | જીસી-૧૦૩, જવાલા, જીસી-૧, ઘોલર |
| ટમેટા | જેટીસિલેક્શન-૩૭, જુનાગઢ રૂબી, એચ-૨૪, પુસારૂબી |

કોઠો નં. ૩ : ભાસ્મિકતાને સહનશીલ પાકો

| વધુ સહનશીલ | મધ્યમ સહનશીલ | સંવેદનશીલ |
|----------------|--------------|-----------|
| ડાંગર | ઘઉં | કપાસ |
| કપાસ | બાજરી | મગફળી |
| સુગરબીટ | જુવાર | ચણા |
| રજકો | રાયડો | મગ |
| પેરાધાસ | શેરડી | ચોળા |
| સૂંધિયા જુવાર | ગાજર | મકાઈ |
| ગતનપેનીક ધાસ | કુંગળી | વાલ |
| ધરો, બરસીમ | મૂળા | વટાણા |
| રોડ, ધાસ, રજકો | ટમેટા | |

પાક પસંદગી ઉપરાંત કેટલીક નીચે મુજબની માવજત કરવી આવશ્યક છે :

ધ્યાનમાં રાખવાના મુદ્દા :

- ભાસ્મિકતાવાળા પાણીમાં પિયત હેઠળની જમીનમાં જિલ્ઝમ ઉમેરવું તેમજ સેન્દ્રિય ખાતર આપવું. પહોળા પાટલે વવાતાં ખેતી પાકો જેવા કે કપાસ, રાયડો, ખારેક, નાળિયેરી, સોપારી, નિલગિરી, બોરડી, સાદળમાં એકાંતર નીકમાં જ પાણી આપી પાળાની ટોચ પર વાવેતર કરવું જોઈએ, તેમજ ઓછા પાણીના સમયે કટોકટીની અવસ્થાએ પિયત આપી ઉત્પાદન લેવું જોઈએ. વધુમાં આવી જમીનોમાં ટપક અને ફૂવારા પદ્ધતિનું તેમજ દૂધી જેવા પાકો માટે પોટ પદ્ધતિથી પિયત અપનાવવાથી તેમજ મલ્લિંગ પદ્ધતિથી ખેતી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- આવી જમીનોમાં વધુમાં વધુ ઓર્ગનિક મેટર, છાણિયું ખાતર, લીલો પડવાશ ઉમેરવા જોઈએ અને શક્ય હોય તો નકામા ધાસ-કચરાનો મલ્લ તરીકે ઉપયોગ કરવો. દા.ત. ઘઉનું ભૂસું અને ડાંગરના ટુકડા / સુગર-

કેનનું ટ્રેસ મહિયંગ વગેરે. બની શકે તેટલું પાણી ઓછું, પરંતુ ટૂંકા ગાળે આપવું અને બે-ગાળ પિયત પછી એકાદ ભારે પિયત આપવું.

૩. ક્યારા પદ્ધતિમાં પાક ઉગતો હોય ત્યારે કુમળો છોડ રૂબી ન જાય તેથી છોડ થોડો મોટો થાય ત્યારે મોહું પાણી આપવું. આથી ઉગ્યા પહેલાં બે ભારે પિયત આપી દેવા, જેથી પાક મોટો થાય ત્યાં સુધી ટકી શકે.
૪. ક્ષાર સહનશીલ પાકોમાં ટૂંકાગાળાના, પાણીની ઓછી જરૂરિયાતવાળા, ક્ષારોનું વધુ દખાણ કરતા પાકો પસંદ કરવા. ઉનાળું વાવેતર કરવું નહીં.
૫. જો કે સ્હુરણ અવસ્થાએ મગફળી ક્ષાર સહનશીલ હોવાથી ચોમાસા પહેલાં ઓરવીને વાવેતર કરી શકાય અને ચોમાસા દરમિયાન ઉમેરાયેલા ક્ષારો નિતરી / લીચ થઈ જવાથી ઉત્પાદનમાં કોઈ વિપરીત અસર પડતી નથી.

(૪) વાવેતરનો સમય :

ખારી જમીનમાં મુખ્ય પાકનું વાવેતર ચોમાસાની સિઝનમાં કરવું જોઈએ કે જેથી પાકને વિકાસ માટે જરૂરિયાત મુજબનો ભેજ મળી રહે.

બીજા ટૂંકાગાળાના પાકનું વાવેતર ચોમાસા સિવાયની શિયાળા અને ઉનાળાની સિઝનમાં કરવું જોઈએ. જે તે ઓછા પિયતની જરૂરિયાત હોય તે પ્રકારની ફોટોઇન્સેટીવ જાતની પસંદગી કરવી જોઈએ કે જેથી સૂર્ય પ્રકાશની હાજરીમાં વધુ પોષક તત્ત્વો મેળવી છોડનો દિવસ દરમિયાન વધુ વિકાસ થઈ શકે.

- (૧) ડાંગરનો પાક ચોમાસાની સિઝનમાં / ભીના વાતાવરણમાં લેવો જોઈએ અને શિયાળામાં ઘઉં, સૂર્યમુખી વર્ગના ટૂંકાગાળાના તથા કઠોળ વર્ગના પાકો / ફોટોસેન્સિટીવ પાક લેવા જોઈએ.
- (૨) ખારી જમીનમાં નિતારની પૂરતી વ્યવસ્થા કરવી આવશ્યક છે કે જેથી પાકના મૂળજોન વિસ્તારમાંથી ક્ષારો ધોવાઈને નિતાર નીક દ્વારા એનો ખેતરની બહાર નિકાલ થઈ શકે.
- (૩) ખેતરનો લે આઉટ નીક પાળા પદ્ધતિ (Ridge & Furrow System) પ્રમાણે કરી પછી ડ્રેનેજની નીકો મૂકી તેને મુખ્ય ડ્રેનેજ લાઈન સાથે જોડી વધારાનાં પાણીનો ખેતરમાંથી નિકાલ કરવાથી પાકનો સારો વિકાસ થવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સાથે સાથે ભલામણ મુજબ કોપ સીકવન્સ/પાકની ફેરબદલી કરી જુદી જુદી ઋતુમાં વાવેતર કરવું જોઈએ.

(૫) ખારી જમીનમાં ભલામણ મુજબ કોપિંગ સીકવન્સ / પાકની ફેરબદલી અપનાવવી જોઈએ.


| ક્રમ | ખરીફ - રવિ | ક્રમ | ખરીફ - રવિ |
|------|--------------------|------|--|
| ૧. | બાજરી - જવ | ૬. | બાજરી - રાઈ અથવા જવ |
| ૨. | બાજરી - ઘઉં | ૭. | જુવાર (ધાસચારા) - ઘઉં |
| ૩. | બાજરી - રાઈ | ૮. | જુવાર (ધાસચારા) - રાઈ |
| ૪. | જુવાર - ઘઉં | ૯. | કલ્સ્ટરબીન - ઘઉં અથવા જુવાર (ધાસચારા) - રાઈ |
| ૫. | કપાસ - ઘઉં અથવા જવ | ૧૦. | ડાંગર-ઘઉં/ડાંગર-શાકભાજી/ડાંગર-કડવા વાલ/ડાંગર-સુંદિયા જુવાર |

ઉપર જણાવેલ પાક સીકવન્સ, પાકની ફેરબદલી, ખારી જમીનોમાં અપનાવવાથી એ વધુમાં વધુ ફાયદાકરક જણાઈ છે.



ખારી અને ભાસ્મિક જમીનમાં લીલા ધાસચારા તરીકે ગતન પેનીક, હાઈશ્રીડ નેપીયર, મલ્ટી કટ જુવાર જેવા ધાસચારાનું પ્લાન્ટેશન કરવાથી જૈવિક પદ્ધતિથી જમીન સહેલાઈથી સુધારી શકાય છે.

ઉપર જણાવેલ પાક સીકવન્સ ખારી જમીનોમાં અપનાવવાથી વધુમાં વધુ ફાયદાકારક જણાયો છે.



ખારી અને ભાસ્મિક જમીનમાં બરસીમ, રચકો, સૂંઢિયા જુવાર, સુબાબુલ, ગતન પેનીક જેવા ધાસચારાનું વાવેતર કરવું અનિવાર્ય છે. ધાસચારાના પાકોનું વાવેતર કરવાથી ઓર્ગેનિક મેટર અને ઓર્ગેનિક એસિડનું જમીનમાં પ્રમાણ વધવાથી જમીનના પિયતને નીચે લાવી શકાય છે. આનાથી ૭.૫થી નીચે pH આંક રહેવાથી ખારી જમીનમાં પણ ક્ષેત્ર પાકો તથા એગ્રોઝોરેસ્ટ્રીના પાકોની ખેતી સારી રીતે થઈ શકે છે.

(૬) ખારી જમીનમાં પિયત અને ખાતર વ્યવસ્થાપન :

- ખારી જમીનમાં સેન્ટ્રિય ખાતરો, છાણિયું ખાતર, ઈકડ જેવા પાકોનો લીલો પડવાશ, અન્ય સેવરી, સસબેનીયા, એકેશિયાનો લીલો પડવાશ મળ્યા કરવાથી જમીનમાં પાણી ગ્રહણ કરવાની શક્તિમાં વધારો કરી શકાય છે, તેમજ જમીનના જૈવિક, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે.
- અસેન્ટ્રિય ખાતરો હપ્તામાં તથા ફોલિયર સ્પ્રેથી આપવાથી પાકને પૂરતા પ્રમાણમાં તત્ત્વો જરૂરી મળવાથી ખારી જમીનોમાં પણ સારું ઉત્પાદન મેળવી શકાય છે અને ખાતરની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે.

ખારી જમીનમાં અપનાવવા ભલામણ કરાયેલી વિવિધ કૃષિ પદ્ધતિઓ :

૧. ઉપર દર્શાવેલા પાકોની ક્ષાર પ્રતિકારક જાતોની પસંદગી કરવી જોઈએ.
૨. જમીનમાં છોડની પૂરતી સંખ્યા જાળવવા માટે સુધારેલા ખેત ઓજારથી ડાંગરની રોપણી કરવી જોઈએ, જેથી મૂળ જમીનમાં ૪ થી ૬ સે.મી. ઊંડાઈએ રહેવાથી આવી જમીનોમાં પ્રતિ ડેક્ટર છોડની સંખ્યા જગ્યાઈ રહેવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

| | |
|--|---|
|  |  |
| ખારી જમીનમાં ઓટોમેટિક પેડી ટ્રાન્સપ્લાન્ટર | ખારી જમીનમાં મેન્યુઅલી ઓપરેટેડ પેડી ટ્રાન્સપ્લાન્ટર |

સામાન્ય જમીનની પાક ઉત્પાદન પદ્ધતિ કરતા ક્ષારમય જમીનમાં આપવાના પેકેજ્સ અને પદ્ધતિઓ સંપૂર્ણ રીતે જુદી પડે છે, જે નીચે પ્રમાણે છે :

- (૧) ક્ષારને ધ્યાનમાં રાખી આવી જમીનમાં છોડની પૂરતી સંખ્યા મેળવવા માટે ૨૫ થી ૩૦ ટકા બિયારણનો દર/ ધરુના રોપની સંખ્યા વધુ રાખવાની ભલામણ થઈ છે.
- (૨) વધુમાં ખારી અને ભાસ્મિક જમીનમાં ડાંગર જેવા પાકમાં ઘૂમડા દીઠ ત્રાણ થી ચાર સિડલીંગની ૨૭ દિવસથી એક મહિનાના ગાળામાં ધરૂથી રોપણી ૧૫ x ૧૫ સે.મી. ગાળે કરવી જોઈએ. આ જ રીતે ધરુંનું વાવેતર ૨૨.૫ થી ૩૦ સે.મી.ના અંતરે બે ચાસ વચ્ચે કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.

(૭) બીજની માવજત :

- (૧) ધરું જેવા પાકમાં બીજને ૩% મીઠાના દ્રાવણ (NaCl)ની માવજત આપવાથી ધરુના બીજની ક્ષાર પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.

(૨) વૃદ્ધિ નિયંત્રકોની બીજને માવજત :

ઘઉના બીજને વૃદ્ધિ નિયંત્રકો જેવા કે GA (Gebralic Acid), ABA (Absorbic Acid), NAA (Nepthalic Acitic Acid) જેવા વૃદ્ધિ કારકો ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૩૦૦ મિ.ગ્રા. પ્રમાણ રાખી ઘઉના બીજને દ્રાવણમાં હુક્કાક સુધી બોળી રાખી ત્યાર પછી સ્કૂકવી અને વાવેતર માટે ઉપયોગ કરવાથી / સોકિંગની માવજત આપવાથી છોડની ઊંચાઈ, મૂળની લંબાઈ, પિલાની સંખ્યા, ઘઉના ઉત્પાદનમાં ૨૦૦ મિ.લિ. ગ્રામ હોર્મોન્સનું દ્રાવણ બનાવી બીજને ટ્રીટમેન્ટ આપવાથી સાર્થક રીતે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.

(૮) વાવણીની પદ્ધતિ :

- (૧) ખારી અને ભાસ્મિક જમીનમાં બીજ અને ખાતર એકી સાથે વાવી શકાય તેવા વાવણીયાની પસંદગી કરવાથી બીજ, ખાતરનું ભલામણ કરેલી ઊંડાઈએ વાવેતર કરવાથી પાકના બીજનો ઉગાવો પૂરતા પ્રમાણમાં મેળવી શકાય છે અને એથી ઉગાવો એકી સાથે અને પૂરતી માત્રામાં મળી રહે છે.

| | |
|---|--|
|  |  |
| <p>ખારી જમીનમાં ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઈઝર સીડ ફ્રીલ વાવણી એક્સરખી ઊંડાઈએ કરવા માટે ઓટોમેટિક સીડકમ ફર્ટિલાઈઝર સીડ ફ્રીલનો ઉપયોગ કરવાથી એક સરખી ઊંડાઈએ બીજ પડવાથી જર્મિનેશનની જણવણી કરી શકાય છે.</p> | <p>ખારી જમીનમાં મેન્યુઅલી ઓપરેટેડ સીડ કમ ફર્ટિલાઈઝર સીડ ફ્રીલ નાના અને સિમાંત ખેડૂતો આ વાવણીયાનો ઉપયોગ કરી સારો ઉગાવો મેળવવાને લીધે વધુ ઉત્પાદન ખારી જમીનમાં મેળવી શકે છે.</p> |

- (૨) રાઈ જેવા પાકોમાં નીકપાળા પદ્ધતિ (Ridge & Furrow System)માં બીજને ઉત્તર દિશા તરફના પાળા ઉપર અથવા નીકની અંદર વાવેતર પદ્ધતિ અપનાવવાથી વધુ પાક ઉત્પાદન મળે છે.



મલિંગ પદ્ધતિ તથા નીકપાળા પદ્ધતિ, ટપક સિંચાઈ, સેન્ટ્રિય ખાતરોનો ઉપયોગ કરી અધતન ટેક્નોલોજી દ્વારા શાકભાજીની ખેતી કરતા જામનગરનાં મહિલા ખેડૂત.

ખારી જમીનમાં નીકપાળા પદ્ધતિ અને મલ્લિયગનો ઉપયોગ કરવાથી કાર, નિદામણ, પોષકતત્વોનો અસરકારક રીતે ઉપયોગ થવાથી પાકનો વધુ વિકાસ અને ઉત્પાદન મેળવી શકાય છે.

- (૩) લસણ, હુંગણી, સુવા, વરિયાળી, ગાજર, કોબીજ જેવા પાકોને પહોળા પાટલે (BBF System) પદ્ધતિનો ઉપયોગ કરી બે હારમાં (Paired raw) વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- (૪) કપાસના પાકનું ખાનિંગ નીકપાળા પદ્ધતિમાં નીકના લેવલથી ૨૦ સે.મી. જમીનની ઊંચાઈએ પાળા (BBF System) બનાવી એની ઉપર મધ્ય ભાગમાં ૧૦ સે.મી. ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ દિશામાં વાવેતર કરવાથી સોલ્ટનું ડિસ્ટ્રીબ્યુશન, ક્યારાનું અનુકૂળ લેઆઉટ/વેન્ડ કોન્ફીશ્યુરેશન દ્વારા પાકનો વિકાસ જરૂરી અનુકૂળતા પ્રમાણે થવાથી વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.

(૯) વાવેતરનું અંતર અને વાવેતરની ઊંડાઈ (સે.મી.)

| ક્રમ | પાક | વાવણીની પદ્ધતિ | અંતર (સે.મી.) | વચ્ચેનું અંતર (સે.મી.) | વાવેતરની ઊંડાઈ (સે.મી.) |
|------|--------------------------------|---|---------------|------------------------|-------------------------|
| ૧. | ઘઉં અને જવ (સામાન્ય વાવેતર) | નીકપાળા પદ્ધતિ બિયારણ તથા ખાતર એક સાથે વાવવાનો વાવણીઓ | ૨૦-૨૨.૫ | — | ૫-૬ |
| ૨. | ઘઉં અને જવ (મોઠું વાવેતર) | નીકપાળા પદ્ધતિ બિયારણ તથા ખાતર એક સાથે વાવવાનો વાવણીઓ | ૧૮-૨૦ | — | ૩.૫ |
| ૩. | રાઈ | નીકપાળા પદ્ધતિ | ૩૦-૪૦ | ૧૨-૧૫ | ૩-૪ |
| ૪. | કપાસ હાઈશ્રીડ | ખાનિંગ / ડિઝિલિંગ | ૬૦-૭૫ | ૩૦-૩૫ | ૫-૬ |
| ૫. | કપાસ ટેશી | ખાનિંગ | ૪૫-૬૫ | ૨૫-૩૦ | — |
| ૬. | બાજરી | નીકપાળા પદ્ધતિ બિયારણ તથા ખાતર એક સાથે વાવવાનો વાવણીઓ | ૬૦ સે.મી. | ૧૫ | ૨-૩ |

(૧૦) વાવણીનો સમય અને બીજનું પ્રમાણ :

ખારી જમીનમાં ક્ષારની અસરને ધ્યાનમાં લઈ બીજનું પ્રમાણ ૨૬% વધારે રાખી સામાન્ય જમીન કરતાં સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે.

| ક્રમ | વિગત | વાવણીનો સમય | બીજનું પ્રમાણ (ક્ર.ગ્રा./હેક્ટર) |
|------|-------------------------------|---|---|
| ૧. | ઘઉના પાકનું સામાન્ય વાવેતર | નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયા સુધી | ૧૨૫ ક્ર./હે. |
| ૨. | ઘઉના પાકનું મોહું વાવેતર | નવેમ્બરના ચોથા અઠવાડિયાથી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધી | ૧૪૫ ક્ર./હે. |
| ૩. | જવના પાકનું સામાન્ય વાવેતર | ઓક્ટોબરની ૧૫મી તારીખથી નવેમ્બરની ૧૫ તારીખ સુધી | ૧૦૦ ક્ર./હે. |
| ૪. | જવના પાકનું મોહું વાવેતર | ડિસેમ્બરની શરૂઆતથી જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડિયા સુધી | ૧૨૫ ક્ર./હે. |
| ૫. | રાઈના પાકનું સામાન્ય વાવેતર | ઓક્ટોબરના પહેલાથી ત્રીજા અઠવાડિયા સુધી | ૫ ક્ર./હે. |
| ૬. | રાઈના પાકનું મોહું વાવેતર | ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ૧૫મી નવેમ્બર સુધી | ૬ ક્ર./હે. |
| ૭. | કપાસના પાકનું સામાન્ય વાવેતર | એપ્રિલના પહેલા અઠવાડિયાથી બીજા અઠવાડિયા સુધી | ૧૫ ક્ર./હે. હાઈશ્રીડ ૨૫ ક્ર./હે. દેશી કપાસ |
| ૮. | કપાસના પાકનું મોહું વાવેતર | મે માસથી ૧૫મી તારીખથી ૩૦મી તારીખ સુધી | ૧૮ ક્ર./હે. હાઈ કપાસ ૩૦ ક્ર./હે. દેશી કપાસ |
| ૯. | બાજરીના પાકનું સામાન્ય વાવેતર | જૂનના છેલ્લા અઠવાડિયાથી જુલાઈના બીજા અઠવાડિયા સુધી | ૫ ક્ર./હે. |
| ૧૦. | બાજરીના પાકનું મોહું વાવેતર | જુલાઈના ત્રીજા અઠવાડિયાથી જુલાઈના અંત સુધી | ૬ ક્ર./હે. |

(૧૧) ખારી અને ભાસ્મિક જમીનમાં પોષક તત્ત્વોનું વ્યવસ્થાપન :

ખારી જમીનમાં બહારથી આપવામાં આવતા રાસાયણિક ખાતરો, નીચે દર્શાવ્યા પ્રમાણો, સામાન્ય જમીનો કરતાં ઓછી માત્રામાં પાકને પ્રાપ્ય બને છે. એના કારણો નીચે મુજબ છે :

- આવી જમીનમાં નાઈટ્રોટ યુરિયા જેવા ખાતરો વાપરવાથી વધુ લિચિંગ થવાને કારણે જમીનમાં ઉદ્દે સુધી ઝડપથી ઉત્તરી જવાથી ઊભા પાકને ઓછા પ્રમાણમાં નાઈટ્રોજન લભ્ય બને છે.
- ખારી જમીનોમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી સૂક્ષ્મ જીવાશુઓ તેમજ બેક્ટેરિયલ પ્રક્રિયા ઘણી જ ધીમી/નબળી થતી હોવાથી ઓર્ગેનિક નાઈટ્રોજનનું રૂપાંતર ઈન ઓર્ગેનિક ફોર્મમાં ધીમું થાય છે જેથી પાકને જરૂરિયાત મુજબનાં તત્ત્વો લભ્ય બનાવવા માટે ઘણી જ મુશ્કેલી પડે છે અને પાકમાં તેની ઊંઘપ જોવા મળે છે.

- આવી જમીનોમાં આડ અસરને લીધે હવામાંથી છોડને મળતા નાઈટ્રોજન જેવા કે રાઇઝોબિયમ અને કઠોળ વર્ગના પાક ઉપર નાઈટ્રોજન ફિક્સેશનની અસર નબળી જેવા મળે છે.
- આવી જમીનોમાં KCL અને K_2SO_4 એમોનિકલ નાઈટ્રોજન (NH_4) ના કારણું પ્રમાણ વધુ હોવાથી પાકના છોડ નાઈટ્રિટ નાઈટ્રોજન (NO_3) ઓછા પ્રમાણમાં લઈ શકે છે. આથી ઊભા પાકમાં નાઈટ્રોજનની ઊંઘપ જેવા મળે છે.
- આવી જમીનમાં રાસાયણિક ખાતરોના તત્ત્વોનું ઝડપથી વાયુમાં રૂપાંતર થવાથી અને ડીનાઈટ્રોફિકેશન પ્રક્રિયા ઝડપથી થવાથી પાકને ખાતર ઓછું લભ્ય બને છે.
- આવી જમીનમાં પાકને આપેલા નાઈટ્રિટ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા કારણે લીધે નબળી / ઘણી જ ધીમી જેવા મળે છે.
- ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના અમુક ભાગોમાં જમીનોમાં રહેલા ખારા પાણીને કારણે નાઈટ્રોજનના વધુ પ્રમાણને લીધે છોડ ઉપર ટોક્સિક / નુકસાનકારક અસર જેવા મળે છે જેને લીધે પાકની પરિપક્વતા મોડી થાય છે અને પાક ઉત્પાદન અને દાણાની ગુણવત્તા પર નબળી અસર જેવા મળે છે તેમજ રોગ અને જીવાતના પ્રશ્નો વધુ વિકટ બને છે.

(૧૨) ખારી અને ભાસ્ટિક જમીનોમાં ફોસ્ફરસ્યુક્ત ખાતરો આપવાથી થતી ફાયદાકારક અસરો :

- ફોસ્ફરસ્યુક્ત ખાતરો આપવાથી છોડને સીધો લાભ મળવાથી ઉત્પાદન વધુ મળે છે.
- છોડમાં જતા ઝેરી તત્ત્વોની માત્રા ઘટાડે છે.
- ફોસ્ફરસને FYMની સાથે આપવાથી છોડને થતી ફાઈટોસીક / નુકસાનકારક અસર ઓછી થાય છે.
- ક્ષારીય જમીનમાં પોટાશ (K)ની લભ્યતા મધ્યમથી ઊંચી જેવા મળે છે.
- પોટાશસ્યુક્ત ખાતરો (K) ક્ષારસ્યુક્ત જમીનમાં આપવાથી Na, Ca અને Mgના અપટેક વધારવાનું મહત્વનું કાર્ય કરે છે અને નાઈટ્રોજનસ્યુક્ત ખાતરોની કાર્યક્ષમતા વધારવાનું પણ કાર્ય કરે છે. આ અંગે ઉત્પાદન વધારવામાં KCl નો ઉપયોગ એપ્લિકેશન K_2SO_4 કરતાં વધુ ફાયદાકારક જણાયો છે.
- સામાન્ય રીતે આવી જમીનમાં ગૌંઝ તત્ત્વો જેવા કે Fe, Mn, Cu અને Znની ઊંઘપ જેવા મળી નથી.

(૧૩) ટેબલ : જુદા જુદા પાકો માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત અંગે ભલામણ

| ક્રમ | વાવણીનો સમય | $N : \text{ક્ર./એ.}$ | $P_2O_5 : \text{ક્ર./એ.}$ | $K_2O : \text{ક્ર./એ.}$ |
|------|----------------------|--|---------------------------|-------------------------|
| ૧. | ઘઉનું સામાન્ય વાવેતર | ૧૨૦-૧૫૦ | ૫૦-૬૦ | ૪૦-૫૦ |
| ૨. | ઘઉનું મોટું વાવેતર | ૮૦-૧૦૦ | ૮૦-૮૦ | ૨૦-૨૫ |
| ૩. | જવ | ૧૦૦-૧૨૦ (૧) ૩૫ કિ.ગ્રा. વાવણી વખતે (૨) ૩૫ કિલો મુકુટ મૂળ ફૂટી વખતે (૩) ૩૫ કિલો પીલા ફૂટી વખતે આપવું | ૩૦-૪૦ | ૩૦-૪૦ |
| ૪. | રાઈ | ૧૦૦-૧૨૦ | ૩૦-૪૦ | ૩૦-૪૦ |
| ૫. | કપાસ | ૬૦-૮૦ | ૩૦-૪૦ | ૩૦-૪૦ |
| ૬. | બાજરી | ૧૦૦-૧૨૦ | ૩૦-૪૦ | ૩૦-૪૦ |

(૧૪) સેન્દ્રિય ખાતરનો જમીનોમાં ઉપયોગ :

- સેન્દ્રિય ખાતર જેવા કે લીલો પડવાશ, છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ અને પાકના અવશેષો ક્ષારયુક્ત જમીનોમાં વધુ પ્રમાણમાં આપવાથી એના ભૌતિક, જૈવિક અને રાસાયણિક ગુણવર્ણનાનું મહત્વનું કાર્ય કરે છે જેને લીધે જમીનની ફર્ટિલિટી અને પાક ઉત્પાદનમાં સારો એવો સુધારો જોવા મળે છે.
- આની સામે અસેન્દ્રિય ખાતરો / રાસાયણિક ખાતરો / નાઈટ્રોજનના વપરાશથી કોઈ રેસિડ્યુઅલ ઈફ્કટ જોવા મળતી નથી.
- સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયું ખાતર અને ઈક્કડના લીલા પડવાશનો ખારી જમીનમાં વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ડાંગરની ખેતી હેઠળની આલ્કલી / ભાસ્મિક જમીનમાં સૂક્ષ્મ તત્ત્વોની ઊંઘપ અટકાવી શકાય છે.
- ક્ષારયુક્ત જમીનમાં ઈક્કડ / હેન્ચા / શાણ ઘણી જ સારી રીતે ઉનાળામાં લીલા પડવાશના પાક તરીકે લઈ શકાય છે, જે જમીનની પ્રત તેમજ નીચેના લેયરની જમીનને સુધારવાનું મહત્વનું કાર્ય કરે છે.
- ક્ષારયુક્ત જમીનમાં વાયુરૂપે ઊરી જતા તત્ત્વો જેવા કે એમોનિયમ (NH_4)નો વાયુ રૂપમાં વધુ પ્રમાણમાં નાશ થાય છે, જે સેન્દ્રિય ખાતરને આપવાથી જમીનનું ઉષ્ણતામાન મોડરેટ/ઓષ્ટું કરી શકાય છે. સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ ક્ષારયુક્ત જમીનોમાં કરવાથી અને નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવાથી બેજ પૂરેપૂરો જળવાઈ રહેવાથી અને તત્ત્વોનો અપટેક વધુ થવાથી ઉત્પાદન ઉપર સારી અસર જોવા મળે છે.
- કહોવાયેલું છાણિયું ખાતર આલ્કલી જમીનોની એસિડિફાયિંગ / અભલતાયુક્ત અસરને ઓછી કરે છે, જે ક્ષારયુક્ત આલ્કલી જમીનને સુધારવાનું મહત્વનું કાર્ય કરે છે. *Nan* જમીનના કણ ઉપરથી દૂર કરી *Ca* અને *Mg* જમીનના કણ ઉપર પ્રસ્થાપિત કરવાનું મહત્વનું કાર્ય કરે છે જેથી સેન્દ્રિય ખાતરો જમીન સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

(૧૫) ખારી જમીનોમાં અપનાવવાની સિંચાઈ પદ્ધતિઓ

- ખારી જમીનોમાં સિંચાઈની ચીલાચાલુ પરંપરાગત પદ્ધતિના સ્થાને ફુવારા અને ટપક પદ્ધતિનો ઉપયોગ કરવાથી સિંચાઈની કાર્યક્ષમતા બમણી થઈ શકે છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- સીંગ (૧૯૭૩, ૧૯૭૪) દ્વારા કરાયેલા અભ્યાસો ઉપરથી માલુમ પડ્યું છે કે સ્પ્રીન્કલર પદ્ધતિનો દૂધીની ખેતીમાં ઉપયોગ કરવાથી પરંપરાગત પદ્ધતિ કરતા પિયતની કાર્યક્ષમતા બમણી થાય છે.
- પટેલ (૧૯૮૨) દ્વારા કરાયેલા સંશોધન ઉપરથી જણાયું છે કે ઉનાળુ મગફળીમાં સ્પ્રીન્કલર પદ્ધતિથી પિયત આપવથી અને ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં મગફળીનું ઉત્પાદન ૨૬% વધુ મેળવી શકાય છે.
- આ પદ્ધતિમાં દબાણ હેઠળ પિયત ટપકના રૂપે પિયત પાકના મૂળ ઝોન વિસ્તારમાં આપવામાં આવે છે, જેથી મૂળ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ ઘટતાં પાકને અનુકૂળ વાતાવરણ મળવાથી મૂળનો સારો વિકાસ થાય છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

બંદલાતા હૃવામાનમાં કુશળ ખેતી



બનદૂતા વિવિધમાંની કુચળ ખેડી



બંગાળ દ્વારા કૃષિ કેન્દ્ર



અદ્યાત્મા બ્યાન્ડિંગ ક્ષમતા ખેડી



(૧૬) ઈકડના લીલા પડવાશની ક્ષારયુક્ત જમીનમાં થતી ફાયદાકારક અસરો :

| | |
|---|--|
|  |  |
| ખારી અને ભાસ્મિક જમીનમાં ઈકડનો લીલો પડવાશ | ખારી અને ભાસ્મિક જમીનમાં ઈકડનો લીલો પડવાશ |

૧. ઈકડનો લીલો પડવાશ ક્ષાર અને વોટર લોગીંગ / પાણીના ભરાવાવાળી પરિસ્થિતિમાં પ્રતિરોધક શક્તિ ધરાવતો પાક હોવાથી આવી જમીનમાં સારી રીતે ઊગી શકે છે.
૨. એનું મૂળતંત્ર આવી જમીનોમાં ઊડા સ્તર સુધી વિસ્તરણ કરી પોષકતાત્ત્વો અને પાણી સહેલાઈથી લઈ શકે છે.
૩. જમીનની Permeability / જમીનમાં નીચે તરફ પાણી વહન કરવાની શક્તિને સુધારવાનું મહત્વનું કાર્ય કરે છે. આવી જમીનમાં આવેલું સફેદ સખત પડ / Hard Pan ઈકડના મૂળ તોડી નીચે સુધી ઊંડાઈએ પ્રસરવાથી જમીનમાં વધુ ઊંડાઈએથી ખોરાક, પાણી અને હવા મેળવે છે. આથી ઈકડનો લીલો પડવાશ જમીનમાં વધુ પ્રમાણમાં બાયોમાસ ઉમેરી જમીનને જૈવિક રીતે નવસાધ્ય કરવામાં ખારી જમીનોમાં મહત્વનો ભાગ ભજવે છે.
૪. એની વિઘટન થવાની કિયા અન્ય લીલા પડવાશના પાકોની સરખામણીમાં ઝડપથી થતી હોવાથી ‘બાયોલોજિકલ રિક્લેમેશન’ કરવાની કિયા ઝડપથી થાય છે.
૫. ઈકડના સેલ સેપ (જીવનરસ) એસિડિક નેચર હોવાથી આલ્કલી/સોડિક જમીનોમાં pH/ અભલતા આંકને ન્યુટ્રિલાઈઝ કરવાનું કાર્ય કરે છે.
૬. ઈકડના છોડનો ધેરાવો વધુ વિસ્તારમાં થતો હોવાથી નવસાધ્ય થયેલી જમીન ફરીથી રિસેલીનાઈઝન પ્રક્રિયાને અટકાવે છે.

(૧૭) પાકના અવશેષોનો મહિંગ તરીકે ઉપયોગ :

| | |
|---|---|
|  |  |
| ઉનાળા અને શિયાળામાં પ્લાસ્ટિક મહિંગનો ઉપયોગ કરવો. મહિંગથી નિદામણ, ભેજ, રોગ અને જીવાત, ઉષ્ણતામાન, પોષકતાત્ત્વોનું નિયંત્રણ, બાધીભવનનું નિયંત્રણ તેમજ જમીનમાં સાનુકૂળ માઈક્રોક્લાઈમેટ રહેવાથી પાકનો વિકાસ સારો થઈ શકે છે. | ચોમાસામાં પાકના અવશેષોનો સેન્ટ્રિય મહિંગ તરીકે ઉપયોગ કરવો. દા.ત. ઘઉનું ભૂસું, ડાંગરની પરાળ તેમજ ધાસચારના અવશેષોનો ઉપયોગ |

કારયુક્ત જમીનોમાં મરચી, રિંગણી જેવા પાકની વચ્ચે મલ્બિંગ કરવાથી જમીનમાં બેજનો સંગ્રહ, નિદામણ નિયંત્રણ, બાધીભવન ઘટવાથી વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.


મુખ્યત્વે બે પ્રકારના મલ્બિંગનો ઉપયોગ કરવામાં આવે છે :

૧. કુદરતી મલ્બિંગ : ડાંગરનું સ્ટ્રો, ધઉનું ભૂસું, પાકના અવશેષો અને નકામા નિદામણના અવશેષો જમીનમાં સારી રીતે મેળવી દેવાથી કુદરતી મલ્બિંગનું ચોમાસાની ઋતુમાં અસરકારક પરિણામ મેળવી શકાય છે.
૨. અકુદરતી : શિયાળા, ઉનાળાની ઋતુમાં બજારમાં મળતા જુદી જુદી ગેજના પ્લાસ્ટિકથી જમીન ઉપર કરી કરવાથી પાક ઉત્પાદનમાં મહત્વનો ફાયદો મેળવી શકાય છે.

દા.ત. ધર્મવાડિયા, ટામેટી, રીંગણી, તડબૂચ, સક્કરટેટી અને દૂધી વગેરે પાકોમાં મોટે પાયે ઉપયોગ કરી વધુ ઉત્પાદન લઈ શકાય છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.

મલ્બિંગ દ્વારા પાકના મૂળમાં રહેલા ક્ષારોને ઘણા જ ઓછા ખર્ચથી દૂર કરી નિયંત્રણ અટકાવી શકાય છે. પહોળા પાટે વવાતા પાકો જેવા કે કપાસ, રીંગણી, તુવેર, દિવેલા વગેરે પાકોમાં પાકના નિદામણ, પાકના અવશેષો અને લીમડા, ઈક્કડ, શેવરી, શાશ જેવા પાકોને ચાસની વચ્ચેના ભાગમાં દબાવી દેવાથી ઊભા પાકમાં મલ્બિંગનો અસરકારક લાભ થવાથી એના પરિણામે વધુ પાક ઉત્પાદન લઈ શકાય છે.

(૧૮) ખારી જમીનમાં પિયત વ્યવસ્થા :


| | |
|--|--|
|  <p>The diagram illustrates a typical irrigation system setup. It starts with a pump at the bottom right, connected to a main line. This line branches into several lateral lines, each ending in a dripper. The drippers are placed directly onto the soil between rows of plants. Various valves (Ball Valves, Lateral Flush Valve, Main Valve) are shown along the lines to control water flow. A sand filter and a pressure gauge are also included in the main line. Labels include: Backwash Valve, Pressure Gauge, Sand Filter, Ball Valve, Lateral Flush Valve, Main Valve, Pump, Ball Valve, Main Valve, Sand Separator Hydro-Cycle, and Drip Irrigation.</p> |  <p>An aerial photograph of a agricultural field. The field is divided into a grid pattern by a network of irrigation pipes. Small, white, cylindrical drippers are attached to these pipes at regular intervals, positioned directly above the base of each plant in the field. The field appears dry, suggesting the irrigation system is active or has recently been used.</p> |
| <p>ખારી જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ક્ષારનું મૂળ વિસ્તારમાંથી ધોવાણ થવાથી પાકનો વિકાસ સારો થઈ શકે છે. વધુમાં ટૂંકે ગાળે પાણી આપી શકાય છે.</p> | <p>ખારી જમીનમાં ફૂવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ક્ષાર જમીનના નીચેના વિસ્તારમાં લીય થઈ જવાથી શરૂઆતમાં પાકનો ઉગાવો સારી રીતે થઈ શકે છે. વધુમાં ટૂંકે ગાળે પાણી આપી શકાય છે.</p> |

ખારી જમીનમાં વિશેષ પ્રમાણમાં ક્ષારો જમીનમાં હોવાથી પિયત આપવાની પદ્ધતિ ક્ષાર ઓછા કરવામાં ઉપયોગી બને છે.

- (૧) જમીનને વાવણી માટે તૈયાર કરતા પહેલાં વધુ પ્રમાણમાં મિ સોઈંગ પિયત / Pre Sowing irrigation આપવાથી ક્ષાર નીચેના સ્તરમાં લીય ડાઉન થઈ જવાથી શરૂઆતમાં પાકનો ઉગાવો સારી રીતે થઈ શકે છે.
- (૨) પહોળા પાટલે વવાતા પાકો જેવા કે કપાસ, દિવેલા, બાગાયતી પાકો, સક્કરટેટી, તડબૂચ અને દૂધી વગેરેની ખેતીમાં ટપક સિંચાઈનો ઉપયોગ કરવાથી તથા મલ્બિંગ પદ્ધતિનો અસરકારક ઉપયોગ કરવાથી આવી જમીનોમાં સેલાઈન વોટર હોય તો પણ સહેલાઈથી ખેતી થઈ શકે છે.

- (૩) હલકી જમીનમાં પિયતની સંખ્યા ટૂકડા ગાળે વધારવાથી આ પ્રશ્ન હલ થઈ શકે છે.
- (૪) પાણીની સુવિધા અપૂરતી હોય તો આવી જમીનોમાં પાકને કટોકટીની અવસ્થાએ / લાઈફ સેવિંગ તરીકે પિયત આપવું જોઈએ.
- (૫) આવી જમીનમાં નીકપાળા પદ્ધતિથી પહોળા પાટલે વાવેતર, પોટ ઈરીગેશન (વેલાવાળા દૂધી જેવા પાકો માટે) ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
- (૬) ખારી જમીનમાં મલ્લિંગ પદ્ધતિની સાથે ટપક સિચાઈનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે અને ક્ષારની માઠી અસરને મહદૂ અંશે ઓછી કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.

(૧૯) ખારી અને ભાસ્મિક અને ભારે કાળી જમીનોમાં નિતાર નીકોની વ્યવસ્થા પાયાની જરૂરિયાત



- (૧) દક્ષિણ ગુજરાતની કાળી જમીનમાં માટીનું પ્રમાણ ૬૫% થી ૭૦% હોવાથી તથા ભાલ પ્રદેશની જમીનમાં નીચે સબ સોઈલમાં સફેદ હાર્ડ પાન/સખત પડ હોવાથી નિતાર શક્તિ ઘણી જ નબળી જેવા મળે છે. આને લીધે ખેતરની ફરતે નિતાર નીકો ઉંડો ત થી ૪ ફૂટ ઉંડી કરી ખેતરના પાણીનો નિકાલ કરવો જોઈએ. આ જ રીતે રેતાળ જમીનમાં વધુ જડપથી પાણી નીચે ઉત્તરી જતું અટકાવવા સેન્દ્રિય ખાતરો જેવા કે લીલો પડવાશ, છાંખિયું ખાતર, કંપોસ્ટ તેમજ બજારમાં મળતા સેન્દ્રિય ખોળનો ઉપયોગ કરી પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો કરી શકાય છે. રેતાળ જમીનમાં કુદરતી મલ્લિંગ (ડાંગરનું ભૂસું, ઘઉંનું ભૂસું અને શેરડીના પાનનું ટ્રેસ મલ્લીંગ) અને અફુદરતી મલ્લિંગ (૫૦ માઈકોન પ્લાસ્ટિકનો સિલ્વર કલરનો (ઉપયોગ કરવાથી) પદ્ધતિ અપનાવવાથી પાણી સંગ્રહ કરવામાં તથા જરૂરી પોષક તત્ત્વો મળવામાં સુધારો અને નિંદામણનું નિયંત્રણ સારી થવાથી વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.
- (૨) સારી નિતાર વ્યવસ્થા અને કુદરતી મલ્લિંગ કરવાથી શેરડી જેવા પાકોનું ઉત્પાદન સારું મેળવી શકાય છે તેમજ રોગ અને જીવાત નિયંત્રણ પણ સારી રીતે કરી શકાય છે. વધુમાં પૂરતી ઝેનેજ વ્યવસ્થા કરવાથી પાકને અનુકૂળ વાતાવરણ મળવાથી તેની ભૌગોલિક, ઔદ્યોગિક અને રાસાયણિક કિયાઓ સારી રીતે થતી હોવાથી પાક જરૂરી પોષક તત્ત્વો સહેલાઈથી મેળવી શકે છે અને શેરડીનું વધારે ઉત્પાદન લઈ શકાય છે.
- (૩) વધુમાં ડાંગરની ખેતીમાં પણ પિયત વ્યવસ્થા ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે ત્યાં ભલામણ કરેલી જરૂરિયાત કરતા ડાંગર અને શેરડીના પાકમાં ૪૦ થી ૬૦ ટકા પિયત વધારે પ્રમાણમાં આપવાથી જમણ

દ્વારા એ વહી જવાથી પાણીનો વધારે વ્યય થાય છે. આથી ઉત્પાદન અને ખેતી ખર્ચ વધે છે અને પાક ઉત્પાદનની ગુણવત્તા ઉપર માટી અસર જોવા મળે છે જેને કારણે બજાર ભાવ ઓછો મળે છે.

- (૪) ડાંગરમાં શ્રી પદ્ધતિ પ્રમાણે (SRI System) ટ્રાન્સપ્લાન્ટિંગ કરવાની પદ્ધતિ અપનાવવાથી ડાંગરનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે તેમજ પાણીનો કાર્યક્ષમ બચાવ કરી શકાય છે.
- (૫) વધુમાં આ અંગે મેઈન કેનાલ તેમજ ફિલ્ડ ચેનલ વગેરે પાકું લાઈનિંગ કરવાથી સીપેઝ દ્વારા જમણાનું પાણી અટકાવી શકાય છે. પૂરતા પ્રમાણમાં ડ્રેનેજ નહીં હોવાથી કમાન્ડ વિસ્તારમાં પાણીનાં સ્તર ઘણાં ઊંચાં લેવલ સુધી આવે છે અને સમયાંતરે વોટર લોગિંગના પ્રશ્નો ઊભા થાય છે અને આ જમીન ખેતી માટે લાંબે ગાળે નકામી બને છે.

ખારી જમીનમાં ભલામણ કરાયેલી કૃષિ તજ્જીતાઓ / ટેક્નોલોજી / ખેડૂત ઉપયોગી ભલામણો :

૧. મધ્ય ગુજરાત વિસ્તારની ક્ષારવાળી જમીનમાં ડાંગરની એસ.એસ.આર. ૫૧૨૧૪ જાતનું વાવેતર ૩૦ x ૧૫ સે.મી.ના બદલે ૧૫ x ૧૫ સે.મી.ના અંતરે કરવું તથા પાકને ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/દે. ચાર સરખા હપ્તામાં એટલે કે પાણાનું ખાતર, ફૂટ પડે ત્યારે, પેનિકલ ઈનીશીએશન અને બુટ અવસ્થાએ આપવાની ભલામણ છે.
૨. જિલ્સમ આપીને નિતારની પ્રક્રિયા પૂરી થાય પછી ડાંગરનો પાક અથવા લીલા પડવાશ માટે ઈક્કડ વાવવી જોઈએ.
૩. જમીન સુધારણા પછીના શિયાળામાં અને ઉનાળામાં જમીન પડતર રાખવી જોઈએ નહીં. એટલે કે સુધારણાના પહેલા બે વર્ષોમાં ડાંગર અથવા ઈક્કડ અને ઘઉં અથવા રાઈ વાવવા. જ્યારે ત્રીજા વર્ષ ચોમાસામાં ઈક્કડ, ચોળા, મકાઈ, ડાંગર અને શિયાળામાં ઘઉં, જવ, રાઈ સુગરબીટ વગેરે વાવવા જોઈએ.
૪. અંશતઃ સુધારેલી જમીનમાં ઘાવલ અને ઊંડી બેડ કરવી જોઈએ નહીં.
૫. ક્ષારમય જમીનમાં પાકને ઓછી ફૂટ મળતી હોવાથી બિયારણનો દર વધારે રાખવો જોઈએ.
૬. જમીન સુધારણાનાં થોડા વર્ષો સુધી એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તથા નાઈટ્રોજન ખાતરની ભલામણ કરતાં ૧૦થી ૧૫ ટકા જથ્થો વધારે આપવો જોઈએ.
૭. જમીનમાં ફોર્સફર્સ અને પોટાસિક ખાતરો જમીન સુધારણાના ૭ થી ૮ વર્ષ પછી આપવાની ભલામણ છે.
૮. ભાસ્મિક જમીનમાં સુધારણા પછી જમીનમાં ૧૫થી ૨૫ કિ.ગ્રા./દે. જીક સલ્ફેટ આપવું જોઈએ.
૯. ભાલ વિસ્તારમાં ઘઉં ઉગાડતા ખેડૂતોને વધારે નકો મેળવવા માટે બિનપિયત ઘઉંની જીડબલ્યુ-૧ જાતનું બિયારણના દર ૬૦ કિ.ગ્રા./દે. રાખીને ૨૦ કિ.ગ્રા./દે. નાઈટ્રોજન આપી વાવેતર કરવા ભલામણ છે.
૧૦. ભાલ વિસ્તારમાં જ્યાં પિયતની સગવડ હોય ત્યાં ઘઉંની જાત જીડબલ્યુ-૧માં વધારેમાં વધારે ફૂટ નીકળવાની અવસ્થાએ એક પિયત આપવામાં આવે તો વધારે ઉત્પાદન મળે છે.
૧૧. સામાન્ય ભાસ્મિક જમીનમાં ઘઉંની જાત જીડબલ્યુ-૧ને જિલ્સમની જરૂરિયાતના ૨૫% એટલે કે એક ટન જિલ્સમ/ દે. આપવાની ભલામણ છે.
૧૨. એકલા પાક કરતાં કપાસમાં આંતર પાક તરીકે મગ વાવવાથી વધારે વળતર મળે છે.
૧૩. બે વર્ષના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે કપાસની જાત ગુજરાત કપાસ-૧ તમાં ફૂલ બેસવાની શરૂઆતની અવસ્થાને ૪%વાળું કેઓલીનનું દ્રાવણ છાંટવામાં આવે તો ૧૦૦% વધારે ઉત્પાદન મળે છે.

૧૪. રાઈના પાકમાં ૧૭૫ પી.પી. એમ. સાઈકોસીલનો છંટકાવ કર્યા પછી ૭૫ પી.પી.એમ. જબ્બેલિક એસિડ અને ચણાના પાકમાં ૫૦ પી.પી.એમ. જબ્બેલિક એસિડનો ફૂલ બેસવાની અવસ્થાએ છંટકાવ કરવાથી બંને પાકમાં ૪૮ અને ૧૮% વધારાનું ઉત્પાદન મળે છે.
૧૫. ડી.પી.એ.પી.ના ભાગ રૂપે ભાસ્મિક જમીન સુધારણાના અભ્યાસમાં ૫૦% જિલ્સમની જરૂરિયાતનું જિલ્સમ અને ૧૦ ટન/ઘે. છાણિયું ખાતર નાખવાથી ઘઉં, જુવાર અને કપાસના પાકમાં ફાયદો થયો છે.
૧૬. કપાસની જાતો ગુજરાત કપાસ-૧૩ અને વિરમગામ-૭૮૭ને સૂકી ખેતીની પરિસ્થિતિમાં નાઈટ્રોજન આપવાથી કપાસના ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી.
૧૭. ક્ષારમય વિસ્તારમાં બિન પિયત ઘઉં પરના અભ્યાસ પરથી જાગ્રાવા મળે છે કે નાઈટ્રોજન અને ફોસ્ફરસ આપવાથી ઘઉના ઉત્પાદનમાં કોઈ તફાવત જોવા મળતો નથી.
૧૮. અતિ ક્ષારમય જમીનમાં કસુબી સફળ રીતે લઈ શકાય. કસુબીની જાત ૧૪૩-૨૦ કરતાં ૧૧-૪-૨૦ અને ૩-૧૧૨૩૮ વધારે ઉત્પાદન આપે છે.
૧૯. ક્ષારમય જમીનમાં શંકર જુવારના પાકને ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અન ૩૦ કિ.ગ્રા./ઘે. આપવાથી નિયંત્રણ માવજત કરતાં દાણાનું વધારે ઉત્પાદન મળે છે.
૨૦. બિન પિયત ઘઉં (અરણેજ ૨૦૮) ને ૨૦ કિ.ગ્રા.નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પૂરતો છે. વધારે નાઈટ્રોજન આપવાથી ઘઉના ઉત્પાદનમાં વધારો થાય છે.
૨૧. સૌરાષ્ટ્ર પ્રદેશના જે ખેડૂતો GG4 જાતની ઉનાળું મગફળી (ઉગાડતા હોય એવા ખેડૂતો 4dsm (20%) જેટલી સેલિનિટી-ખારાશ ધરાવતાં પાણીથી સિંચાઈ કરી શકે છે.
૨૨. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ખારા પાણીથી (ઈ.સી. ૬.૦૦ કે.સા./મી.) પિયત કરતા સરેરંદું હુંગળી ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ભલામણ કરેલા રાસાયણિક ખાતરના ઊઝ (૭૫ કિલો નાઈટ્રોજન + ૬૦ કિલો ફોસ્ફરસ) ઉપરાંત છાણિયું ખાતર ૨૦ ટન સાથે ૧૦૦ કિલો પોટાશ પ્રતિ હેક્ટરે અથવા છાણિયું ખાતર ૨૦ ટન / ઘે. + જિલ્સમ ૭ ટન/ઘે. (૫૦ ટકા જ.આર.)ની સાથે ૧૦ કિ.ગ્રા. પોટાશ/ઘે. આપવાથી વધારે ઉત્પાદન અને વધુ આવક મળે છે. (૨૦૧૧)
૨૩. વેજાનિકો માટે / એમના દ્વારા એવું સૂચવાયું છે કે, ઘઉની GW-322 અને KRL-119 ની જાતો, Ece 4dsm (2007-09) સુધી ક્ષાર સહિષ્ણુ જણાઈ હતી.
૨૪. આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારની સમર્યાયુક્ત જમીનમાં દિવેલા ખેડૂતોને દિવેલાની જસી-૩ જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે. સાથે જમીનમાં છાણિયું ખાતર ૧૦ ટન પ્રતિ હેક્ટર અને જિલ્સમ તેની જરૂરિયાતના ૫૦ ટકા પ્રમાણે ભલામણ કરેલા રાસાયણિક ખાતર સાથે આપવું. (૨૦૧૦-૧૧ થી ૨૦૧૩-૧૪)
૨૫. દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખેત આબોહવાકીય વિસ્તારની ક્ષારમય જમીનમાં લસણ વાવતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, લસણનું વધુ ઉત્પાદન અને ચોખ્યું વળતર મેળવવા માટે ભલામણ કરેલા રાસાયણિક ખાતરના ૫૦% જથ્થા સાથે ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવાથી લસણનું અર્થક્ષમ વધુ ચોખ્યું વળતર મળે છે. (2010 to 2013)
૨૬. The relative salt tolerance of wheat varieties was found in order of GW 322 > GW 366 < Lok 1 > GW 273 > GW 496 up to EC 4.0 dSm-1 of irrigation water. (2011-2013).
૨૭. દક્ષિણ સૌરાષ્ટ્ર એટ્રો કલાઈમેટીક ઝોનનાં દરિયા કંઠાની ખારી ભાસ્મિક જમીનની પરિસ્થિતિમાં ખરીફ મગફળી ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે જમીનમાં જિલ્સમની જરૂરિયાતનાં ૫૦ ટકા જિલ્સમ (૫ ટન/ઘે.) આપવાથી ચોખ્યું વધુ વળતર મળે છે. (2004-05 to 2006-07)

૨૮. દક્ષિણ સૌરાષ્ટ્ર એગ્રો કલાઈમેટીક જોનના દરિયાકાંઠાની ભાસ્મિક જમીનની પરિસ્થિતિમાં ખરીફ મગફળી ઉગાડતા બેડૂતોને ભલાષ આપવામાં આવે છે કે ભલામણ કરેલા રાસાયણિક ખાતરનાં જથ્થા ઉપરાંત હેક્ટરે ૧૦૦ કિલો પોટાશ આપવાથી ચોખું વધુ વળતર મળે છે. (2004-05 to 2006-07).

૨૯. વૈજ્ઞાનિક સમાજ માટેની માહિતી :

ઉપરના પરિણામો ઉપરથી વૈજ્ઞાનિક સમાજ માટે એવી ભલામણ કરવામાં આવી છે કે, ચણાની GG-4 જાત ખારાં પાણીની સિંચાઈની પરિસ્થિતિમાં (2003-04, 2005-06) ક્ષાર સહિષ્ણુ જણાઈ હતી.

૩૦. વૈજ્ઞાનિક સમાજ માટે માહિતી :

ઉપરના પરિણામો ઉપરથી વૈજ્ઞાનિક સમાજ માટે એવી ભલામણ કરાઈ છે કે, G-herbaceumની GJHV-851 અને GJHV-34 જેનોટાઈપ ક્ષાર સહિષ્ણુ જણાઈ હતી અને એ પછીના ક્રમે સ્થાનિક જાત ધૂમડ (૧૯૮૮-૮૯થી ૨૦૦૫-૦૫) હતી.


૩૧. ક્ષારયુક્ત જમીનોને નવસાધ્ય કરવા ઉપર જમીનની સાપેક્ષ પરિસ્થિતિની અસર

પ્રાચ્ય માહિતી-ટેટા (કોઠો-૫) ઉપરથી એવું જણાયું હતું કે હાલની સપાટ વાવણી (flat sowing)ની સરખામણીએ Board band furrow system (M3)ની વાવણીથી અનાજના અને ઘાસચારાના પાકમાં નોંધપાત્ર પ્રમાણમાં અનુક્રમે (૩,૦૩૩ કિ.ગ્રા.) અને (૬,૭૨૭ કિ.ગ્રા.) વધુ ઉતાર થયો હતો, જે હેક્ટરર્ટીઠ અનુક્રમે ૩૪૨ કિ.ગ્રા. અને ૨૪૪ કિ.ગ્રા.નો વધારો સૂચવતો હતો. એનાથી હેક્ટરર્ટીઠ રૂ. ૭૧૬નું નેટ-ચોખું વળતર મળ્યું હતું. આ જ પ્રમાણે સ્ટ્રોમલ્યની પ્રક્રિયાને પરિણામે હેક્ટરર્ટીઠ ઉના ધોરણે હેક્ટરર્ટીઠ રૂ. ૫૦૧નું વધુ વળતર મળ્યું હતું.

૩૨. આથી દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારની ખારા પાણી પિયત પરિસ્થિતિમાં દિવેલા વાવતા બેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે દિવેલાની ગ્ર.સી.-૩ જાતનું વાવેતર કરવાથી શંકર દિવેલા-૪ અને શંકર દિવેલા-પની સરખામણીમાં વધુ ઉત્પાદન મળે છે. (૨૦૦૫-૨૦૦૭)

દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન અંગે ઉભરાટ અને દાંતી કેન્દ્ર ખાતે સંશોધન કેન્દ્ર પર થયેલા સંશોધન ઉપરથી નીચેની ભલામણો કરવામાં આવી છે :

(૧) ડાંગર : દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીનો માટે ભલામણ કરેલ ડાંગરની જાત : જ્યા



ફેરરોપણી માટેની ભલામણ કરેલ ડાંગરની જાતો :

મુસરી, જ્યા, દાંતી, એસઅલઆર-૫૧૨૧૪, GR-3

ઓરણ ડાંગરની જાતો : સાઢી-૩૪-૩૬, SLR-51214 અને લોકલ ડાંગરની જાત ભૂરા રતા BR-4-10

(૨) ડાંગરના પાક ટ્રાન્સપ્લાન્ટિંગ માટે થયેલી ભલામણો :

- ૪ થી ૫ અઠવાડિયાની ઉમરની ધરુનો ઉપયોગ કરવો.
- ધરુની રોપણી 15×15 સે.મી. કરવી.
- દરેક ખામણા દીઠ ૬-૮ ધરુની રોપણી કરવી.
- જૂનના ત્રીજા અઠવાડિયામાં ડાંગરની ફેરરોપણી કરવી.
- ફણગાવેલ ડાંગરના બીજ/ધરુનું (SRI Systems) ૨૦ સે.મી. અંતરે વાવેતર કરવું.
- ખરીફ ડાંગર રોપતાં પહેલાં શાણનો લીલો પડવાશ કરવામાં આવે તો ૪૦% નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય.
- ZnSO_4 નો હેક્ટરે ૧૫ કિલો પ્રમાણે ઉપયોગ કરવાથી જ્યા ડાંગરના ઉત્પાદન ઉપર ફાયદાકારક અસર જોવા મળે છે.

(૨) ઘઉના પાકની વાવણી માટે થયેલી ભલામણા :



ખારી જમીનમાં ભલામણ કરેલી ઘઉની જાતો : J-314, સોનાલીકા, ગુ. ઉબલ્યુ-૧, ગુ. ઉબલ્યુ-૪૮૬

ઘઉની માટે કૃષિ કાર્યોની ભલામણા :

૧. ૩૦ સે.મી.નો ગાળો રાખી ઘઉનું વાવેતર કરવું.
૨. ખાતર : ૧૨૦-૬૦-૦૦ NPK કિલો ૧ હેક્ટરે
૩. ઝીક (Zn)ની ઊંણાપ હોય તો ઘઉના પાકને હેક્ટરે ૧૮૦ન -૫૦૦P - ૨૫ ZnSO_4 આપવું.

(૩) બાદી / જવ :

- સ્થાનિક જાત માટે BHD-18 નો વાવેતર માટે ઉપયોગ કરવાથી વધુ ઉત્પાદન થયાનું જણાયું છે.

(૪) કપાસની જાત : G Cot-13 અને Hy cotton - C જાતની પસંદગી કરવી

- કપાસની હાઈબ્રીડ જાત - Cને હેક્ટરે ૫ ટન છાણિયું ખાતર / ધાસનું મળ્યું અથવા ૫૦ / પ્લાસ્ટિક મલ્યનો ઉપયોગ કરવાથી અને હેક્ટરે ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

રજકો અને બરસીમ જેવા પ્રોટીનયુક્ત લીલા ઘાસચારાના પાકોનું વાવેતર (ખારી જમીનમાં) :



જાતો : સ્થાનિક રજકાની જાતો આણંદ-૨, લોકલ રજકાની જાત ટ-૮ની રજકાની જાત વાવેતર માટે પસંદગી કરવી.

- ૨૦ કિલો નાઈટ્રોજન પ્રતિ હેક્ટરે આપવું. ખારી જમીનોમાં ફોસ્ફરસ મધ્યમ પ્રમાણમાં હોય તો આપવો નહીં. વધુમાં આ પાકો હવામાંના નાઈટ્રોજન જમીનમાં પ્રસ્થાપિત / Fixation કરવાનું મહત્વનું કાર્ય કરે છે. આ પાકો જમીનની ઉપરની સપાટી પર છવાઈ જવાથી બાષ્પીભવનનું પ્રમાણ ઘટાડે છે, જેથી નીચેથી આવતા કારો અટકાવવામાં મદદરૂપ બને છે.

(૫) ખારી જમીન માટે પાકની ફેરબદલી / Crop sequence :

- શિયાળામાં ઘઉં લીધા પછી ડાંગરની ખેતી સૂર્યમૂખી, કસંબી અને જવ કરતાં આર્થિક દસ્તિઓ વધુ ઉત્પાદન આપે છે.
- હેક્ટરે $ZnSO_4$ ૨૫ કિલો પ્રમાણે આપવાથી ડાંગર અને ઘઉં બંને પાક માટે વધુ ઉત્પાદન મળતું હોવાથી એની ભલામણ કરાઈ છે.
- ડાંગરની ખરીફ ઝતુમાં પાક લેતા પહેલાં ઈક્કડનો લીલો પડવાશ કરવાની અને રાસાયણિક ખાતરનો ૭૫% જથ્થો આપવાની ભલામણ કરાઈ છે. એનાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો જેવા મળે છે.
- ડાંગરની રોપણી સંન્કન બેડ / Sunken bed, ઘઉનું વાવેતર સંન્કન બેડ (૬૭% વિસ્તારમાં) અને રિંગશમાં ગાઢી ક્યારા (૩૩% વિસ્તારમાં) વાવેતરની પદ્ધતિ અપનાવવાથી વધારે ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.

ખારી જમીનને નવસાધ્ય કરવાની ભલામણ (Recommendations for reclamation of salt affected soils) :

- (૧) દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીનોને નવસાધ્ય કરવા માટે હેક્ટરે ૭૫% જિસ્મની જરૂરિયાત (GR) જથ્થો પ્રમાણે આપવાની ભલામણ છે.
- (૨) ડાંગરના પાકને ખારી અને ભાસ્મિક જમીનોમાં હેક્ટરે ૫૦% (GR) + ૫૦% પ્રેસમડ + ૨૦ ટન છાણિયું ખાતર હેક્ટરે આપવાથી જમીન સુધરવાને લીધે ડાંગરનું ઉત્પાદન મેળવી શકાય છે.

જૈવિક પદ્ધતિ દ્વારા ખારી જમીનની સુધારણા : (Biological Method for amelioration of salt affected soils)

- (૧) ચોમાસાની ઋતુમાં ડાંગરની રોપણી કરતાં પહેલાં શાશનો લીલો પડવાશ કરવાથી ખારી અને ભાસ્મિક જમીનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સુધારી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૨) ખારી અને ભાસ્મિક જમીનોમાં ગતનપેનિક (Panicum maximum Jacq) ઘાસની 30×14 સે.મી. અંતરે રોપણી અને હેક્ટરે ૩૦ કિલો (DAP) નાં રૂપમાં જમીન તૈયાર કરતી વખતે ૬૦ કિલો / નાઈટ્રોજનયુક્ત ખાતર બે હપે આપવાથી સૂક્ષ્મ ઉત્પાદન (Dry matter production) તેમજ તેની જમીન નવસાધ્ય કરવામાં ખારે અસર જોવા મળે છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૩) ખારી ભાસ્મિક જમીનોમાં એકેસિયા ઓરિક્યુલિફોર્મિસ (Acacia auriculiformis) 2×2 મીટરના અંતરે અને 26 Kg M_2 હોડ દીઠ (૫૦% રોપણી વખતે) ભાસ્મિક જમીનને અસરકારક અને નવસાધ્ય કરી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૪) રાઠોડ અને અલ્લાવત (૧૯૮૬) દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન ઉપર કરેલા સંશોધન ઉપરથી માલુમ પડ્યું છે કે, 60 સે.મી.ની ડ્રેનેજની ઉંડાઈ રાખવાથી અને ગાદી ક્યારાની પહોળાઈ \times લંબાઈ (2.4 મીટર $\times 6.00$ મીટર) અપનાવવાથી ગતનપેનીક ઘાસ (Panicum maximum Jacq) નું ઉત્પાદન (Dry matter production) 83% અને 142% સપાટ ક્યારાની લોકલ પદ્ધતિથી / સપાટ ક્યારા સરખામણીમાં સાર્થક રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૫) રાઠોડ અને અલ્લાવત (૧૯૮૬) દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન ઉપર કરેલા સંશોધન ઉપરથી માલુમ પડ્યું છે કે, ગતનપેનીક ઘાસ (Panicum maximum Jacq)નું ખાન્ટેશન (૪૫થી 60 સે.મી.ની ડ્રેનેજ ઉંડાઈ રાખવાથી અને ગાદી ક્યારાની લંબાઈ (2.4 મીટર $\times 6.00$ મીટર) અપનાવવાથી pH, EC, ESP, Bulk density અને N, P, K અને Na ના અપટેકમાં સાર્થક રીતે પ્રથમ વર્ષ કરતાં બીજા વર્ષના અંતે તમામ પેરામીટરમાં આંકડાકીય દણિએ સાર્થક તફાવત કંટ્રોલ ખોટ/સપાટ ક્યારાની સરખામણીમાં જોવા મળે છે. આથી આવી જમીનોમાં બે વર્ષ (ચોમાસાની બે એકધારી સિઝન) ગતનપેનીક ઘાસ (Panicum maximum Jacq)ની રોપણી BBF સિસ્ટમમાં કરવાથી ખારી અને ભાસ્મિક જમીનને જૈવિક રીતે સુધારી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૬) રાઠોડ અને અલ્લાવત (૧૯૮૬) દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન ઉપર કરેલા સંશોધન ઉપરથી માલુમ પડ્યું છે કે, ગતનપેનીક ઘાસનું ખાન્ટેશન (૪૫ થી 60 સે.મી.ની ડ્રેનેજ ઉંડાઈ રાખવાથી અને ગાદી ક્યારાની પહોળાઈ \times લંબાઈ 2.4 મીટર $\times 6.00$ મીટર) અપનાવવાથી ગતન પેનીક ઘાસની ગુણવત્તામાં પ્રોટીન, ફોસ્ફરસ, પોટાશ વગેરે ગુણવત્તાના પેરામીટરમાં કન્ટ્રોલ ખોટની સામે સાર્થક રીતે સુધારો જોવા મળ્યો છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૭) રાઠોડ અને અલ્લાવત (૧૯૮૬) દક્ષિણ ગુજરાતની દરિયાકાંઠાની ખારી અને ભાસ્મિક જમીન ઉપર કરેલા સંશોધન ઉપરથી માલુમ પડ્યું છે કે, ગતનપેનીક ઘાસનું ખાન્ટેશન ($D_3 = 60$ સે.મી. ડ્રેનેજ / નિતાર નીકની ઉંડાઈ રાખવાથી અને ગાદી ક્યારાની પહોળાઈ \times લંબાઈ ($S_3 = 2.4 \times 6.00$ મીટર) રાખવાથી અનુક્રમે વર્ષ $1982-83$ માં ઘાસમાંથી ચોખ્યો નફો રૂ. ૪,૮૭૫ (BCR 1:3:66) અને $1983-84$ માં ચોખ્યો આવક રૂ. ૮,૦૮૮ (BCR 1:8:90) થઈ છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)
- (૮) Prosopis Juliflora / વિલાયતી બાવળ (2×2 , 3×3 અથવા 2×4 મીટરના અંતરે) ખારી અને ભાસ્મિક જમીનમાં વાવવાથી જમીનોના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો સુધારી શકાય છે અને હેક્ટરે રૂ. ૪૦૦૦-૫૦૦૦ની

આવક પાંચમા વર્ષે ખુલ્લી જમીનમાં ખાણ્ટિંગ કર્યો પછી મેળવી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)

(૮) Acaciaનું ખાણ્ટિંગ રૂ. ૧ x ૧ મીટર અંતરે કરવાથી એક હેક્ટરમાંથી રૂ. ૧.૨ લાખની આવક રોપણીના છંદ્ર વર્ષે પણ ખારી અને ભાસ્મિક જમીનમાંથી મેળવી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)

(૧૦) ખારા પાણીના પિયત માટે ઉપયોગ કરવા માટેની ભલામણો : ટ્યુક સિંચાઈ પદ્ધતિની EC ૬.૦૦ dS/m સુધીનાં પાણીનો રોંગડાની ખેતીમાં ઉપયોગ કરવાથી દક્ષિણ ગુજરાતની ખારી અને ભાસ્મિક જમીનોમાં સારું અને વધુ ઉત્પાદન રોંગડા તેમજ ડાંગરના પાકનું ખરીફ ઝતુમાં મેળવી શકાય છે. (Associate Research Scientist, Danti Farm, NAU, Navsari)

ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વિવિધ પાકોનું હાઇટેક ફાર્મિંગ કરતાં પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણો :

બાયોટેકનોલોજીના ઉપયોગ દ્વારા પાટણ જિલ્લાના જંગરાળ ગામના ખેડૂતની અનોખી સિદ્ધિ-વીધા દીઠ સરેરાશ ૮૦થી ૧૦૦ મણા બી. ટી. કપાસનું રેકોર્ડ ઉત્પાદન મેળવનાર પ્રગતિશીલ ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ બારોટ. કપાસની ખેતીમાં ઉત્તર ગુજરાત વિસ્તારના જમીનના ઉષ્ણતામાને છાણિયા ખાતરના વૈજ્ઞાનિક ઉપયોગ દ્વારા નીચા ઉષ્ણતામાનની જાળવણી / **Moderate temperature** કરી હાઇબ્રિડ કપાસની ખેતીમાં બીટી કપાસનું બિયારણ તેમજ વૈજ્ઞાનિક ધોરણે તૈયાર કરેલા છાણિયા ખાતરના ઉપયોગ / **Recycling of FYM** દ્વારા રાજ્ય કક્ષાએ કપાસનું રેકોર્ડ બ્રેક ૮૦ થી ૧૦૦ મણા ઉત્પાદન મેળવનાર ખેડૂત :



બદલાતા હવામાનમાં પાટણ તાલુકાના ગામ જંગરાળના ખેડૂતે બીટી કપાસમાંથી મેળવેલું વિક્રમ ઉત્પાદન

- જમીનની ફળદુપતા છાણિયા ખાતર દ્વારા વધારી
- મે માસમાં સિંચાઈનો ઉપયોગ
- ટ્યુક સિંચાઈનો ઉપયોગ

૧. નામ : ઘનશ્યામભાઈ બારોટ

સરનામું : ગામ - જંગરાળ, તા.જિ. પાટણ

૨. પાકનું નામ : બીટી કપાસ

૩. અપનાવેલી પદ્ધતિ : દિવાળીના સમયથી છાણિયા ખાતરની બહારથી ખરીદી કરી ફરીથી તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી કહોવડાવી તેનો ઉપયોગ કર્યો. કપાસની વાવણી પહેલાં ચાસ હળથી ખુલ્લા કરી દરેક ચાસમાં સારું કોહવાયેલું છાણિયું ખાતર ભર્યું. ત્યાર બાદ તે ચાસ ઉપર બંડ કોર્મેટ પાયા બનાવી તેના ઉપર $2' \times 2'$ બીટી કપાસનું વાવેતર કર્યું. કપાસના બીજને ઉગાવવા માટે નીકથી બંને બાજુએ પિયત આપી કપાસને ઉગાડે છે. કપાસ એક મહિનાનો થયા પછી ટપક સિંચાઈથી પિયત આપે છે અને સમયસર ખાતર પૂરવા, આંતરખેડ, નિંદામણ જેવા કાર્યો કરે છે.

૪. ઉત્પાદન : સતત ૮૦થી ૧૦૦ મણનું સરેરાશ ઉત્પાદન વીધાઈઠ મેળવીને રાજ્ય કક્ષાએ અજોડ સિદ્ધિ બીટી કપાસનું ઉત્પાદન કરવામાં મેળવી છે.

ખેડૂતનો અનુભવ :

- આજના મૌંધવારીના સમયમાં સસ્ટેનેબલ ફાર્મિંગ કોટન ટેકનોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા કપાસની ખેતી વધુ નફાકારક બનાવી શકાય છે.
- જમીનની ફળદુપતા જાળવી વધુ કૃષિ ઉત્પાદન મેળવવું એ આજના સમયની જરૂરિયાત છે. આ માટે સોઈલ હેલ્પ કાર્ડના અસરકારક ઉપયોગ દ્વારા ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર પાછળનું ૫૦% ખર્ચ બચાવી વધુ ઉત્પાદન ‘ઉત્તમ છાણિયા ખાતર’નો ઉપયોગ કરી મેળવી શકે છે.
- રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓના વધુ ઉપયોગથી જમીનમાં અને છોડની આસપાસ ‘Micro Climate’ની વિપરીત અસરને ઓછી કરવા છાણિયું ખાતર / સેન્ટ્રિય ખાતરો એકમાત્ર રામબાળ ઈલાજ છે.

ભારે કાળી જમીનમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરી શેરડીની આધુનિક ખેતી દ્વારા વધુ ઉત્પાદન મેળવતા ભરૂચ જિલ્લાના નિલેષભાઈ પટેલ



શેરડીની આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા વાર્ષિક રૂ. ૨૮ લાખની આવક મેળવતા ભરૂચ જિલ્લાના ખેડૂત નિલેષભાઈ પટેલ

ભરૂચ જિલ્લાના ઉપરાલી ગામના ખેડૂતે ૪૫ વીધા જમીનમાંથી ૧૩૫૦ ટન શેરડીના ઉત્પાદન દ્વારા રૂ. ૨૮ લાખની આવક મેળવી.

૧. નામ : નિવેષભાઈ જ્યંતીભાઈ
૨. ગામ : ઉપરાલી, તા. જિ. ભરુચ
૩. ઉંમર : ૩૮ વર્ષ
૪. પાકનું નામ : શેરડી

અપનાવેલી પદ્ધતિ :

આજુબાજુના વિસ્તારમાંથી છાણિયું ખાતર ખરીદીને તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી ફરીથી ૪ મહિના સુધી કહોવડાવી તૈયાર કરી આ સંપૂર્ણ કહેવાયેલું ખાતર ૪૫ વીધા જમીનમાં રોપણી પહેલાં ચાસમાં આપી શેરડીના પાકની રોપણી કરી. જરૂરી છાણિયું ખાતર જમીનમાં ઉમેરવાથી જમીન પોચી બને છે અને છોડના મૂળનો વિકાસ વધુ થાય છે જેને લીધે છોડ જમીનમાંથી બેજ અને પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં લે છે અને એથી શેરડીનો સારો વિકાસ થવાથી ઉત્પાદન વધુ મળે છે.

કુલ ઉત્પાદન : ૪૫ વીધામાંથી ૧૩૫૦ ટન (હેક્ટરે ૧૫૦ ટન)

કુલ ખર્ચ : રૂ. ૪.૫૦ લાખ

કુલ આવક : રૂ. ૧૩૫૦.૦૦/- ટન \times રૂ. ૨૪૦૦/- ટન = આવક રૂ. ૩૨,૪૦,૦૦૦/- રૂ. ૪.૫૦ લાખ ખર્ચ

ચોઘ્યી આવક : રૂ. ૨૭,૬૦,૦૦૦/- (i.e. Rs. 28.00 Lacs)

સંપર્ક : મો. ૮૮૭૮૮ ૨૦૦૦૩

ખેડૂતનો અનુભવ :

- શેરડી લાંબાગાળાનો પાક હોવાથી વધુમાં વધુ છાણિયા ખાતરનો ઉપયોગ કરી શેરડીની ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- છાણિયા ખાતરથી જમીનના જૈવિક, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં સુધારો થવાથી ભરુચ જિલ્લાની કાળી જમીનોમાં વધુ ઊંડાઈએથી પોષક તત્ત્વો, પાણી અને હવાની અવરજન વધુ થવાથી પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

બદલાતા હવામાનમાં ૩૦ એકરમાં ધાસચારાની ખેડૂતની સફળ ખેતી દ્વારા વાર્ષિક રૂ. ૬૦ લાખની ચોઘ્યી આવક મેળવતા વડોદરાના જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત



બદલાતા હવામાનમાં હાઈબ્રીડ નેપીયર, આફિકન ટોલ મકાઈ, મલ્ટીકટ સુંદિયા જીવારની ખેતી દ્વારા વાર્ષિક ૬૦ લાખની આવક કરતાં કરજણ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત

હાઈબ્રીડ નેપીયર ધાસનું ૧.૫ થી ૩ ફૂટ લંબાઈ ધરાવતા અને દરેક દંડામાં ૩ થી ૪ આંખ રહે તે પ્રમાણે કટિંગ કરી તેની રોપણી કર્યા પછી નીકપાળા પદ્ધતિ અપનાવવાથી ધાસનું વધુ ઉત્પાદન મળે છે.

- नाम : पिंगवाडा, ता. करजण, जि. वडोदरा
- वीधे ४,००० मण घासचारानु थतुं उत्पादन :
एक मणना सरेराश ३. १५ नो भाव मणतां पिंगल वाडाना खेडूतनुं वार्षिक ८० लाख रुपियाना लीला चारानुं वेचाण :
- भर्य : वार्षिक ३. ३० लाख
- अपनावेली कृषि टेक्नोलोजी : बदलाता हवामानमां कपास, शेरडी जेवा रोकडिया पाकोने बदली घासचारानी भेती द्वारा आवकमां कांति सर्जता वडोदरा जिल्हाना प्रगतिशील खेडूत
- घासचाराना पाको :

 - मल्टीकट बाजरी
 - मल्टीकट जुवार
 - हाईब्रीड नेपीयर घास
 - आफ्किन टोल मकाई
 - सुबाबुल कठोणयुक्त झोडर

- वावेतर छेठगनो विस्तार : १५० वीधा जमीनमां उपर जणावेला घासचाराना पाकोनुं वावेतर
 - ५० एकरमां हाईब्रीड नेपीयर
 - १० एकरमां मल्टीकट जुवार, आफ्किन टोल मकाई, मल्टीकट बाजरी, सुबाबुल वगेरे घासचाराना पाक
- वावेतरनी पद्धति : आइतिमां दर्शाव्या प्रमाणे गजराज घासना राढाने उ फूटना कटकाने बे गांठो बहार रहे तेम २' x २' अंतरे (बे छोड वऱ्ये) राखी रोपडी करवाथी तेमજ भलामण मुजब पियत अने खातर व्यवस्थापन करवाथी घासचारामांथी वधु उत्पादन मेणवी शकाय छे. १० फूटनी ऊंचाई थाय त्यारे हाईब्रीड नेपीयर घासनुं वर्षमां उ वर्खत कटिंग करवामां आवे छे. दरेक कटिंग पछी खातर व्यवस्थानुं सारुं मेनेजमेन्ट करवाथी हाईब्रीड नेपीयरमांथी वधु उत्पादन मेणवी शकाय छे.
- उत्पादन : सारी मावजूत द्वारा वर्षे एक वीधामांथी ४,००० थी ४,५०० मण उत्पादन मेणवी शकाय छे.
- भाव : हाईब्रीड नेपीयर घास १५ थी २० रुपिया २० किलोना भावथी वेचाय छे. पशुपालको तेमना माणसो लावीने कटिंग करीने लर्ह जाय छे.
- कुल आवक : १५० वीधामांथी कुल ३. ६०.०० लाखनी आवक
- कुल भर्य : १५० वीधामां कुल भर्य ३. ३०.०० लाख
- योग्यी आवक : ३. ६०.०० लाख (१५० वीधामांथी)

खेडूतनो अनुभव :

- बदलाता हवामानमां पाकनी फेरबदली करीने कपासनी भेतीनी जग्याए सुधारेला घासचारानी भेती द्वारा आवकमां धरभम वधारो करी शकाय.
- पशुपालन व्यवसायमां दूधाणा जनवरोने सवार, बपोर अने सांज सूका चारा साथे लीलो चारो (६० : ४०) आपवाथी दूध-उत्पादनमां वधारो करी शकाय छे.
- घासचारानु भार्कट स्थानिक छोवाथी पशुपालको जाते भेतरमां आवी पाकनी जात प्रमाणे २० किलोना ३. १५ थी २० ना भावे भेतर बेठा घासचारो कापीने लर्ह जाय छे ऐ मोटी सुविधा कहेवाय.

બદલાતા હવામાનમાં બાગાયતી પાકોનું નુકસાન ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો :

કૃષિક્ષેત્ર પાકોની સરખામણીમાં બાગાયતી પાકો ભારતના કૃષિવિકાસ દરમાં અગત્યનો ભાગ ભજવે છે. બદલાતા હવામાનમાં તેનું ઉત્પાદન વધારવા માટે નીચે દર્શાવ્યા પ્રમાણેનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી એની ઉત્પાદકતામાં વધારો કરી શકાય તેમ છે.

- (૧) બદલાતા હવામાનમાં બાગાયતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરવા માટે કૃષિના તમામ પાકોનું કાર્યક્ષમ સંરક્ષણ
- (૨) કુદરતી ઝોતો દ્વારા જમીન, જળ અને પવન દ્વારા નિયંત્રણ
- (૩) જળનું વૈજ્ઞાનિક ભલામણ અભિગમ દ્વારા સંરક્ષણ
- (૪) વધુમાં વધુ જાડોનું પ્લાન્ટેશન અને ડીફોરેસ્ટેશન પ્રક્રિયાનું કાયદાથી આરક્ષણ
- (૫) બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારવા/બાગાયતી પાકના કૃષિ કાર્યો અને અધ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી
- (૬) બાગાયતના અધ્યતન સાધનોનો ઉપયોગ કરવાથી
- (૭) અધ્યતન એઓપ્રોસેસિંગ અને વેલ્યુ એડીશન ટેક્નોલોજી અપનાવવાથી
- (૮) અધ્યતન માર્કેટિંગ પદ્ધતિ અપનાવવાથી
- (૯) વધુમાં વધુ ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પોલી હાઉસ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન. હવામાનની વિપરીત પરિસ્થિતિ જેવી કે વધુ ઠંડી, વધુ ગરમી અને વધુ વરસાદની પરિસ્થિતિમાં આનો ઉપયોગ કરવાથી ફળ, ફૂલ અને શાકભાજીના પાકોનું વધુ પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
 ૧. દ્રાક્ષ જેવા ફળ પાકોમાં રૂટસ્ટોકને માઈકોરાઇઝાની ટ્રીટમેન્ટ આપી રોપણી કરવી જોઈએ.
 ૨. ચીકુ અને રાયણનો રૂટસ્ટોક ઉપયોગ કરી કલમો બનાવવી જોઈએ.
 ૩. કેળાને ટ્રોયકોડર્મા ફૂગની માવજત આપી ટિસ્યુકલ્બર પ્લાન્ટ/ગાંઢોને રોપતા પહેલા અડધો કલાક ટ્રીટમેન્ટ આપી રોપણી કરવી જોઈએ.
 ૪. દરેક ખાડામાં વર્મિકલ્મોસ્ટ, જિસમનો ઉપયોગ કરી કલમની રોપણી કરવી જોઈએ.
 ૫. લીંબુ વર્ગના પાકોમાં કાગદી લીંબુની જાતની પસંદગી કરી રોપતી વખતે કલમને ટ્રોયકોડર્મા ફૂગના દ્રાવકણમાં બોળી ૧૫ મિનિટ પછી રોપણી કરવી.
 ૬. લીંબુ વર્ગના પાકમાં દર વર્ષે નવા ફુટેલા મૂળની જાળને કાપી નાંખી મૂળ વિસ્તારમાંથી દૂર કરવી.
 ૭. દાડમ, બોર, નાળિયેરી, ખજૂર જેવા ક્ષારપ્રતિરોધક બાગાયતી પાકોની વાવેતર માટે પસંદગી કરવી.
 ૮. પિયતમાં ટપક તથા કુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી આવી જમીનોમાં ખારાશનું પ્રમાણ નિયંત્રિત કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
 ૯. સેન્ટ્રિય અને એસેન્ટ્રિય મલ્ટ્ય, લીલો પડવાશ વગેરે પદ્ધતિ અપનાવવાથી જમીનના ઉપરના ભાગમાં જમા થતા ક્ષારોને અટકાવી શકાય છે.

બદલાતા હવામાનની ભાગાયતી પાકો ઉપર થયેલી અસરો :

૧. વાતાવરણમાં વધુ ઉષ્ણતામાનને કારણે સૂર્યપ્રકાશ દ્વારા વધુ ફેરફાર થયો નથી જેને કારણે સૂર્યપ્રકાશથી સંવેદનશીલ પાકોમાં પરિપક્વતા વહેલી આવી જાય છે.
૨. વધુ ગરમીને લીધે પરાગરજ બળી જવાની વિપરીત અસરને કારણે ફૂલોમાં તથા ફળ બેસવામાં એબોસન વિપરીત અસર જોવા મળે છે.
૩. વધારે ઉષ્ણતામાનને કારણે બટાટાના પાકમાં બટાટાની બેસવાની પ્રક્રિયામાં વિલંબ જોવા મળે છે, જ્યારે ટામેટાના પાકમાં ગુણવત્તા ઉપર માઠી અસર જોવા મળે છે. ગરમીને કારણે એન્થોસાયનીની ઉત્પાદન ઉપર વિપરીત અસર જોવા મળે છે.
૪. દરિયાકિનારાની પદ્મીના વિસ્તારમાં દરિયાથી અંતરિયાળ ભાગમાં વધુ જવાથી ત્યાં ખારાશ વધવાના પ્રશ્નો વધુ પ્રમાણમાં ઉપસ્થિત થયેલા જોવા મળે છે.

(૧) નાળિયેર (Coconut) :

- સતત સૂક્ષ્મ દુકાણને કારણે નાળિયેરીના પાકમાં ત લાખ નાળિયેર વર્ષ સુધીમાં ખરી પડે છે.
- પ્રતિ હેક્ટરે ઉત્પાદનમાં ૩૫૦૦થી વધારે પરિપક્વ નાળિયેરનો ઘટાડો જોવા મળે છે.
- નાળિયેરીના પાકને બદલાતા હવામાનમાં સાયકલોનને લીધે ઉત્પાદનમાં ગંભીર નુકસાન થાય છે.
- વાતાવરણ બદલાવને લઈને કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને લીધે નાળિયેરીના પાકમાં બાયોમાસ/વનસ્પતિક વૃદ્ધિનું પ્રમાણ/જનનીક ભાગોની સરખામણીમાં વધુ જોવા મળે છે. એટલે કે નાળિયેરનું ઉત્પાદન ઘટવા પામ્યું છે.
- હવામાનમાં ઊંચા તાપમાનના કારણે નાળિયેર સોપારી/Checunut અને કોકો/Coco ના પાકમાં ફોટો સિન્થેસીસના પ્રમાણમાં ઘટાડો થયો છે અને ઉપરના ત્રણે પાકમાં Total Dry Matterના ઉત્પાદનમાં વધારે, મધ્યમ અને સાધારણ પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે.

(૨) સોપારી :

- સંશોધન કેન્દ્ર ખાતે થયેલા સંશોધન ઉપરથી જાણવા મળે છે કે સોપારીના પાકમાં બદલાતા હવામાન અને અનિયમિત વરસાદના કારણે સોપારી બેસવા (Fruit Setting) ઉપર ગંભીર વિપરીત અસર જોવા મળે છે.
- સોપારીના પાકમાં ઉત્તમ ફળ બેસવા માટે સામાન્ય રીતે શિયાળામાં (૧૫ - ૨૦) °C સુંકું હવામાન, રાત્રે સાધારણ ભેજનું પ્રમાણ હોય ત્યારે ભરપૂર માત્રામાં ફૂલો બેસે છે.
- સોપારી ઊંચા ઉષ્ણતામાને ૩૪.૪૦ °C અને બપોર < ૨૦ °C પછી ઓછા હવામાનમાં ઓછો ભેજ થવાથી ફૂલો ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
- સોપારીના પાકમાં વર્ષ દરમ્યાન આક્સિમિક વરસાદ અને હવામાનમાં વધુ ભેજ હોય તો રોગ અને જીવાત વધારે આવે છે. આને કારણે ફળ બેસવામાં મોટો ઘટાડો નોંધાય છે, જેને લીધે ઉત્પાદનમાં ૫૦ થી ૬૫ ટકા ઘટાડો જોવા મળે છે.

(૩) મરીમસાલાના પાકો ઉપર થતી અસરો :

- આ પાકો મુખ્યત્વે રાજ્યાની અને ગુજરાતમાં શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે. શિયાળાની ભારે ઠંડીમાં અને હીમ પડવાને લીધે જીરું, ધર્ભાં, નાઈજેલા, અજમાના ઉત્પાદન ઉપર ગંભીર અસર જોવા મળે છે અને કેટલીક વખત સંપૂર્ણ પાક કરા પડવાને લીધે નાશ પામે છે. દા.ત. જીરું અને ઈસબગુલ સંપૂર્ણપણે નાશ પામે છે.

(૪) ફૂલોના પાકો ઉપર થતી અસરો :

હિમાલય જેવા ઠંડા પ્રદેશમાં થતા શોભાના ફૂલ છોડ જેવા કે Rhododen dro, Orchid, Tulia, Al (Tomerg, Moynolia, Su(Area, Impatient, Nurcissus) બરફ ઓગળવાના સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી ફૂલો આવવાનો સમય શરૂ થાય છે.

(૫) આંબળા : (Aonla - Emblica Offcinalis)

આંબળાના પાકનું આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ છે. તેમાં પોલી ફીનોલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે એસ્ફોરબીક એસિડનું ઓક્સિડેશન ઓદ્ધું કરે છે, જેથી આંબળામાં વિટામિન ‘સી’ ભરપૂર માત્રામાં હોય છે. (૬૩ ગ્રામ/ ૧૦૦ ગ્રામ) આંબળાનો પાક રાજ્યસ્થાન અને ગુજરાત જેવા સૂકા અને અર્ધસૂકા પ્રદેશમાં વાવવાની ભલામણ છે કે જ્યાં વધુ ઉત્પાદન અને ગુણવત્તા ઉચ્ચ પ્રકારની જોવા મળે છે. વાતાવરણમાં જ્યારે કરા પડે છે ત્યારે તેની વિપરીત અસર ચીકુના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર જોવા મળે છે.

ગ્રાફર ટેડ છોડ ઉપર હીમની વધુ અસર થવાથી તેમાં રીકવરી માટેની તકો ઘણી ઓછી જોવા મળે છે. આંબળાના આંખથી ચડાવેલા છોડ ઉપર હીમની ગંભીર અસર જોવા મળે છે.

- આંબળામાં હીમ પડતાં પહેલાં પરિપક્વ અવસ્થામાં આવી જાય છે અને એને લીધે વધુ ઉત્પાદન આપે છે.
- આમળાની લેટ વેરાયટીમાં પરિપક્વતા મોડી આવવાથી આવા આમળાની લેટ જતોમાં હીમની અસરો તેના ફૂલમાં જોવા મળે છે.
- આવાં આમળાં ફૂલો કલરમાં સફેદ દેખાવા લાગે છે.
- એમાંથી ફળ ઉપર પાણી નીકળતા (Oozing Effect) જોવા મળે છે.
- એની ડાળીઓ સૂકી અને કાળી પડી જાય છે.
- આમળાં છોડની વૃદ્ધિ અને વિકાસ હીમ પડવાને લીધે નબળા જોવા મળે છે જેને લીધે આવા છોડ ઉપર ફળ અને ફૂલ આવવા ઉપર અસર જોવા મળે છે.
- અતિ તીવ્ર ગરમીમાં આમળાનો છોડ નાશ પામે છે.

(૬) બોર (Zizipus Mauritiana)

- બોર એ સામાન્ય રીતે સૂકા પ્રદેશનો ફળ પાક છે. આ પાક સૂકા પ્રદેશમાં ખૂબ સારી રીતે આર્થિક ઉત્પાદન આપતો પાક છે. તેના ફળ ખૂબ ખૂબ મીઠા લાગતા હોવાથી તેને સૂકા પ્રદેશના ‘અપલ’ તરીકે ઓળખવામાં આવે છે.
- બોરનું જાડ ઓછામાં ઓછા ૪ °C અને વધુમાં વધુ ૪૨ °C ઉષ્ણતામાનમાં સારી રીતે વિકાસ પામી ઉત્પાદન આપતો પાક છે.
તેના બીજાનું સ્ક્રોણ/Germination થવા ઉષ્ણતામાનની જરૂરિયાત રહે છે.
- બોરમાં વાતાવરણમાં ઉપર ૦°C થી વધારે ઉષ્ણતામાન હોય ત્યારે ફળ બેસવામાં ગંભીર અસર થાય છે, જે બોરની જાત પ્રમાણે તીવ્ર થાય છે.
- ગરમીથી સંવેદનશીલ બોરની જતોમાં પાંડડાં, ફળ ડાળીઓ અને એની કેનોપીના વિસ્તારમાં ૪૦% ઘટાડો જોવા મળે છે.
- હિમ/Frostથી બોરના પાકમાં વધુ નુકસાન થાય છે, જેને લીધે બોર ચીમળાઈ જાય છે અને બદામી રંગના કલરમાં ફેરફાર જોવા મળે છે અને પાછળથી તે હિમ પડવાને લીધે કાળા રંગના થઈ જાય છે.

- બોરમાં હીમની માઠી અસરની રિકવરી ઝડપથી આવે છે, જેને લીધે હીમ પડ્યા પછી બોરમાં વાનસ્પતિક વૃદ્ધિ સારી થાય છે. તેમનું કાર્બોહાઇડ્રાટ્સ મેટાબોલિઝમ સારું થવાથી વાનસ્પતિક અને જનનીક વૃદ્ધિ સારી જોવા મળે છે.
- હીમ પડવાથી ફૂલ આવવાની પ્રક્રિયા અને ફળ બેસવાની કિયા ઉપર ખરાબ અસર જોવા મળે છે. ફળ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી સપેટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વિલંબથી જોવા મળે છે અને છેલ્લે ઓક્ટોબર મહિના સુધી ફૂલ ખરી પડવાને લીધે ઘટાડે ઉપ-૪૦% નોંધાયો છે.

(૭) દાડમ : (Pomegranate - Punica Granatum)

- સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં દાડમ એ ટેબલ માટેની કેટેગરીમાં આવતું સ્વાહિષ અને ઉત્તમ ગુણવત્તાયુક્ત હાઈલી એન્ટી ઓક્સિડન્ટ ધરાવતું ફળ છે. આથી જ્યાં દુકાળ પડતો નથી એ પ્રદેશના અમૃત ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- દાડમનો રસ લેપ્રસીના દર્દને સાજી કરવામાં વધુ અસરકારક જણાયો છે.
- ફળનો વધુ ઉપયોગ જાડા અને ઉલટી થતી હોય તેવા દર્દની ઉપર વધુ અસરકારક જોવા મળે છે.
- દાડમનો છોડ ૧૦-૩૫ °C ડિગ્રી ઉષ્ણતામાનમાં સારી રીતે ઉછરી શકે છે.

દાડમમાં વાતાવરણની વિપરીત અસરો :

- ઓછા ઉષ્ણતામાનની દાડમના પાક ઉપર વિપરીત અસર જોવા મળે છે.
- ICDqFrostની દાડમના નવા છોડ, પાન ઉપર ખરાબ અસર જોવા મળે છે.
- હીમને લીધે દાડમના પાકના વિકાસ અને ફૂલના ઉત્પાદનમાં ભારે ઘટાડો/નુકસાન જોવા મળે છે.
- હીમ પડવાના ૨ થી ૩ દિવસમાં દાડમના છોડ ઉપરથી તમામ પાંદડાં જમીન ઉપર ખરી પડે છે. આખો છોડ પાંદડાં વગરનો દેખાય છે.
- વધુમાં હીમને લીધે દાડમના નવા છોડ ઉપર નવા પીળાનું પ્રમાણ ઘટે છે અને નવા પીળા નાશ પામે છે.
- હીમ પડી ગયા પછી છોડ ઉપરથી બધાં ૪ પાંદડાં ખરી પડે છે. અને ત્યાર બાદ આ દાડમના છોડનો વધુ વિકાસ થાય છે અને તેના ઉપર ફળ અને ફૂલ વધારે બેસે છે.

વધુ ગરમીની ફળ પાકો ઉપર અસરો : (Effects of temperature on Fruit Crops)

- વધુ ગરમીને કારણે આ બાગાયતી પાકો જલદીથી પરિપક્વ થવાની અસર જોવા મળેલ છે. દા.ત. લીંબુ, દ્રાક્ષ, તરબૂચ અને સક્કરટેટીના પાકો ૧૫ દિવસ વહેલા પરીપક્વ થાય છે.
- સ્ટ્રોબેરીમાં વેલા વધુ થવાની / વાનસ્પતિક વૃદ્ધિ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને લીધે ફળોના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે.
- દાડમ અને સ્ટ્રોબેરીના ફળ પાકોમાં ડોરમન્સી પીરિયડ ઝડપથી બ્રેક થવાથી વૃદ્ધિમાં અને વિકાસમાં ઘટાડો જોવા મળે છે.
- (૮) લીંબુ વર્ગના પાકોમાં ચોમાસું મોંસું થવાની ઘટના, વર્ષાંગતુમાં સૂકો પીરિયડ આવતાં અને ફળ આવવાની અવસ્થાએ કરા પડવાથી ફળ પાકમાં બેરિંગમાં ફળ અને ફૂલમાં ફંગસના રોગોનું પ્રમાણ વધવાથી ફળની ગુણવત્તા, ફળ ફાટી જવા, ફળમાં કાળાશ પડવી, ફળ ખરી જવાં જેવાં જટિલ પ્રશ્નોને લીધે ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે.

૮. વાતાવરણમાં બદલાવને લીધે કેળાના પાક પર વધુ ઉષ્ણતામાનને કારણે, પાણીની ખેંચ થવાથી અથવા વધુ વરસાદને કારણે વોટર લોગિંગના / વધુ પાણી ભરવવાના પ્રશ્નો ઊભા થયેલા જોવા મળે છે.
૧૦. ઊંચા તાપમાનને લીધે સફરજનના પાકમાં સન બર્ન ઈફેક્ટના પ્રશ્નો જોવા મળે છે.
૧૧. ઊંચા તાપમાને ટામેટો અને રોંગણની ગુણવત્તા ઘટવાને કારણે એના સારા બજાર ભાવ મળતા નથી. કેટલીક વખત આ બન્ને શાકભાજુના પાકમાં ૫૦ થી ૬૦% ઉપરના ફળો ગ્રેડિંગ કરતી વખતે ફેંકી દેવા પડે છે.

ટેબલ : એ બાયોટીક - સ્ટ્રેસની સામે ફળપાકોની ભલામણ કરેલી પ્રતિકારક જાતો

| ક્રમ | પાક | જાત | પ્રતિકારક જાત |
|------|---------|--------------------------------|------------------|
| ૧. | દાડમ | રૂબી | સુકારા પ્રતિકારક |
| ૨. | અનાનસ | અક્સિસાન | સુકારા પ્રતિકારક |
| ૩. | અંજીર | દેન્ના અને એક્સેલ | સુકારા પ્રતિકારક |
| ૪. | દ્રાક્ષ | હોળીડિ | ક્ષાર પ્રતિકારક |
| ૫. | કેરી | બખ્ખાકાઈ | ક્ષાર પ્રતિકારક |
| ૬. | લીંબુ | રંગપુર અને કલીઓપત્રા મેન્ડ્રીન | ક્ષાર પ્રતિકારક |

સંદર્ભ : બોડી અને મિત્રા (૧૯૯૬)

૧૨. રાજસ્થાનમાં આવેલા બિકાનેરના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવેલા સંશોધન કેન્દ્ર પરથી જાણવા મળ્યું છે કે હીમ પદ્ધા પદ્ધી આમળાં, ફાલસા, બોર, સરગવાની શિંગો, ફણસ/અંજીરના ફળો હીમને લીધે વધુ પ્રભાવિત થાય છે અને તેની ગુણવત્તા પર માઠી અસર જોવા મળે છે. જ્યારે દાડમ અને ચીકુ ઉપર હીમની મધ્યમ અસર જોવા મળે છે. ખારેક હીમ પ્રતિકારક ફળની જાત હોવાથી કોઈ ખરાબ અસર એના ઉપર જોવા મળી નથી.

બાગાયતી પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાના મુખ્ય કારણો :

૧. સમયસર અને યોગ્ય તબક્કે ફળો અને શાકભાજી પાકોની લણણી થતી નથી.
૨. ખેડૂતો પાસે ફળો અને શાકભાજુના પાકોના સલામત સંગ્રહ માટે કોલ સ્ટોરેજની પૂરતી સુવિધા નથી.
૩. ફળ અને શાકભાજી પાકોની લણણી કર્યા પદ્ધી સફાઈ, ગ્રેડિંગ, પેકિંગ, ટ્રાન્સપર્ટેશન અને માર્કેટિંગ સમયસર કરવામાં આવતું નથી.
૪. ખેડૂતો હજુ પણ વચ્ચેટિયા/ખાનગી વેપારીઓ દ્વારા માલનું વેચાણ કરે છે.
૫. વરસાદ, માવઢા, હીમ, વધુ ગરમી (Heat Wave – Cold Wave) અપૂરતા પાક-સંરક્ષણ એટલે રોગ અને જીવાત નિયંત્રણનો અભાવ.
૬. પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજીના જ્ઞાનનો અભાવ હોવાથી ખેડૂતો વધારે ઉત્પાદન અને પોષણક્ષમ ભાવ મેળવી શકતા નથી.

પાકની લણણી કર્યા પછી જુદા જુદા ફળ અને શાકભાજના બાગાયતી ઉત્પાદનમાં થતો સરેરાશ ઘટાડો (%)

| ક્રમ | પાકનું નામ/ ફળપાકો | પોસ્ટ હાર્વેસ્ટિંગ કર્યા પછી ફળ પાકોમાં થતો ઘટાડો | ક્રમ | પાકનું નામ/ ફળપાકો | પોસ્ટ હાર્વેસ્ટિંગ કર્યા પછી ફળ પાકોમાં થતો ઘટાડો |
|------|-----------------------|---|------|-----------------------|---|
| ૧. | કેરી | ૩૦% | ૮. | ઝુગળી | ૨૫% |
| ૨. | ચીકુ | ૨૨% | ૯. | ટામેટો | ૩૧% |
| ૩. | કેળા | ૩૦% | ૧૦. | કોબીજ | ૨૮% |
| ૪. | જામફળ | ૧૫.૫૦% | ૧૧. | ફલાવર | ૨૨.૫૦% |
| ૫. | પાપૈયા | ૨૪% | ૧૨. | ગુવાર | ૨૭.૫૫% |
| ૬. | બોર | ૧૬% | ૧૩. | મરચા | ૨૦% |
| ૭. | બટાટા | ૨૮.૫૦% | ૧૪. | ભીડા | ૨૧% |

અગાઉ જણાવેલી કાર્યપદ્ધતિ અપનાવવાથી આ ઘટ ઓછી કરી શકાય છે અને ખેડૂતની આવકમાં વધારો કરી શકાય છે. પરંતુ આ માટે દરેક તબક્કે ધ્યાન રાખવું જરૂરી છે.

બાગાયતી પાકોનું વ્યવસ્થાપન (Management of Horticulture Crop in saline and alkaline condition) :

ખારી અને ભાસ્મિક જમીનોમાં ક્ષાર પ્રતિકારક બાગાયતી પાકો જેવા કે ખારેક, નાળિયેરી, સોપારી જેવા પાકોની ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ.



ખારી જમીનમાં આદર્શ બારાહી ખારેકની ઉત્તમ ખેતી પદ્ધતિ

આબોહવામાં બદલાવની દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક ઉપર થયેલી વિપરીત અસરો :



દક્ષિણ ગુજરાતમાં કેરીની વિવિધ જાતોની ખેતી પદ્ધતિ

(૧) નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે થયેલા અભ્યાસ ઉપરથી જાણવા મળે છે કે,

- ઉષ્ણતામાનથી આંબામાં ફૂલ આવે ત્યારે હવામાનમાં રાત્રિનું ઠંકુ વાતાવરણ એટલે કે ૮૦-૧૫૦ સેલ્બિયસ અને દિવસનું તાપમાન ૨૦૦ સેલ્બિયસ હોય ત્યારે આંબાના પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે.
- જો તાપમાનમાં ફેરફાર થાય અને ૭૦ થી ૧૦૦ સેલ્બિયસ સુધી નીચું ઉષ્ણતામાન ૫ થી ૬ દિવસ રહેતો ફૂલ બેસવાની સારી શરૂઆત જોવા મળે છે. આવા સમયે પુષ્પગુચ્છમાં નર ફૂલોની સંખ્યા વધારે પ્રમાણેમાં જોવા મળે છે.
- વધુમાં એવું જણાયું છે કે, વધારે ઉષ્ણતામાન ફૂલોમાં જાતીય પરિવર્તનના પ્રમાણ ઉપર પણ અસર કરેથી.
- જો ઉષ્ણતામાન ૧૦૦ સેલ્બિયસ થી ૧૫૦ સેલ્બિયસ વચ્ચે રહેતો હરમેફલોરાઈડ (પુષ્પગુચ્છમાં નર અને માદા ફૂલો)નું પ્રમાણ સમતોલ રહેવાથી કેરી બેસવાનું પ્રમાણ/ફૂટ સેટિંગ આ ઉષ્ણતામાનમાં વધુ રહેણે છે.

(૨) ઉષ્ણતામાનની પરાગનયનની કિયા ફળ બેસવા / Fruit setting ઉપરની અસર :

- તાપમાન જ્યારે 25° સેલ્સિયસ હવામાન રહે તો આંબામાં ફૂલનીકરણનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
- પોલન નળીનો વિકાસ (Pollan tube) ઉષ્ણતામાન 15° સેલ્સિયસ રહે તો પૂરેપૂરો થતો નથી.
- હવામાનમાં તાપમાન 15° સેલ્સિયસ થી 18° સેલ્સિયસ તાપમાન વચ્ચે રહે તો એ કેરીના ફળ બેસવામાં અનુકૂળ રહેતું નથી અથવા કેરીએ ફાલ આ સમયે ઓછો બેસે છે.
- નીચા ઉષ્ણતામાને ફૂલોનું ડીફોરમેશન થાય છે અને પરાગરજ જીવંત રહેતી નથી.
- 14° સેલ્સિયસથી નીચા ઉષ્ણતામાને ગત્થિશયમાં ફલીનીકરણ થતું નથી.
- 14° સેલ્સિયસથી નીચું તાપમાન હોય ત્યારે આંબા ઉપર મોર/ફૂલોનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે જ્યારે પુષ્પગુચ્છમાં કેરીએ વધુ પ્રમાણમાં બેસતી જોવા મળે છે.

(૩) તાપમાનની કેરીના વિકાસ ઉપર થતી અસરો (Effect of temperature on fruit development) :

સંશોધનનાં પરિણામો ઉપરથી જાણવા મળ્યું છે કે, ખૂબ વધારે અને ખૂબ ઓછું ઉષ્ણતામાન એમ બંને પરિસ્થિતિ નિર્માણ થવાને લીધે કેરીના વિકાસમાં નકારાત્મક અસર જોવા મળે છે.

- 12° સેલ્સિયસથી 22° સેલ્સિયસ તાપમાને કેરીના ફૂલનો સારામાં સારો વિકાસ થાય છે. આ તાપમાનથી ઓછું અથવા વધારે તાપમાન રહે તો કેરીના ફળ વટાણાની સાઈઝના હોય ત્યારે બીજ બેસતા નથી તેમજ પાછળથી પીળા કલરના થઈ ખરી પડવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

(૪) ક્રમોસમી વરસાદની આંબાની કેરી પર થતી અસર :

ફૂલ આવવાના સમયે જો આક્રિસ્મિક વરસાદ/કરા પડે તો હીટ વેવ/કોલ વેવ વગેરેની જોવા મળતી વિપરીત અસરો નીચે મુજબ છે :

- આક્રિસ્મિક વધુ વરસાદ આવવાને લીધે આંબાના પાકમાં ફૂલોમાં પોલીનેશનના પ્રમાણમાં વધુ ઘટાડે જોવા મળે છે અથવા તો ફૂલના ગુચ્છમાંથી પરાગરજ ધોવાઈ જાય છે જેને લીધે ફૂલ બેસવામાં ઘટાડે જોવા મળે છે.
- કાળી ફુગના ઈન્ફેક્શનની અસર જોવા મળે છે.
- માર્ચ મહિનામાં આક્રિસ્મિક વરસાદ આવે તો આંબાના ફૂલ અને કેરીમાં ફુગને લીધે કાળાશની અસર જોવા મળે છે.

ચીકુનું પોસ્ટ હાર્વેસ્ટિંગ કરી વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ દ્વારા વધુ આવક :

1. ચીકુનું પોસ્ટ હાર્વેસ્ટિંગ કર્યા પછી એગ્રો પ્રોસેસિંગ અને વેલ્યુએડિશન દ્વારા તેના ભાવમાં વધારો કરી શકાય છે તેમજ નફાનું ધોરણ વધુ મેળવી શકાય છે. સાથે સાથે ગ્રાહકને ગુણવત્તાયુક્ત માલ પૂરો પાડી શકાય છે.
2. ચીકુનું મૂળ વતન દક્ષિણ અમેરિકા માનવામાં આવે છે. ભારતમાં અનું સૌ પ્રથમ ખાન્દાન મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.
3. પોષણની દણિએ વાત કરીએ તો ચીકુમાં તમામ પોષક તત્ત્વો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી ફળ પાકોમાં તેનું વિશેષ મહત્વ છે.

ચીકુના પોસ્ટ હાર્વેસ્ટિંગ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા :

(૧) ચીકુની સંપૂર્ણ પરિપક્વ અવસ્થા થાય ત્યારે તેનું હાર્વેસ્ટિંગ નીચેની પદ્ધતિથી કરવું જોઈએ :

૧. હાથથી તોડીને
૨. વાંસની વેડકીથી તોડીને
૩. વાંસ ઉપર બાંધેલી આંકડીથી પ્લાસ્ટિક અથવા કાથીથી ગૂંઘેલી વેકડી મારફત મોટે ભાગે કરવામાં આવે છે.
૪. હાર્વેસ્ટિંગ કરતી વખતે ચીકુના ફળને યાંત્રિક ઈજથી નુકસાન ન થાય એ ધ્યાનમાં રાખી ફળનું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ.
૫. ચીકુના ઝડપ ઉપરથી ચીકુ જમીન પર નીચે ન પડે તેની કાળજ લેવી જોઈએ
૬. કલર, સાઈઝ વગેરે મુદ્દા ધ્યાનમાં લઈ ચીકુના ફળનું પરિપક્વ સ્ટેજ આવે ત્યારે હાર્વેસ્ટિંગ કરવું જોઈએ.
૭. હાર્વેસ્ટિંગ કરેલા ચીકુના ફળને પ્રિક્લુલિંગ ચેમ્બરમાં રાખી ભલામણ મુજબ ૧૦° સેલ્સિયસ ઉષ્ણતામાને ૮ કલાક પ્રિક્લુલિંગ કરવાથી ચીકુના ફળની શેર્ડ લાઈફમાં બે થી ત્રણ દિવસનો વધારો થઈ શકે છે અને ગુણવત્તાનું ધોરણ પણ જળવાઈ રહે છે.
૮. પાકેલા ચીકુના સારા ભાવ મળે તે માટે દરેક ફળને ટિસ્યુ પેપરથી વાંટાળી દઈ-ઢાંકી દઈન/રેપિંગ કરી સ્ટેન્ડર્ડ એજન્સી અથવા સંસ્થા મારફત એનું વેચાણ કરવાથી ખેડૂત મિત્રો વધુ ભાવ મેળવી શકે છે.
૯. નિકાસના ધોરણો અપનાવી નિકાસ કરવાથી ખેડૂત મિત્રો લોકલ માર્કેટ કરતાં વધુ ભાવ મેળવી શકે છે.
૧૦. હાર્વેસ્ટિંગ કરેલા ચીકુને વેન્ટિલેટેડ બોક્ષમાં રેપિંગ કરી સારા પ્લાસ્ટિક બોક્ષમાં પેક કરી વેચાણ માટે સુવ્યવસ્થીત ટ્રાન્સપોર્ટેશન દ્વારા માર્કેટમાં મોકલવા જોઈએ.
૧૧. ચીકુને કદાપિ કંતાનના કોથળા કે ગની બેગમાં ભરી માર્કેટમાં ન મોકલવા જોઈએ.
૧૨. ચીકુને કોલ સ્ટોરેજમાં રોગથી મુક્ત કરવા માટે હાર્વેસ્ટ કરેલા ચીકુના ફળને બાવીસ્ટીન (૦.૧%) ઈમાઝલીલ, (૦.૧%) બાવિસ્ટાન અને (૦.૧%) બેનલેટની માવજત વધુ અસરકારક છે. જીબ્રેલીક એસિડથી (૨૦૦ મિલિ/લિટર) ચીકુના વજનમાં ઘટાડો/ફળનો બગાડ નથી થતો. ફળ પર કરચલી ન દેખાય અને ફળનો ભરાવદાર દેખાવ વગેરેની કાળજ જીબ્રેલીક એસિડની માવજતથી થાય છે.

પેકિંગ (Packing) :

- બ્રાઉન કલરના ૩ ફોલ્ડવાળા CFB બોક્ષમાં પેકિંગ લોકલ માર્કેટ માટેની સરળ પદ્ધતિ છે, જ્યારે ૫ ફોલ્ડ CFB બોક્ષનો ઉપયોગ લાંબા અંતરે આવેલા માર્કેટ માટે પેકિંગમાં કરવામાં આવે છે.
- પ્રિક્લૂલ ચીકુને ૧.૦% વેન્ટિલેટરવાળી LDPE બેગમાં પેક કરવાથી CFBBને લીધે ૪ થી ૫ દિવસની શેર્ડ લાઈફ વધારી શકાય છે.

સ્ટોરેજ (Storage) :

- ચીકુના ફળનું હાર્વેસ્ટિંગ કર્યું પછી કોલ સ્ટોરેજની અંદર ૧૦ થી ૧૨° સેલ્સિયસ ઉષ્ણતામાને ૮૦ થી ૮૫% રીલેટીવ ડિયુમિડિટી હેઠળ એનો બે મહિના સુધી સંગ્રહ કરી શકાય છે.
- ચીકુના ફળનું મીણ દ્વારા વેક્સિન કરવાથી ફળમાં રહેલા પાણીના લોસને નિયંત્રણ કરી તેની શેર્ડ લાઈફમાં વધારો કરી શકાય છે.

એગ્રોપ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન :

- ચીકુ ઉપર પ્રોસેસિંગ દ્વારા જામ, જેલી, સૂકી ચીભ્સ, સ્લાઈસ, પાઉડર, ઇન્સ્ટન્ટ મીલ્શેક પાઉડર બનાવી એનું વેલ્યુએડિશન કરી એની માર્કેટ વેલ્યુમાં વધારો કરી ઊંચા બજાર ભાવ મેળવી શકાય છે.
ચીકુની જેતીની પદ્ધતિ સુધારીને અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી એનું વધારે ઉત્પાદન મેળવી શકાય છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગ સમસ્યા ઉકેલી એના લીધે થતો બગાડ અટકાવી શકાય તેમ છે.

ચીકુના પાકમાં પોસ્ટ હાર્વેસ્ટિંગ કર્યા પછી મૂલ્યમાં વધારો થવા બાબત :



ચીકુનું પરિપક્વ અવસ્થાએ હાર્વેસ્ટિંગ કરવું તથા તૈયાર થયેલા ચીકુને વાંસની વેડકી, હાથથી તોડીને અથવા દોરીથી ગૂંઘેલ વેડકીથી હાર્વેસ્ટિંગ કરવું જોઈએ.



ચીકુની પરિપક્વ અવસ્થાએ ફળના વિકાસ માટે પોષકતત્વો અને સમયસરનું પિયત મહત્વનું પરિબળ



ચીકુનાં ઘટાદાર ફળથી લદાયેલું જાડ



ચીકુનું સ્લાઈસ દ્વારા પરીક્ષણ

બાગાયતી પાકોમાં રૂટ સ્ટોકનું મહત્વ વધારે ઉત્પાદન માટે અગત્યનું અંગ/ફાયદા :

૧. દ્રાક્ષ જેવા ફળપાકોમાં રૂટસ્ટોકને માઈકોરાઇઝ ફૂગની ટ્રીટમેન્ટ આપી રોપણી કરવી જોઈએ.
૨. ચીકુ જેવા પાકમાં રાયશનો રૂટસ્ટોક ઉપયોગ કરી કલમો બનાવવી જોઈએ.
૩. કેળાને ટ્રાયકોડર્મા ફૂગની માવજત આપી ટિસ્યુકલ્બર પ્લાન્ટ/ગાંઠોને રોપતા પહેલા અડધો કલાક ટ્રીટમેન્ટ આપ્યા પછી તેની રોપણી કરવી જોઈએ.



બદલાતા હવામાનમાં / સૂક્ષ્મ અને અર્ધ સૂક્ષ્મ વિસ્તારમાં સફળ રીતે ઉત્પાદન આપતો અંજરનો પાક

૪. આંબામાં દેશી ગોટલા પહેલેથી રોપી એનો રૂટ સ્ટોક તરીકે ઉપયોગ કરવાથી નૂતન કલમ દ્વારા આંબાવાડિયાનું આયુષ્ય વધે છે. ગ્રાફટિંગની કલમો કરતાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
૫. કલમી બોરમાં, ગુલાબમાં, ગુંડાના પાકમાં આંખ કલમ દ્વારા વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
૬. દરેક ખાડામાં વર્મિકન્ફોસ્ટ, જિલ્સમ અને તળાવની નવી મારીનો ઉપયોગ કરી કલમની રોપણી કરવી જોઈએ.
૭. લીંબુ વર્ગના પાકોમાં કાગદી લીંબુની જાતની પસંદગી કરી રોપણી વખતે કલમને ટ્રાયકોડર્મા ફૂગના દ્રાવશમાં બોળી ૧૫ મિનિટ પછી રોપણી કરવી.
૮. આંબાની વાડીમાં ગ્રાફટેડ કલમો કરતાં નૂતન કલમ એમ બોરમાં ગ્રાફટેડ કલમો કરતાં આંખ કલમનો ઉપયોગ કરી લાંબા ગાળા સુધી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
૯. લીંબુ વર્ગના પાકમાં દર વર્ષે નવા ફુટેલ મૂળની જાળને કાપી નાંખી મૂળ વિસ્તારમાંથી દૂર કરવી અને છાણિયું ખાતર, વર્મિકન્ફોસ્ટ, ટ્રાયકોડર્મા જાડની ઉમર પ્રમાણે ભલામણ કરેલી માત્રામાં જુલાઈ માસમાં આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
૧૦. દાડમ, બોર, નાળિયેરી, ખજૂર જેવા ક્ષારપ્રતિરોધક બાગાયતી પાકોની વાવેતર માટે પસંદગી કરવી.
૧૧. પિયતમાં ટ્પક તથા ફુવારા પદ્ધતિનો પોટ ઈરિગેશન (દૂધી, કારેલી જેવા પાકોમાં) ઉપયોગ કરવાથી આવી જમીનોમાં ખારાશનું પ્રમાણ નિયંત્રિત કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
૧૨. સેન્ટ્રિય અને અસેન્ટ્રિય મલ્બ્ય, લીલો પડવાશ વગેરે પદ્ધતિ અપનાવવાથી જમીનના ઉપરના ભાગમાં જમા થતા ક્ષારોને અટકાવી શકાય છે. જમીનમાં નિંદામણ, જીવાત તથા રોગનું સરળતાથી નિયંત્રણ કરવાથી છોડને વધુ બેજ મળવાથી એનો સારો વિકાસ થાય છે.

પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણો

પાકમાં બદલાવ કરી બદલાતા હવામાનમાં નખત્રાણા (કચ્છ)માં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા એપલ મેન્ગોની ખેતીમાંથી યુવાન ખેડૂતે હેક્ટર દીઠ ૧૨૫ થી ૧૩૦ ક્રિકિન્ટલ ઉત્પાદન મેળવ્યું.



૧. નામ : યશવંતસિંહ રાઈડ

સરનામું : ગામ - બારડોલી, તા. નખત્રાણા, જિ કચ્છ

૨. અભ્યાસ : ડિલ્ફોમા ફાર્મસી

૩. ખેતી પદ્ધતિ :

૧. કેન્યામાં થતી એપલ મેન્ગો કેરીનું કચ્છમાં પ્લાન્ટેશન કરી અન્ય આંબાની જાતો કરતાં વધુ ઉત્પાદન મેળવ્યું.
૨. ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરી બાગાયત ખેતી પદ્ધતિ અપનાવી છે.

૪. વાવેતર હેઠળનો વિસ્તાર :

૧. એપલ મેન્ગોનું એક એકરમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું.
૨. અન્ય જાતો જેવી કે કેસર, આપ્રિલી, હાઇસ, બદામ અને જમ્બો કેસરનું ૮ એકરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
૩. અન્ય બાગાયતી પાકોમાં અંજર, લીચી, મોસંબી, આમળા, અળસી વગેરે પાકોનું પ્લાન્ટેશન કર્યું છે.

૫. ઉત્પાદન : કેસર આંબાની અન્ય જાતોનું ઉત્પાદન ૫૦ થી ૬૦ ક્રિકિન્ટલ / હેક્ટર મળે છે, જ્યારે એપલ મેન્ગોનું ઉત્પાદન ૧૨૫ થી ૧૩૦ ક્રિકિન્ટલ, લગભગ ઉબલ ઉત્પાદન મેળવ્યું છે અને એપલ મેન્ગો કેરી અન્ય જાતો કરતાં ૨૫ થી ૩૦ દિવસ વહેલી પાકતી હોવાથી તેના બજાર ભાવ વધુ મળે છે.

૬. કુલ આવક : એક ઝડ દીઠ રૂ. ૧૦૦૦ x ૨૫૦ ઝડ = રૂ. ૨,૫૦,૦૦૦

૭. ખેતી ખર્ચ : રૂ. ૫૦,૦૦૦

૮. ચોખ્ખી આવક : રૂ. ૨ લાખ

બદલાતા હવામાનમાં અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે કાગદી લીંબુની બાગાયત ખેતી તથા આધુનિક ટેક્નોલોજીના સમન્વય દ્વારા સારી આવક મેળવી.



૧. નામ : મકનભાઈ ભીજુભાઈ જાવિયા

સરનામું : ગામ - સાંકડિયા, તા. જિ. અમરેલી

૨. અપનાવેલી કલાઈમેટ સ્માર્ટ ટેક્નોલોજી : કાગદી લીંબુની બાગાયતની સુધારેલી ખેતી પદ્ધતિ

૩. અપનાવેલી સુધારેલી પદ્ધતિ : જાત : કાગદી લીંબુ

૧. વાવેતરનું અંતર : ૨' x ૨'ના ખાડા ખોડી લીંબુના રોપાનું ૨૦' x ૨૦'ના અંતરે હેક્ટારે ૨૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું. રોપણી પહેલા દરેક ખાડા દીઠ ૧ કિલો કહોવાયેલું છાણિયું ખાતર, ૨૫૦ ગ્રામ દીવેલીનો ખોળ, ૧૦૦ ગ્રામ ડી.એ.પી. માટીમાં મિક્સ કરી ખાડા તૈયાર કરી પછી કાગદી લીંબુના રોપાની રોપણી કરવામાં આવી હતી.
૨. શરૂઆતમાં નીક પિયત આપવામાં આવ્યું. ત્યાર પછી લીંબુના દરેક ઝડની ૨૫૬ પદ્ધતિએ સિંચાઈ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની ભારે કાળી જમીનમાં પષેયાની અધતન ખેતી દ્વારા હેક્ટારે રૂપિયા ૮ લાખની આવક મેળવતા સુરત જિલ્લાના નવ યુવાન પ્રગતિશીલ ખેડૂત દિલીપસિંહ બહાદુરસિંહ દેસાઈ

૧. અપનાવેલી સુધારેલી પાક પદ્ધતિ : પષેયાની વૈજ્ઞાનિક ખેતી અને રતાળુની આંતરપાક પદ્ધતિ

૨. નામ : દિલીપસિંહ બહાદુરસિંહ દેસાઈ

સરનામું : ગામ - આંબોલી, તા. કામરેજ, જિ. સુરત, (મો. ૮૪૨૬૮ ૮૩૮૦૮)

૩. ખેતી પદ્ધતિની ટૂંકી વિગત :

૧. વાવેતરનો વિસ્તાર : ૧ હેક્ટર
૨. વાવેતરનું અંતર : ૬' x ૬' (બે છોડ અને બે પષેયાના છોડ) કુલ છોડની સંખ્યા ૧૨૦૦
૩. આંતરપાકનું નામ : રતાળુ
૪. સરેરાશ ઉત્પાદન રૂ. ૧૦૦ / ઝડની દીઠ
૫. કુલ આવક : રૂ. ૧૦૦ x ૧૨૦૦૦ ઝડ = રૂ. ૧,૨૦,૦૦૦૦
૬. ખેતી ખર્ચ : એક છોડ દીઠ રૂ. ૧૦૦ x ૪૦૦૦ છોડ = રૂ. ૪,૦૦,૦૦૦
૭. ચોખ્યી આવક : રૂ. ૮ લાખ / હેક્ટર

પાકમાં બદલાવ કરીને બદલાતા હવામાન, સૂકા હવામાનમાં પાટણ જિલ્લાના ખેડૂતે દાડમની બાગાયત ખેતી દ્વારા રૂ. ૪૨ લાખની આવક મેળવી શિક્ષિત નવ્યુવાનોને રોજગારીનો નવો રાહ ચિંધ્યો.

૧. નામ : ભરતકુમાર રામજીભાઈ પટેલ

સરનામું : ગામ - ખલીપુર, તા. જિ. પાટણ

૨. અપનાવેલી અધતન પદ્ધતિ : બાગાયતી પાકોમાં દાડમની વૈજ્ઞાનિક ખેતી

૩. આંતર પાક : શરૂઆતનાં ગ્રાણ વર્ષમાં તેમણે દાડમની વચ્ચે દેશી ગુવાર-ગુજરાત અને સવાની ખેતી કરી હતી.

૪. અપનાવેલી પદ્ધતિ : પાટણના પટેલ ભરતકુમાર રામજીભાઈ નામના એક તબીબે તાલુકાના ખલીપુર ગામની પોતાની ૨૬ વીધા જમીનમાં દાડમની ખેતીની કમાણીમાંથી ૨૦ ટકા છિસો આપવાની શરતે સતીષભાઈ નામના એક ઉત્સાહી યુવક સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેમણે ૫૦૦૦ દાડમના રોપા રૂ. ૧૨ના ભાવે નાસિકથી લાવી દાડમની ખેતી કરી હતી.

દાડમની ખેતીમાં ગ્રીજા વર્ષ ઉત્પાદન શરૂ થાય છે, જેમાં છોડ દીઠ ૬ થી ૭ કિલો ઉત્પાદન મળે છે. રોપણીના ચોથા વર્ષ છોડ દીઠ ૧૨ થી ૨૫ કિલો ઉત્પાદન શરૂ થતાં હરિયાણા અને દિલ્હીના વેપારી ખેતરમાં આવીને કિલોના રૂ. ૭૦ થી ૧૨૦ ચૂકવી રૂ. ૪૨ લાખના દાડમ લઈ ગયા હતા.

૫. કુલ આવક : રૂ. ૮૮ લાખ

૬. કુલ ખર્ચ : રૂ. ૩૮ લાખ

૭. ચોખ્યી આવક : રૂ. ૫૦ લાખ

બદલાતા હવામાનમાં ભંડારિયા ગામ (કાવડધામ), તા. ગોડલના ખેડૂત વિજયકુમાર નટવરલાલ ચાંદરાણીએ દાડમની બાગાયતી ખેતીમાં બદલાવ કરીને રૂ. ૫૭ લાખની ઊંચી આવક સૌરાષ્ટ્રના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેળવી... ધન્યવાદ પ્રગતિશીલ ખેડૂતને



સૌરાષ્ટ્રના ગોડલ તાલુકાના ખેડૂત વિજયકુમાર નટવરલાલ ચાંદરાણીએ દાડમની આદર્શ ખેતી અપનાવી બદલાતા હવામાનમાં / સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં સફળ ટેક્નોલોજી દ્વારા રૂ. ૫૭ લાખની વાર્ષિક આવક મેળવી.

૧. નામ : વિજયકુમાર નટવરલાલ ચાંદરાણી

સરનામું : મુ. ભંડારિયા (હાવડાધામ), તા. ગોડલ,

સંપર્ક : મો : ૮૮૭૬૦ ૭૭૭૮૯

૨. અપનાવેલી ઈનોવેટિવ ખેતીપદ્ધતિ :

૧. દાડમની ખેતીમાં વાવેતર પદ્ધી ૪ મહિને કટિંગ કરવું.
૨. રોપણી પદ્ધી ફૂલ બેસે ત્યારે - ૧ વર્ષમાં તુ વખત કટિંગ કરવું.
૩. દર ૧૫ દિવસે ફૂલ તોડવા જરૂરી છે કે જેથી છોડનો ઝડપી વિકાસ થાય.
૪. છત્રી આકારનું ઝડપ વધારે ઉત્પાદન આપે છે.
૫. રોપણી પદ્ધી ૧૪ મહિને ઉત્પાદન આપે છે.
૬. દાડમના દુ વર્ષના એક ઝડપ પાછળ ખર્ચ ૧૦૦૦ રૂપિયા જેટલો થાય છે.
(ખાતર, મજૂરી, કન્સટિંગ ચાર્જ વગેરે)
૭. દુ વર્ષ પદ્ધી દાડમનું ઝડપ સરેરાશ ૧૦ થી ૧૨ કિલો ઉત્પાદન આપે છે.
૮. બગીચામાં કુલ ૬૦૦૦ ઝડપનું વાવેતર કરવામાં આવ્યું છે.
૯. દાડમના છોડની રોપણી કરી ખેડૂતે બાગાયત ખાતાની સબસિડી મેળવી છે.

ઉત્પાદન : ઝડપ ૬૦૦૦ x ૧૨ કિલો સરેરાશ ઉત્પાદન દુ વર્ષ પદ્ધી મળે છે.

ચોખ્ખી આવક : રૂ. ૫૭.૬૦ લાખ

●

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરી તરબૂચની ખેતી દ્વારા ભર્યું જિલ્લાના વાલિયા તાલુકાના ગીમજર ગામના ખેડૂતે કાન્ટિકારી પગલું ભરી નવો ચીલો પાડી ખેતી પાકમાં એક હેક્ટરમાં તરબૂચની ૮૦ દિવસના ટૂંકા ગાળાની ખેતી દ્વારા રૂ. દુ લાખની ચોખ્ખી આવક મેળવી.

૧. નામ : શ્રી રણધીરસિંહ હરસિંહ આડમાર

૨. ઉંમર : ૨૮ વર્ષ

૩. અપનાવેલ નવીન ખેતી : તરબૂચની વૈજ્ઞાનિક ખેતી

૪. અપનાવેલી પાક પદ્ધતિ : શેરડી ૧૮ મહિના સુધીનો લાંબાગાળાનો પાક હોવાથી એને બદલે તરબૂચની ૮૦ દિવસની ટૂંકાગાળાની ખેતી અપનાવી હતી. તેમણે સાત ફૂટ પહોળાઈના બેડ બનાવી ચાસની વચ્ચે ફ્રીપ નાંખી તેમજ ચાસમાં પ્લાસ્ટિકથી મલ્ટિગ્રાહ પદ્ધતિ વાવેતર કર્યું હતું. બે છોડ વચ્ચે તુ ફૂટનું અંતર રાખ્યું હતું. એક હેક્ટરમાં કુલ રૂ. ૩૫,૦૦૦ નો બિયારણ ખર્ચ થયો હતો તેમજ એને ધરૂ બેગમાં ઉછેરવાનો ખર્ચ રૂ ૧૦,૦૦૦ થયો હતો. તેમણે ૧૫ દિવસના તૈયાર ધરના છોડની રોપણી કરી હતી.

૫. કુલ ખર્ચ : હેક્ટરે રૂ. ૪૫,૦૦૦ કર્યો હતો.

૬. ચોક્કી આવક : રૂ. ૩.૦૦ લાખ દિવસના ટૂંકા સમયમાં મેળવી છે.

એમનું કહેવું છે કે શેરડીના પાક કરતા વર્ષમાં તરબૂચના બે પાક દ્વારા હેક્ટરમાંથી વધુ આવક મેળવી શકાય છે.

બદલાતા હવામાનમાં સક્કરટેટીની અધતન ખેતી દ્વારા એક એકર વિસ્તારમાંથી ૮૦ દિવસમાં રૂ. ૨.૦૦ લાખની ચોખ્ખી આવક મેળવતા રમાકાન્તભાઈ પટેલ, જિ. તાપી

૧. નામ : શ્રી રમાકાન્ત પટેલ

સરનામું : ગામ - બહુરૂપા, તા. નિઝર, જિ. તાપી

૨. અપનાવેલી ઈનોવેટી ખેતી પદ્ધતિ : તેમણે સક્કરટેટીની ખેતી-જાત - કુંદરન (નોન્યુ બીજ કંપની) ૪ એકર વિસ્તારમાં કરી હતી. એમાં તેમણે છાણિયું ખાતર ૧૦ ટન/એકર ડિ.એ.પી. ૫૦ કિલો અને પોટાશ ૫૦ કિલો નાંખીને ગાડી કયારા બનાવ્યા પછી તેમાં ટપક સિંચાઈ માટે પાઈપ ગોઠવી તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ પાથરી (સિલ્વર પોલિથીનનું મલ્ટિગ) દેવામાં આવ્યું. સક્કરટેટીના પ્લગ નર્સરીમાં તૈયાર કરેલા એક મહિનાનાં છોડ, જેમાં બે હાર વચ્ચેનું અંતર સાત ફૂટ અને બે છોડ વચ્ચેનું અંતર એક ફૂટ રાખ્યું હતું. છોડના સારા વિકાસ માટે દસ દિવસના ગાળામાં ૧૮:૧૮:૧૮ અને ૧૨:૩૨:૧૬ ખાતર છોડ વાવ્યા પછી ૪૫ દિવસ સુધી ટપક સિંચાઈ સાથે આપવામાં આવ્યું અને ૨ મહિના પછી ૧૩:૦:૪૫, ૦:૫૨:૩૪ અને ૦:૦:૫૦ (૧૫ કિલો/દરેક ખાતર) ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ હપ્તામાં ટપક સિંચાઈ સાથે આપ્યું હતું. મેળેશિયમ સલ્ફેટ (૧૦ કિલો/એકર) અને સૂક્ષ્મતત્ત્વો જેમ કે ઝીંક સલ્ફેટ, બેરોન બે થી ત્રણ હપ્તામાં ટપક સિંચાઈ સાથે આપ્યું હતું. આ બધું કરતાં સક્કરટેટીમાં ૬૦ થી ૬૫ દિવસમાં ફૂલ આવ્યા હતા અને ૭૫ થી ૮૦ દિવસમાં ફળ ઉતારવા માટે તૈયાર થઈ ગયા હતા.

ઉત્પાદન અને કુલ આવક : તેમણે સક્કરટેટી ઉતારીને મુંબઈ વાશી માર્કેટમાં મોકલીને પ્રતિ કિલો રૂ. ૧૮ જેટલો ભાવ મેળવ્યો હતો અને એમને ૧ એકર વિસ્તારમાં ૧૫ ટન ઉત્પાદનની સામે કુલ રૂ. ૭૦,૦૦૦ પ્રતિ એકર ખર્ચ (જમીનની તૈયારી, બિયારણનો ખર્ચ, સિલ્વર પ્લાસ્ટિકનું આવરણ, ખાતર-વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને ઉતાર્યા પછીનો ખર્ચ) થયો હતો અને કુલ આવક રૂ. ૨,૨૭,૦૦૦ મળી હતી.

ચોખ્ખી આવક : સક્કરટેટીની ખેતી કરવાથી માત્ર ૮૦ દિવસમાં રૂ. ૨,૦૦,૦૦૦ જેટલો ચોખ્ખો નફો મેળવ્યો છે.

●

બાયોટેકનોલોજીના અધતન ઉપયોગ દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવતા ખેડૂત મિત્રો :

- (૧) બદલાતા હવામાનમાં ટિસ્યુ કલ્બ્યર પ્લાન્ટ / બાયોટેકનોલોજીના અધતન ઉપયોગ દ્વારા કેળના પાકમાંથી વડોદરા જિલ્લાના આદિવાસી પદ્ધીના નવયુવાન ખેડૂતે રૂ. એક લાખ દસ હજારની આવક મેળવી.

૧. નામ : રાઠવા મોતેસિંગભાઈ

સરનામું : ગામ-ધુણવડ, પો. ધુટીય, તા. પાવીજેતપુર, જિ. વડોદરા

૨. ઉંમર : ૩૫ વર્ષ

૩. લાભાર્થીને આપેલી કૃષિ સામગ્રી : કેળ-ટી-છના ટિસ્યુકલ્બ્યર છોડ સંખ્યા : ૧૩૭૦

૪. લાભની ટૂંકી વિગત : ‘જીવિકા’ કાર્યક્રમ અંતર્ગત વોલેન્ટીયર ભાઈઓ દ્વારા રજિસ્ટ્રેશન કરી લાભાર્થીને કેળના ટિસ્યુકલ્બ્યર પ્લાન ૭ સંખ્યા : ૧૩૭૦ આપવામાં આવ્યા અને કેળની ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિ જેમાં રોપણી, ખાતર આપવું, આંતરખેડ, પીલા કાઢવા, પાળા ચઢાવવા વગેરે અંગે તાલીમ અને એમના જ ખેતરમાં પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું. કેળની લૂમ ૧૫ મહિને તૈયાર થાય ત્યારે કેળનો છોડ જમીન પર ઢળી પડે નહિ એ માટે લાકડાનો ટેકો આપવાની માહિતી તેમજ ખેતરમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આના પરિણામે કેળની દરેક લૂમ સરેરાશ ૨૫ થી ૨૭ કિલોગ્રામની જોવા મળી હતી. છોટાઉદેપુર, જિ. વડોદરા અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતે એક એકરમાંથી રૂ. ૧,૧૦,૦૦૦નું ઉત્પાદન મેળવ્યું છે. આ અનુભવ લઈને બીજા વર્ષે પણ ટિસ્યુકલ્બ્યર પદ્ધતિથી કેળની ખેતી પદ્ધતિ અપનાવી છે.

શાકભાજીના પાકોનો વિસ્તાર અને ઉત્પાદન :

શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો નંબર ચીન પછી બીજો આવે છે. દુનિયાના કુલ ઉત્પાદનમાં ૧૫ ટકા ઉત્પાદન ભારત દેશમાં થાય છે. ભારતમાં ૬.૨ મિલિયન વિસ્તારમાંથી કુલ ૮૦ મિલિયન ટન ઉત્પાદન થાય છે. ભારતમાં મુખ્યત્વે બટાટા, કંગળી, ટામેટાં, રીગણા, કોબીજ, ફુલાવર, ટોડેરા, કારેલા, ગલકાં, તુરિયાં, દૂધી, પરવળ, કંકોડા, રતાણું, ગુવાર, ચોળી વગેરે શાકભાજીના મુખ્ય પાકો છે.

શાકભાજીનું પોષકતત્ત્વોની દાખિએ મહત્વ :

શાકભાજી તંદુરસ્તીની દાખિએ ખોરાકમાં મિનરલ્સ, પ્રોટિન્સ, કુદરતી તેલો, ફેટ, સર્કરા વગેરે અગત્યના પોષકતત્ત્વો પૂરાં પાડે છે, જેથી પુખ્ત વયની દરેક વ્યક્તિએ ૪૦૦ ગ્રામ/ક્લરી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે ખાસ જેવું ૪૩રી છે. શાકભાજી મુખ્યત્વે ખનિજતત્ત્વો અને પ્રોટિન્સ, ફેટ તેમજ સર્કરા પૂરતાં પ્રમાણમાં લભ્ય બનાવી માણસની રોગપ્રતિકારક શક્તિ જાળવવાનું મુખ્ય કામ કરે છે.

વાતાવરણ બદલાવની શાકભાજી પાકો ઉપર થયેલી અસરો :

૧. વાતાવરણનો બદલાવ સમગ્ર દુનિયામાં તમામ પાક-ઉત્પાદનમાં ઘટાડા માટેનું પ્રાથમિક-મૂળભૂત કારણ છે. (Bray etal, ૨૦૦૦)
૨. ઊંચું તાપમાન, ટામેટાનાં ઓછા ફળો બેસવાને લીધે ટામેટાની ઉત્પાદકતામાં સાર્થક રીતે ઘટાડો, ફળોની નાની સાઈઝ અને હલકી ગુણવત્તા માટે જવાબદાર મુખ્ય કારણ છે.
૩. Sato etal ૨૦૦૦ નોંધું છે કે ઊંચા ઉષ્ણતામાનને લીધે ખાસ કરીને પરાગરજ ઉત્પાદન ઘણું જ નબણું થાય છે જેને લીધે ફળ ઓછા બેસે છે. વધારે ફળોનું ખરી જેવું, ફળોનો વધુ વિકાસ ન થવો અને પાનમાં પણ રંધ ન ખુલવા, કાર્બોહાઇડ્રેટના પ્રમાણમાં ઘટાડો થવો, વગેરે વિપરીત અસરો વધુ તાપમાનને કારણે જોવા મળે છે.
૪. કાળી માટીમાં ઊંચા ઉષ્ણતામાને પીસ્ટીલ અને સ્ટેમન જીવંત ન રહી શકતા હોવાથી પોલનટ્યુબ ખાલી રહેવાથી કાળા મરીના ફળ બેસતા નથી એટલે ઊંચાં ઉષ્ણતામાને મરીના પાકમાં ફલિનિકરણ નબણું થાય છે. એથી મરીના પાકમાં ફળ બેસતા નથી.
૫. જમીનમાં વધારે પડતા ક્ષારોની અસરને લીધે પાકમાં રસાકર્ષણ દબાણ Cosmotic Pressure ઘટે છે. વૃદ્ધિ ઓછી થાય છે. છોડ ચીમળાવા લાગે છે. પાનમાં લીફ કાલિંગ, ઓદ્ધું પ્રકાશ સંશ્લેષણ અને શાય્યોશાસની કિયામાં ઘટાડો, સેલ ઉત્પાદનમાં ઘટાડો અને પેશીઓ નીકોસીસનું પ્રમાણ વધવાથી છોડનું જલ્દીથી મૃત્યુ થાય છે. મોટા ભાગના શાકભાજીના પાકો વધારે ભજ/વરસાદની અસરથી વધુ સંવેદનશીલ બને છે.
૬. વધુ પાણીની અસરને લીધે ટામેટાના છોડમાં ઈથીલીનના પ્રમાણમાં વધારો થાય છે જેને લીધે છોડ મરી જાય છે અથવા નાશ પામે છે. (S. Drive ડ્રીવ ૧૯૭૮)
૭. સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ, હાઈડ્રોક્સાઈડ, ઓઝોન અને એસીડનો વરસાદ પડવાની ઘટના મુખ્યત્વે વાતાવરણમાં એર પોલ્યુશનની અસરને લીધે જોવા મળે છે.
૮. ઓઝોન વાયુની ઘટનાની શાકભાજીના વિકાસ-વૃદ્ધિ-ઉત્પાદન ઉપર અને ગુણવત્તા ઉપર વિપરીત અસર જોવા મળી છે.
૯. શાકભાજીના છોડનું નજીક નજીકમાં ઘાટું વાવેતર કરવામાં આવું હોય તો ત્યાં હવાના પ્રદૂષણની વધારે ખરાબ અસર જોવા મળે છે.
- દા.ત. ટામેટાં, તરબૂચ, બટાટા, સોયાબીન, વટાણા, ગાજર, બીટ, ટરનીપ ઉપર હવાના પ્રદૂષણની ગંભીર અસર જોવા મળે છે.

વિવિધ શાકભાજ્ઞા પાકો ઉપર એબાયોટીક સ્ટ્રેસની અસરો :

| ક્રમ | સહનશક્તિનો પ્રકાર | પાકનું નામ |
|------|----------------------------|-------------------------------|
| ૧. | સુકારાને પ્રતિકારક | મરચાં, તરબૂચ, ટામેટાં, ગુગળ |
| ૨. | ગરમીને પ્રતિકારક | ટામેટાં વટાણાં, વાલ, કેપ્સીકમ |
| ૩. | ક્ષારને પ્રતિકારક | તરબૂચ, વટાણા, કુંગળી |
| ૪. | વધુ પાણીની અસરને પ્રતિકારક | ટામેટાં, કુંગળી, મરચાં |

બદલાતા હવામાનની ફળ અને શાકભાજ્ઞા પાકો પર થતી વિપરીત અસરો :

૧. ફળ અને શાકભાજ્ઞા પાકોમાં બદલાતા હવામાનમાં ડોરમેન્સી પિરિયડ જલ્દીથી પૂરો થઈ જાય છે.
૨. વાતાવરણ બદલાવથી શિયાળાના વધુ ચીલિંગ/અતિ ઠંડા વાતાવરણમાં ફળોના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર નકારાત્મક અસર જોવા મળે છે. ડોરમેન્સી સમયને નિયમિત કરવા માટે પાકને માઈક્રોક્લાયમેટ પૂરું પાડવું જોઈએ એટલે કે પાકને પિયત આપવું જોઈએ.
૩. બદલાતા હવામાનમાં ઊંચા ઉષ્ણતામાનથી વધતાં ફળોની પાકવાની શક્તિ તથા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
૪. હવામાનમાં હફના પ્રમાણમાં વધારો થાય તો ફળમાં સ્થાર્યનું પ્રમાણ, દ્રાવ્ય સુગરનું પ્રમાણ, પ્રોટીન, ખનિજ તત્વોમાં ઘટાડો જોવા મળે છે, જ્યારે તૈલી પદાર્થોમાં વધારો જોવા મળે છે.
૫. ફળ અને શાકભાજ્ઞામાં ગુણવત્તાની દિશિએ જોતાં માલુમ પડ્યું છે કે ઉષ્ણતામાનમાં હફનું પ્રમાણ વધતાં ફિનોલ અને એસ્ફોરલીક એસિડના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

ઉપાય :

ઠંડી સામે પ્રતિકારક શક્તિ ધરાવતા શાકભાજ્ઞ અને ફળોની જાતોની પસંદગી કરવી જોઈએ કે જેથી ઠંડીથી થતાં નુકસાનને અટકાવી શકાય.

બદલાતા હવામાનની વિપરીત અસરો નિવારવાના ઉપાયો :

૧. વધુ ઠંડી અને વધુ ગરમી અને વરસાદનો પ્રતિકાર કરી શકે એવી જાતોની વાવેતર માટે પસંદગી કરવી.
૨. અતિ તીવ્ર ઠંડીના સમયમાં જે પાકની જાતો પાનખરની સ્થિતિમાં આવી જાય છે, તેવી ડોરમન્સીના પિરિયડવાળી ફળ/શાકભાજ્ઞની જાતોની પસંદગી કરવાથી ડોરમન્સી પિરિયડમાં એ લાંબાગાળા સુધી જાળવી શકાય છે
૩. ઠંડીના સમયમાં હીમ સામે રક્ષણ મેળવવા માટે આવા ફળ-હૂલ, શાકભાજ્ઞના પાકોને માઈક્રોક્લાયમેટનું વાતાવરણ ઊભું કરવા માટે ૨ થી ૩ દિવસના અંતરે પિયત આપવું જોઈએ.
૪. પ્રકારનો સીધો ફાયદો મેળવવા માટે જુદા જુદા પ્રકારના કલર જોવા કે પીજો, મોતી જેવો લાલ વગેરે કલરનો પાક ઉપર ઉપયોગ કરી ફળ અને શાકભાજ્ઞના પાકોનો લાંબા ગાળા સુધી સંગ્રહ કરી શકાય છે. ફળ અને શાકભાજ્ઞના પાકોમાં વધારે માત્રામાં એન્ટીઓક્સીડિન્ટનું પ્રમાણ જાળવી શકાય છે.
૫. કેમિકલની માવજત બીજ/ક્રમ/કંઇને આપવાથી ડોરમન્સી બ્રેક કરી તેની વાનસ્પતિક અને જિનેટીક વૃદ્ધિમાં વધારો કરી સારું ઉત્પાદન મેળવી શકાય છે.
૬. ફળ અને શાકભાજ્ઞને 1-MCનો ઉપયોગ/માવજત આપવાથી જ્યારે વધારે ઉષ્ણતામાન હોય ત્યારે અથવા સૂક્ષ્મ હવામાન / Heat-stress દરમ્યાન હાનિકારક અસરને ઓછી કરી શકાય છે.
૭. હાર્સેસ્ટ કરેલા ફળ અને શાકભાજ્ઞનો કોલ સ્ટોરેજમાં અથવા મિની પ્રિકુલિંગ દ્વારા સંગ્રહ કરવો જોઈએ.
૮. કોલ સ્ટોરેજમાં ફળ અને શાકભાજ્ઞનો પાકને ભલામણ કરેલી ડિશ્રી સેલ્વિસ્યસ તાપમાને સંગ્રહ કરવો જોઈએ જેથી સંગ્રહની ખરાબ અસરનું નિયંત્રણ કરી શકાય.

૮. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ દરમ્યાન હાયજન અને ક્લિનિંગનું સંપૂર્ણ ધોરણ અપનાવવાથી ફળ અને શાકભાજની શેફ્ટ લાઈફમાં વધારો કરી શકાય.
૯૦. બેડૂતોને દરરોજના ભાવતાલની માહિતી અને ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી પોસ્ટ હાર્વેસ્ટ/નુકસાન અટકાવી શકાય છે.
૯૧. પોસ્ટ હાર્વેસ્ટિંગમાં તૈયાર થયેલાં ફળ અને શાકભાજનનું કયા સમયે હાર્વેસ્ટિંગ કરવું તેની માહિતી “હવામાનની પરિસ્થિતિ” અંગેના ખાસ બુલેટિન તથા વૈજ્ઞાનિક કાર્યક્રમો દ્વારા નિયત સમયે પ્રસારિત કરવી જોઈએ.
૯૨. જુદા જુદા ફળ અને શાકભાજના પાકોનું ગ્રેડિંગ, પ્રિક્ચલિંગ, પેકિંગ, ટ્રાન્સપોર્ટેશન અને માર્કટિંગ નિયત ધોરણો પ્રમાણે કરવાથી પોસ્ટ હાર્વેસ્ટથી થતા નુકસાનને ઓછું કરી શકાય છે.
૯૩. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અંગે ખાસ ટ્રેનિંગ પ્રોગામો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ ટ્રેનિંગ નિષ્ણાત દ્વારા આપવાથી પોસ્ટ હાર્વેસ્ટિંગ પછીના નુકસાનના પ્રમાણને ઘટાડી શકાય છે.

શાકભાજના પાકોમાં પોસ્ટ હાર્વેસ્ટિંગ કર્યા પછીની અસરો :

સંશોધનથી જ્ઞાનવા મળ્યું છે કે સામાન્ય રીતે ફળ અને શાકભાજના પાકોની લાણણી/હાર્વેસ્ટિંગ કર્યા પછી ઊચાં તાપમાનમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનને લીધે નુકસાન થાય છે.

(૧) બટાટા :

હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતાં...

૧. બટાટામાં હાર્વેસ્ટિંગ કર્યા પછી એની સુગર કન્ટેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.
૨. હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવાથી માલફોરમેશની ઈફ્કટ જોવા મળે છે.
૩. હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવાથી બેક્ટેરિયલ બ્લાઇટ અને સ્કેબના રોગની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
૪. વધારે ઊંચાઈ ઉપર રાખવામાં આવતા બટાટામાં ઓઝોનની વિપરીત અસર થવાને લીધે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ અને ફેટની વૃદ્ધિ થતાં વિટામિન ‘સી’માં ઘટાડો જોવા મળે છે.

(૨) ટામેટો :

હાર્વેસ્ટિંગ કર્યા પછી ટામેટાને ઓઝોનમાં રાખવામાં આવે તો (૦.૦૦૫ થી ૧.૮ ml)તો ટામેટાના ફળમાં બી-કેરોટીન, લ્યુટેઈન અને લાયફોપીનના કન્ટેન્ટમાં વધારો જોવા મળે છે.

બદલાતા હવામાનમાં ટામેટાની ખેતીમાં સુધારેલી જાત અને ટેલિફોન પદ્ધતિનો ઉપયોગ

પાકમાં બદલાવ કરીને સુધારેલા શાકભાજ હાઈબ્રીડ ટામેટાની ખેતીપદ્ધતિ : ટેલિફોન પદ્ધતિ દ્વારા આધુનિક ખેતી કરતાં આદિવાસી વિસ્તારના ભહિલા બેડૂત શ્રીમતી ગંગાબેન



ટેલિફોન સિસ્ટમ દ્વારા હાઈબ્રીડ ટામેટાનો વધુ વિકાસ અને વધુ ઉત્પાદન + નીકપાળા પદ્ધતિનો ઉપયોગ

૧. નામ : રાઈવા ગંગાબેન બાબલાભાઈ

સરનામું : ગામ - રાજવા, તા. પાવીજેતપુર, જિ. વડોદરા

૨. અપનાવેલી ટામેટાની સુધારેલી જાત અને ખેતીપદ્ધતિ : હાઈબ્રિડ ટામેટાં-ટેલિફોન પદ્ધતિનો ઉપયોગ કરીને

૩. આપવામાં આવેલી કૃષિ સામગ્રી : ટામેટાનું બિયારણ-૪૦ ગ્રામ, યુરિયા - ૩ બેગ, ડી.એ.પી.-૩ બેગ, પોટાશ-૩ બેગ, વાયર-૮૦ કિલોગ્રામ, વાસના દંડા નંગા ૮૬૬, સુતળી-૧૦ કિલોગ્રામ, ડામર-૩ કિલોગ્રામ, ફેરોમેન ટ્રેપ ૬ નંગા.

૪. થયેલા લાભ અંગેની ટૂંકી વિગત : જીવીકા - ૩ કાર્યક્રમ અંતર્ગત વોલેન્ટિયર દ્વારા રજિસ્ટ્રેશન અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગંગાબેન બાબલાભાઈ રાઈવાને ફિલ્ડમાં જઈને સૌ પ્રથમ ટામેટાના બિયારણનાં ધરુ ઉછેર પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ રોપણી પદ્ધતિ, આંતરખેડ, પાળા ચઢાવવા, નીદણ અને ખાતર આપવાની પદ્ધતિની પગથિયાં પ્રમાણેની કામગીરીની માહિતી ફિલ્ડમાં તેમજ કલાસરૂમ દ્વારા આપવામાં આવી. ટામેટાના પાકમાં ટેલિફોન પદ્ધતિ અપનાવવા અને ઓછી મહેનતે ટેકા ઊભા કરવા માટે તેમો દ્વારા સમજ ફિલ્ડ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. ફેરોમેનટ્રેપનું મહત્વ અને તેને લગાવવાથી થતા ઉત્પાદનના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. આથી આ બેડૂતે એક એકરમાંથી કુલ ૨૪ ટન ટામેટાનું ઉત્પાદન મેળવ્યું છે. આ યોજનાથી ટામેટાના પાકમાં ટેલિફોન પદ્ધતિ દ્વારા વધારે ઉત્પાદન કેમ મેળવવું એ અંગે બેડૂતોને ચીલાચાલુ પદ્ધતિ કરતાં વધારાની જાણકારી મળી છે. વધુમાં હાઈબ્રિડ ટામેટાની જાત વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે.

૫. ટામેટાનું ઉત્પાદન/એકર : ૨૪ ટન / એકર, કુલ આવક રૂ. ૧૦ કિલો પ્રમાણે ૨૪ ટનના રૂ. ૨,૪૦,૦૦૦ પ્રતિ એકર - રૂ. ૪૦,૦૦૦ એકર દીઠ ખર્ચ.

૬. ચોખ્ખી આવક : રૂ. ૨.૦૦ લાખ એકરદીઠ

પ્રાપ્તિસ્થાન : શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, પાવીજેતપુર, જિ. વડોદરા

બેડૂતનો અનુભવ :

- આધુનિક ટેલિફોન સિસ્ટમનો વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટાં, દૂધી, ગલકાં, તૂરિયા, કાકડી વગેરેમાં ઉપયોગ કરવાથી ફળનો વધુ વિકાસ, પૂરતો પ્રકાશ, હવા, પોષક તત્ત્વો પૂરતા મળવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
- બાગાયત ખાતું ટેલિફોન સિસ્ટમ, ટપક સિંચાઈ, મલ્ટિય્યા, સુધારેલું બી ખરીદવા માટે સબસિડીની સહાય આપે છે. બદલાતા હવામાનમાં ઉષ્ણતામાનની વધુ અસરને ઓછી કરવા માટે રીંગણની ખેતીમાં છાણિયા ખાતરના ભરપૂર ઉપયોગ દ્વારા વધુ ઉત્પાદન અને વધુ આવક :
- રાજકોટ જિલ્લાના ગોંડલની રીંગણની આધુનિક ખેતી દ્વારા ૨૨ વીઘામાંથી રૂ. ૪૦ લાખની ચોખ્ખી આવક



બદલાતા હવામાનમાં વૈજ્ઞાનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીંગણની અધતન ખેતી કરતા પ્રગતિશીલ બેડૂત

- નામ : ગજેન્ટ્રસિંહ વિકમસિંહ જાડેજા
- ગામ : મેસપટ, તા. ગોડલ, જિ. રાજકોટ
સંપર્ક : મો. : ૯૮૭૯૮૩ ૬૭૭૧૮
- પાકનું નામ : રીંગણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
- અપનાવેલી પદ્ધતિ : વીધા દીઠ ૪ ટ્રેલર છાણિયું ખાતર ચાસમાં નાંખી ત' x ર'ના અંતરે ફાગણ માસ બેસતા રીંગણની રોપણી કરી હતી. તેમણે રીંગણના પાકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરેલી માવજત કરવામાં આવે તો દોઢ વર્ષ સુધી ઉત્પાદન આવે છે. તેઓ ૨૨ વીધા રીંગણની ખેતીમાં ટપક પદ્ધતિ દ્વારા પિયત આપે છે.
ઉત્પાદન : ૨૨ વીધામાંથી ૪૦૦ ટન કુલ ઉત્પાદન મળે છે.
ખાતર, પાણી, પિયત, મજૂરીનો ખર્ચ એક વીધામાં રૂ. ૫૦ હજાર ગણતાં, ૨૨ વીધામાં કુલ રૂ. ૧૧.૦૦ લાખનો ખર્ચ કર્યો છે. ખર્ચ બાદ કરતાં ખેડૂતે રૂ. ૪૦ લાખની ચોખ્ખી આવક મેળવી છે.
ચોખ્ખી આવક : રૂ. ૪૦ લાખ

ખેડૂતનો અનુભવ :

- શાકભાજની ખેતીમાં વાવણીનો સમય અને બજારની માંગ વધુ ભાવ મેળવવામાં અગત્યનો ભાગ ભજવે છે.
- રીંગણનું ફાગણ માસમાં વાવેતર કરવાથી ગરમીના સમયમાં લગ્નગાળો હોવાથી રીંગણનો ભાવ વધુ મળે છે અને અન્ય પાકોની સરખામણીમાં વધુ આવક મેળવી શકાય છે.
- રીંગણનો પાક ઉનાળામાં લેવાથી રોગ અને જીવાતનું પ્રમાણ ઓદૃષ્ટ આવે છે, જેથી ઊંચી ગુણવત્તાવાળા રીંગણનું ઉત્પાદન મેળવી શકાય છે.

બદલાતા હવામાનમાં ભીડાની ખેતીમાં આધુનિક પદ્ધતિ / કૃષિ કાર્યો દ્વારા યુનિટ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન અને આવક મેળવતા ખેડૂત રાઠવા મકાભાઈ :

બદલાતા હવામાનમાં સફળ કૃષિ ટેક્નોલોજી અપનાવી ભીડાની ખેતીમાંથી વડોદરા જિલ્લાના ખેડૂતે રૂ. ૫૮,૦૦૦ની આવક મેળવી.



- નામ : રાઠવા મકાભાઈ જલુભાઈ
- સરનામું : ગામ - પાવી જેતપુર, તા. પાવી જેતપુર, જિ. વડોદરા
- ઉંમર : ૪૨ વર્ષ
- અપનાવેલી સુધારેલી શાકભાજની પદ્ધતિ : ભીડાની સફળ ખેતી પદ્ધતિ

૩. લાભાર્થીને આપવામાં આવેલી ખેતી સામગ્રી :

સુધારેલું ભીડાનું બીજ

૧૦૦ કિલો યુરિયા - ૨ બેગ

૧૦૦ કિલો ટી.એ.પી. - ૨ બેગ

પોટાશ ૫૦ કિલો - ૧ બેગ

૪. લાભ અંગેની ટૂંકી વિગત : જીવકા - ૩ (રવિ) કાર્યક્રમ અંતર્ગત વોલેન્ટિયર દ્વારા રજિસ્ટ્રેશન અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં મકાભાઈ જલુભાઈ રાઠવાને સૌ પ્રથમ બિયારણની વાવળી પદ્ધતિ અંગે તાલીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને અંતરખેડ, નીંદણ અને ખાતર નાખવાના યોગ્ય સમય પ્રમાણેના પગથિયાંની કામગીરી અંગે ઓન ફિલ્ડ તેમજ કલાસરૂમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દ્વારા એમણે એક એકરમાંથી કુલ ૫૨૦૦ કિલો ભીડાનું ઉત્પાદન મેળવ્યું છે. તેમનો અનુભવ જોવા જઈએ તો આ બિયારણની વેરાયટી ખૂબ સારી હતી અને બજારમાં તેનો ઉપાડ સારો એવો હોવાથી કુલ રૂ. ૫૮,૦૦૦ની આવક થઈ છે.

૫. ઉત્પાદન અને આવક : ૫૨ કિલો / એકર

૬. આવક : રૂ. ૫૮,૦૦૦/- એકર

ખેડૂતનો અનુભવ :

- ભીડાનો પાક રવિ ઋતુમાં લેવાથી બજારમાં લગ્નગાળાને લીધે વધુ માંગ હોવાથી ઊંચા ભાવ મેળવી શકાય છે.
- નીક-પાળા પદ્ધતિ અને મલ્લિંગનો ઉપયોગ કરવાથી જમીનમાં ભેજનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે અને નિદામણનું નિયંત્રણ સહેલાઈથી થતું હોવાથી ભીડાનું ઉત્પાદન વધુ મળે છે.

ખંભોળજના ખેડૂતે શ્રીનહાઉસમાં કેસ્સીક્રમ મરચાની ખેતી દ્વારા રૂપિયા ૬.૬૦ લાખની કમાણી કરી.

૧. નામ : શ્રી નિરલભાઈ એમ. પટેલ

૨. સરનામું : ગામ : ખંભોળજ, તા. ઉમરેઠ, જિ. આણંદ

૩. અપનાવેલી ઈનોવેટિવ પદ્ધતિ : ખેડૂતે ૧ એકર જમીનમાં પથરાયેલા શ્રીન હાઉસમાં કેસ્સીક્રમ મરચાની ખેતી કરી રૂ. ૬.૬૦ લાખની કમાણી કરી.

ખેતીપદ્ધતિ :

૧. કેસ્સીક્રમ મરચાના લાલ, પીળા અને કેસરી રંગની પસંદગી કરી વાવેતર કર્યું હતું.
 ૨. એક એકર જમીનમાં ઓટો કલાઈમેટ અને ઓટો ફિટિંગેશનવાળું અતિ આધુનિક સગવડતાવાળું મ્યુઝિક સિસ્ટમ સહિતનું શ્રીન હાઉસ બનાવ્યું છે.
 ૩. ઈજરાયલની બિયારણ કંપનીમાંથી રૂપિયા ૧૦ એક બીજની કિંમત પ્રમાણે કુલ ૧૪,૦૦૦ બીજ લાવી તેનું શ્રીન હાઉસમાં વાવેતર કર્યું હતું.
- ઉત્પાદન : તેમણે એક એકરના શ્રીન હાઉસમાંથી ૪૦ ટન કેસ્સીક્રમનું ઉત્પાદન મેળવ્યું
- કુલ આવક : રૂપિયા ૮.૬૦ લાખની કમાણી કરી હતી, જેમાંથી રૂપિયા ૩.૦૦ લાખનો ખર્ચ બાદ કરતાં ચોખ્યી આવક રૂપિયા ૬.૬૦ લાખ મેળવી હતી.

બદલાતા હવામાનમાં કોબીજની ખેતીમાં સમયનું એડજસ્ટમેન્ટ કરી ઊંચા ભાવ મેળવતા ખેડૂત :

બદલાતા હવામાનમાં કોબીજની ખેતીમાં વાવણીના સમયમાં ફેરફાર કરી એક વીવામાંથી રૂ. 30,000ની આવક મેળવતા સૌરાષ્ટ્રના યુવાન ખેડૂત



શ્રાવણ મહિનામાં કોબીજની ખેતી કરવાથી ઓફ સિઝનને લીધે વધુ ભાવ મેળવી શકાય છે.

બદલાતા હવામાનમાં કોબીજની ખેતીપદ્ધતિમાં સમયમાં ફેરફાર કરતાં ખેતી વધુ લાભદાયી બની.

- શાકભાજની વાવણીનો સમય બજાર ભાવ માટે મહત્વનું પાસું
- ૧. નામ : રાજેશભાઈ વેલજભાઈ ચોવટિયા (મો. : ૮૮૨૪૫૧૨૦૩૮)
- ૨. વિસ્તાર : ઉ વીધા
- ૩. અપનાવેલી સુધારેલી ખેતી પદ્ધતિ :
 ૧. દાગોબીનું ૩૦ દિવસનું ધરુ થાય ત્યારે બે છોડ વચ્ચે ૧' x ૧' અંતર રાખી જમીનમાં વાવતા પહેલા ૧ વીધામાં ૨ ટ્રોલી છાણિયું ખાતર જમીનની તૈયારી વખતે તથા ૨૫ કિલો ડિ.એ.પી. રોપણી પહેલા આપી કોબીજના ૩૦ દિવસના ધરુની રોપણી કરવામાં આવી.
 ૨. રોપણીનો સમય - શ્રાવણ માસ
 ૩. પ્રથમ પિયત રોપણી પછી તરત જ અને બાકીના પિયત દ થી ૭ દિવસના અંતરે આપવમાં આવ્યા હતા.
 ૪. ફેર રોપણી પછી ૩૮ દિવસે દરો બંધાય છે અને ૪૮માં દિવસે કોબીજનો દરો તૈયાર થાય છે અને કાપણી માટે ૬૦ દિવસે દરો તૈયાર થાય છે.
 ૫. ઉત્પાદન : એક વીધામાંથી ૮ ટન જેટલું સરેરાશ ઉત્પાદન મળે એટલે કે ઉ વીધામાંથી ૨૪ ટન જેટલું ઉત્પાદન મળે છે.
 ૬. આવક : ૧ કિલોના સરેરાશ રૂ. ૫ પ્રમાણે ગણતાં ૧ વીધામાંથી રૂ. ૪૦,૦૦૦ ગણતાં ગ્રામ વીધામાંથી ૧,૪૪,૦૦૦ કુલ આવક મળે.
 ૭. ખર્ચ : ૧ વીધા ખાતર, બિયારણ પિયત તથા પાક-સંરક્ષણનો સરેરાશ ખર્ચ રૂ. ૧૦,૦૦૦ પ્રમાણે ઉ વીધામાં રૂ. ૩૦,૦૦૦નો ખેતી ખર્ચ થયો હતો.
 ૮. ચોખ્યી આવક : રૂ. ૧,૧૪,૦૦૦ આવક ઉ વીધામાંથી મળી હતી.
- ખેડૂતનો અનુભવ :
- સૌરાષ્ટ્રમાં પિયતની સુવિધા ઓછી હોવાથી કોબીજ જેવા શાકભાજના પાકની શ્રાવણ મહિનામાં વાવણી કરવામાં આવે તો વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે.

સરગવાના પાકમાં બદલાયેલા હવામાનમાં મૂલ્ય વર્ધન :

પાણીની ઓછી જરૂરિયાતવાળા શાકભાજના પાક સરગવાની ખેતી અને તેના મૂલ્યમાં વૃદ્ધિ કરી ઊંચી આવક મેળવવાનો રામબાણ ઈલાજ


મોરીન્ગા (સરગવા)નું બીજ દ્વારા તેમજ કલમ દ્વારા વાવેતર કરી શકાય.




મોરીન્ગા (સરગવા)ના ફળની સહેલાઈથી લાણણી કરી શકાય.



બજાર માટે મોરીન્ગા (સરગવા)નું પેકિંગ



મોરીન્ગા (સરગવા)ના પાંડાંની સૂકવણી



સૂકાયેલ મોરીન્ગા (સરગવા)ના પાંડાંનો પાઉડર બનાવી પેકિંગ કરવું.



મોરીન્ગા (સરગવા)ના થડ પરનો ગુંદર



બદલાતા હવામાનમાં અને જમીનની ખારાશને અનુકૂળ ખેતી/મધ્યપાલન એકવા કલ્યારલ ફાર્મિંગ,
વ્યવસાય દ્વારા સારી આવક મેળવતા ગુજરાતના ખેડૂતમિત્રો અને સંસ્થાઓ

(૧) ગણાટવી વિવિધ સહકારી બાગાયત સંધ : કેરીની બનાવટો (કેરીનો રસ, કેરીના ચીરીયા, કેરીના પાપડ, કેરીનો પાવડર વગેરે)



ચીકુની વિવિધ બનાવટો અને પરદેશમાં એની નિકાસ માટે ઘણી જ ઉજળી તકો

બદલાતા હવામાનમાં ગણાટકી વિવિધ સહકારી સંઘ એગ્રોપ્રોસેસિંગ અને વેલ્યુએડીશન દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી કેળા, કેરી, ચીકુ, શાકભાજ પાકો અને વિવિધ બનાવટો જેમ કે કેરીનો રસ, ચીકુનો રસ, કેળાની વેફર તથા તાજ ફળોના મૂલ્યવર્ધન મારફત નિકાસ માટે દાખલારૂપ કામ કરી રહેલી રાજ્યની અગ્રગણ્ય સંસ્થા છે. રાજ્યના બાગાયત વિભાગ અને રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા મદદ મેળવતી સારી આવક કરી રહેલી સદ્ગ્રહ સંસ્થા છે. બદલાતા હવામાનમાં મીઠી ખારેકની લાલ, પીળી જાતની ખેતી અપનાવી સફળ ખેતી મારફત અન્ય પાકો કરતા રૂ. ૧૩ થી ૧૪ લાખની ઊંચી આવક મેળવતું જામનગર જિલ્લાનું ખેડૂત દંપતી.



૧. નામ : નાનજલ્લભાઈ તથા વિજયાબેન અકબરી
 ૨. ગામ : મોટા વડાલા, તા. કાલાવડ, જિ. જામનગર, રાજ્ય - ગુજરાત
 ૩. જમીન : કોઈપણ પ્રકારની સારી નિતારવાળી જમીન વધારે અનુકૂળ પરંતુ દરિયાકાંઠાની ખારાશવાળી જમીન આ પાકને વધારે અનુકૂળ આવે છે.
- ઉષ્ણતામાન : ૪૦° થી ૪૫° ડિગ્રી સેલ્સીયસ અને ૫૦° ડિગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાનમાં સારો પાક લઈ શકાય છે.
 - બારાહી ખારેક : જાતની પસંદગી અને સૌરાષ્ટ્રનું હવામાન વધારે અનુકૂળ આવે છે. મીઠી ખારેક લાલ અને પીળા કલરના ફળોવાળી જાત
 - એમાં ૫૦ ટકા સબસિડી મળે છે. એક ટિસ્યુકલ્બર છોડની કિંમત ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા સુધીની હોય છે. બાગાયત વિભાગ ગુજરાત રાજ્ય એક છોડ દીઠ રૂપિયા ૧૨૦૦ની સબસિડીની સહાય ખેડૂતને આપે છે.
 - એક સરખો નાનો ઠળિયો, એક સરખી ગુણવત્તા અને ઉત્પાદન વધુ આપતી જાત છે.
- વાવેતર : ૨૦૦ રોપાનું ૭ વીધામાં વાવેતર કરવામાં આવે છે.

- રોપણીની પદ્ધતિ : ૧ x ૧ મીટરના ખાડા સાત વીઘામાં કરી તેમાં પાયાના ખાતર તરીકે ૧૦ કિલો છાણિયું ખાતર + ટ્રાયકોડર્મા + તળાવની તાજ માટી સાથે મિશ્ર કરી ખાડો ભરી ત્યારબાદ ટિશ્યુકલ્બર રોપાનું ૩૦ x ૩૦ ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે.

પિયત પદ્ધતિ :

1. ટપક સિંચાઈથી ૪ x ૪ ફૂટ અંતરે રહે તે પ્રમાણે ખેતરમાં આયોજન કરી પિયતની આધુનિક વ્યવસ્થા અપનાવવી. ૪ વર્ષના ખારેકના કુલ ૨૦૦ ઝડ્પ ખારેકની લુભ્સ સાથે ઊભા છે. સદર જેડૂત ખારેકનું વેચાણ છૂટક રીતે વાડી બેઠા કરે છે.
2. ખારેકના છોડને - ૪ વર્ષના ઝડ્પને ઉર લિટર પાણી મળી રહે તેવી વ્યવસ્થા ટપક દ્વારા ગોઠવી છે.
3. શરૂઆતમાં દરરોજ અડધો કલાક સુધી ટપક ચાલુ રાખવી અને ફળ લાગે ત્યારે ઉ કલાક ચલાવવી જરૂરી છે.
4. ખારેકના પાકને ચોમાસામાં ખાસ પિયતની જરૂરિયાત રહેતી નથી, જેથી જરૂરિયાત પ્રમાણે શિયાળા અને ઉનાળામાં પિયત આપવું.



ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં ખારેકની બારાહી જાત વધારે અનુકૂળ

3. દાડમની ખેતી સાથે મધ્યપાલનનો વ્યવસાય કરી વધારે આવક મેળવતા જામનગર જિલ્લાના નવયુવાન પ્રગતિશીલ ખેડૂત

ખેડૂતનું નામ : સંદીપ લાલજીભાઈ બુલા ઉંમર : ૨૪ વર્ષ અભ્યાસ : ૧૦ પાસ ગામ : મોટા વડાળા, તા કાલાવડ, જિ. જામનગર

| | |
|---|--|
|  |  |
| મધની પેટી | મધનો તૈયાર થયેલ પુડો |

આગાયતી પાકોમાં દાડમ અતિ મહત્વનો મોનોપોલી ધરાવતો, તદ્દન હલકી જમીનમાં સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં, ખારી જમીનમાં, પિયતની ઓછી જરૂરિયાતવાળો પાક છે. આ ગામ જામનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું છે અને ત્યાંનું પાણી પણ ખારાશને લીધે ભાભરું (સલાઈન પાણી) છે.

નાનપણાથી ખેતી સાથે મધુઉંઘરમાં રસ ધરાવતા સંદીપભાઈએ ખેતીમાં મધ્યપાલન દ્વારા કાંતિ સર્જવાનું નક્કી કર્યું છે. તેમણે મધ્યપાલનની વ્યાવસાયિક ટ્રેનિંગ વાપીમાં મેળવી હતી.

- દાડમનો વાવેતર વિસ્તાર : પાંચ વીધા/એક હેક્ટાર
- મધ્યપાલનની પદ્ધતિ : ૩૦ પેટીથી શરૂઆત કરી અને ૧૦૦ પેટી સુધી મધ્યપાલન કરવું એવા નિશ્ચય સાથે આગળ વધ્યા છે.


મધ્યપાલન પાયાની જરૂરિયાત : (Prerequisite for honeybee keeping)

1. પાણીની જરૂરિયાત તેમજ ફળ પાકો અને શાકભાજીની ખેતી આ વ્યવસાય માટે પાયાની જરૂરિયાત છે.
 2. મધુઉંઘર માટે પેસ્ટીસાઈડ દવાનો ઉપયોગ થતો હોય એવા વિસ્તારમાં મધુપેટી રાખવી નહીં.
 3. ઊનાળામાં ગરમી હોય ત્યારે મધુપેટીને ભીના કોથળા / કંતાનના કોથળાથી ઢાંકી દેવી.
 4. પાણીમાં ખોરાક માટે ૨૦૦ મિ.લી. પાણીની કોથળીમાં ૪ થી ૫ ચમચી ગ્લુકોઝ નાંખી તેમાં કાણું પાડી ઉપર રાખવાથી મધમાખી તેમાંથી જાતે ખોરાક બનાવે છે.
 5. મધુપેટીની અંદર સાત ફેમ હોય છે. રાણી કાયમ લોકેશન મુજબ ૧૫૦૦ થી ૨૦૦૦ હેડા મૂકે છે અને ખાસ સારું લોકેશન મળે તો નવી રાણી મધુપૂડાની રોયલ ક્રિન જેવી જ કિંમતી અને શક્તિવર્ધક હોય છે. અત્યારે કુલ ૩૦ પેટીમાં મધમાખી ઉંઘર થઈ રહ્યો છે.
- ઉત્પાદન : કુલ ૩૦ પેટીમાંથી ૮ મહિનામાં ૭૦ કિલો ઉત્પાદન મળ્યું છે.
 - મધમાખીને ગરમ કરતા હુંકું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે.
 - આવક : કિલો મધના રૂ. ૬૦૦ થી ૧૦૦૦ સુધીના વેચાણ કરતાં કુલ રૂ. ૫૭,૦૦૦નું વેચાણ થયું છે. વધુમાં દાડમના ૧૪૦૦ છોડની આવક. મધ્યપાલને લીધે ૧૦ ટકા દાડમનો ઉતારો વધુ મળે છે.

૪. ભાવનગરમાં વિદ્ધલભાઈ પટેલ, ૭૦ વીધામાં કલમી બોરની ખેતી દ્વારા એક વીધામાંથી રૂ. ૫૦ થી ૭૦ હજારની ચોખ્યી આવક, ખારી / ભાસ્ટિક / પડતર જમીનમાં અત્યંત અધતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેળવે રહ્યા છે. આ પ્રગતિશીલ ખેડૂત પડતર જમીનમાં અન્ય કૃષિ પાકોની સરખામણીમાં ઊંચી આવક મેળવે છે, એ સરાહનીય છે.



૫. સૌરાષ્ટ્રના પોરબંદર વિસ્તારમાં દરિયા પઢીમાં આવેલા ગણોદના ખેડૂત મહાદેવભાઈ બાગાયતી ખેતીમાં ફૂલોની વિવિધ ખેતી અપનાવી બદલાતા હવામાનમાં ખારી જમીનની અસરો હોવા છતાં આધુનિક ભલામણ મુજબની ખેતી પદ્ધતિઓ અપનાવી વર્ષે દિવસે ૬૦ વીધામાંથી રૂ. ૪૦ લાખની ઊંચી આવક મેળવે છે.





૬. ખારી જમીનમાં થઈ શકે તેવા બાગાયતી પાકો જેવા કે ખારેક, ખજૂર અને કેસર કેરી, દાડમ તથા કલમી બોરની ખેતી દ્વારા કચ્છના નભત્રાણામાં ખેતી કરતા શ્રી રાહુલ ગાલા – મિકેનિકલ એન્જિનિયર.

ખારી જમીનમાં નૂતન અભિગમ અપનાવી અધતન ખેતી કરી ખારેક, ખજૂર, અંજર, કેરી, બોર વગેરેની નિકાસ કરી સારી આવક મેળવે છે. કચ્છમાં વધુ ગરમીને લીધે દરિયાનાં પાણી જમણ દ્વારા જમીનના નીચેના સ્તરમાં જતાં બાષ્પીભવન દ્વારા કેપેલરી એક્શનથી કારો જમીનના ઉપરના ભાગમાં જમા થવાથી બાગાયતી પાક તથા પાકોની ઉત્પાદકતાને વિપરીત અસર કરી ઉત્પાદન ઘટાડે છે. ફૂલિની અધતન ટેક્નોલોજી જેવી કે મલ્ટિગ્ર, ટપક સિંચાઈ, વાવેતરની પદ્ધતિ, ક્ષાર પ્રતિકારક જાતોની પસંદગી, અત્યંત આધુનિક પદ્ધતિનો અમલ કરી સમગ્ર કચ્છ વિસ્તારમાં સારી આવક મેળવી આ ખેડૂત સમગ્ર કચ્છ વિસ્તારમાં દીવાદાંડીરૂપ સાબિત થયા છે.

શાકભાજના પાકોમાં અધતન પોસ્ટ હાર્વેસ્ટ ટેક્નોલોજીનું આવક વધારવામાં વિશેષ મહત્વ :

ફળ અને શાકભાજના પાકોમાં હાર્વેસ્ટિંગ કર્યી પછી ૩૦ ટકાનો બગાડ થાય છે જેથી કુલ વાર્ષિક રૂ. ૩૧,૪૮૬ હજાર કરોડનું નુકસાન ખેડૂત મિત્રોને થાય છે. આથી ફળ અને શાકભાજના પાકોમાં હાર્વેસ્ટિંગ કર્યી પછી નીચે દર્શાવેલા ઉદ્દેશો અધતન ટેક્નોલોજી દ્વારા પાર પાડી શકાય છે :

૧. વજનમાં ઘટાડો અટકાવી શકાય.
૨. ગુણવત્તામાં વધારો કરી શકાય.
૩. સારા બજાર ભાવ મેળવી શકાય છે.

આ માટે નીચેના વૈજ્ઞાનિક ઉપાયો ખેડૂત મિત્રોએ હાથ ધરવા જરૂરી છે :

૧. યોગ્ય પરિપક્વ અવસ્થાએ ફળ અને શાકભાજ પાકોનું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. (Harvesting Indices)

૨. હાર્વેસ્ટિંગ કર્યા પછી ફળો અને શાકભાજનું યોગ્ય સાઈઝમાં ગ્રેડિંગ કરવું જોઈએ અને યોગ્ય માવજન દ્વારા મીથાથી વેક્સિન અને ટિસ્યુ પેપર દ્વારા તેનું રેપિંગ કરી ટિસ્યુ પેપરથી સંપૂર્ણ ઢાંકી દેવા જોઈએ કે જેથી તેની શેલ્ફ લાઈફમાં વધારો કરી શકાય.
 ૩. ફળ અને શાકભાજનો બગાડ થતો અટકાવવા માટે પ્રી-કુલિંગ ભલામણ કરાયેલા તાપમાને કરી તેની શેલ્ફ લાઈફ / ટકાઉ શક્તિમાં વધારો કરવો જોઈએ.
 ૪. કોલ સ્ટોરેજમાં ફળ અને શાકભાજનો ભલામણ કરેલા ઉષ્ણતામાને સંગ્રહ કરવો જોઈએ કે જેથી કોલ સ્ટોરેજમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રિત થવાથી તેની શેલ્ફ લાઈફ અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે.
 ૫. માર્કટિંગનો સરવે કર્યા પછી અગાઉથી નિયત કરેલી એજન્સી / સંસ્થા દ્વારા ફળ અને શાકભાજનું એગ્રોપ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી બજારની સુનિશ્ચિત અધ્યતન માર્કટિંગ પદ્ધતિ દ્વારા વેચાણ કરવાથી ઊંચા ભાવ મેળવી શકાય છે.
 ૬. ફળ અને શાકભાજની નિકાસ માટે / વેચાણ માટે એરપોર્ટ / માર્કટયાર્ડમાં નિયત સમયે ફળ અને શાકભાજનું શીતવાનમાં ટ્રાન્સપોર્ટેશન કરવાની સુવિધા સારા ભાવ મેળવવા માટે અને ગુણવત્તા જાળવવા માટેનું મહત્વનું પાસું છે.
 ૭. માર્કટિંગ માટે એમ.બી.એ. કક્ષાની ફૂલિની ડિગ્રી ધરાવતા અનુભવીની સેવા તથા એમની નીચે મેળા સિટી નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે માર્કટિંગની વેચાણની ચેનલ વધુ નફો મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
- ટેક્નોલોજીના સમન્વય દ્વારા નારંગીની ખેતીમાંથી રૂ. ૮૬ લાખની ઊંચી આવક મેળવતા ખેડૂત
૭. બદલાતા હવામાનમાં નારંગી જેવા લાંબા ગાળાના બાગાયતી પાકની પસંદગી દ્વારા વાર્ષિક રૂ. ૮૬ લાખની આવક કરતા સૌરાષ્ટ્રના સૂક્ષ્મા અને અર્ધસૂક્ષ્મા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ તારપરા

૬ ચોપડી ભણોલા ખેડૂતની વાર્ષિક આવક રૂ. ૮૬ લાખ રૂપિયા



૧. નામ : રમેશભાઈ શિવાભાઈ તારપરા
સરનામું : ગામ - જગાર પીપળિયા, તા. લોઘિકા, સૌરાષ્ટ્ર
૨. અપનાવેલી પાક પદ્ધતિ :
 ૧. સુધારેલી નારંગીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
 ૨. કુલ ઝડાડ : ૮૦૦૦
 ૩. વાવેતરનું અંતર ૧૫ ફૂટ x ૧૫ ફૂટ

૪. $2 \times 2 \times 2$ ફૂટના ખાડા ઉનાળામાં કરી રોપણી પહેલા કહોવાયેલું છાણિયું ખાતર ૧ કિલો, દીવેલો ખોળ ૨૫૦ ગ્રામ અને ૫૦ ગ્રામ ડી. એ. પી. દરેક ખાડામાં માટી સાથે બેળવી જુલાઈના પહેલા અઠવાડિયામાં રોપણી કરવામાં આવી હતી.
૫. શરૂઆતમાં નારંગીના છોડનો / પાકનો વિકાસ થાય ત્યાં સુધી નીક પદ્ધતિ દ્વારા પિયત આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૦૦ વીધામાં ટ્પક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયત આપવામાં આવ્યું.
૬. નારંગીના પાકમાં શરૂઆતમાં જમીનના લેવલથી ૨.૫' ડાળીઓની ઊંચાઈ રાખી છાટણી/પ્રુનિંગ કરવામાં આવ્યું હતું.
૭. શરૂઆતમાં ૫ વર્ષ સુધી આંતરપાક તરીકે ગુવાર ગુજરાત-૧, કોબીજ, મગફળી જેવા આંતરપાક લેવામાં આવ્યા હતા.
૮. પિયત, શિયાળામાં ૧૫ દિવસે અને ઉનાળામાં ૧૦ દિવસે પિયતની જરૂરિયાત રહે છે.
૯. ખાતર : નારંગીના ઝાડ દીઠ ત્રણ વર્ષ પછી ૧૦ કિલો છાણિયું ખાતર ૧ કિલો ડા. એથી ૫૦૦ ગ્રામ યુરિયા ચોમાસાની ઋતુમાં આપવામાં આવે છે.
૧૦. ઉત્પાદન : ઉત્પાદનમાં નારંગીના પાકમાં ધંધાદારી ઉત્પાદન શરૂ થાય છે. સારું ઉત્પાદન લેવા પિયત નિયમિત આપવું મહત્વાનું છે. સાતમા વર્ષે નારંગીના ઝાડ દીઠ ૮ કિલો જેટલું સરેરાશ ઉત્પાદન મળે છે. એટલે ઝાડ દીઠ ૮ કિલો \times ૮૦૦૦ ઝાડ = ૫૬૦ મેટ્રિક ટન નારંગીનું ઉત્પાદન મેળવ્યું હતું.
૧૧. આવક : ૧ કિલોના રૂ. ૨૦નો સરેરાશ વેચાણ ભાવ ગણતાં ૫૬૦ મેટ્રિક ટનમાંથી રૂ. ૧૧૨ લાખની આવક થઈ છે.

કુલ ખર્ચ : ઝાડ દીઠ રૂ. ૨૦૦ ખર્ચ ગણતા ૮૦૦૦ ઝાડનો રૂ. ૧૬ લાખ ખર્ચ થયો છે.

કુલ આવક : રૂ. ૧૧૨ લાખ બાદ રૂ. ૧૬ લાખ ખર્ચ = રૂ. ૮૬ લાખની ચોખ્ખી આવક થઈ હતી.

ખેડૂતનો અનુભવ :

- બદલાતા હવામાનમાં મગફળી, તલ જેવા ટૂંકા ગાળાના પાકોની જગ્યાએ નારંગી જેવા બહુવર્ષયું પાકની પસંદગીથી ખેતીમાં કાંતિ
- ટ્પક સિંચાઈના ઉપયોગ દ્વારા પાણીનો, વીજળીનો અને મજૂરીનો ૧૦૦ વીધામાં બચાવ કરતા પ્રગતિશીલ ખેડૂત
- ફળ પાકોમાં નારંગીમાં ક્યારેય નીચો ભાવ રહેતો નથી આથી આવા મોનોપોલી ધરાવતા પાકની પસંદગી કરવી જોઈએ.

મૂલ્યવર્ધક અન્ન-કૃષિ ઉત્પાદનનો અભિગમ

મૂલ્યવર્ધક અન્ન-કૃષિ ઉત્પાદનનો અભિગમ બદલાતા હવામાનમાં ટકી શકે એવી કુશળ ખેતી સાથે સીધી રીતે જોડાયેલા છે. આ અભિગમ સમગ્ર કૃષિ ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે જમીનની તૈયારી, બિયારણની વાવણી, યોગ્ય ખાતરનો ઉપયોગ, દવાનો છંટકાવ, પાકની લણણી, એની સાર-સંભાળ, સંગ્રહ, વિતરણ અને છૂટક-જથ્થાબંધ વેચાણ, વપરાશ અને છેલ્લે નકામા ફાજલ પદાર્થોના કૃષિ કચરાના નિકાલની પદ્ધતિ સુધીની કામગીરી સુધારણામાં સહાયક બનવાનો છે.

આ ઉપરાંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની આ બાબત છે. તેનો હેતુ ખેડૂતને તેણે ઉત્પન્ન કરેલ પાક/દૂધ/માછલી વગેરેનું વેચાણ કરવામાં મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય અને તેની આવક વધે તે છે અને આવકમાં ઉત્તરોઉત્તર વધારો ટકાઉ રીતે થાય તે છે. આ બાબત સમગ્ર ખેડૂત કુટુંબને સ્પર્શ છે.

મૂલ્યવર્ધક સાંકળ : “એ પાકની લણણી કર્યા પછી પેદાશ બજાર સુધી મૂલ્ય વધારીને ઘટ વગર પહોંચાડવાની આ સાંકળ છે.”

“પાકની લણણી થાય ત્યાર બાદ અનાજની ચોખ્ખાઈ કરી શહેરમાં અથવા તો શહેરની પાસે તેનું વેચાણ ખેડૂતને ફાયદાકારક થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવાનો આ અભિગમ છે. તેની લાક્ષણિકતા એ છે કે એમાં સર્વેનો સમાવેશ થાય છે. જેનો અર્થ એ છે કે આ કાર્ય પદ્ધતિ મોટા ખેડૂત પૂરતી નથી પણ નાના ખેડૂતોને પણ આવરી લે છે.” સાથે વપરાશકાર, વ્યાપારી અને ઉદ્યોગપતિને અને સરકારી તંત્રને આવરી લે છે.


વાસ્તવમાં સૌથી ગરીબ ખેડૂત ઉપર તેનું ધ્યાન કેન્દ્રીત કરવાનો આ અભિગમ છે. જેથી તેઓને પણ તેમના ઉત્પાદનનું વધુ મૂલ્ય પ્રાપ્ત થાય.

સામાન્ય નાના ગરીબ ખેડૂત પાસે ઉપજનો જથ્થો ઓછો હોવાથી અને નાણાંની ભીડ હોવાથી વ્યાપારીઓ સસ્તા ભાવે તેમની પાસેથી ખરીદી કરી લે છે. તેથી તેમને સંગઠિત કરી અને ડિફાયતી ભાવ મળે તે આ વ્યવસ્થાનો મૂળભૂત અભિગમ છે.

આ કામગીરીનું અમલીકરણ સફળતાપૂર્વક કરવામાં આવે તો ખેતીના ધંધાને નફાકારકતાની દિશા તરફ લઈ જઈ શકાય, ટકાઉ વિકાસ થાય, યુવાન ખેડૂતોને ખેતી આકર્ષક લાગે, ખેતી છોડવાની જગ્યાએ તેઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધુ આવક પ્રાપ્ત કરે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં અન્ન કે ફળનું પ્રોસેસિંગ પણ સ્થાનિક રીતે કરે અને સ્થાનિક અને શહેરી બજારમાં અનાજ-ચોખા કે કેરીનો રસ સીધો વેચવા મૂકે.

આ અભિગમ ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ તમામને આવરી લે છે. તેમાં ભાગ લેનાર તમામની આવકમાં મહત્તમ વધારો થાય - ઉત્પન્ન કરેલ ઉપજનું ઉચ્ચિત મૂલ્ય મળે તેવી વ્યવસ્થા કરવાનો છે.

અન્ન-કૃષિ ઉત્પાદન સાંકળ



| | | |
|--|--|---|
| <p>-બજારની માંગ જાહેરી ઉત્પાદન કરવું.</p> <p>-ઉત્પાદનની પદ્ધતિમાં વૈજ્ઞાનિક રીત-રસમોનો ઉપયોગ કરવો.</p> <p>-લાણણીની કાર્યપદ્ધતિમાં સુધારો લાવવો.</p> <p>-લાણણી પદ્ધી બરાબર ચોખ્ખાઈ કરવી.</p> <p>-બજારનો ભાવ ઓછો હોય તો ઘરમાં કે ગોડાઉન/કોલ સ્ટોરેજમાં બાકીનો જથ્થો મૂકવો.</p> | <p>-પાકની લાણણી બાદ અનાજ, ફળ, માછલી અને અન્ય કૃષિ ઉત્પાદનને નુકસાનથી બચાવી સીધા બજારમાં તેનું વેચાણ કરવું.</p> <p>-સ્થાનિક કૃષિ બજારના ભાવો અને અન્ય બજારો સાથે સરખામણી પદ્ધી જ વેચાણ કરવું.</p> | <p>-પાકની લાણણી બાદ અનાજ, ફળ, માછલી અને અન્ય કૃષિ ઉત્પાદનને સ્થાનિક પ્રોસેસિંગ-પરીક્ષણ કરી બજારમાં તેનું સીધું વેચાણ કરવું જેથી વધુ ભાવ મેળવી શકાય.</p> <p>-દા.ત., સાફ કરેલા ઘઉં અને ચોખા</p> |
|--|--|---|

કૃષિ પેદાશોના ટકાઉ મૂલ્યવર્ધક સાંકળના માળખાના હાઈમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

| ખેતી/ ખેત-ઉત્પાદન | ગ્રેડિંગ (અલગ-અલગ વક્કલ) | પેકિંગ | પ્રોસેસિંગ (પરીક્ષણ) | બજાર | કૃષિ કચરાનો નિકાલ |
|---|-------------------------------|--|---|---|--|
| -જમીનને ખેડ કરી તૈયાર કરવી. | -ઉત્પાદનના જથ્થાની ચોખ્ખાઈ. | -ઉત્પાદનને અનુરૂપ કોથળા અથવા તો બોક્સમાં અલગ કરી તેનું પેકિંગ કરવું. | -ઉત્પાદનનું મૂલ્યવર્ધન ગામ સ્તરે કરવું. | -ખાનગી ક્ષેત્રે : ગામ કક્ષાએ આવેલ ખાનગી | -દાશા પ્રાપ્ત પદ્ધી ઉત્પાદનનો તમામ કચરો ઉપયોગ છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરવો. આમ કરવાથી ખાતર પર થતા ખર્ચમાં બચાવ થાય છે. |
| -જમીનમાં પ્રથમ વરસાદ પદ્ધી જરૂરી ભેજ ઉપસ્થિત થતા વાવણી. | - નાના-મોટા પ્રમાણે અલગ કરવા. | -મોટા અને નાના દાશા છૂટા પાડવા. | પોસેસિંગ કરી સીધું વેચાણ કરવું. | ● વ્યાપારી | ● મોટા ગામ-તાલુકાના જથ્થાબંધ વ્યાપારી. |

| ખેતી/ ખેત-ઉત્પાદન | ગ્રેડિંગ (અલગ-અલગ વક્કલ) | પેકિંગ | પ્રોસેસિંગ (પરીક્ષણ) | બજાર | કુષિ કયરાનો નિકાલ |
|---|---|---------------------------------------|---|---|--|
| -જમીનની ફળદૂપતાને લક્ષમાં રાખીને પાક પસંદ કરવો. | -અનાજમાં રહેલો કચરો ચારણાથી સાફ કરવો -નાના અને મોટા ફળો | -કાણા વગરના કોથળા, કાગળના બોક્સ વગેરે | -આ પૈકી કેટલુંક તો સ્થાનિક રીતે વેચાઈ જશે. -વધારાનું શહેરમાં વેચવા મોકલવું પડે. | -ખેત પેદાશોનું બજાર : જાહેર ક્ષેત્ર-ખેડૂતોની ઉત્પાદકોની મંડળી ● જેવી કે દુધ ઉત્પાદકની મંડળી ● વેર-હાઉસિંગ કોલ સ્ટોરેજ ● ખેત-બજાર સમિતિ ● સરકાર તરફથી નિયુક્ત કરેલ સંસ્થા -વેચાણ કરનાર ● જથ્થાબંધ વ્યાપારી ● છૂટક વ્યાપારી ● લારી-ગલ્લાવાળા -સીધી રીતે વેચાણ કરતા ખેડૂતો | અને ઉત્પાદન ખર્ચ ઘટે છે. વર્મિકમ્પોસ્ટ કરવાથી કચરા દારા વધુ ફળદૂપ ખાતર તૈયાર થાય છે. |
| -સર્ટિફાઇડ બિયારણ વાપરવું. | | | | ● વેર-હાઉસિંગ કોલ સ્ટોરેજ ● ખેત-બજાર સમિતિ ● સરકાર તરફથી નિયુક્ત કરેલ સંસ્થા -વેચાણ કરનાર ● જથ્થાબંધ વ્યાપારી ● છૂટક વ્યાપારી ● લારી-ગલ્લાવાળા -સીધી રીતે વેચાણ કરતા ખેડૂતો | |
| -જમીનમાં સોઈલ-હેલ્થ કાર્ડમાં દર્શાવ્યા પ્રમાણે : જૈવિક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ. | અલગ પેટીમાં પેક કરવાં. - મોટા ફળોની વધુ કિંમત પ્રાપ્ત થાય છે. | | | ● ઉત્પાદકોની સહકારી મંડળી. ● જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ● ગામડાઓમાંથી પેદાશો પ્રાપ્ત કરીને અને અન્ન, ફળ, શાકભાજી શહેરોમાં વેચાતા ઉધોગો દા.ત., રિલાયન્સ ફેશન ● નિકાસ કરનાર | |
| -જરૂરિયાત મુજબ જંતુનાશક દવાઓનો છંટકાવ. | | | | | |
| -જમીનની ફળદૂપતાને અનુકૂળ પાકની પસંદગી | | | | | |

મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદનનું ટકાઉપણું ત્રણ પરિણામોની સાથે સંકળાયેલું છે :

૧. આર્થિક પરિણામ :

જે પ્રત્યેક સહભાગી એટલે કે ખેડૂત, સેવા પૂરી પાડનાર સંસ્થા, સ્થાનિક વ્યાપારી અને સરકારી મંડળી તમામને નફો પ્રાપ્ત કરી આપે છે. સેવાઓ - નાણાકીય રીતે સહખ છે અને તે કરવાથી ખોટ જતી નથી. આખરી ઉપભોક્તાને ચોખ્ખાઈ કરેલ કૃષિ પેદાશ-અનાજ-ફળ-શાકભાજુ ઉપલબ્ધ કરે છે. તેમાં કચરાનો કે પાંદડાને સમાવેશ થતો નથી.

આ સમગ્ર પ્રક્રિયામાં ખેડૂત દ્વારા બજારમાં મોકલેલા જથ્થાનું ખેડૂતને સૌથી વધુ મૂલ્ય મળે તે અભિગમમાં આ મૂલ્ય નીચેના સંજોગોમાં વધારે મળે.

- ખેડૂત ઉત્પાદનની ચોખ્ખાઈ કરીને બજારમાં મૂકે.
- તેનું પેંકિંગ એવી રીતે કરે કે જથ્થામાં ઘટાડો અને બગાડ ના થાય.
- બજારના ભાવ જ્ઞાણો : પોતાની નાણાકીય જરૂરિયાત સમજ્ઞને સ્થિર ભાવો અથવા તો વધતા ભાવોમાં વેચાણ કરે.
- ધરમાં, ગોડાઉનમાં કે કોલ સ્ટોરેજમાં જથ્થો સાચવીને મૂકે અને ઊંચા ભાવ આવે ત્યારે વેચે. બજાર ભાવની માહિતી આકશવાણી, દુરદર્શન, વર્તમાનપત્રો, જેત-બજાર સમિતિ વગેરે પાસેથી પ્રાપ્ત કરે.
- કમોસમી વરસાદ - વાવાજોડાની આગાહી આવે તો ઊભા પાકની લાણણી કરે અને સુરક્ષિત જગ્યાએ મૂકે જેથી નુકસાન ન થાય.

૨. સામાજિક પરિણામ :

તમામ ખેડૂતોને - ખાસ કરીને નાના અને ગરીબ ખેડૂતોને વધારાનું મૂલ્ય પ્રાપ્ત થાય તેવો આ અભિગમ છે. હવે ખાસ કરીને આદેખદ અનાજ ઝાટકવાથી બગાડ થાય છે. ઘણી જગ્યાએ દાણાને પ્રાપ્ત કરવા માટે અનાજને રસ્તા વચ્ચે ઝાટકવામાં આવે છે, જો શ્રેશરનો ઉપયોગ કરવામાં આવે તો પૂર્ણ અનાજ અને પાકોનું કચરો પ્રાપ્ત થાય છે. કચરાનો ઉપયોગ બળતણ તરીકે ન કરવો અને વર્મિકમ્પોસ્ટ દ્વારા ખાતર બનાવી તેનો ઉપયોગ કરવો. આમ કેટલીક પ્રચલિત કાર્ય-પદ્ધતિઓમાં બદલાવ જરૂરી છે. આમ કરવાથી રસાયણી ખાતરનો ખર્ચ ઘટે છે જેથી જેત-ઉત્પાદન ખર્ચ ઘટે છે.

૩. પર્યાવરણીય પરિણામ :

મૂલ્યવર્ધક કૃષિ પદ્ધતિથી હવામાનમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ (CO_2)નું પ્રમાણ ઘટે છે. અનાજ/ફળ/શાકભાજુ સડતા નથી તેમજ બગાડ જુદ્દો પડે છે. બગાડ-કચરામાંથી ખાતર તૈયાર થાય છે. આમ થવાથી કૃષિ કાર્ય પદ્ધતિથી ઉત્પન્ન થતા જેરી ગેસ - ગ્રીન હાઉસ ગેસ (GHG) ઘટે છે. આ ઉપરાન્ત આ કાર્ય પદ્ધતિમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય તો વીજળીની બચત થાય છે. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જે હાનિકારક ગેસ છે તે ઝાડ-પાનની ફોટોસીન્થસીસ્થી પ્રક્રિયા દ્વારા શોખાય છે અને તે પ્રક્રિયા દ્વારા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. બાયોગેસ ખાટને કારણે છાણથી ઉત્પન્ન થતો પ્રદૂષિત મિથેન ગેસ ખાતરમાં શોખાય છે. ગ્રુહિણીને ચુલામાં ગેસ મળવાથી - લાકડાનું બાળવાનું પ્રમાણ ઘટે છે. હવે ગાયના મૂત્રનો પણ ખેતીમાં જંતુનાશક દવા તરીકે અને ખાતર તરીકે ઉપયોગ થાય છે.

મૂલ્યવર્ધક કૃષિ પદ્ધતિના પાયાના સિદ્ધાંત :

ટકાઉ મૂલ્યવર્ધક કૃષિ પદ્ધતિનો અભિગમ અને “બદલાતાં હવામાનમાં કુશળ ખેતી” એકબીજાના પૂરક છે. મૂલ્યવર્ધક કાર્ય પદ્ધતિ એટલે હાલની પદ્ધતિમાં એક હકારાત્મક અને ઈચ્છનીય પરિવર્તન સિદ્ધ કરવાનું છે. તેમાં ઉત્પાદન, પ્રોસેસિંગ અને સંગ્રહની અને વેચાણની કાર્ય પદ્ધતિમાં સુધારણા, શાન, માહિતી અને શોધ-ખોળનો લાભ મેળવવા સંબંધમાં પગલાંનો સમાવેશ થાય છે.

ટકાઉ વિકાસને નીચે મુજબના ત્રણ તબક્કામાં વહેંચી શકાય :

૧. કામગીરીને સમજવી
૨. કામગીરીને સુધારવી
૩. કામગીરીનું માપ કાઢવું

કામગીરીને સમજવી

મૂલ્યવર્ધક કાર્યપદ્ધતિ એક ગતિશીલ છે. તેમાં સ્વાભાવિક રીતે સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. લાણણી કર્યા પછી જો માલ બેતરમાં લાંબો સમય પડી રહે તો નુકસાન થાય છે. દાણા/ફળ ઉતાર્યા પછી વ્યવસ્થિત રીતે રાખવામાં ન આવે તો નુકસાન થાય છે. આ બાબત સામાન્ય છે પણ ઘણી વખત ધ્યાન બહાર જાય છે જેથી આ બાબત રહી જાય છે અને કુલ ઉત્પન્ન કરેલ જથ્થામાં ઘટ પડે છે. નુકસાન થાય છે.

❖ અંતિમ બજાર લક્ષ્ણિત :

આ સિદ્ધાંત બજારમાં ઉપભોક્તાને શું જરૂરી છે તે સમજવાનો થાય છે. એ હકીકતની બાબત છે કે મોટા દાણા, મોટી કેરી કે ચીકુ, મોટા ટામેટાં વધુ ભાવ પ્રાપ્ત કરે છે. તેથી પેંકિંગ કરતા પહેલાં નાના અને મોટા ફળ જુદા પાડી જુદી રીતે વેચવા મોકલવા જોઈએ. જે વધુ ભાવનો લાભ મેળવી શકે.

❖ વેચાણ પદ્ધતિ :

ઘણીવાર બેડૂતો સ્થાનિક વ્યાપારી સાથે ભાવ નક્કી કરી નાબે છે. પાકનું ઉત્પાદન થયે તુરત જ અમુક ભાવે તેમને વેચી દે છે. બજાર ભાવની તપાસ કરતા નથી. વાસ્તવમાં વેચાણ કરતા પહેલા એ.પી.એમ.સી.માં શું ભાવ છે? ભાવ ઉત્તરોત્તર વધે છે કે ઘટે છે? એ જાણીને જ્યાં ભાવ વધુ હોય ત્યાં વેચાણ કરવું જોઈએ. ભાવ ઓછા હોય તો ધીરજ રાખી - ભાવ વધે ત્યારે વેચવું જોઈએ. હવે બેન્કો, ગોડાઉન, કોલ સ્ટોરેજમાં રાખવામાં આવેલ અનાજ કે ફળોના જથ્થા સામે બેન્ક લોન આપે છે. જે જ્યારે તાત્કાલિક નાણાની જરૂરિયાત હોઈ ત્યારે લેવી જોઈએ.

કામગીરીને સુધારવી :

આ સિદ્ધાંત “મૂલ્યવર્ધન કૃષિ ઉત્પાદનની સાંકળ”ની કામગીરી સુધારવા માટેના વ્યૂહાત્મક પગલા સરકારી તંત્રને લેવાના રહે છે. બેડૂતો સુધી બજારભાવ, માંગનો પ્રકાર અને જરૂરિયાતની માહિતી ઉપલબ્ધ કરવી જોઈએ. વખતોવખત માર્ગદર્શન આપવું જોઈએ. કૃષિ વિસ્તરણ તંત્રની કામગીરી માત્ર કેવી રીતે વૈજ્ઞાનિક જેતી કરવી તેના માર્ગદર્શનથી પર્યાપ્ત નથી. તેમણે પાકની લાણણી અને તે પછીના દરેક તબક્કા માટે બેડૂતોને સજાગ અને માહિતગાર કરવા જોઈએ.

કામગીરીનું ધોરણ સુધારવા ઉપર મુખ્ય ધ્યાન :

આ બાબત વેચાણ માટે ખૂબ જ અગત્યની છે. કાણાવાળા કોથળામાં મોકલેવા આનજમાં ઘટ આવે છે. જૂના કાણાવાળાં કે ઘસાઈ ગયેલા કોથળાનો ઉપયોગ ન કરવો જોઈએ. સારા કોથળાનો ઉપયોગ કરવો જરૂરી છે. દરેક કોથળાનું વજન કરી તેના પર તે લખવું જરૂરી છે. ઘણીવાર વ્યાપારીઓ આમાં ગફલત કરતા હોય છે.

ફળોનું પેટીમાં પેંકિંગ હવે ઘણા બેડૂતભાઈઓ કરે છે. વાસ્તવમાં બધાએ કરવું જોઈએ. કેરી કે શાકભાજી કોથળામાં ઢગલો કરી ભરીને ના મોકલવા જોઈએ. આંબાના બેડૂતો સીધી રીતે કેરી પેટીમાં પેક કરીને વેચવા મોકલે છે. કેટલાક સાહસિક શહેર વિસ્તારમાં પોતાનું ટ્રેક્ટર લઈને આવે છે અને વેચાણ કરે છે. આમ, વેચાણ કરતાં પહેલાં વધુ નફો ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગ્રામ કક્ષાએ આ બાબત મંડળી દ્વારા પણ થઈ શકે છે. બેડૂતો - ખાસ કરીને મહિલા બેડૂતો સ્વસહાય જૂથ યોજનાનો લાભ લઈ ગ્રામ કક્ષાએ આવી મંડળી સ્થાપવી જોઈએ અથવા હ્યાત મંડળીનો આ કામ માટે ઉપયોગ કરવો જોઈએ.

મહિલા સ્વસહાય જૂથને ગ્રામ વિકાસ એજન્સી નાણાકીય સહાય આપે છે અને બેન્કો તેને ઓછા વ્યાજની લોન આપે છે. આપણે ત્યાં લગભગ દરેક ગામમાં આવા જૂથો છે. આવા જૂથો આ કામગીરી માટે પ્રવૃત્તિશીલ બનાવવા જોઈએ - જેથી સૌને લાભ મળે.

ફળ-શાકભાજી નાશ પામવાના કે બગાડ થવાના કારણો :

મોટેભાગે કૃષિપેદાશની સંબંધમાં નીચે મુજબની કામગીરી ગમે તેમ કરવામાં આવે તો તેને લીધે એ નાશ પામે છે કે એનો એનો બગાડ થાય છે કે તેમાં મોટી ઘટ આવે છે અને નાણાકીય નુકસાન થાય છે.

- ❖ ઉત્પન્ન કરવાની રીત : આડેધડ બીજની રોપણી કરવી કે જમીનમાં ભેજ ચકાસ્યા વગર રોપણી કરવી. સર્ટિફિકેટ બિયારણ ના ખરીદવું. જરૂર કરતા વધુ અથવા ઓછું ખાતર વાપરવું.
- ❖ લાણણી પછી એની સાર-સંભાળનો અભાવ-ઢગલો કરીને પડી રહેવા દેવું.
- ❖ સંગ્રહ (કોઠી કે પીપ સાફ કર્યા વગર અનાજ રાખવું કે વરન્ડામાં ઢગલો) કરીને ફળો/અનાજ રાખવું.
- ❖ જાળવણી : ઉંદર-ચકલા-બિસકોલી ગમે ત્યારે આવી જાય - નુકસાન કરે તો પણ સચેત ન થશું.
- ❖ પેંકિંગ : કાણાવાળા કોથળા અથવા કોથળાને બકલથી પકડી ઊંચા કરવા કે ઊંચકવા, જેથી નવા કાણાં ના પડે. હવે ફળો-શાકભાજી માટે ખોખા આવે છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.
- ❖ ટ્રાન્સપોર્ટ : ટેમ્પામાં વ્યવસ્થિત ગોઠવીને મૂકવાની જગ્યાએ ઢગલો કરી મોકલવું.

વધુમાં નીચેની બાબતોને પરિણામે ખેડૂતો અનાજને સારી રીતે જાળવી શકતા નથી. એને કારણે પેદાશ નાશ પામે છે અને એનો બગાડ થાય છે.

- ❖ અપૂરૂતી આવક : નાણાંની તુરંત જરૂર - અનાજ રાખવાના પીપ લાવવાની ખરીદ શક્તિનો કે જાણનો અભાવ.
- ❖ અપૂરૂતા સાધન : ઘરમાં અનાજ/ફળ/શાકભાજી રાખવા જગ્યાનો અભાવ.
- ❖ સ્થાનિક બજારનો અભાવ અથવા મર્યાદિત બજારો, રસ્તા, રેલવે, જળમાર્ગો, બંદરનું આંતરમાળખું - જેવી આંતરમાળખાની સગવડોનો અભાવ અથવા એનું અપૂરૂતું પ્રમાણ.
- ❖ જ્ઞાનનો અભાવ : અનાજ કે ફળોને કેવી રીતે, ક્યા સાધનોથી ચોખ્ખા કરવા, પેંકિંગ કેવી રીતે થાય, બજારોમાં શું ભાવ છે ? શીત ગોડાઉન ક્યાં છે વગેરે જાણકારીનો અભાવ.
- ❖ સમજણનો અભાવ : અનાજ/ફળ/શાકભાજીને સારી રીતે જાળવવાથી અને યોગ્ય રીતે વેચવાથી વધુ આવક પ્રાપ્ત થાય છે. જે ઘણી વખત રૂપ ટકાથી વધુ હોય છે.
- ❖ વ્યાપારી પાસેથી નાણાનું દેવું : એટલે જેવી પેદાશ આવે કે તરત જ તેને નક્કી કરેલ ભાવે વેચવાની મજબૂરી. આ સમગ્ર બાબતોમાં સહાયભૂત થવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને કૃષિ વિભાગ પાસે યોજનાઓ છે. તેની જાણકારી મેળવી સહાય પ્રાપ્ત કરવી જોઈએ.

કામગીરીનું માપ કાઢવું :

બદલાતા વાતાવરણમાં ટકાઉ કૃષિ વિકાસ પ્રાપ્ત કરવા આર્થિક, સામાજિક અને પર્યાવરણ પરિણામો વચ્ચે સુસેણ સાધવો આવશ્યક છે. મૂલ્યવર્ધક કાર્ય પદ્ધતિમાં એ ખાસ જોવાનું રહે છે કે ખેડૂતની આર્થિક સ્થિતિમાં ઘટાડો ના થાય પણ આવક ઉત્તરોત્તર વધતી રહે. તેને સંલગ્ન સંસ્થાઓ સાથે સરકારી મંડળી કરીને અથવા વ્યક્તિગત રીતે વેચાશ કામગીરી થાય છે, જેમાં તમામ - એટલે કે ખેડૂત - ખાસ કરીને નાના ખેડૂતને વેચાશ લેનાર - વેચનાર, સામાન્ય ઉપભોક્તા, ગ્રાહક - બધાને લાભ થાય છે. તે જ પ્રમાણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ગોસનું પ્રમાણ ઘટે. આ સમગ્ર બાબતો ઉત્તરોત્તર બને તેનું સતત મૂલ્યાંકન કરવું આવશ્યક છે. જે સરકારી તંત્ર-

કૃષિ-વિસ્તરણ તંત્રની જવાબદારી છે. તેઓએ દરેક વર્ષમાં કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા-વધારા ખેડૂતો અને અન્ય સંસ્થાઓ સાથે પરામર્શ કરી તેમના સુધી પહોંચાડવાનું છે.

નુકસાનમાં ઘટાડો કરવાની રીતો :

ઉત્પાદનની લાણણી પછી એની સાર-સંભાળ તથા સંગ્રહ દરમ્યાન થતા નુકસાનને ઘટાડવા માટે વિવિધ પ્રકારની રીત-રસમો અને ટેક્નોલોજી પ્રાય છે. દાખલા તરીકે ફળો/ગ્રામેટાં/ઈડાં મોકલવા માટે એક પર એક રાખી શકાય તેવા કાગળના કે પ્લાસ્ટિકના બોક્સ ઉપલબ્ધ છે.

- ❖ ટ્રકમાં કે ટ્રેક્ટરમા બોક્સ કે અનાજ કે કોથળા - શાકભાજના પોટલા એકબીજાની તે સંભાળપૂર્વક ગોઠવવા જોઈએ. આદેખ મૂકવાથી નીચે મૂકેલ વસ્તુઓનું નુકસાન થાય છે. આ માટે ટ્રક ડ્રાયવર કે કિલિનર પર આધાર ના રાખવો.
- ❖ ઉતારતી વખતે ઉપરથી ફેંકવું નહીં.
- ❖ પેદાશ પાકને સીધો જમીન ઉપર ખાસ કરીને વધુ પ્રમાણમાં બેજ ધરાવતી જમીન ઉપર મૂકવો ન જોઈએ.
- ❖ ટ્રક કે ટ્રેક્ટર સાફ કરીને માલ મૂકવો જોઈએ.
- ❖ માલને ઓઈલ, ગેસોલીન કે અન્ય કેમિકલ્સ ખેતીને લગતી દવાઓ વગેરે સાથે સીધા સંપર્કમાં મૂકવામાં ન આવે તે જોવું અથવા તેની સાથે ન લઈ જવો જોઈએ.
- ❖ પાક-પેદાશો મોટે ભાગે છાંયડામાં રાખવામાં આવે કે જેથી તાજ પેદાશોના ઉષ્ણતામાનમાં ઘટાડો ન થાય.
- ❖ પાકના દાણા કાઢવા માટે યંત્રોનો ઉપયોગ તેમજ પેદાશોને સૂર્યશક્તિ ઉપયોગથી સૂકવવા. પાકની જાળવણી તથા પ્રોસેસિંગ માટે સુધારેલી ટેક્નિકનો ઉપયોગ.
- ❖ ઓછા ખર્ચના કાર્યક્રમ સંગ્રહ તેમજ કુલિંગ માટેની આંતરમાળાની સગવડોનો ઉપયોગ કરવો.

મૂલ્યવર્ધિત કૃષિ સાંકળને સમાંતર ટકાઉપણાં સુધારવા માટેની શક્ય પદ્ધતિ અને ઉકેલ :

ખેતરમાં શાની, ક્યારે અને કેવી રીતે વાવણી કરવી અને પાકની લાણણી ક્યારે કરવી એને લગતા નિષાયિકને કારણે તેમજ પાકની લાણણી અગાઉનાં પગલાં, લાણણીની પદ્ધતિ, રીત-રસમોનો કૃષિ બનાવટો-પેદાશોની લાણણી પછીની ઉપયોગિતાની અવધિ ઉપર પ્રભાવ પડે છે.

લાણણી અગાઉની ઉત્પાદન સંબંધિત રીત-રસમો અને ખેતીની પદ્ધતિ, પાણીનો જથ્થો, જમીનનો પ્રકાર સહિતનાં પરિબળો લાણણી પછી પાકની ગુણવત્તા, આવરણ સાથે ઉપયોગિતાની અવધિ તથા લાણણી પછીના નુકસાન ઉપર માઠી અસર પાડી શકે છે.

લાણણી પછીની સારી સાર-સંભાળ પણ ખાસ ફળો અને શાકભાજની લાણણી પછીની ઉપયોગિતાની અવધિમાં વધારો કરી શકે છે. ગમે એમ પણ આનો આધાર પણ આ પેદાશની ક્યારે અને કેવી રીતે લાણણી કરવામાં આવી છે એની પરિસ્થિતિ ઉપર રહેલો છે.

કેટલાક કિરસામાં પાકની કસમયની, સમય પહેલાની લાણણીને કારણે પાકને નુકસાન થવાની સંભાવના છે, કારણ કે ખેડૂતો ઘણીવાર અસલામતી અનુભવતા હોવાથી અને એમને આવક જરૂરી હોવાથી પાકની સમય પહેલાની લાણણી કરવાનો નિર્ણય કરે. એવું પણ બને કે પાકની લાણણી બહુ મોડી હાથ ધરવામાં આવે તો પણ નુકસાન થાય છે. ઘણીવાર લાણણી દરમિયાન ઢોળાઈ જવાને કારણે પાકને નુકસાન થાય છે. પરિણામે ઉત્પાદનના દરેક તબક્કે

ખોરાક-અનાજને નુકસાન ન થાય અને એનો બગાડ ન થાય એ જોવું જરૂરી છે. સાથોસાથ સારી ખેતી પદ્ધતિ અને પાકની લણણી દરમિયાન નીચે મુજબની ચોક્કસ કાર્યપદ્ધતિ અપનાવવાની જરૂર છે :

સારી ખેતી પદ્ધતિ અને લણણીના નિયમો

- સારી ખેતી પદ્ધતિ રીત-રસખોમાં નિંદામજા કે નકામા ઘાસ-રોપા સહિત જમીનનું યોગ્ય વ્યવસ્થાપન,
- પાકનું રક્ષણ અને તંદુરસ્તીની જાળવણીમાં સડી જતા છોડ અને ફળો એકત્ર કરી એને દૂર કરવા.
- શાકભાજ અને ફળોમાં ચેપ ફેલાવે એવાં જંગલી-રોપાને શોધી કાઢી દૂર કરવાનો સમાવેશ થાય છે.
- વધુમાં છોડને પૂરા પાડવામાં આવેલો પાણીનો જથ્થો. રાસાયણિક ખાતરો, જંતુનાશકો ને ન જોઈતી-નકામી વનસ્પતિનો નાશ કરતી દવાઓનો, પેદાશોની લણણી પછીની ગુણવત્તા તેમજ એના જથ્થા ઉપર પ્રભાવ પડી શકે છે અને આમ પાકની લણણી પછીનું નુકસાન ધટાડવામાં મદદરૂપ બની શકે છે.

પાકને શક્ય એટલી શ્રેષ્ઠ હાલતમાં બજારમાં લઈ જવાના ધ્યેય સાથે પાકની લણણીના મૂળભૂત નિયમો નીચે મુજબ છે :

- ❖ દિવસ દરમ્યાન સૌથી ઓછા ઉષ્ણતામાન દરમ્યાન સવારે અથવા મોડી બપોર પછી લણણી કરવી.
- ❖ જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે આ કામ પડતું મૂકવું, કારણ કે એની સડી જવાની સંભાવના વધુ છે તેમજ એને નુકસાન થવાની સંભાવના પણ વધુ છે.
- ❖ લણણી કરલા પાકને જો તરત જ યોગ્ય ઠેકાણો ન લઈ જઈ શકાય એમ હોય તો એને તડકા-સૂર્યપ્રકાશથી બચાવવાની પાકી ગોઠવણ કરો અને ટાંકો. છાંયડામાં રાખો.

એક સરળ મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનમાં દર્શાવાયેલા ખોરાકની નુકસાની અને બગાડના કારણો અને ચેઈનના સહભાગીઓ-સૂત્રધારો દ્વારા લઈ શકાય એવા શક્ય પગલાં :

| અન્ન-કૃષિ ઉત્પાદન | | |
|---|--|---|
| ખેત-ઉત્પાદન | પાકની લાણણી પછી સાર-સંભાળ | બજારમાં મોકલતા પહેલાની પ્રક્રિયા |
| <ul style="list-style-type: none"> -હલકું બિયારણ -પાકની જાતોની નબળી પસંદગી -જમીનની ફળકુપતાને ધ્યાનમાં રાખ્યા વગર નિર્ણય -જંતુઓ, ઉંદર અને રોગને કારણે નુકસાન -વાતાવરણના બદલાવના કારણે જમીનની નબળી હાલત -પાણીનું નબળું વ્યવસ્થાપન -સમય પહેલા કસમયે પાકની લાણણી -લાણણીનો સમય અનુકૂળ ન હોવો. | <ul style="list-style-type: none"> -ખેતરમાં રહી ગયેલા, ખેતરમાં જેડાયેલા અને અથવા પક્ષીઓ ઉંદરોએ ખાધા હોય એવા ખાધ પદાર્થો. -સંગ્રહ અને સાધનની નબળી હાલત અને એને કારણે જંતુઓ રોગોનો ઉપદ્રવ, બગાડ પાકનું દૂષિત થવું અને ખોરાક સુકાઈ જવો. -પરિવહનના અંતે માળખાનો અભાવ અથવા એની અપૂરતી સગવડો. -યોગ્ય વાહન ભાડે ન રાખવું. -સારા વાહન રાખવાથી ઝડપથી બજારમાં માલ પહોંચે છે. બગડતો નથી. | <ul style="list-style-type: none"> -ફળો અને શાકભાજી ધોવા, સાફ-સૂઝી, આ દરમ્યાન અને પેકેજિંગને કારણે એનો બગાડ-વ્યય અને ગુણવત્તામાં ઘટાડો. -યોગ્ય આકાર, કદ, વજન, સાઈઝ અને દેખાવની બનાવટોની પસંદગીને કારણે એમાં કાપકૂપ. -મોટા ફળો દાણા જુદા-જુદા પાડી અલગ-અલગ રીતે પેક કરી વેચવા-તેનો શહેરીઓ વધુ ભાવ આપે છે. |
| પશુપાલન | | |
| <ul style="list-style-type: none"> -પશુપન અને ડેરીની બનાવટો -વંશ-વૃદ્ધિ-ઉછેર દરમ્યાન નબળાં પોષણ અને રોગોને પરિણામે પશુનું મૃત્યુ થઈ શકે છે. -સમય પ્રમાણે રસી ના આપવી. -પશુઆને દોહવાની (દૂધ-કાઢવાની) નબળી ટેકનિકની દૂધના ઉત્પાદન પર માટી અસર -ગરમી દરમ્યાન છાયામાં રાખવાની વ્યવસ્થા-ધણા જેડૂતો પંખા રાખે છે. દૂધનું ઉત્પાદન ઘટતું નથી. -ચોખ્યા પીવાના પાણીની સગવડ - દૂધનું ઉત્પાદન વધે છે. | <ul style="list-style-type: none"> -બગાડ, પરિવહન અને સંગ્રહ -દૂધને કેનમાં રાખીને વેચાણ કેન્દ્ર પર લઈ જવું જોઈએ. -તપેલામાં લઈ જવાથી ઉલેચાય / ઢોળાઈ જવાની / બગાડ થાય છે. કોઈ સંજોગોમાં દોહ્યા પછી તુરત જ વેચાણ કેન્દ્રમાં ન જવાય તો તેને ઉકાળી રાખવાથી બગડતું નથી. | <ul style="list-style-type: none"> -દૂધ ઉપર પ્રક્રિયા દા.ત., ઉકાળીને જંતુરહિત કરવા દરમ્યાન અને દૂધ ઉપર પોસેસિંગ કરી એમાંથી અન્ય બનાવટો-બનાવવા દરમ્યાન દૂધ ઢોળાઈ જવું, વ્યથવો અને કુલિંગની સગવડોના અભાવને કારણે બગાડ. -કોઈ સંજોગોમાં દૂધ બજારમાં ન લઈ જવાય તો તેનું દેશી પદ્ધતિથી ‘ધી’માં રૂપાંતર કરવું જોઈએ. જેથી આવક પ્રાપ્ત થાય. -છાણ અને મૂત્રા - બન્નેનો હવે સફળતાપૂર્વક ખાતર તરીકે ઉપયોગ થાય છે. વ્યક્તિગત અથવા સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કરવાથી સારું ખાતર અને રાંધવા માટે ગેસ બન્ને મળે છે. આ માટે સરકારી યોજના હેઠળ સહાય મળે છે. |

| મત્સ્યઉદ્યોગ | | |
|---|---|---|
| <p>માછલીની જતોનું ઉત્પાદન</p> <p>-માછીમારી દરમ્યાન નકામી માછલી અને અન્ય દરિયાઈ જળોનો શિકાર અને ફેંકી દેવાયેલા પદાર્થો. ભેગા થવાથી-જંતુઓનો ઉપદ્રવ</p> | <p>માછલીની જણસો-</p> <p>-માછલી કિનારે ઠલવાય પછી એની નબળી અને અપૂરતી સાર-સંભાળ અને ખોટી સંભાળ. એમાં ક્ષતિઓ, સંગ્રહ અને ચીલિંગની સગવડોનો અભાવ તથા તાત્કાલિક પરિવહનનો અભાવ જેથી તેનો બગાડ થવો.</p> | <p>પ્રાપ્ત કરેલ માછલીઓને ચોખ્ખાઈ કરીને તરત ૪ કોલ્ડ સ્ટોરેજમાં અથવા રેફિજરેટ વાહનો દ્વારા વેચાણ કરવા મોકલવી. જો આ શક્ય ન જ બને તો માછલીની સૂક્વણી કરીને વેચવી.</p> <p>-મોટી અને નાની માછલી જુદી પાડવી.</p> |
| વિતરણ : | | |
| <ul style="list-style-type: none"> - પરિવહન સેવા અને માર્કેટિંગનું નબળું આંતરમાળખું. - સંગ્રહ અને કુલિંગની સગવડોનો અભાવ અથવા એની અપૂરતી સગવડો. - બજારો સુધી પહોંચવામાં વધુ સમય - બજારનો અભાવ-માંગ કરતાં વધુ પુરવઠો. - બજારની અપૂરતી સગવડોને કારણે અસ્વચ્છ અને બિન-આરોગ્યપ્રદ રીત-રસમ, સાર-સંભાળ, કચરાના યોગ્ય નિકાલની અપૂરતી સગવડો, મળમૂત્ર, ગટરના પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધ. | | |
| પેકેજિંગ | | |
| <p>-અયોગ્ય અને અપૂરતા પેકેજિંગને પરિણામે વિતરણ, પરિવહન અને માર્કેટિંગ દરમ્યાન ભૌતિક અને રાસાયણિક-કેમિકલ સ્વરૂપનું નુકસાન અને જીવજંતુઓ, ઉંદર અને અન્ય દૂષિત પદાર્થો, ખોરાકમાં પ્રવેશ સામે અપૂરતું રક્ષણ. આથી પેકેજિંગ કરતી વખતે કેવા પ્રકારનું પેકેજિંગ - કોથળો/પેટી છે તે બરાબર ચકાસવું જરૂરી છે. આડેધ કે ઉતાવળી કાર્યવાહીથી નુકસાન.</p> | | |

ખોરાકનું નુકસાન અને બગાડ ઘટાડવા માટેના શક્ય પગલાં

| અન્ન-કૃષિ ઉત્પાદન | | |
|--|--|---|
| <p>-ઉત્પાદન અને ખેતીની રીતરસમોમાં સુધારા, જમીન અને પાણી સહિત અને જંતુઓ તથા રોગોનું વ્યવસ્થાપન-નિયંત્રણ</p> <p>-લાણણીની કાર્યપદ્ધતિ રીત રસમાં સુધારો.</p> | <p>-સંગ્રહ અને કુલિંગની સગવડોમાં મૂડીરોકાણ દા.ત., લાંબા ગાળા માટે સફળ-સલામત સંગ્રહ માટે ઓછા બર્યના સંગ્રહ માટેના તથા કુલિંગ માટેના માળખા.</p> <p>-લાંબા ગાળાના સફળ સંગ્રહ માટે સંગ્રહ અને કુલિંગની સગવડો.</p> <p>દા.ત., ઓછા બર્યના સંગ્રહ અને કુલિંગના માળખામાં મૂડીરોકાણ</p> <p>-ઘરમાં અનાજ-ખોરાકના સંગ્રહ. ખોરાક તૈયાર કરવાની અને રાંધવાની પદ્ધતિમાં સુધારા</p> <p>-બગાડને અલગ પાડવાની વ્યવસ્થામાં સુધારો.</p> <p>-કચરાના યોગ્ય વ્યવસ્થાપન નિકાલની વિવિધ પદ્ધતિઓમાં સુધારા કે જેનાથી આ પદ્ધતિની કાર્યક્ષમતાનું પ્રમાણ વધે.</p> | <p>-ઉપજ-પેદાશમાંથી દાણા કાઢવા અને પેદાશોને સૂર્યશક્તિની મદદથી સુકવવા સહિત પેકેજિંગ અને પોસેસિંગ ટેક્નિકોમાં સુધારો.</p> <p>-પાકના કણસલામાંથી દાણા કાઢવા અને ખેત-પેદાશને સૂર્યશક્તિની મદદથી સુકવવા સહિત પેકેજિંગ અને પ્રોસેસિંગની ટેક્નિકમાં સુધારો.</p> <p>-ખેત-પેદાશોની ગુણવત્તા જાળવવા અને પાકની લાણણી પછી એની આવરદા અવધિ વધારવા કુલિંગની સગવડોમાં સુધારો કરવો.</p> |

પેકેજિંગ :

કોઈ એક બનાવટની વેલ્યુ ચેઈનને આધારે બનાવટનું ફૂડ ચેઈનના વિવિધ તબક્કે પેકેજિંગ અને પુનઃ પેકેજિંગ કરી શકાય છે. પેકેજિંગ બનાવટના વિતરણમાં તેમજ ખેતરમાંથી તેને સંગ્રહ, કુલિંગ અને પ્રોસેસિંગ સગવડો સુધી જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિકેતાઓ ને વપરાશકારો સુધી લઈ જવામાં મદદ કરે છે. આ ઉપરાંત પેકેજિંગ બનાવટના વિતરણ, પરિવહન અને માર્કેટિંગ દરમ્યાન તેને ભૌતિક અને રાસાયણિક ડેમિકલ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવું જોઈએ તથા તેણે ખોરાકમાં-બનાવટમાં જીવજંતુઓ, ઉંદર અને અન્ય દૂષિત પદાર્થોના પ્રવેશ સામે પણ રક્ષણ પૂરું પાડવું તેના પગલા તથા ટેક્નોલોજી ખોરાકની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરી શકે છે. કે જેથી પાકની લાણણી પછીના નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય.

અનાજનું વિતરણ, માર્કેટિંગ અને છૂટક વેચાણનો તબક્કો :

વિતરણ અને પરિવહન :

સમગ્ર ફૂડ ચેઈનમાં વિતરણ અને પરિવહનના પ્રશ્નોને કારણે ખેત-પેદાશોનું નુકસાન થાય, વેક્ઝાય અને તેનો બગાડ થાય છે. આ પ્રશ્નોમાં રસ્તાઓનો સંદર્ભ અભાવ, રસ્તા અને વાહનો સારી પરિસ્થિતિમાં ન હોવા, ચોમાસાની ઝતુમાં રસ્તાઓનો ઉપયોગ થઈ શકે છે કે કેમ, રસ્તા સુધી પહોંચવાની સમસ્યાઓ અને રસ્તા ઉપરથી મોટા વાહનો

પસાર થઈ શકે એવી એની હાલત છે કે કેમ તે જોવું જરૂરી છે. તેમાં ધ્યાન રાખી જિલ્લા પંચાયત દ્વારા રસ્તા દુરસ્ત કરવા જોઈએ. આ પ્રશ્ન ખાસ કરીને અંતરિયાળ ગામો કે ટેકરા - પહાડની ઉપર આવેલ વસાહતોને અસર કરે છે. આ બાબતમાં ગામના સરપંચ - ખેડૂતો આગેવાનોએ સજાગ રહેવું જોઈએ. ચોમાસું પૂરું થાય પછી રસ્તા રીપેરની ઝુંબેશ કરવી જોઈએ.

પરિવહનની પરિસ્થિતિ :

પરિવહનની સગવડોની ખરાબ હાલત સહેલાઈથી પાકને-પેદાશને નુકસાન પહોંચાડી શકે છે. ઉદાહરણરૂપે જોઈએ તો જે વાહનોમાં વધુ પડતો માલ-સામાન ભરવામાં આવ્યો હોય, જે પેદાશો-બનાવટોનું પેકિંગ નબળું થયું હોય અથવા તો જેને અયોગ્ય વાહનમાં તથા વેન્ટિલેશન-હવાની અવર-જવરની તથા કુલિંગની અપૂરતી સગવડોમાં લઈ જવાની હોય એવા ડિસ્સામાં પાક પેદાશોને થતા નુકસાનમાં વધારો થાય છે. આ ઉપરાંત કોઈ એક બનાવટને એના વપરાશકાર સુધી પહોંચવામાં જે સમય લાગે છે એ સમયગાળો પણ એને થતાં નુકસાનમાં ફાળે આવે છે. કારણ કે બનાવટ જેમ વધુ લાંબા સમય તડકામાં અથવા તો ભેજવાળા વાતાવરણમાં અથવા તો અન્ય હવામાન પરિસ્થિતિમાં રહે એમ એનો આવરદાનો સમય વધુ ટૂંકો થાય છે. આનું કારણ એ છે કે ફળો અને શાકભાજમાં હપ થી હપ ટકા પાણી હોય છે અને એથી એ સહેલાઈથી બગડી જાય છે અને તેને નુકસાન થાય છે. ફળો અને શાકભાજમાંનું પાણી ખૂટવા માંડતા એ બગડવા માંડે છે. અને ક્રમશઃ નાશ પામે છે અને એ વપરાશકાર સુધી પહોંચે ત્યાં સુધી ખાવ માટે અયોગ્ય બની જાય એવી સંભાવના રહેલી છે. ખેડૂતો એ સજાગ રીતે ટ્રક-ટેંબ્યો ભાડે રાખતી વખતે તેની પરિસ્થિતિ બરાબર ચકાસવી જોઈએ. રસ્તામા ખોરવાઈ જાય તેવું વાહન લેવું ન જોઈએ. ભાડું નક્કી કરતી વખતે કેટલા કલાકમાં વેચાણ સ્થળ પર પહોંચશે તે પણ નક્કી કરવું જોઈએ. લાણણી થાય તેની સાથે તેનું વેચાણ ગોઠવવું જરૂરી છે. આથી લાણણી કરાયેલી પેદાશોના પરિવહન-અન્ય સ્થળે પહોંચાડવા માટેની વ્યવસ્થાનું અગાઉથી આયોજન કરવાની જરૂર છે કે જેથી એને થતું નુકસાન બને તેટલું ઘટાડી શકાય. દરેકે જુદી-જુદી ટ્રક કરવાની જગ્યાએ મોટી ટ્રકમાં ભેગો જથ્થો મોકલવાથી કિફાયતી ભાવથી વહન થાય છે. આ માટે સહભાગી અભિગમ રાખવો જરૂરી છે.

શીત સાંકળ :

કૃષિ ઉત્પાદન બદલાતા હવામાનમાં ખૂબ જ ગરમી કે માવઠાથી નુકસાન પામે છે. શીત સાંકળ આ પરિસ્થિતિમાં ખેડૂતને બચાવે છે. ખાસ કરીને ફળ-ફળાઈ, દૂધ અને મત્સ્ય પેદાશો પરિવહન દરમિયાન બગડી ન જાય તે માટે આ વ્યવસ્થા અમલમાં છે. દૂધના વાહન માટે તે ખૂબ જ સારી રીતે અમલમાં છે પણ અન્ય પેદાશો માટે એટલું જ જરૂરી છે. આ “દૂધના પરિવહનની સાંકળ”ના ઉદાહરણને લઈએ તો આ વ્યવસ્થા અનુકરણીય છે. આ માટે રાજ્ય કક્ષાની સહાય ઉપલબ્ધ છે. બહેનોએ મંડળી બનાવી આ કાર્ય હાથ લેવું જોઈએ.

આ એક આધુનિક કાર્ય પદ્ધતિ છે. શાકભાજ/ફળ અને અન્ય ઉત્પાદનનું પરિવહન દરમ્યાન યોગ્ય રેફિજરેશનની સગવડ હોય તો તે ફળો/શાકભાજ તાજ રહે છે. જંતુઓ કે બેક્ટેરિયાથી ખરાબ થતા નથી.

કૃષિ બજાર વ્યવસ્થા :

કૃષિ બજાર સમિતિ - વ્યવસ્થા (એ.પી.એમ.સી. દ્વારા)

વર્ષોથી આ યોજના અમલમાં છે. કૃષિ બજારમાં ખેડૂતો પોતાનો માલ લાવે છે. ત્યાં દરરોજ હરાજ થાય છે અને ભાવ નક્કી થાય છે, આ ભાવ માલની આવક, માગ અને જાવક આધારિત છે. રાજ્ય સરકારના ધ્યાન પર આવેલ છે. કેટલીક જગ્યાએ વ્યાપારીઓ ભાવ અંકુશમાં રાખે છે. તે માટે તમામ કૃષિ બજારના ભાવો જુદી-જુદી માહિતી-સંચાર વ્યવસ્થા મારફતે પ્રસારિત કરવામાં આવે છે. તેમ જ બજારના પ્રમુખ અને નિયામક મંડળમાં માત્ર ખેડૂત આવી શકે તેવા કાયદાકીય ફેરફાર પણ વિચારણ હેઠળ છે જેથી સીધો ફાયદો ખેડૂતોને થાય. આપણા ગુજરાત રાજ્યમાં વ્યવસ્થા ખૂબ જ સારી છે.

કૃષિ બજાર સમિતિઓ - કેટલીક જગ્યાએ - બજારના વેચાતા અનાજના ભાવો નિર્દર્શિત કરે છે - ખરેખર તેમણે વધુ આગળ વધીને બેડૂતભાઈને દરરોજ ૧૧.૦૦ અને બપોરે ૧.૦૦ વાગ્યા પ્રવૃત્તિ ભાવો SMSથી બેડૂતોને મોકલવા જોઈએ.

આપણા ગુજરાત રાજ્યમાં કેટલીક પેદાશો માટે વિશિષ્ટ ખેતબજાર છે. - તેજાના માટે “ઉંઝા”, કપાસ માટે “કરી”, મગફળી માટે “ગોંડલ-રાજકોટ”, એરંડા માટે “કરી” - મંડળી બનાવીને તેના દ્વારા અને બેડૂતોએ ગામ કક્ષાએ ગામમાં સ્વસહાય જૂથ બનાવી બેડૂતો સીધું વેચાણ કરવું જોઈએ.

હાલ રિલાયન્સ અને અન્ય સંસ્થાઓએ “રીટેલ” મોટા બજાર શાકભાજ-અનાજ માટે કરેલ છે. તેમના અધિકારીઓ સીધી જ ખરીદી કરે છે. તેમની સાથે સીધું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

બેડૂતોએ વેચાણ કરતા પહેલા જુદા-જુદા બજારના ભાવો જાણી સમજીને પછી જ વેચાણ કરવું જોઈએ.

બજાર સુધી પહોંચવામાં અવરોધો :

ભૌતિક, માળખાકીય માહિતી અને સંગઠનમાં બેતી વિભાગ દ્વારા ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

| અવરોધો | મુશ્કેલ બાબતો |
|--------------------------|--|
| ભૌતિક | ખરાબ, નબળા રસ્તા, પરિવહનના ખર્ચ, પેદાશનું ઓછું મૂલ્ય-વજન |
| માળખાકીય | બજારના સંબંધોની ઈજારાશાહી ધરાવતા વ્યાપારીઓ. વ્યાપારીઓ દ્વારા વધુ ભાવની માંગણી અને મોહું મૂલ્ય ચુકવણી-ઘટ ના બહાને કુલ મૂલ્યમાં કપાત કરવી. |
| કુશળતા, માહિતી અને સંગઠન | બજારો કેવી રીતે કામ કરે છે તેની સમજણનો બેડૂતોમાં અભાવ. |

આ અવરોધો બેડૂત-આગેવાને અને કૃષિ વહીવટી તંત્રોએ આગળ પડતો ભાગ લઈ દૂર કરવા જોઈએ.

કૃષિ બજાર વ્યવસ્થા - સીધું વેચાણ

રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેદાશોને બહેનો પાસેથી સીધી રીત ખરીદવા-વેચવાની વ્યવસ્થા પણ અમલમાં મુકવામાં આવી. તેમાં જ્યન્ત એગ્રો ઓર્ડર લિમિટેડ જે જગ્યાએ - બનાસકાંઠામાં એરંડાનું તેલ બનાવતો ઉદ્યોગ છે. તેની કાર્યપદ્ધતિ પ્રશંસનીય છે. જે નીચે મુજબ છે :

- ❖ તેઓએ ગ્રાયોગિક ધોરણે - સુરેન્દ્રનગર, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં સીધી ખરીદી કરી.
- ❖ ગામના બેડૂત મંડળ ગામ કક્ષાએ ખરીદી કરી, એરંડા ટ્રક લોડ તૈયાર કરી જાણ કરે છે અને સીધા જ જ્યન્ત એગ્રો ઓર્ડર લિમિટેડના ગોડાઉનમાં પીલાણ માટે માલ ગામના બેડૂ મંડળો દ્વારા પહોંચાડે છે.
- ❖ સંસ્થાદારી ખરીદીના ધ્યાનમાં રાખવાના મુદ્દા માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત -
- ભાવ : દરરોજના સવાર-બપોર ને સાંજના ભાવો એસ.એમ.એસ. દ્વારા ગામના બેડૂતોને આપવા આવતા જેથી મંડળ ગામના બેડૂતો પાસેથી ખરીદી કરી શકે.
- પ્રોસેસિંગ સેન્ટર : ગામ કક્ષાએ એ પ્રોસેસિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી, જેમાં ઊંચી ગુણવત્તાવાળા કોથળા આપેલ છે. આ ઉપરાંત એરંડા ચોખ્ખા કરવા માટે મોટા ચારણા આપેલ છે. જેથી ગામના માલની ખરીદી ગામમાં જ થાય.

- **સ્થાનિક રોજગારી :** ગામના યુવાન લોકોને આ સાંકળમાં સાંકળવામાં આવ્યા. - (ખરીદીમાં, વજન કરવામાં, સફાઈ કરવામાં, ડિસાબ રાખવામાં, પરિવહનની ગોઠવણ કરવામાં.)
- ચુકવણાની પદ્ધતિ-ગામ કક્ષાએ બજાર ભાવની ચુકવણી
- સંસ્થા દ્વારા જથ્થો પ્રાપ્ત થયા પછી — એક અઠવાડિયામાં નાણાંની ચુકવણી કરવામાં આવે છે.

આ પ્રકારની કામગીરીથી નીચેના ફાયદા થયા :

- ગામના પૈસા ગામમાં રહ્યા.
- ખેડૂતો સીધા બજાર સાથે જોડાયા. બજાર ભાવ ગામ કક્ષાએ મળ્યા.
- ગામ કક્ષાએ રોજગારી ઊભી થઈ.
- ખેડૂતો ગામમાં બેસીને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભાવ જાણતા થયા અને વેપારી સાથે વાટાઘાટો કરતા થયા.
- સોદા શક્તિ વધી.
- તાલીમ લઈ દિવેલાની આધુનિક ખેતી કરતા થયા.
- દિવેલાને ચોખ્ખા કરીને વેચતા થયા. ઘટ ન રહી.

બજાર સુધી પહોંચવાના એક માર્ગરૂપ સામૂહિક માર્કેટિંગ :

સામૂહિક માર્કેટિંગ બજાર સુધી પહોંચવામાં ઉત્તેજન પૂરું પાડી શકે છે અને સ્વરૂપ બિન્ન-બિન્ન હોઈ શકે છે. આ માટે સહકારી માર્કેટિંગ મંડળી રચી શકાય છે. નાના ખેડૂતને દૂધાળા પશુધનના માલિકોને અને માધીમારોને એક એવું સ્થળ પૂરું પાડી શકે છે, જ્યાં ખેતપેદાશો વગેરેને તૈયાર કરી એનું પેક્ઝિંગ કરી ત્યાંથી બજારોમાં અને અન્ય વિતરણ કેન્દ્રોમાં મોકલી શકાય છે. ગમે તેમ પણ આવી સહકારી મંડળીઓ વગેરે જેવા સંગઠનના પરિણામો મિશ્ર રહ્યા અને તેમાથી કેટલાક પુરકારો પણ ઊભા થયા છે. જેમ કે પરિવહનની સગવડો સરળતાથી સારા ગ્રમાણમાં મળી રહેવાનું ભહૃત્વ, એક અનુકૂળ બજાર, જેનું માર્કેટિંગ થઈ શકે એવી બનાવટો તેમજ સભ્યો વચ્ચે જવાબદારી તથા પારદર્શિતા વધારવાના જુદા-જુદા દાખલા જેવા કે સારી રીતે કામગીરી બજાવતી રેકોર્ડ સિસ્ટમ ઊભી કરવી. જેનો સભ્યો વચ્ચે પરસ્પર ઉપયોગ થતો હોય, ઝઘડા વિવાદ નિવારણની વ્યવસ્થા તથા સભ્યો વચ્ચે બેઠકોનું આયોજન કરવું. આપણી પાસે દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આ ઉત્તમ ઉદાહરણ ઉપલબ્ધ છે. જેનું અનુકરણ અન્ય ખેત-પેદાશો માટે આવશ્યક છે.

આ બાબતો આપણે દૂધ ઉત્પાદકો, તેમની ગામ કક્ષાની મંડળી — જિલ્લા સંઘ અને ફેડરેશન દ્વારા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ છે.

બજારમાં સરકાર દ્વારા ખરીદી

ભારત સરકારે નિયત કરેલા ટેકાના ભાવોથી યોજનાઓમાં સમાવિષ્ટ ખેત-પેદશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો પોતાની નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કરી ખેડૂતોને આર્થિક રક્ષણ આપે છે. આમ રાજ્યમાં ખેડૂતોને મહત્વના પાકોના નિશ્ચિત રૂપી ટેકાના ભાવો મળવાની વ્યવસ્થા અમલમાં છે. રાજ્ય સરકારશીની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમમાં ટેકાના ભાવની યોજના સમાવિષ્ટ ના હોય તેવા પાકો માટે યોજના અમલમાં છે.

ટેકાના ભાવો નક્કી કરવા એ ભારત સરકારશી અધિકારીક્ષેત્રની બાબત છે. પરિસ્થિતી ઊભી થયેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે વ્યવસ્થાતંત્ર તૈયાર કરેલ છે અને બજાર ભાવો પર સતત મોનીટરિંગ રાખવામાં આવે છે. આમ રાજ્યમાં ખેડૂતોને મહત્વના પાકોના નિશ્ચિત રૂપી ટેકાના ભાવો મળવાની વ્યવસ્થા અમલમાં છે.

ખેડૂતમિત્રોએ પોતાની પેદાશનું વેચાડ કરતા પહેલા ટેકાના ભાવની જાણકારી પ્રાપ્ત કેવી જોઈએ. બજાર કરતા તે વધુ હોય ત્યારે સરકારશીની નિયુક્ત કરેલ સંસ્થાને વેચવું જોઈએ. કપાસ અને ઘઉમાં ચાલુ વર્ષે આ રીતે થયેલ છે. જેની માહિતી નીચે મુજબ છે :

| અ. નં. | પાકનું નામ | ૨૦૧૪-૧૫માં કેન્દ્ર સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ રૂ. / ક્રિંટલ |
|--------|--------------------------------------|---|
| ૧. | ડાંગર | ૧૩૬૦ |
| ૨. | બાજરા | ૧૨૫૦ |
| ૩. | જુવાર | ૧૪૩૦ |
| ૪. | મકાઈ | ૧૩૧૦ |
| ૫. | તુવેર | ૪૩૪૦ |
| ૬. | મગા | ૪૬૦૦ |
| ૭. | અડણ | ૪૩૪૦ |
| ૮. | મગાફળી | ૪૦૦૦ |
| ૯. | તલ | ૪૬૦૦ |
| ૧૦. | કપાસ - મધ્યમ તારી કપાસ - લંબ તારી | ૩૭૫૦ ૪૦૫૦ |

● ● ●


મૂલ્યવર્ધન – સ્થાનિક પ્રોસેસિંગ

મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન – ફળ, અનાજ – સ્થાનિક કક્ષાએ પ્રોસેસ કરીને બજારમાં સીધી રીતે મોકલવું :


વિવિધ કૃષિવિષયક પેદાશો અને ઉત્પાદનોનું વિવિધ અધતન ટેકનોલોજી દ્વારા મહત્તમ ઉત્પાદન અને સર્ફાઈ, ગ્રેડિંગ, પેકિંગ, પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને અધતન માર્કટિંગ પદ્ધતિ દ્વારા તેના મૂલ્યમાં વધારો કરવાની કિયાને “વેલ્યુ એરીશન” કહેવામાં આવે છે. દા.ત., કેરીમાંથી અથાણું, મેંગો પલ્ય, જામ, કેરીના રસના પાપડ, આમચૂર. દૂધમાંથી દહીં, માખણ, ઘી, માવો, પેંડા, બરફી, શિખંડ વગેરે વેલ્યુ એડેડ બનાવટો તૈયાર કરવામાં આવે છે. બેડૂત/ઉત્પાદક આ દ્વારા ૨૦ થી ૫૦ ટકા સુધીની વધારે આવક મેળવી શકે છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સારો માલ મળી રહે છે. આ સમગ્ર સાંકળને કૃષિ ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીની બધી જ પ્રક્રિયાઓને વેલ્યુ એડેડ એટ્રિકલ્યર તરીકે ઓળખવામાં આવે છે.

ઉત્પાદકતામાં સ્થિરતા, ખર્ચમાં વધારો, જેતીની આવકમાં ઘટાડો અને કૃષિ પેદાશના બજાર ભાવોમાં થતી મોટી વધઘટ વગેરે કારણોસર ખેતી બિન નફાકારક અને જોખમી ધંધો ગળાવા માંડી છે. ઊંચી ગુણવત્તા ધરાવતી પેદાશો, કાપડી બાદ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનને કારણે જેતી પેદાશોનો ઉપયોગ વધતાં જેતી ક્ષેત્રે નોંધપાત્ર ફેરફારો થશે. જેતી પેદાશોનાં મૂલ્યવર્ધન દ્વારા તથા વેલ્યુ ચેઇન મારફત આવી પેદાશોને છેવટના વપરાશકાર ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો જેતીની આવક, રોજગારી, નફાકારકતા, ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક હરીફાઈ તથા સમાજ કલ્યાણમાં વધારો કરી શકાય તેમ છે.

પુરવઠાની સાંકળ – સપ્લાય ચેઇન (હાલની પરિસ્થિતિ)



સૂચિત પુરવઠાની સાંકળ - સપ્લાય ચેઈન



મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાકળ વેચાણ પદ્ધતિ

આધુનિક કૃષિમાં વેલ્યુ ચેઈનના પ્રવાહમાં મુખ્ય ત્રાણ પ્રકારનું નેટવર્ક જરૂરી છે :

૧. કૃષિ પેદાશનું નેટવર્ક :

ઇનપુટ્સ પૂરા પાડનારથી ઇનપુટ્સ ખરીદનાર અને છેલ્લે ગ્રાહક/વપરાશકાર સુધીનો પ્રવાહ

૨. નાણાંનું નેટવર્ક :

ધિરાણ અને તેની મુદત, આવક અને નાણાંની ચૂકવણી, બચત અને વીમાની વ્યવસ્થા

૩. માહિતીનું નેટવર્ક :

કૃષિ ક્ષેત્રે વેલ્યુ ચેઈનની સફળતા માટે ઉપરોક્ત ત્રાણો પ્રકારનું નેટવર્ક સતત અને નિયમિત રીતે એકબીજા સાથે સંકળાયેલું અને કાર્યશીલ હોવું જોઈએ.

વેલ્યુ ચેઈન અનેક સંસ્થાઓ, ઝોતો અને જ્ઞાનના પ્રવાહ સાથે જોડાઈને છેવટના વપરાશકારને પસંદ હોય તે મુજબની માંગ મુજબ જરૂરી પુરવઠો પૂરો પાડે છે. સપ્લાય ચેઈન મેન્યુફેક્ચરરને, હોલસેલર કે રીટેઇલરને જ્યારે ડિમાન્ડ ચેઈન પેદાશ અને તેના ગ્રાહકને જોડવાનું કાર્ય કરે છે. આમ સપ્લાય ચેઈન સપ્લાયર અને એની પ્રોસેસને જોડી પેદાશનો બગાડ ઘટાડી અસરકારકતામાં વધારો કરે છે જ્યારે વેલ્યુ ચેઈન ગ્રાહકની પસંદગી મુજબની પેદાશો ઉત્પન્ન કરવા તરફ ધ્યાન દોરે છે.

ખેડૂતની આવક માત્ર ખેતી પેદાશનું ઉત્પાદન વધારીને જ નહીં, પરંતુ અસરકારક રીતે ખેતપેદાશના મૂલ્યવર્ધન દ્વારા પણ વધારી શકાય છે. મૂલ્યવર્ધિત પેદાશો માટે ગ્રાહકો જે કિમત ચૂકવે છે એ અને ખેડૂતને એની મૂળ પેદાશની જે કિમત મળે છે તેમાં ભારે તફાવત છે. આ માટે ખેડૂતો, પ્રોસેસર્સ અને વચ્ચગાળાની સંસ્થાઓ વચ્ચેના યોગ્ય જોડાશની ખામી જવાબદાર છે. જેના કારણે ખેડૂતને તેની પેદાશની યોગ્ય કિમત ન મળવાથી એને આર્થિક લાભ મળતો નથી. ખેતી પેદાશનું એની, સફાઈ, ગ્રેડિંગ, પેકેજિંગ, પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ દ્વારા મૂલ્યવર્ધન થઈ શકે છે. આમ મૂલ્યવર્ધન દ્વારા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ કરી, વધુ સારી આવક અને સેવાઓ ઉપલબ્ધ કરી શકાય છે.

મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાંકળના લાભો :

૧. નાના અને સીમાંત ખેડૂતો માહિતીના પ્રવાહનો લાભ મેળવી બજારની જરૂરિયાત મુજબના પાકોની ખેતી કરી સંબંધિત પાકનો વિસ્તાર વધારી વધુ પાક-ઉત્પાદન મેળવી શકે છે.
૨. ખેતી ખર્ચ ઘટાડી પાકની ગુણવત્તા વધારી શકે છે.
૩. ખેડૂતો વિરાણ મેળવી શકે છે.
૪. પાકના ઉત્પાદનથી માંડી માલના વેચાણ સુધીના દરેક તબક્કે રહેલું જોખમ ઘટાડે છે.
૫. કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપે છે.
૬. વેચાણ માટેનો તનાવ ઘટાડે છે.
૭. પ્રાથમિક ઉત્પાદન ખેડૂતના સંસ્થાકીય માળખા મારફતે રક્ષણ પૂરું પાડે છે.
૮. બજારમાં ખરીદકારો ભાવતાલ અંગે ખેડૂતો સારી એવી સોદાગીરી કરી શકે છે.
૯. સ્થાનિક કક્ષાએ ખેતી પેદાશનું મૂલ્યવર્ધન કરી શકાય છે.
૧૦. આવક, નફો અને સલામતીમાં વધારો કરી શકાય છે.

વેલ્યુ ચેઈન પ્રક્રિયા મારફતે ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે અને યોગ્ય ખેતી વ્યવસ્થા અપનાવી ખેતીની ઉત્પાદકતા વધારી શકે છે. ઉત્પાદનમાં વધારો, મૂલ્યવર્ધન અને સારા માર્કેટિંગ દ્વારા ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે. માર્કેટમાં માલનો ભરાવો, દરેક તબક્કે વેપારીઓની સંખ્યા અને હરીફાઈ તથા નફાનો ગાળો અને વિવિધ માર્કેટિંગ ચેનલ મારફતે થતું મૂલ્યવર્ધન વગેરે બાબતો માર્કેટને અસર કરે છે.

અસરકારક વેલ્યુ ચેઈન દ્વારા ખેડૂતોનું સીધું જોડાણ માર્કેટ સાથે થતા વેચાણમાં આવો અભિગમ અપનાવવો જરૂરી છે. સારી ટેક્નોલોજી દ્વારા મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓને વેગ મળતા આંતરમાળખાકીય સુવિધાઓ, પ્રોસેસિંગ વગેરેમાં વધારો થતા નિકાસને પણ વેગ મળે છે. આમ વેલ્યુ ચેઈન દ્વારા કૃષિ ક્ષેત્ર વધુ વેગવાન બનતા ખેડૂતોને સમૃદ્ધિ તરફ દોરી જાય છે.

મૂલ્યવર્ધક કૃષિ ઉત્પાદન સાકળ માટે ખેડૂતે ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દાઓ :

ખેતીમાં કૃષિ પાકો અને પેદાશો, ફળો, શાકભાજ અને ફૂલોના વેચાણમાં આવો અભિગમ અપનાવવો જરૂરી છે. આ માટેના સઘન પ્રયત્નો ખેડૂતોએ રાજ્ય સરકારના નેજા હેઠળ જાતે જ કરવા જરૂરી છે. દરેક ખેડૂત નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખે તો એને પોતાના ઉત્પાદનનું વધુ મૂલ્ય પ્રાપ્ત થઈ શકે છે :

૧. ઉત્તમ ગુણવત્તાવાળું બિયારણ, ટીસ્યુકલ્બરના રોપા, જૈવિક ખાતરો જેવી ઊંચી ગુણવત્તાયુક્ત સાધન-સામગ્રી વાપરવાથી ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવી સારા કૃષિ ભાવ મેળવી શકાય છે.

૨. કૂષિ પેદાશોનું તેના કદ પ્રમાણે ગ્રેડિંગ કરી પેદાશો અલગ રીતે પેકિંગ કરવાથી મોટા દાખાનો અને ફળોનો વધુ ભાવ મેળવી શકાય છે.
૩. ચીકુ અને પપૈયામાં બેદૂતોએ પેકેજિંગમાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે અને પોતાના બેતરમાં નાના-મોટા ફળ જુદા કરી પેક કરી બજારમાં મોકલાવે તો બજારમાં વધુ ભાવ મેળવી શકાય.
૪. શક્ય હોય ત્યાં સુધી બેદૂતોએ બજારમાં બેતપેદાશો વેચતાં પહેલા બજારભાવ જાણી લેવા જોઈએ પછી જ વેચાણ કરવું જોઈએ. દરેક બેદૂતે બેત પેદાશોનો સંગ્રહ કરે તો માલ બગાડતો અટકી શકે છે અને બજારમાં જ્યારે ભાવ વધે ત્યારે તે બેતપેદાશોનું વેચાણ કરવાથી બેદૂતને સવાથી દોઢ ગણો ભાવ મળે છે.
૫. હાલમાં રાજ્ય સરકાર દ્વારા “જ્યોતિગ્રામ યોજના” અંતર્ગત ગ્રામ્યકક્ષાએ ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે. જેથી રાજ્ય સરકારની સહાયની યોજના દ્વારા સહકારી માળખું એટલે બેદૂતોના સહકારી સંઘ અને મંડળીની રચના કરી ડાંગરમાંથી ચોખા પ્રોસેસ કરવાની નાની મિલ, દાળ બનાવવાની મશીનરી દ્વારા પ્રોસેસિંગ કરી તેનું સુંદર પેકિંગ કરી જો બેદૂતો બજારમાં સીધું વેચાણ કરે તો એમની ઉપજના ઊંચા ભાવ મેળવી શકે છે અને વચેટિયા દલાલોના કમિશન બંધ થાય છે.

મૂલ્યવર્ધક કૂષિ ઉત્પાદન સાકણમાં પ્રોસેસિંગ મશીનના ઉપયોગ દ્વારા મૂલ્યવર્ધન

આપણા દેશમાં કાપણી પછીની પ્રક્રિયામાં યોગ્ય ટેક્નોલોજી ન અપનાવવાને કારણે દર વર્ષે લગભગ ૧૦ થી ૧૨ ટકા અનાજ અને ૨૫ થી ૪૦ ટકા જેટલા ફળ-શાકભાજનો બગાડ થવા પામે છે. એનું મૂલ્ય રૂ. ૫૦,૦૦૦ કરોડથી પણ વધુ થાય છે. જો બેદૂત પોતે એની કૂષિ પેદાશોની સફાઈ, પૃથક્કરણ, ગ્રેડિંગ, સુકવણી, રૂપાંતર વગેરે કરે તો પોતાની પેદાશના વધુ ભાવો મેળવી શકે છે. સાથો સાથ દેશના કૂષિ ઉત્પાદનમાં કરોડો રૂપિયાનો બગાડ અટકાવી શકાય તેમ છે. વિશ્વના અન્ય દેશોમાં ખાદ્યપેદાશોનું ૪૦ થી ૮૦ ટકા જેટલું પ્રોસેસિંગ કરવામાં આવે છે, જ્યારે ભારત સરકારનું ખાદ્ય પ્રોસેસિંગ મંત્રાલય તેનું પ્રમાણ ૧૦ ટકા સુધી લઈ જવા માંગે છે. જેના દ્વારા ૭૭ લાખ લોકોને સીધી રોજગારી અને તુલનાની કરોડ લોકોને પરોક્ષરૂપે રોજગારી મળશે તેવો અંદાજ છે. તેની સાથોસાથ અંદાજે રૂપિયા ૮,૦૦૦ કરોડ જેટલું પાકને થતું નુકસાન અટકશે.

સહકારી સંસ્થા કે બેદૂત સમૂહ મારફત પાકોની કાપણી બાદ એની સફાઈ, ગ્રેડિંગ, સુકવણી, દાળ પાડવી, તેલ કાઢવું તેમજ પાપડ, અથાણાં, મુરબ્બા, દાળ વગેરે બનાવવા પ્રોસેસિંગ કરવાથી બેશેજગારીમાં ઘટાડો થશે તેમજ શહેરોમાં ઓછા ભાવે માલ ઉપલબ્ધ થશે. આ અંગેની માહિતી અને માર્ગદર્શન કૂષિ યુનિવર્સિટીઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો ખાતેથી મળી શકે છે. પ્રોસેસિંગ માટે સારી જાતની મશીનરીનો ઉપયોગ કરવાથી મોટા ભાગના પાકોમાં ૭.૫ થી ૩૦ ટકા જેટલી વધુ આવક બેદૂતો પ્રાપ્ત કરી શકે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય, ભારત સરકાર અને કૂષિ અને સહકાર વિભાગ દ્વારા પંચવર્ષીય યોજનામાં આ અંગે કેન્દ્રીય યોજના શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય ક્ષેત્રોમાં પ્રાથમિક પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધન કરી નુકસાન ઘટાડવાનો અને બેદૂતોને તેના ઉત્પાદનના વધુ ભાવ મળે તેમજ વપરાશકારોને ઉચ્ચિત ભાવે વસ્તુ મળે તે જોવાનો છે. આ માટે ભારતીય કૂષિ અનુસંધાન પરિષદે તેના વિવિધ કેન્દ્રો દ્વારા વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરવાની રીતો, તેને લગતી સુધારેલી મશીનરીનું ઉત્પાદન, ટેક્નોલોજીનું પ્રદર્શન કરી બેદૂતો અને ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ગોઠવી છે.

નીચેના કોઈમાં કૃપિ ઉત્પાદન આધારિત ઉદ્યોગો માટેના કેટલાક લઘુ મશીનોની માહિતી આપવામા આવી છે. (કિંમત અંદાજિત છે વિસ્તાર દ્વારા અલગ હોઈ શકે.)

| અ. નં. | મશીનનું નામ | ઉપયોગ | ક્ષમતા (કિ.ગ્રા./કલાક) | શક્તિ (કિલો વોટ) | અંદાજિત કિંમત / ખર્ચ | |
|--------|---|--|---------------------------|---------------------|----------------------|------------------------------------|
| | | | | | મશીન (રૂ.) | કામગીરી (રૂ./ પ્રતિ કિવન્ટલ) |
| ૧. | હાથ વડે અનાજ સાફ કરવાનું મશીન | દરેક અનાજ | ૧૫૦-૨૨૫ | માનવશક્તિ | ૨,૦૦૦ | ૫.૫૦ |
| ૨. | પગ વડે અનાજ સાફ કરવાનું મશીન | દરેક અનાજ | ૩૮૦-૪૦૦ | માનવ/૦.૩૬ | ૧૨,૦૦૦ | ૭.૫૦ |
| ૩. | ફળ-શાકભાજનું ગ્રેડર | બટાટા, નારંગી, સફરજન, માલ્ટા | ૧૫૦૦-૨૫૦૦ | ૧-૨ | ૨,૦૦૦ | ૨-૩ |
| ૪. | આટા સેપરેટર (લોટમાંથી સોજી, મેદા અલગ પાડવા માટે) | ધઉં, ચણા, સોયાબીન | ૮૦-૧૨૦ | ૦.૭૫ | ૨૨,૦૦૦ | ૧૪ |
| ૫. | ટ્યુબ્યુલર મેઇઝ શેલર | મકાઈ | ૧૮-૨૨ | માનવ | ૩૦ | ૬૨ |
| ૬. | મેઇઝ હસ્કર શેલર | મકાઈ | ૮૦૦ | ૩.૫ | ૩૩,૦૦૦ | ૧૪ |
| ૭. | મગફળી ફોલવાનું યંત્ર | મગફળી, દિવેલા | ૬૦-૭૦ | માનવ | ૬૦૦ | ૧૮ |
| ૮. | પર્લર (દાણાનું ઉપરનું પડ દૂર કરવા) | ધઉં, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ | ૧૦૦-૩૦૦ | ૩.૫ | ૧૮,૦૦૦ | ૧૫ |
| ૯. | દાળ મિલ | મગ, અડદ, તુવેર | ૧૦૦ | ૧.૫ | ૧૩,૫૦૦ થી ૪૦,૦૦૦ | ૧૭ |
| ૧૦. | દળવાનું યંત્ર | અનાજ, દાળ, મસાલા (ધાળા) | ૧૦-૩૦ | ૦.૭૫ | ૮,૪૦૦ | ૪૫-૧૧૦ |
| ૧૧. | બટાટા છોલવાનું મશીન (બંચ ટાઈપ) | બટાટા | ૩૦-૩૨ | માનવ | ૪,૦૦૦ | ૪૫-૧૧૦ |

| અ. નં. | મશીનનું નામ | ઉપયોગ | ક્ષમતા (ક્રિ.ગ્રા./કલાક) | શક્તિ (કિલો વૉટ) | અંદાજિત કિંમત / ખર્ચ | |
|--------|--|--|-----------------------------|---------------------|----------------------|------------------------------------|
| | | | | | મશીન (રૂ.) | કામગીરી (રૂ./ પ્રતિ કિવન્ટલ) |
| ૧૨. | બટાટા સ્લાઈસર (ચિભ્સ, બેકરી હેતુ માટે) | બટાટા | ૩૦ | માનવ | ૪,૫૦૦ | ૩૫ |
| ૧૩. | લસણ ગાંઠ પૂથક્કરણ | લસણ | ૮૦૦ | ૦.૫ | ૧૫,૦૦૦ | ૩.૦ |
| ૧૪. | લસણ કળી મશીન | લસણ | ૪૨૦ | ૦.૭૫ | ૧૨,૦૦૦ | ૩.૦ |
| ૧૫. | પૌઆ મશીન | સોયાબીન, જુવાર, મકાઈ, ચણા | ૨૦ | ૦.૭૫ | ૧૩,૦૦૦ | ૭૫ |
| ૧૬. | સૌર કેબિનેટ (શુષ્ક) | બટાટાની ચિભ્સ, મરચી લીલા પાંડાવાળી ભાજ | ૩-૫ ક્ર./બેંચ | સૌરગીજ | ૬,૦૦૦ થી ૩૫,૦૦૦ | ૬૬ |
| ૧૭. | વટાણા મશીન | વટાણા | ૫૦-૬૦ | ૦.૨૦ | ૧૦,૦૦૦ | ૪-૫ |
| ૧૮. | મરચામંથી બીજ કાઢવાનું મશીન | મરચા | ૫૦-૭૦ | ૧.૫-૨ | ૧૦,૦૦૦ થી ૪૦,૦૦૦ | ૧૦-૧૫ |

૧. ઉપરોક્ત જગતાવેલા મશીનોની વધુ માહિતી માટે કટાઈ ઉપરાંત તકનિકી કેન્દ્ર, પ્રૌદ્યોગિક એવં કૃષિ અભિયાંત્રિકી મહાવિદ્યાલય, મહારાષ્ટ્રા પ્રતાપ કૃષિ એવં પ્રૌદ્યોગિક વિશ્વવિદ્યાલય, ઉદયપુર (ફોન : ૦૨૮૪-૨૪૭૦૧૦૨)નો સંપર્ક સાધવો.
૨. આણંદ, જૂનાગઢ, નવસારી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાંથી અથવા સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)માંથી પણ આ સાધનો મેળવવા માટેના જરૂરી સંપર્કની માહિતી મળી રહેશે.

● ● ●

સફળતાનાં ઉદાહરણો

(૧) રૂકમાવતી રીવર બેઝિન મેનેજમેન્ટ પ્રોજેક્ટ

શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ૧૯૭૫થી કષ્ટ જે શુષ્ક આબોહવા ધરાવતો અને દુષ્કાળનો માર સહન કરતો મદ્દેશ છે, ત્યાં કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપન આધારિત ગ્રામીણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થાના મોભી શ્રી કાંતિસેન શ્રોઙ્ના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકોનું પરંપરાગત જ્ઞાન તથા વૈજ્ઞાનિક અભિગમનો સમન્વય સાધી ટકાઉ વિકાસ સાધવાના પગલાં લેવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન જેમાં તેનો સંગ્રહ તથા તેના અસરકારક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી દુષ્કાળગ્રસ્ત કષ્ટમાં જળકાંતિના અભિયાનની શરૂઆત કરવામાં આવી. લગભગ ૭૫૦ જેટલા ચેકડેમો/તળાવો દ્વારા ૧૦ કરોડ ક્યુબિક મીટર પાણીની સંગ્રહશક્તિ ઉભી કરવામાં આવી. સરકારની વોટરશેડ યોજનાના અમલીકરણ દ્વારા ૪૨,૦૦૦ હેક્ટર જમીનને આવરી લેવામાં આવી. પાણી ઉપરાંત ખેતી તથા પશુપાલન ક્ષેત્રના પ્રશ્નોને હલ કરવા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી. જેમાં ખેતીની નવી તકનીકો ખેડૂતો સુધી પહોંચાડી તેની ઉત્પાદકતા વધારવાની તથા પશુપાલકો માટે ડેરી ક્ષેત્ર સાથે જોડાણની કામગીરી મુખ્ય કરી.

આજે આબોહવા પરિવર્તનની અસર હેઠળ કુદરતી ઋતુચક ખોરવાયું છે અને તેના વિપરીત પરિણામો ખેતી તથા પશુપાલન ક્ષેત્રે જોવા મળી રહ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે પરંપરાગત વિચારશ્રેણીથી કંઈક અલગ રીતે વિચારીને એક નવો જ તથા પ્રમાણમાં મોટા ફલક પર કામગીરી કરી શક્યા હોય તેવા અભિગમની જરૂર જણાઈ. શ્રી કાંતિસેન શ્રોઙ્ન દ્વારા આ અનુસંધાને રીવર બેઝિન મેનેજમેન્ટ અભિગમ દ્વારા આજની વૈશ્વિક સમસ્યાના નિવારણ માટે એક નવો વિચાર રજૂ કર્યો જે સંસ્થાના રૂકમાવતી રીવર બેઝિન પ્રોજેક્ટમાં મૂર્તિમંત થયો.

આજની વૈશ્વિક સમસ્યા આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ વાતાવરણમાં વધું જતું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે. આ વાયુનું પ્રમાણ ઓછું થાય તો સમસ્યાનું સમાધાન મેળવી શકાય. લીલી વનસ્પતિ દ્વારા થતી સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં આવે છે. રીવર બેઝિન મેનેજમેન્ટ અભિગમ હેઠળ લીલી વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધે તે પ્રકારની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આ સાથે એ પણ જ્યાલ રાખવામાં આવ્યો કે ખેતી તથા પશુપાલનની ઉત્પાદકતામાં વધારો થયા અને ખેડૂતો, પશુપાલકો તથા સમુદ્ધાયની આબોહવા પરિવર્તન સામે ટકી રહેવાની ક્ષમતા વધે.

આબોહવા પરિવર્તનના નિરાકરણ સંબંધની પ્રવૃત્તિને મુખ્ય બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે :

૧. મીટીગેશન (શમન) : આ કામગીરીમાં શ્રીન હાઉસ વાયુઓ (જેમનું વાતાવરણમાં પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનથી પરિસ્થિતિ ઉભી થઈ છે)નું ઉત્સર્જન ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. રીવર બેઝિન મેનેજમેન્ટના અભિગમ હેઠળ મીટીગેશન સંદર્ભે નીચે મુજબની મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી.

- ખેતી તથા પશુપાલનમાં જરૂરી સંસાધનોનો અસરકારક ઉપયોગ. જે કારણોસર રાસાયણિક ખાતર, પિયતની જરૂરિયાત ઘટતાં પરોક્ષ રીતે શ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટયું. જાણ તથા ખેતરના કચરાને યોગ્ય પ્રક્રિયા દ્વારા ખાતરમાં ફેરવવું જે કારણે મિથેનનું ઉત્સર્જન ઓછું થાય તથા રાસાયણિક ખાતરનો વપરાશ ઘટે.
- ખેતરના કચરાને સળગાવવાને બદલે તેનું ખાતર બનાવવું. (કચરાને સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય.)

૨. એડેપ્ટેશન (અનુકૂલન) : આ કામગીરીમાં આબોહવા પરિવર્તનની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાથે તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જે મુખ્યત્વે નીચે મુજબ છે :

- વરસાદી પાણીનો સંગ્રહ તથા વ્યવસ્થાપન જે પાણીની ખેંચ વખતે પાકને જરૂરી રક્ષણ પૂરું પાડે છે.
- લોકોની આવક વધે તે પ્રકારની કામગીરી જે આબોહવા પરિવર્તન સંદર્ભે લોકોની સંવેદનશીલતા સાથે નાણાકીય રક્ષણ આપે છે.

રૂકમાવતી રીવર બેઝિન મેનેજમેન્ટ ગ્રોઝેક્ટ ડેટના ૨૦૧૦ થી ૨૦૧૬ સુધી મુખ્યત્વે નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે :

❖ વરસાદી પાણી તથા ભૂગર્ભજળનું વ્યવસ્થાપન

રૂકમાવતી રીવર બેઝિન વિસ્તારમાં લોકો સાથે રહી વિવિધ સ્થળો પર જળસંચયની કામગીરીનું આયોજન કરી અને સરકારની વિવિધ યોજનાઓ સાથે સંકલન કરી ૧૦૭ નવા ચેકડેમો અને બંધારા બનાવવામાં આવ્યા. આ ચેકડેમોને કારણે ૧,૭૦૦ જેટલા લાભાર્થી ખેડૂતોની ૩,૮૦૦ હેક્ટર ખેતીની જમીનમાં પિયતની સુવિધા ઊભી થઈ. આ ઉપરાંત સંગ્રહ થયેલું વરસાદી પાણી જમીનમાં ઉત્તરતાં ભૂગર્ભજળની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો.

જળસંચય માટેના નવા બાંધકામોની સાથોસાથ હ્યાત સંસાધનોની મરામત તથા જાળવણીને લગતી કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ૮૮ ચેકડેમ તથા તળાવોમાંથી કાંપ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. આ કામગીરીને કારણે ચેકડેમોની સંગ્રહક્ષમતા વધીને સાથે આ કાંપનો ખેતરમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદૃપતામાં પણ વધારો થયો તથા રાસાયણિક ખાતર તથા પિયતની જરૂરિયાત ઓછી થઈ ૪૮૫ ખેડૂતોએ તેમની ૬૨૫ હેક્ટર જમીનમાં આ કાંપનો ઉપયોગ કર્યો.

સંગ્રહ થયેલ પાણીનો મહત્તમ ઉપયોગ થાય તથા પિયત હેઠળનો વિસ્તાર વધે તે માટે ટ્પક સિંચાઈ પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. ખેડૂતોને આ પદ્ધતિના ફાયદા સમજાતાં લગભગ ૨,૦૦૦ ખેડૂતોએ ૪,૧૦૦ હેક્ટર જમીનમાં ટ્પક સિંચાઈ પદ્ધતિ અપનાવી. આ પદ્ધતિ અપનાવવાથી પિયતમાં ૫૦% જેટલા પાણીની બચત થાય છે. ખાતર તથા મજૂરની જરૂરિયાત ઘટે છે અને ઉત્પાદનમાં પણ વધારો મળે છે.

❖ સંસાધનોનો અસરકારક ઉપયોગ

- પશુના છાણ તથા ખેતરના કચરામાંથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને ખાતર બનાવવું. રૂકમાવતી બેઝિન વિસ્તારના ૮૦૦ ખેડૂતોને આ પદ્ધતિ શીખવાનામાં આવી. આ ખેડૂતોએ લગભગ ૨,૦૦૦ મેટ્રિક ટન છાણ તથા કચરાનો ઉપયોગ કરી છાણિયું ખાતર બનાવ્યું અને ૪૦૦ હેક્ટર જમીનમાં તેનો વપરાશ કરવામાં આવ્યો.
- કપાસ તથા એરંડા જેવા પાકોમાં કઠોળ વર્ગના પાકોનું આંતર પાક તરીકે વાવેતર : પિયત, પાણી તથા ખાતર જેવા સંસાધનોનો અસરકારક ઉપયોગ થાય, તદ્વારાંત જમીનમાં નાઈટ્રોજન ઉમેરાય તે ઉદેશથી આ કામગીરી હાથ ધરવામાં આવી. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી ૩,૬૦૦ હેક્ટર જમીનમાં મગને આંતર પાક તરીકે ઉગાડવામાં આવ્યા. આ કારણોસર લગભગ ૧૦૩ મેટ્રિક ટન નાઈટ્રોજન જમીનમાં ઉમેરાયો જે ૨૨૪ મેટ્રિક ટન યુરિયા ખાતર બરાબર છે. આ કામગીરી બાદ ખેડૂતો હવે આ પદ્ધતિને અપનાવતા થયા છે અને કઠોળનો આંતર પાક તરીકેનો વિસ્તાર વધ્યો છે.

❖ બાગાયત હેઠળનો વિસ્તાર વધારવો

- પ્રોજેક્ટના સમયગાળામાં લગભગ ૧,૦૦૦ હેક્ટર જમીન બાગાયત પાક હેઠળ આવી છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ખારેક, દાડમ, આંબા, પપૈયા, તડબુચ જેવા પાકો લેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં પિયત, પાણી તથા જમીનમાં ખારાશની સમસ્યા છે તે વિસ્તારોમાં ખારેક તથા દાડમના વાવેતરથી ખેડૂતોને સારું વળતર મળે છે. બાગાયત પાકોમાં મોટા ભાગે ટપક સિંચાઈનો ઉપયોગ થતો હોવાથી પાણી અને ખાતરમાં બચત થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે.
 - ખેતરના શેડાપાળે પણ ફળાઉ વૃક્ષોનું વાવેતર થાય તે માટેની કામગીરી પણ કરવામાં આવેલ, જેમાં ખેડૂતોએ બોર, સીતાફળ, જાંબુ તથા સરગવા જેવા વૃક્ષોનું વાવેતર કર્યું. આ ઉપરાંત ગામના મંદિર કે સ્મશાન નજીક વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. આ પ્રવૃત્તિ દ્વારા ૪૦,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
 - ખેડૂતો તથા પશુપાલકોને સાથે રાખીને ગુણવત્તાયુક્ત ઉત્પાદકતા વધે તે માટે વિવિધ તાલીમ કાર્યક્રમો, નિર્દર્શનો તથા ખેડૂત શાળાના માધ્યમથી ખેડૂતોને નવી ટેકનોલોજીની સમજ આપવામાં આવી.
 - પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવા તેરી સાથે જોડાણ કરી દૂધની બજાર વ્યવસ્થા તથા ખાણદાણ કેન્દ્ર, ગૌચર સુધારણા, લીલા ચારાનું વાવેતર અને પશુ રસીકરણની પ્રવૃત્તિઓ પણ હાથમાં લેવામાં આવી. તેરી સાથે જોડાણ થતા પશુપાલકોની દૂધમાંથી થતી આવકમાં ૨૦%નો વધારો જોવા મળ્યો. ૫૪૦ હેક્ટર જમીનમાં ભેજ સંરક્ષણની કામગીરી તથા ઘાસચારાના બીજના છંટકાવ દ્વારા ગૌચર સુધારણાના કામો થયા. આ ઉપરાંત લીલા ચારાની ઉપલબ્ધતા વધારવા પિયત વિસ્તારોમાં નેપિયર ઘાસના વાવેતરનું પ્રોત્સાહન આપવામાં આવ્યું.
 - ઉપરોક્ત કામગીરી ઉપરાંત નાના પાયા પર નીચેની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી :
 - વરસાદી પાણી સંગ્રહના ટાંકા (ધરની છત પરનું પાણી પીવા માટે સંગ્રહ)
 - ગોબરગેસ યુનિટ
 - ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન માટે ગ્રેડિંગ પેકિંગ એકમ
 - કેરી તથા ખારેકનું પેકિંગ કરી ખેડૂતો દ્વારા મોટા શહેરોમાં સીધું વેચાણ
 - બહેનો તથા યુવાનોને વ્યવસાયિક તાલીમો
 - સરકારશીની ખેડૂતો તથા પશુપાલકો માટેની વક્તિગત યોજનાઓ બાબતે માર્ગદર્શન
- ❖ આ કામગીરીને કારણે નીચે મુજબના પરિણામો મળ્યા છે :
- વરસાદી પાણીની સંગ્રહક્ષમતામાં વધારો
 - ખેતી તથા પશુપાલનની ઉત્પાદકતામાં વધારો તથા ખર્ચમાં ઘટાડો
 - ઘાસચારાની ઉપલબ્ધતામાં વધારો
 - રીવર બેઝિન વિસ્તારમાં વૃક્ષ આવરણ તથા જમીનમાં કાર્બન તત્વમાં વધારો.

(૨) દાહોદનું પરિવર્તન :



માઈકો કક્ષાએ આબોહવા પરિવર્તનના ઘટાડાનું રીજનરેટિવ મોડલ

| ૧૯૭૪નાં વર્ષ પહેલાં | ૨૦૧૦નાં વર્ષમાં |
|---|--|
| <ul style="list-style-type: none"> - સૌથી ગરીબ જિલ્લો - દુષ્કાળગ્રસ્ત વિસ્તાર - સમગ્ર આદિવાસી વિસ્તાર - ચોમાસા પછી લોકોનું સ્થળાંતર-મજૂરી માટે - માત્ર ૧૦ ટકા સિંચાઈની નોંધણી પણ વાસ્તવમાં પ ટકા - સૌથી ઓછી ખેત-ઉપજ - દૂધ ઉત્પાદન સૌથી ઓદ્ધું - સાક્ષરતાનું નીચું પ્રમાણ - સ્ત્રી સાક્ષરતા ૧ ટકા કરતાં પણ ઓછી - વ્યાપક વેરાન જમીન કે જ્યાં ભાગે જ જાડનો ઉદ્ધેર હોય - વૃક્ષ વિનાનો મોટાભાગનો વન વિસ્તાર - હોર્ટિકલ્ચર, શાકભાજી અને ફ્લોરિકલ્ચરની ગેરહજરી - ગરીબીની ઊંચી કક્ષા | <ul style="list-style-type: none"> - ફૂડ સિક્યોરિટીની પ્રાપ્તિ - રહેઠાણ પરિસ્થિતિમાં સુધારા - શાળામાં નોંધણી અને હાજરીમાં ગણનાપાત્ર વધારો - ૬૮,૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઈ - ૧૭,૦૦૦ કૂવા રિ-ચાર્જ થયાં - સિંચાઈ હેઠળ ૩૦ ટકા વિસ્તાર - ૩૨૫ ગામોમાં સિંચાઈ સહકારી મંડળીઓ દ્વારા ૭૦૦ સામૂહિક જળ સંસાધનો વિકસાયાં. - ૨,૭૦૦ ગ્રામ્ય સંસ્થાઓ કે જે પોતાની પ્રવૃત્તિઓ અને મિલકતોનું સંચાલન કરે છે. - ૬૫ નદીઓમાં એવી રેચના થઈ છે કે જે બારેમાસ પાણી આપે છે. - સ્થળાંતર દર : ૧૦ થી ૧૫ ટકા - ૬ કરોડ જાડનું ખાન્દેશન જે પૈકી ૫૦ ટકા જાડ જીવંત છે. - લગભગ ૨૫,૦૦૦ બેડૂતોએ હોર્ટિકલ્ચર અપનાવ્યું છે જેનાથી સરેરાશ વાર્ષિક આવક રૂ. ૫૦,૦૦૦ વધી છે અને ગરીબ કુટુંબોની આવી આવક ઉત્તરોત્તર વધતી જાય છે. |



THE DIFFICULT SITUATION





ટકાઉ વિકાસ-દાહોદ પરિવર્તન :

- ગરીબ કુટુંબો સહિતનાં કુટુંબોની આવકમાં સતત વધારો
- ફૂડ સિક્યોરિટી
- પોષણક્ષમતા
- નાણાંકીય સિક્યોરિટી
- ઘાસચારો અને ઈમારતી લાકડાની નજીકમાં ઉપલબ્ધી
- પીવાના પાણીની નજીકમાં ઉપલબ્ધી
- જંગલોમાં હરિયાળી
- શાળામાંથી ઊઠી જતા બાળકોમાં ઘટાડો
- ઉચ્ચ કેળવણીમાં બાલિકાઓનો વધારો
- તંદુરસ્ત જીવન
- કાયમી અને પાકા ઘરો
- સ્થળાંતરની સંખ્યા અને દિવસોમાં મોટો ઘટાડો
- સશક્ત અને આત્મવિશ્વાસવાળો સમાજ
- દુષ્કાળરહિત વિસ્તાર

આવકો અને જીવન ધોરણમાં સર્વાંગી વિકાસ :

ગામલોકો, સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થા - સદગુરુ ફાઉન્ડેશન, રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને વિકાસલક્ષી યોજનાઓનું સંકલિત અને સહભાગી ધોરણો અમલ થવાથી એક વખતનું દુકાળગ્રસ્ત દાહોદ આજે ચરોતર જેવા ફળદ્વારા વિસ્તાર તરીકે આકાર લઈ રહ્યું છે.

(૩) કૃષિમાં સાહસિક નેતૃત્વ કરતા ગુજરાતના ખેડૂતો :

ભારત એ કૃષિપ્રધાન દેશ છે અને દેશની આર્થિક સમૃદ્ધિ માટે કૃષિક્ષેત્રનું મહત્વનું યોગદાન રહેલું છે. ટૂંકમાં કહીએ તો ભારતનું કૃષિક્ષેત્ર દેશની આબાદી માટે કરોડરજૂ સમાન છે. ભારતના કૃષિક્ષેત્રનો વિકાસ દર ૨.૫ ટકા છે. ૧૨મી પંચવર્ષીય યોજનામાં આયોજન પંચે કૃષિનો વિકાસ દર ૪ ટકા હંસલ કરવાનું લક્ષ્ય રાખેલ છે. જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર સરેરાશ ૧૦ ટકા છે.

ગુજરાતમાં હાલ ૪,૦૦૦ ગ્રીન હાઉસ તેમજ ૧૨,૫૦૦ જેટલાં નેટ હાઉસમાં ગુજરાતના ખેડૂતો હાઈટેક ફાર્મિંગ/પ્રોટેક્ટેડ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે. જેને પરિણામે બાગાયતી અને શાકભાજના પાકોમાંથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી દરેક ગ્રીન હાઉસ/નેટ હાઉસમાંથી ખેડૂતો દ્વારા કેવી રીતે વધુ ઉત્પાદન તેમજ વધુ આવક મેળવવામાં આવી જે અંગેની સંપૂર્ણ માહિતી આજના મારા વ્યક્તવામાં રજૂ કરીશ.

(અ) હાઈટેક ફાર્મિંગ એટલે શું ?

કુદરતી સંસાધનો (નેચરલ રિસોર્સિસ) જેવાં કે જમીન, સૂર્યપ્રકાશ, ઉષ્ણતામાન, જેજ, પવન, પિયત, કુદરતી ખાતરોનો વૈજ્ઞાનિક રીતે કાર્યક્ષમ ઉપયોગ કરી અને સદર કુદરતી પરિબળોને કૃત્રિમ રીતે અંકુશિત કરી, ઓફ સિઝનમાં અથવા બારેમાસ વધુ ઉત્પાદન આપતી પદ્ધતિને હાઈટેક ફાર્મિંગ કહેવાય છે. જે દ્વારા વધુ ઉત્પાદન આપતાં પાકો જેવાં કે, ડય રોજ (ધૂંઘિશ ગુલાબ), જરબેરા, સેવંતી, રજનીગંધા જેવા ફૂલોના પાકો તથા કેપ્સીકમ, અડવી, કાકી, ટામેટાં, લીલા ધાળા તથા ટીસ્યુ કલ્યાનના પ્લાન્ટ જેવાં કે કેળા, ખારેક, ચંદન વગેરે પાકોની ગ્રીનહાઉસ / નેટહાઉસમાં રક્ષિત ખેતી કરવામાં આવે છે.

ગ્રીનહાઉસમાં અળવીનો પાક વાવીને સિદ્ધપુરના ખેડૂતે ૪ લાખની કમાણી કરી :

- (૧) ઈનોવેટિવ ખેડૂતનું નામ : શ્રી અમિતભાઈ પટેલ
ગામ : પાટણ, તા.જિ. પાટણ
- (૨) ઈનોવેટિવ ફાર્મિંગ મોડ્યુલ્સ : પાટણ જિલ્લામાં ગ્રીનહાઉસ ઊભું કરનાર ખેડૂતે કેપ્સીકમ ટામેટાં, જરબેરાના વાવેતરના બદલે અળવી વાવીને સફળ ખેતી કરી.
- (૩) ખેડૂતોની હિસ્ટ્રી : શ્રી અમિતભાઈ પટેલનો પાટણમાં ઈસબગુલનો પ્રોસેસિંગ પ્લાન્ટ છે છતાં પણ ખેડૂતપુત્ર હોવાને નાતે ખેતીમાં ઘણો જ રસ ધરાવે છે. પરિણામે હાઈટેક ફાર્મિંગ દ્વારા ગ્રીનહાઉસમાં અળવીનો પાક કરવાનું સાહસ કર્યું. વધુમાં ચંદનની પણ ખેતી અપનાવેલ છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં જઈ ગ્રીન હાઉસમાં ખેતી કેવી રીતે કરવી તેનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી પાટણમાં ગ્રીન હાઉસ બનાવેલ છે.
- (૪) ખેતીપદ્ધતિ : અળવીનો પાક ગાંઠો દ્વારા કરવામાં આવે છે. જેના પાનનો ભાવ ૨૦ કિલોના ૧૦૦ થી ૫૦૦ રૂપિયા બજારભાવ હોય છે. એક હેક્ટાર વાવેતર પાણી રૂ. ૧.૦૦ લાખનો ખર્ચ કર્યો હતો. દર અઠવાણીયે આશરે ૨૦ થી ૪૦ પણ પાનનો ઉતારો મળી શકે છે અને તેનો વેપાર પાટણના સ્થાનિક માર્કેટમાં થાય છે.
- (૫) આવક : વાર્ષિક રૂ. ૪.૦૦ લાખની આવક થાય છે. વધુમાં તેમણે ૭.૫ વીધામાં ચંદનના છોડનું વાવેતર કરેલ છે. તેમણે ગ્રીનહાઉસ જિલ્લામાં સૌપ્રથમ આર.કે.વી.વાય. યોજના હેઠળ કરેલ છે.

(બ) ટેક્સ્ટાઇલ ઇજનેરીની નોકરી છોડી પશુપાલનમાં વ્યસ્ત બેડૂતપુત્ર :

“ઉમરાદી ગામના દોલતસિંહ રામસિંહ સોલકીએ ભેંસોની દેખરેખ માટે કામ કરતા મજૂરો પાસે કામ કરાવવા મેનેજર રાખ્યા. રોજનું ૩. ઉર હજારનું દૂધ ભરાવવામાં સફળ રહ્યા.”

ગામ : વડોલી, ઉમરાદી ગામના રહીશ શ્રી દોલતસિંહ રામસિંહ સોલકી

કુલ ૧૧૦ ભેંસો અને ૫ જેટલી ગાયો છે તેમજ ૨૫ થી ૩૦ જેટલા વાછરડા તથા વાછરડી છે.

આ ઉપરાંત ૨ જાફરાબાદી જે રોજનું ૪૦ લિટર દૂધ આપે છે.

દૂધની આવક : દરરોજનું ૮૫૦ થી ૮૦૦ લિટર દૂધ મેળવે છે.

જેની કિંમત રૂ. ૩૧,૫૦૦ જેટલી થાય છે. દૂધ તેરીમાં ભરવામાં આવે છે.

આમ, આ ગણતરી મુજબ જોઈએ તો મહિને દાઢે રૂ. ૮,૪૫,૦૦૦નું દૂધ ભરવામાં આવે છે. તેમના દીકરાએ પણ ટેક્સ્ટાઇલ એન્જિનિયરની રૂ. ૨૫,૦૦૦/-ની નોકરી છોડી પશુપાલન ઉદ્યોગમાં જોડાયેલ છે.

તબેલા ભેંસોને ઠંડક માટે વોટર સ્થિકલર શેડ પણ મુકેલ છે.

સ્ટાફ ને મેનેજર સહિત રૂ. ૬૫,૦૦૦/-ની રોજગારી પૂરી પાડે છે.

વેટરનરી સેવાઓનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે.

શ્રી દોલતસિંહના જણાવ્યા મુજબ ઉત્ત થી ૩૭ ટકા નફો જણવી રાખે છે.

(૪) સ્થાનિક નેતૃત્વનો વિકાસ :

- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આતાપી સેવા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા (NGO) દ્વારા સ્થાનિક નેતૃત્વના વિકાસની શરૂઆત થઈ. સ્થાનિક નેતાઓને શોધવા માટે આતાપી સેવા ફાઉન્ડેશને બેડૂતો/ ગ્રામવાસીઓની મીટિંગ બોલાવી અને તેમની સાથે ચર્ચા યોજવામાં આવી અને એવા બેડૂતોને ઓળખવામાં આવ્યા કે જેઓમાં નેતૃત્વના ગુણો હોય અને જેઓ મરજિયાત રીતે કામ કરવા માટે ઈચ્છા ધરાવતા હોય.
- ઓળખાયેલા આવા સ્થાનિક નેતાઓને તાલીમ પૂરી પાડવામાં આવી. સૌપ્રથમ તેઓને જવાબદારી કેમ ઉઠાવવાની તેની સલાહ આપવામાં આવી અને તેમની પાસેથી સમાજની શી અપેક્ષાઓ છે તે જણાવવામાં આવ્યું. તેઓને સરકારમાંથી મ્રાય યોજનાઓ અને સહાય સંબંધી માહિતી બેડૂતોને કઈ રીતે મળવાપાત્ર છે અને તે કઈ રીતે મેળવી શકાય, તેના માટે કોનો સંપર્ક કરવો, તે અંગે ફોર્મ કઈ રીતે ભરવું વગેરે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી. તેઓને બ્લોક અને જિલ્લા કક્ષાએ સરકારી અને નાણાકીય સંસ્થાઓના વહીવટી માળખા અંગે પૂરું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું.
- આતાપી સેવા ફાઉન્ડેશને ૧૪ ગામોમાંથી ૪૪ નેતાઓને તૈયાર કર્યા. જેઓ હવે ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે. તેઓ ક્ષતિયુક્ત લોકો (Disable Persons)ને શોધી તેઓને તે અંગેનું પ્રમાણપત્ર મેળવવામાં સહાય કરે છે. તેઓ બેડૂતોનો સંપર્ક કરે છે અને સંબંધિત પ્રવૃત્તિઓ સંબંધી તેઓને માર્ગદર્શન પૂરું પાડે છે.

(૫) જમીન તંદુરસ્તી વિશ્લેષણનાં આધારે સંતુલિત ખાતરનો ઉપયોગ – જંબુસર, ભરૂચ, ગુજરાત :

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામના શ્રી મહેશભાઈ સીંધા પાસે ત્રણ એકર જમીન છે. તેમને ખેતીવાડી પેદાશોને લગતી જાણકારી ભળી તે અગાઉ તેઓ રાસાયણિક ખાતરનો ઘનિષ્ઠ ઉપયોગ કરતા અને સસ્તા બિયારણો ખરીદતા. તેમનો મુખ્ય પાક કપાસ હતો, પરંતુ તેમના ખર્ચ ઊંચા હતા અને ખેત-ઉપજ નીચી હતી. ૨૦૧૨ અને ૨૦૧૩ની સાલમાં તેમણે જમીન તંદુરસ્તી કાઈ મેળવ્યું. તેના આધારે તેઓએ ભલામણો પ્રમાણે પ્રમાણિત થયેલા બિયારણ અને ઓર્ગનિક અને રાસાયણિક ખાતરોના સંતુલિત પ્રમાણનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. આના પરિણામે તેમની ખેતીવાડી પ્રવૃત્તિઓના ખર્ચમાં રૂ. ૨,૮૦૦/-નો ઘટાડો થયો અને કપાસની ઉત્પાદકતામાં ૪ ક્રિવન્ટલનો વધારો થયો. તેમણે અળસિયાના ખાતરની જાણકારી મેળવી અને ખેતપેદાશના નકામા વધારા (રેસીડ્યુ) સાથે અળસિયાના ખાતર સ્વરૂપના સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કર્યો. આના પરિણામે તેમની કપાસની ઉત્પાદકતામાં બીજા ૧ ક્રિવન્ટલનો વધારો થયો અને સાથે સાથે તેમણે અન્ય ખેડૂતોને અળસિયાનું વેચાણ પણ કર્યું. બે વર્ષમાં તેમની આવકમાં રૂ. ૩૧,૫૦૦/-નો વધારો થયો.

(૬) બાયો-ટેકનોલોજી :

સુધારેલ ખેતીપદ્ધતિ – પેશીસંવર્ધન (ટીસ્યુકલ્યર)

લાભાર્થીનું નામ : રાઠવા મોતેસિંગભાઈ ભણતાભાઈ

સરનામું : ગામ - ધુટણવડ, પો. ધુટીયા, તા. પાવી જેતપુર, વડોદરા

ઉંમર : ૪૫ વર્ષ

લાભાર્થીને આપેલ વસ્તુઓ : કેળના ટીસ્યુકલ્યર છોડ-૧-૩-૭૦ No. of Plants

ખેડૂતને થયેલ લાભ અંગેની ટૂંકી વિગત :

જીવિકા-૩ કાર્યક્રમ અંતર્ગત વોલીયન્ટર દ્વારા રજિસ્ટ્રેશન અને વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ બોરવાળા લાભાર્થી પાણીની સુવિધાવાળા ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી અને તેઓને આ યોજના વિષયક માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં રાઠવા મોતેસિંગભાઈ ભણતાભાઈ ખાસ કરીને કેળના ટીસ્યુકલ્યરના છોડ દ્વારા વાવેતર કરવાનું સૌ પ્રથમ વખત કર્યું હતું. જેમાં લાભાર્થી સૌ પ્રથમ ટીસ્યુકલ્યરના છોડ વિષયક તેમજ તેની વાવણી વિષયક તાલીમ આપવામાં આવી હતી. તેમજ નીદણ અને આંતરખેડ તેમજ પણ ચડાવવા વગેરે વિષયક તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ જે છોડ ઉપર લૂમ તૈયાર થાય છે તે લૂમને લાકડાના ડાંડા દ્વારા ટેકા આપવાની રીતની માહિતી ઓન ફિલ તાલીમથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. જેનાથેડ દરેક કેળની લૂમ સરેરાશ ૨૨ થી ૨૭ કિલોગ્રામની જોવા ભળી હતી. ખેડૂતને એક એકરમાંથી રૂપિયા ૧,૧૦,૦૦૦/-નું ઉત્પાદન મળેલ છે. ખેડૂત નવા વર્ષે પણ ટીસ્યુકલ્યર પદ્ધતિથી કેળની ખેતી કરતા થયા. શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની ખેતી આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.



ઉપસંહાર

ભલામણનો સારાંશ :

વાતાવરણના બદલાવ સામે ટકી શકે તેવી અનુકૂળ સુધારેલ પાક પદ્ધતિ દ્વારા ટકાઉ ઉત્પાદન અને આવક મેળવવી તેને બદલાતા હવામાનમાં કુશળ ખેતી (Climate Smart Agriculture) કહેવામાં આવે છે.

જેમાં મુખ્યત્વે ભલામણ કરેલ નીચેની કૃષિ તજ્જ્ઞતાઓ/તકનિકોનો ઉપયોગ કરી હવામાનની વિપરીત પરિસ્થિતિમાં પણ ટકાઉ ઉત્પાદન અને આવક મેળવવામાં ખેડૂતોને ઉપયોગી બને શકે છે :

- (૧) ખેડૂતમિત્રોએ વધુ ગરમી, ઠંડી, પાણી, રોગ અને જીવાતને સહન કરી શકે તેવી પ્રતિકારક જાતોની પસંદગી કરી વાવેતર કરવું જોઈએ. ખેડૂતમિત્રોએ બાયો-ટેકનોલોજી અને બાયોડાવર્સિટી, સજીવ ખેતીનો મહત્તમ ઉપયોગ કરી કૃષિ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકે છે.
- (૨) બદલાતા હવામાં ખેડૂત મિશ્ર પાક પદ્ધતિ દ્વારા એક આવકનું પાસું નિષ્ફળ જાય તો બીજા સ્તોતમાંથી આવક મેળવવા માટેનું આયોજન કરવામાં આવે છે. દા.ત., કૃષિ પાક નિષ્ફળ જાય તો પશુપાલન, મરઘાંપાલન કે મત્સ્યપાલન અને ગૃહઉદ્યોગો દ્વારા ખેડૂત આવક મેળવવાનું આયોજન કરી આવકનું પાસું સમતોલ કરી શકે છે.
- (૩) વાતાવરણ બદલાવમાં જમીનમાં ભેજનો સંગ્રહ અને ફળદુપતા વધારવા માટે “૦” ઝીરો ટીલેજ મલ્ટિંગ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, સેન્ટ્રિય ખાતરોનો ઉપયોગ, લીલો પડવાશ, કઠોળ પાકની પસંદગી કરવાથી ટકાઉ ઉત્પાદન મેળવી શકાય છે.
- (૪) બદલાતા હવામાનમાં શ્રીનહાઉસ, પોલીહાઉસ, નેટહાઉસ પદ્ધતિ અપનાવી હવામાનના પરિબળોનો કાર્યક્ષમ ઉપયોગ કરી હાઈ વેલ્યુડ પાકોની ખેતી દ્વારા વધુ આવક મેળવી શકાય છે.
- (૫) બદલાતા હવામાન/વાતાવરણને લીધે થતી કુદરતી હોનારતો સામે ખેડૂતને પાક, પશુ-પક્ષી અને મિલકતોને થતા નુકસાન સામે વિમા દ્વારા આર્થિક રક્ષણ મળી શકે છે, જે ખેડૂતને જીવનનિર્વાહ માટે ધાણું ઉપયોગી થઈ શકે છે.
- (૬) બદલાતા હવામાનમાં બાયોડાવર્સિટી, બાયો-ટેકનોલોજી અને ઓર્ગનિક ફાર્મિંગનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન અને આવક મેળવવાના પ્રયત્નો ખેડૂતોએ હાથ ધરવા જોઈએ.
- (૭) બદલાતા હવામાનમાં ખેડૂતને હવામાન અંગે આગોતરી જીણ (Wealth Fore Casting) કરવામાં આવે છે. જેથી ખેડૂતો ભલામણ કરેલ કૃષિ પદ્ધતિઓ અને કૃષિકાર્યોનો અમલ કરી ટકાઉ ઉત્પાદન અને આવક સારી રીતે મેળવી શકે છે.
- (૮) બદલાતા હવામાનમાં ખેડૂતો જમીનની ફળદુપતાની જાળવણી (Soil Health Card Programme) કરી જરૂરી પોષક તત્વો પૂરા પાડી વધુ ઉત્પાદન મેળવી શકે છે.
- (૯) બદલાતા હવામાનમાં ભલામણ કરેલ પદ્ધતિએ “૦” ટીલેજ પદ્ધતિના ઉપયોગ દ્વારા SRI પદ્ધતિ દ્વારાં ડાંગરની ખેતી મલ્ટિંગ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને પાકના કહોવાયેલ અવશેષોનો ઉપયોગ, લીલો પડવાશનો અને કઠોળ પાકોના ઉપયોગ દ્વારા જમીનની ફળદુપતા અને ઉત્પાદકતા જાળવી શકાય છે.
- (૧૦) બદલાતા હવામાનમાં ટૂંકા ગાળાના પાકોની જગ્યાએ એગ્રોફોરેસ્ટ્રી અને બાગાયતના બહુવર્ષાયુ પાકોનું આયોજન કરી ખેડૂત નિયમિત આવકના સ્તોત્ર ઊભા કરી શકે છે.

- (૧૧) વાતાવરણ બદલાવમાં ભલામણ કરેલ જળ સંરક્ષણ અને સંચયની વિવિધ પદ્ધતિઓ અપનાવી ભેજને અછતના સમયમાં ઉપયોગ કરી ટકાઉ કૃષિ ઉત્પાદન મેળવવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવા.
- (૧૨) ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા માટે ભલામણ કરેલ સંકલિત પોષણ વ્યવસ્થા, સંકલિત પિયત વ્યવસ્થા અને સંકલિત રોગ અને જીવાતોનું નિયંત્રણ કરી વધુ ઉત્પાદન અને આવક મેળવી શકે છે.
- (૧૩) ગૌચર સુધારણા કાર્યક્રમ દ્વારા દરેક પંચાયત ગામના નાના અને સીમાન્ત ખેડૂતોને વર્ષ દરમિયાન (Around the year) લીલો ચારો પૂરો પાડે છે.

કુશળ ખેતીનો અભિગમ :

- આ અભિગમ દ્વારા ખેતી વિકાસના પ્રયત્નો સાથે ટેકનિકલ જ્ઞાન અને તે અંગેની નીતિ અને કૃષિવ્યવસ્થામાં વધુ મૂરીરોકાણનો અભિગમ છે. આ અભિગમ કૃષિ વિકાસની નીતિમાં સૌથી વધુ ધ્યાન આપવાનો વિષય બનાવવામાં આવે છે.
- આ અભિગમ દ્વારા ખેતીની ઉત્પાદકતા ઘટે નહીં, પણ વધે તેવી પરિસ્થિતિનું નિર્માણ, સહિયારા પ્રયત્નો દ્વારા, આવતા પડકારોને જીલી, તેને તકમાં નિર્માણ કરવાનું છે.
- આ સમગ્ર બાબતમાં ખેડૂતોના પારંપારિક જ્ઞાન અને અનુભવો સાથે રાખી ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને અગમયેતીના પગલાં લેવાં અનુસરવાનું છે.

ગુજરાતમાં ટકાઉ ખેતીનો વિકાસ :

- વર્ષ-૨૦૦૦માં પૂરી થયેલ છેલ્લી સહભ્રાણ્ભિમાં ખેતી ક્ષેત્રે અનિશ્ચિતતા, વારંવાર પાકોની નિષ્ફળતા અને ઘણાં વર્ષો દરમ્યાન નેગેટિવ વિકાસદર જોવા મળ્યો હતો. જેનાં મહત્વનાં પરિબળો - વરસાદ આધારિત ખેતી ૭૦ ટકા, અનિયમિત અને કેટલીક વાર મોડો વરસાદ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અને રણ વિસ્તારોનો વધારો, જમીનની નીચે ખારાશનો વધારો.
- આજે ખેત-ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દેશના ખેતી ક્ષેત્રના વિકાસદર કરતાં ઘણો ઊંચો એવો ૧૧ ટકાનો વિકાસદર હાંસલ કરેલ છે. મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી, આયોજન અને અમલીકરણના જે પ્રયાસો હાથ ધર્યા તેના કારણે આ બધું શક્ય બન્યું છે. આ અભિગમને કારણે ગુજરાતમાં પ્રતિકુળ આબોહવાની પરિસ્થિતિ જેવી કે ઓછો અથવા મોડો વરસાદ હોવા છતાં ખેત-ઉત્પાદન દર વધ્યો અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે. જેમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે.
- ખરીફ ઝતું પહેલાં કૃષિ મહોત્સવ દરમિયાન એકે-એક ખેડૂતનો સંપર્ક સાધી વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું હતું.
- રાજ્યમાં કાર્યરત વિકાસ વહીવટી તંત્રના અધિકારી કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો અને ખેતીવાડી અધિકારીઓએ દરેક ગામની મુલાકાત લઈ ગામના આગેવાનો, સરંપંચ અને પંચાયતના સત્યોને સાથે રાખી ખેડૂતોને જમીન પૃથક્કરણના આધારે કયો પાક લેવો તેની સમજ તેમના ૪ ગામમાં આપી હતી. દર વર્ષે ૫ લાખ સોઈલ હેલ્પ કર્દાનું વિતરણ.
- રાજ્ય સરકારે સાથે સાથે દરેક ગામોમાં ૧૫ ગરીબ ખેડૂતોને સર્ટિફિકેટ બિયારણ, ખેતીનાં સાધનો અને ફળફળાઈનાં રોપાઓ વિના મૂલ્યે આપે છે. દર વર્ષે ૨.૧૫ લાખ ખેડૂતોને આ રીતે છેલ્લાં ૮ વર્ષથી સીધો લાભ અપાય છે.
- છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાનનાં ખેત-ઉત્પાદનોના ભાવોને લક્ષમાં લઈ જમીન પૃથક્કરણ અને ભેજસંગ્રહની સ્થિતિને ધ્યાને લઈ કયા પાકો લેવા તેની સમજ આપવામાં આવી હતી.

- વરસાદનાં પાણીના સંગ્રહ માટે ચેક ટેમ, બોરી બંધ, ખેત-તલાવડી, ગ્રામ્ય તળાવો જેવાં આશરે ૨ લાખથી વધુ કામો હાથ ધરી પાણીને સંગ્રહવામાં આવ્યું હતું.
 - ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા સૂક્ષ્મ પ્રદેશમાં સાબરમતી અને મહી નદી જેવી નદીઓને નર્મદા સાથે જોડીને સુજલામ-સુફલામ યોજના દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. શાકભાજી, ફળ-ફળાદિ, કપાસ અને ઘઉંનાં પાકોમાં નોંધપાત્ર સફળતા મળી હતી.
 - ગ્રામ્ય વિસ્તારમાં તૃ ફેઝ વીજજોડાણો અને સતત વીજળી પૂરવઠો પૂરો પાડવાની તકેદારી રાખવામાં આવી હતી.
 - આ સફળતાનું કારણ તેનું આગવું નેતૃત્વ રહેલ. મુખ્યમંત્રીશ્રી પોતે દરેક ગામની પ્રગતિની રોજબરોજના ધોરણે સમીક્ષા કરી — ગામલોકો સાથે વીજિયો કોન્ફરન્સથી સીધો સંપર્ક રાખ્યો. બીજી બાજુ મંત્રીશ્રી, ધારાસભ્યો, સચિવો, કલેક્ટરશ્રીઓ અને તમામ વહીવટી તંત્રે ગામની મુલાકાત કરી.
 - આ સંઘળા પ્રયત્નોને લીધે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરી શકાઈ છે, આના કારણે જ વાતાવરણીય પરિવર્તનની સંઘળી અસરોને નિવારવામાં ગુજરાતને સારી એવી સફળતા મળી છે. વિશિષ્ટ સફળતા અગાઉના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો કચ્છ-સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાતમાં મળી - ત્યાં કૃષિ ઉત્પાદન વધ્યું - વધુ પાકો લેવાયા - બાગાયતી પાકોનો વિકાસ થયો.

વીન-વીન સિચ્યુઅ૱શન :

- વનસ્પતિ દ્વારા ફોટોસિન્થેસીસ પ્રક્રિયા વાતાવરણમાંથી CO_2 અનુષ્ઠાન કરી તેનું જ્લુકોઝ અને ફળ ફૂલ દાણામાં રૂપાંતર અને સાથે જમીનમાં કાર્બન પ્રસ્થાપિત કરવાની શક્તિ - વનસ્પતિને હવામાનમાં સમતુલન કરાવવા માટે મુખ્ય બળ ગણી શકાય.
- આ પ્રકારે કાર્બન એકત્ર કરે તેવી કોઈ સમાંતર માનવ ટેક્નોલોજી હાલ ઉપલબ્ધ નથી. આને જળ સંગ્રહ અને ખારાશવાળી તથા પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનના ઉપયોગીથી સંગીન બનાવવાની જરૂર છે.
- પાંચ મુખ્ય કુદરતી તત્ત્વો જેવાં કે, આકાશ, સૂર્ય, પૃથ્વી, જળ અને વનસ્પતિનો સંતુલિત ઉપયોગ એ આની શુરૂ ચાવી છે. આમાંના કોઈ પણ એક તત્ત્વનો વધુ પડતો ઉપયોગ કરીએ તો અસમતુલા સાથે વિનાશ નોતરી શકે છે. આનો વિવક્પૂર્ણ ઉપયોગ “વીન-વીન” સ્થિતિનું નિર્માણ કરી શકે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકમાં થયેલ કામગીરી આનું ઉદાહરણ છે.

વિકાસ ક્ષમતા :

- દુનિયાના ધણા બધા દેશોમાં ખેતી છોડી શહેરો તરફના સ્થળાંતરણ તથા શહેરી વિસ્તાર વધવાના કારણે ખેતી અને તેમાં પણ ધાન્ય પાકોમાં ધટાડો થવા પાખ્યો છે. ધણા વિકસિત અર્થતંત્રમાં ખેતીનું જબરજસ્ત વ્યાપારીકરણ પણ જવાબદાર ગણી શકાય.
- અનાજ અને ખેતીની અન્ય પેદાશોની માત્રા સારા એવાં પ્રમાણમાં વધવા પામી છે.
- દેશમાં અને વિશ્વમાં બાયો-ફિયુલની માગ વધવાથી ધાન્ય પાકોમાં ધટાડો થવા પામેલ છે.

ઉત્પાદનમાં વધારો :

- વિશ્વની ખેતીલાયક જમીનના ૧૧.૩ ટકા જમીન આપણા દેશમાં છે.
- મોટા ભાગના પાકોમાં ઉત્પાદકતા વધારી શકાય તેમ છે.
- આપણા દેશના કેટલાક મહત્વના પાકોની પેદાશ વિશ્વની આ પાકોની સરેરાશ પેદાશ કરતાં ઓછી છે. ચોખા (૭૫ ટકા), ધઉં (૬૩ ટકા), ધાન્ય (૭૩ ટકા), કઠોળ (૭૮ ટકા), સોયા (૮૮ ટકા) અને મકાઈ (૩૮ ટકા).

- જો આપણે ચીન સાથે સરખામણી કરીએ તો ચીનમાં મકાઈનું ઉત્પાદન હેક્ટરદીઠ ૪૮,૦૦૦ કિ.ગ્રા. સામે આપણું ૨૮,૦૦ કિ.ગ્રા. ચોખાના ૬,૦૦૦ કિ.ગ્રા. સામે ૩,૦૦૦ કિ.ગ્રા. અને સોયાબીનમાં ૧,૭૪૦ કિ.ગ્રા. સામે ૧,૦૫૦ કિ.ગ્રા., ટામેટોમાં ૨,૪૦૦ કિ.ગ્રા. સામે આપણે ૧,૪૩૦ કિ.ગ્રા. પક્કવીએ છીએ.
- આપણે સૌ પ્રથમ તો વિશ્વના સરેરાશ ઉત્પાદનને પહોંચી વળવાનું છે. પછી કપાસની જેમ બીજા પાકીમાં પણ વિશ્વના સરેરાશ ઉત્પાદન કરતાં સૌથી વધારે ઉત્પાદન મેળવવાનું છે.
- આપણી પાસે ૧.૩ મિલિયન હેક્ટર ખરાબાની જમીન છે અને તેના કરતાં ઘડી જમીનમાં સતત પાણી ભરાયેલા રહે તેવી વેટલેન્ડ છે. આપણે તેને ઉત્પાદકીય સંશોધન તરીકે વિકસાવી તેમાં ખારાશની સામે ટકી શકે તેવા પાકો લેવા જોઈએ. આમાં આપણે નોલેજ ઈકોનોમી અને આપણા સફળ અનુભવોનો ઉપયોગ કરવો જોઈએ.

ટકાઉ વિકાસ માટે નેતૃત્વ :

- ગ્લોબલ વોર્મિંગના પડકારને તકમાં બદલી શકાય.
- જેતીને કેન્દ્રમાં રાખી ટકાઉ વિકાસ પર ભાર આપવાના પ્રયત્નોને સાંકળી સૌના માટે સારી પરિસ્થિતિ ઊભી કરી શકાય.
- બાળકથી માંડી વરિષ્ઠ નાગરિક સુધીની તમામ ખાનગી અને જાહેર વ્યક્તિઓ આનાથી સંજગ છે.
- આ બધા પડકારોનો સામનો કરવામાં નેતૃત્વ મહત્વનો ભાગ ભજવી શકે. સ્પષ્ટ દસ્તિકોણ ધરાવતા ટકાઉ વિકાસને વરેલા નિષ્ઠાવાન નેતાઓ આ કરી શકે. નોલેજ ઈકોનોમીનાં ઉપયોગ દ્વારા વિગતવાર આયોજન અને અમલીકરણ સ્ટ્રેટેજીથી આ શક્ય બની શકે.
- રાષ્ટ્રીય આંકડા સંગઠન NSSOના અહેવાલ મુજબ ૬૦ ટકા બેડૂતોને જેતી કરવી ગમતી નથી. બેડૂતોમાં પણ અસમતુલા જોવા મળે છે. કેટલાક બેડૂતો સમૃદ્ધ થયા છે, જ્યારે કેટલાકે આપધાત કરવો પડ્યો છે કે નકસલીજમમાં જોડાયા છે. જેતીખર્ચમાં ઘટાડો અને ઉત્પાદકતામાં વૃદ્ધિ સાથે વિકસિત બજારના સીધા સંપર્ક દ્વારા જેતીને નફાકારક બનાવી શકાય.

ઉપસંહાર :

ટકાઉ વિકાસ માટે નેતૃત્વએ નીચેના પર લક્ષ આપવું :

- ચુંટાયેલા નેતાઓ જેવા કે, સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, સહકારી નેતાઓ, વ્યાપાર અને ઉદ્યોગોનાં મંડળોના નેતાઓએ આ બાબત પર ધ્યાન આપવું.
- કેટલાક બિનચુંટાયેલા નેતાઓ જેવા કે, માલિકો, ઉદ્યોગ-સાહસિકો, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરો, સ્વૈચ્છિક સંસ્થાઓ, જાહેર સેવકો, શૈક્ષણિક આગેવાનો (શિક્ષકો, વિદ્યાર્થીઓ), ધર્મિક વડાઓ, આંતર રાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ સાથે મળીને કામ કરવું પડશે.
- માણસમાં પડેલી સુષુપ્ત શક્તિને જગાડી સરકાર, ઉદ્યોગ, સ્વૈચ્છિક સંસ્થાઓના લોકોની સહભાગિતાથી ઉપલબ્ધ તામમ સંશોધનોના ઉપયોગથી આ કરી શકાય. વર્તમાન અને ભાવિ નેતાઓમાં રહેલી નેતૃત્વ શક્તિને જગાડી તેમને કામે લગાડવાથી ટકાઉ વિકાસ માટે લાભદાર્યી સ્થિતિ ઊભી કરી શકાય.
- જેને પહોંચી વળવું મુશ્કેલ જણાય છે તેવી ગરીબી અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓના પડકારોને પહોંચી વળવા આવું હસ્તાંતરણ જરૂરી છે આ એટલું મુશ્કેલ નથી. આને પહોંચી વળવા દઢ મનોબળ અને સતત પ્રયત્નોની આવશ્યકતા રહે છે.
- જો બધા જ એક લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી એક સાથે કામ કરે તો સર્વગ્રાહી વિકાસ સાધી શકાય તેમ છે. ગુજરાત રાજ્યમાં થયેલ ટકાઉ કૂષ્ણ વિકાસ બતાવે છે કે સબજ નેતૃત્વ ધારે તે કરી શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિને જીતી શકે છે.

• • •

બદલાતા હવામાનમાં ટકાઉ ખેતી માટે ખેડૂતો દ્વારા ઉદ્ભવતા પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન-૧ : બદલાતા હવામાનમાં વાતાવરણના પરિબળો જેવાં કે ઉષ્ણતામાન, સૂર્યપ્રકાશ, વરસાદ/ભેજ, પવન અને બાધીભવન કૃષિ-ઉત્પાદનમાં કેવી રીતે ઉપયોગી અને નુકસાનકારક બને છે ?

જવાબ :

- (૧) ઉષ્ણતામાન વધવાથી બાસ્પોત્સર્જન કિયા જડપથી થવાથી છોડને પાણીની જરૂરિયાત ટૂંકે ગાળે વધુ રહે છે.
- (૨) વધુ ઉષ્ણતામાનથી પરાગરજ બળી જાય છે. જેને લિધે પાક-ઉત્પાદન ઓછું મળે છે.
- (૩) સૂર્યપ્રકાશની હાજરીમાં છોડ પ્રકાશ-સંશ્લેષણની કિયા દ્વારા પોતાના ખોરાક તૈયાર કરે છે. જેથી છોડની વૃદ્ધિ થાય છે.
- (૪) વાતાવરણમાં વધુ વરસાદ થવાથી રોગ અને જીવતનું પ્રમાણ વધે છે.
- (૫) વાતાવરણમાં વધુ વરસાદને કારણે જમીનમાં પાણીનાં તળ ઉપર આવે છે.
- (૬) પવનને લિધે પરાગનયનની કિયા સારી થવાથી પાક-ઉત્પાદન વધુ મળે છે.
- (૭) જડપી પવનથી પાક ફળી પડે છે અને ફૂલ અને ફળ જમીન પર ખરી પાડવાથી ઉત્પાદન ઓછું મળે છે.

પ્રશ્ન-૨ : બદલાતા હવામાનની પરિસ્થિતિમાં કયા પાકોની પસંદગી કરવી જોઈએ ?

જવાબ : સોઈલ હેલ્પ એનાલીસીસની ભલામણ મુજબ પાકોની પસંદગી કરવી જોઈએ અને દર વર્ષ જમીનનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે.

પ્રશ્ન-૩ : સજીવ ખેતીનું ઉત્પાદન કયા સંજોગોમાં લેવું જોઈએ ?

જવાબ : સજીવ ખેતી જમીનનું પૃથક્કરણ કરાવી અને જો પાક જમીનની ફળદૂપતાને અનુકૂળ હોય તો લઈ શકાય, પરંતુ બજારમાં આ માટે માંગ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.

પ્રશ્ન-૪ : બાયો-ટેક્નોલોજીનો ખેતીમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે ?

જવાબ :

- (૧) આધુનિક બિયારણ જેવાં કે બીટી સીડ્જ, મકાઈ અને શાકભાજમાં ઉપલબ્ધ બિયારણનો ઉપયોગ કરી શકાય તે પછી તેમાં રોગ/જીવત પ્રતિકારક શક્તિ હોવાને કારણે દવાનો વપરાશ ઘટે છે એટલે ખેતીખર્ચમાં બચાવ થાય છે.
- (૨) પેશી સંવર્ધન (Tissue Culture) ઉપલબ્ધ છોડવાઓનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. દા.ત., કેળાં, શેરડી, ખજૂર વગેરે.

આ ઉત્પાદન પ્રક્રિયામાં બધા જ છોડ સામાન્ય રીતે ટૂંકા રહે છે જેથી વધુ ઉત્પાદનનો લાભ મળે છે.

- (૩) પશુપાલનમાં ભૂણ પ્રત્યારોપણ (Embrioyotuntion Technology) હવે ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ વધારે દૂધ-ઉત્પાદન લેવા માટે કરવો જોઈએ.

પ્રશ્ન-૫ : સામાન્ય ખેડૂત અને પ્રગતિશીલ ખેડૂત વચ્ચેની ઉત્પાદકતામાં કેટલો તફાવત રહે છે ? આ તફાવત ઘટાડવા માટે શું કરવું જોઈએ ?

જવાબ :

- (૧) ભલામણ કરેલ વધુ ઉત્પાદન આપવી સુધારેલ અને સંકર જાતોનું સર્ટિફાઈડ બિયારણ પ્રાપ્ત કરવું જોઈએ અને દર વર્ષ બદલવું જોઈએ.
- (૨) સોઈલ હેલ્પ કર્દને ધ્યાને લઈ પાકોની પસંદગી કરવી જોઈએ અને સમતોલ ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.

- (૩) ભલામણ કરેલ વૈજ્ઞાનિક પદ્ધતિ, પિયત પદ્ધતિ, રોગ અને જવાતોનું નિયંત્રણ કરવું જોઈએ.
- (૪) પાક પરિપક્વ થયા પછી, કાપણી, દાણાદ્રપ્ય પાડવા, દાણા ચોખ્ખા કરવા, તેનો સંગ્રહ કરવો વગેરે પોસ્ટ હાર્વેસ્ટિંગ કાર્યો હવામાનની પરિસ્થિતિ ધ્યાને લઈ કરવા જોઈએ.

પ્રશ્ન-૬ : મિશ્રપાક પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે ?

જવાબ : બદલાતા હવામાનની પરિસ્થિતિમાં જ્યારે એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાંથી બેદૂતને ઉત્પાદન અને આવક મળી રહે છે.

દા.ત., ૧. મગફળી - દિવેલા, ૨. મગફળી - તલ, ૩. કપાસ - દિવેલા, ૪. કપાસ - તુવેર,
૫. બાજરી - તુવેર.

પ્રશ્ન-૭ : ‘વેધર ફોરકાસ્ટિંગ’ની માહિતી ક્યાંથી અને કઈ રીતે મેળવી શકાય ?

જવાબ : વેધર ફોરકાસ્ટિંગની માહિતી ભારત સરકારનું હવામાન ખાતું, રાજ્ય સરકારના હવામાન ખાતા દ્વારા પ્રસારણ રેઝિયો, ટી.વી., બુલેટિન, વર્તમાનપત્ર મેળવી શકાય છે.

પ્રશ્ન-૮ : કૃષિ-ઉત્પાદનોના મહત્તમ ભાવો મળે તે માટે શું કરવું જોઈએ ?

જવાબ :

- (૧) કૃષિ-ઉત્પાદનોનું ચારણાદળ, ગ્રેડિંગ વગેરે વ્યવસ્થિત કરવું જોઈએ.
- (૨) વધુ ભાવો મેળવવા માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ.
- (૩) કૃષિ ઉત્પાદનના વેચાણમાં ઉતાવળ ન કરતાં જુદી જુદી સંસ્થાના ભાવ મેળવ્યા પછી મહત્તમ ભાવ મળે ત્યાં વિકસિત માળખાકીય સુવિધાઓ હોય ત્યાં વેચાણ કરવું જોઈએ.

પ્રશ્ન-૯ : સિંચાઈ માટેની પિયતની અછિતની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ?

જવાબ : (૧) બેત-તલાવડી, (૨) ટ્રેન્ચ પદ્ધતિ, (૩) ટપક સિંચાઈ પદ્ધતિ, (૪) મલ્બિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ.

પ્રશ્ન-૧૦ : એગ્રો સર્વિસ સેન્ટરનો લાભ લેવા માટે કઈ સંસ્થાઓનો સંપર્ક કરવો જોઈએ ?

જવાબ : ભારત સરકાર દ્વારા ‘મેનેજ’ હૈદ્રાબાદ મારફત કૃષિ સ્નાતક, કૃષિ ડિલોમા તથા બી.આર.એસ. (બેચલર ઓફ રૂરલ સ્ટડીસ)ની ડિગ્રી ધરાવતા યુવાનો માટે ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ વિનામૂલ્યે બે મહિનાની પૂર્ણ સમયની રેસિડેન્શીયલ તાલીમ આપવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી બેન્કમાંથી નાણાકીય સુવિધા પ્રાપ્ત કરી શકાય છે. આ યોજના હેઠળ ૩. ૨૦ લાખ સુધીની બેંક લોન મળે છે, જેમાં ૩૬ ટકા (અનામત વર્ગ અને બહેનોને ૪૪ ટકા)ની મર્યાદામાં સબસિડી ઉપલબ્ધ છે. આ માટે તાલીમનો કાર્યક્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ ફોર પલિસ્ક લીડરશીપ (ISPL), અમદાવાદ ફોન : (૦૭૯) ૨૬૪૨૧૫૮૦ તથા agriclinics.netના વેબસાઇટ પરથી મેળવી શકાશે.

પ્રશ્ન-૧૧ : પાક નિષ્ફળ જાય તો વળતર માટે શું કરવું જોઈએ ?

જવાબ : પાક માટે વીમા યોજના જાહેર કરવામાં આવેલ છે. આર્થિક સંરક્ષણ મેળવવા નીચે પ્રમાણે વીમા ઉતારવા જોઈએ :

૧. કૃષિપાક વીમા લેવો જોઈએ..
૨. ગાય અને ભેંસનો વીમો ઉતારવો જોઈએ.
૩. કૃષિના અન્ય સાધનો જેવાં કે ટ્રેક્ટર, ઈલેક્ટ્રિક મોટર અને મકાનના વીમા ઉતારવા જોઈએ.

પ્રશ્ન-૧૨ : પશુપાલન અને પોસ્ટ્રીના સંરક્ષણ માટે શું કરવું જોઈએ ?

જવાબ : પશુપાલન અને પોસ્ટ્રીના સંરક્ષણ માટે જુદા જુદા રોગના નિયંત્રણ તથા રોગોને આવતા રોકવામાં માટે જુદા જુદા સમયે વેક્સીનેશન કરાવવું જોઈએ.

• • •



નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લિડરશીપ (NCCSD)

‘અન.સી.સી.એસ.ડી.’ એ બિન-નફો ઉદ્દેશ ધરાવતી બિન-સરકારી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ હવામાન પરિવર્તનની અસરો ઘટાડવાનો અને તેને અનુરૂપ થતા તરફથી યોગ્ય અને દિશાલક્ષી પ્રયત્નોને સહાયક બનવાનો અને ચલાવવાનો; કૃષિ, ટકાઉ વિકાસ અને ગ્રામ્ય વિકાસનો છે. આવા સંકલિત અભિગમ ધરાવતા ઉદ્દેશની પૂર્તિ અર્થે જાહેર નેતૃત્વ પોષણ તથા તેનો મહત્તમ લાભ મેળવવાનો અને જ્ઞાનલક્ષી અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.

તેના પ્રમુખપદે માનનીય શ્રી બી. પી. સિંઘ સાહેબ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે. સર્વશ્રી ડૉ. એમ. એસ. સ્વામીનાથન્, પ્રો. નાથુ પૂરી, શ્રી કાંતિસેન શ્રોઙ, વૈજ્ઞાનિક ડૉ. વાય. એમ. રાજન્, શ્રી પુરુષોત્તમ રૂપાલા કાઉન્સિલના પેટ્રન સભ્યો છે.

ડૉ. કે. એન. શેલત, આઈ.એ.એસ. (રિટાઇર્ડ) સંસ્થાના એક્ઝિક્યુટીવ ચેરમેન છે. ડૉ. આર. ગોપીચંદ્રન્ કાઉન્સિલના માનદ્ધમંત્રી છે અને કમાન્ડર આશિષ મિતલ અને શ્રી શાલિન શાહ સંયુક્ત માનદ્ધમંત્રી તરીકેની સેવાઓ પૂરી પાડે છે.

વેસબાઈટ : www.nccsdindia.org

ઈ-મેઈલ : info@nccsdindia.org



SAHITYA MUDRANALAYA PVT. LTD.

Sahitya Mudranalaya Pvt. Ltd., wedded to the mantra ‘Whare Printing is a Craft’, is an **ISO-27001 : 2013 certified company** for effective Information Security Management System, the first Printing Press to have this global honour in India.

It has been awarded **NSIC-CRISIL Credit Rating of ‘SE 1A’** for ‘Highest performance capability and High financial strength.’

The average annual turnover of the Company in last 5 years is ₹ 25 crores and working as ‘Zero Debt’ Campany since more than last 10 years.

With corporate outlook, co-operative attitude and dedication to quality, it has scaled higher peaks periodically and regularly. During its successful journey of 50 years towards fulfilment of Excellence in Printing it has reached many a milistones.

It has been conferred with two President of India Awards, the highest our nation can offer, along with several National and State level awards. It has received the prestigious ‘Star Printer of SAARC Nations’ Award at the First South Asia Print Congress. They all symbolize Sahitya Mudranalaya Pvt. Ltd.’s will to excel, always.

Sahitya Mudranalaya Pvt. Ltd. is recognized as one of the prestigious and outstanding Graphic Art Centres of India.

E-mail : smpl99@gmail.com

ખેડૂતમિત્રોને ખાસ વિનંતી

આ માર્ગદર્શિકાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ભાગમાં કુદરતી વાતાવરણમાં શું ફેરફારો થઈ રહ્યા છે અથવા થનાર છે અને તેની શું અસરો છે તેની રજૂઆત કરાઈ છે. બીજા ભાગમાં તેના સંભવિત ઉપાયો સમજાવવામાં આવ્યા છે અને ત્રીજા ભાગમાં આપણા વિસ્તારના ખેડૂતોના અનુભવો અને સફળ વાર્તાઓ રજૂ કરાઈ છે.

બદલાતા હવામાનમાં નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે :

- જમીનનું પૃથક્કરણ દર વર્ષે કરાવવું અને તેને અનુરૂપ પાકો પસંદ કરવા.
- હવામાનના વર્તારાના સમાચાર ધ્યાનથી સાંભળવા અને અગમયેતીથી યોગ્ય પગલાં લેવાં.
- પ્રતિકૂળ બનાવ બને કે પછી તરત જ પાક વ્યવસ્થા શું કરવી તે અંગેનું માર્ગદર્શન સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસેથી મેળવવું.
- ઈ-ગ્રામ સેવા સુવિધા

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઈ-ગ્રામ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઈ-ગ્રામ સુવિધા એ ગ્રામ્ય કક્ષાએ પ્રાપ્ય છે. આ સેવા દ્વારા વિવિધ યોજનાકીય માહિતી અને ખેતીને લગતું માર્ગદર્શન ખેડૂત પોતાનું નામ રજિસ્ટર કરાવીને મેળવી શકે છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા એક ટોલ ફી નંબર : ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ ની વ્યવસ્થા પણ કાયમી ધોરણે ઉપલબ્ધ છે.

● SMS સેવા

ભારતીય હવામાન વિભાગે SMS દ્વારા હવામાન વર્તારાની માહિતી પૂરી પાડવાની સેવા ચાલુ કરેલ છે. આ સેવાનો લાભ લેવા ખેડૂતે પોતાના જિલ્લામાં નિમેલ અધિકારી પાસેથી મોબાઇલનું કાર્ડ ખરીદવાનું રહે છે. આ કાર્ડ દ્વારા ભારતીય હવામાન વિભાગ ખેડૂતને દિવસના જ �SMS દ્વારા હવામાન વર્તારાની માહિતી પૂરી પાડે છે. આ કાર્ડ રૂ. ૭૦/- જેવી નજીવી કિંમતે ખેડૂત ખરીદી શકે છે.


આ સમગ્ર માર્ગદર્શિકા તૈયાર કરવામાં ખેડૂતોને ઉપયોગી બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ત્રણ જિલ્લા – નવસારી, કચ્છ અને આણંદના ઉપરોક્ત ખેડૂતમિત્રો સાથે આ બાબતમાં તેમની સમજ શું છે, તેઓ શું ઉપાયો કરે છે, તેમના પ્રશ્નો શું છે અને કઈ બાબતમાં તેમને હાલ માર્ગદર્શન મળે છે તેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બાબતો સ્પષ્ટ થયા પછી માર્ગદર્શિકામાં કઈ બાબતો હોવી જોઈએ અને તેની ઉપલબ્ધ માહિતી અંગે કૃષિ તજ્જ્ઞો સાથે પરામર્શ કરવામાં આવ્યો. તેમાંથી મળેલા સુધારા-વધારા અને સ્થળ મુલાકાત પછી સંસ્થાના તજ્જ્ઞોએ માર્ગદર્શિકાનું પ્રારંભિક સ્વરૂપ ફરીથી તજ્જ્ઞો સમક્ષ રજૂ કર્યું. જેમાં કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિઓ, નિયામક રિસર્ચ અને વિષય તજ્જ્ઞોએ ફાળો આપ્યો. જેનો હેતુ ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવાનો હતો.

આ પછી આ માર્ગદર્શિકાને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આમાં દર્શાવેલ બધી જ બાબતોને શક્ય તેટલી ચકાસવામાં આવી છે. આમ છતાં રજૂઆતમાં કોઈ ભૂલ હોય તો તે સંપાદકોની છે.

– ડૉ. ક્રિસ્ટાન અન. શેલત

તાલુકા એક્શન પ્લાન





Contact Us

NISHA SHAH

CEO

**National Council for Climate Change Sustainable Development
and Public Leadership (NCCSD)**

Patel Block, Rajdeep Electronic's Compound, Near Stadium Six Road, Navrangpura, Ahmedabad-380 0014
Phone/Fax: (00 91 79) 26421580
Email: drkiritshelat@gmail.com, Website: www.nccsdindia.org